

ઉદ્યોગ અને ખાણ વિભાગ
કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૩૯૪(૨) અન્વયે
બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડનો પાંચમો વહીવટી અહેવાલ
(નાણાંકિય વર્ષ ૨૦૨૨ -૨૩)

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ (BRCL) કંપની ધારા, ૨૦૧૩ હેઠળ નોંધાયેલ ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મારૂતી સુઝુકી ઈન્ડીયા લિમિટેડ સાથેની જોઇન્ટ વેન્યર સરકારી કંપની છે. જેની સ્થાપના તા.૧૩.૧૨.૨૦૧૮ ના રોજ થયેલ છે.

આ કંપનીની રચના ગુજરાત રાજ્યના કટોસણ રોડ-બેચરાજી-ચાણસ્મા-રણૂજ (૬૫ કીમી) લાઇનના ગેજ કન્વર્ઝન માટે પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવો, નાણાકીય ધીરાણ, આયોજન અને અમલીકરણ અર્થે થયેલ છે.

ચાલુ વર્ષ દરમિયાન કંપનીએ નીચે મુજબની પ્રોજેક્ટની ગતિવિધિઓ હાથ ધરેલ છે :

એ) પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે વર્ષ દરમિયાન, એન્જિન રોલિંગ અને SAG નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે અને વર્ષ દરમિયાન ઓટોમોબાઇલ રેકનું લોડિંગ શરૂ થયેલ છે.

બી) ફિલ્ડ સુપરવિઝન અને કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ માટે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એજન્સી કામ કરી રહી છે.

સી) કંપની દ્વારા પ્રોજેક્ટની સરળ પ્રગતિ માટે અન્ય ઇન-હાઉસ રોજિંદા કામ હાથ ધરવામાં આવે છે.

ડી) પ્રોજેક્ટ માટે જમીન સંપાદન રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.

ઈ) કંપની દ્વારા પ્રોજેક્ટની વિવિધ ગતિવિધિઓની પ્રગતિનું દેખરેખ રાખવામાં આવેલ છે.

એફ) કંપની દ્વારા પ્રોજેક્ટને લગતા વિવિધ મુદ્દાઓ માટે રેલવે અને રાજ્ય સરકાર સાથે સંકલન પ્રગતિમાં છે.

કંપનીને રીપોર્ટિંગ સમયગાળા દરમિયાન રૂ. ૨,૫૮,૬૧,૮૮૨/- નું નુકસાન થયેલ છે. (વેરા પછી).



મુખ્ય કારોબારી અધિકારી
બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ



અધિક મુખ્ય સચિવ
ઉદ્યોગ અને ખાણ વિભાગ,
ગુજરાત સરકાર



બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ

સીઆઈએન : યુઝપ૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨

પાંચમો વાર્ષિક અહેવાલ

(નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩)

તારીખ : ૨૮/૧૨/૨૦૨૩
સમય : ૦૧:૪૫ કલાકે
સ્થળ : બ્લોક નં. ૬, ૭ મો માળ, ઉદ્યોગ ભવન,
સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧,
ગુજરાત.

: રજીસ્ટર્ડ ઓફીસ :

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ

બ્લોક નં. ૬, ૭ મો માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧

ફોન : ૦૭૯-૨૩૨-૩૨૭૨૮ / ૨૯, ઈ-મેલ : info@brcl.org.in

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ

સીઆઈએન : યુ૪૫૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨

અનુક્રમણિકા

ક્રમ	વિગત	પાના નં.
૧.	બોર્ડના નિયામકો	૪
૨.	પાંચમી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ	૫
૩.	બોર્ડનો રોપોર્ટ	૬
૪.	સી અને એજી નો અહેવાલ	૨૦
૫.	સ્વતંત્ર ઓડીટર અહેવાલ	૨૨
૬.	બેલેન્સ શીટ	૪૦
૭.	નફા નુકશાનનો હિસાબ	૪૨
૮.	ઈકવીટીમાં ફેરફારનો પત્રક	૪૪
૯.	રોકડ પ્રવાહ પત્રક	૪૬
૧૦.	નાણાકીય પત્રકોની નોંધો	૪૮

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ

સીઆઈએન : યુ૪૫૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨

સંચાલક મંડળ

ક્રમ	ડિરેક્ટરનું નામ અને ડિઆઈએન	હોદ્દો
૧.	શ્રી સંતોષ કુમાર - ૦૭૮૫૪૧૭૯	નિયામક
૨.	શ્રી બજરંગ ઇગનભાઈ વર્લી - ૦૭૧૩૩૯૪૨	નિયામક
૩.	શ્રી પવન અગ્રવાલ - ૦૯૬૫૦૭૪૦	નિયામક
૪.	શ્રી રાજ સ્વરૂપ કપુર - ૦૮૩૦૩૬૮૮	નિયામક
૫.	જ્વલેશ પીયુશભાઈ જવેરી - ૦૮૫૦૭૨૨૪	નોમિની નિયામક
૬.	સંતોષ કુમાર - એએફપીપીકે૫૭૭૬ડી	સી. ઈ. ઓ
૭.	શંભુપ્રસાદ જોષી - એબીઈપીજે૬૫૬૮કે	સી. એફ. ઓ

સ્ટેચ્યુટરી ઓડિટર

મેસર્સ શાહ એન્ડ દલાલ,
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ,
અમદાવાદ.

બેન્કર્સ

યસ બેન્ક, ગાંધીનગર
યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, ગાંધીનગર

રજીસ્ટર્ડ ઓફિસ

બ્લોક નં. ૬, ૭ મો માળ,
ઉદ્યોગ ભવન, સેક્ટર - ૧૧,
ગાંધીનગર - ૩૮૨૦૧૧.

પાંચમાં વાર્ષિક સામાન્ય સભાની નોટીસ

આથી ઓટીસ આપવામાં આવે છે કે કંપની બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડની પાંચમી વાર્ષિક સામાન્ય સભાની બેઠક ગુરૂવાર, ૨૮ મી ડીસેમ્બર, ૨૦૨૩ ના રોજ ૧:૪૫ કલાકે (શોર્ટ નોટીસમાં) વીડીયો કોન્ફરન્સીંગ / ઓએવીએમ મોડ દ્વારા બ્લોક નંબર ૬, ૭ મા માળે, ઉદ્યોગ ભવન, સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧ ખાતે રાખવામાં આવેલ છે અને તેમા નીચે મુજબની કાર્યવાહીઓ હાથ ધરવા માટે રાખવામાં આવેલ છે.

સામાન્ય કાર્યવાહી:-

૧. ૩૧ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ પૂર્ણ થતી આ કંપનીની ઓડીટેડ નાણાંકીય પત્રકોને પ્રાપ્ત કરવા, ચકાસવા અને મંજૂર કરવા અને તેની સાથો સાથ બોર્ડ ઓફ ડિરેક્ટર અને ઓડીટરોના રીપોર્ટ અને કમ્પ્રોલર અને ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયાની ટીપ્પણીઓ બાબતે ઘટતું કરવા સારૂ.
૨. શ્રી બી. સી. વર્લી (ડીઆઈએન : ૦૭૧૩૩૮૪૨) કે જેઓ નિયામક તરીકે રોટેશનથી નિવૃત્ત થાય છે તેઓને તેમની લાયકાતને ધ્યાને રાખી તેઓએ ફરીથી નિયુક્તી માટે પોતાને પ્રસ્તુત કરેલ હોય જેથી તેઓને નિયામક તરીકે નિયુક્ત કરવા સારૂ.
૩. શ્રી રાજ સ્વરૂપ કપુર (ડીઆઈએન : ૦૮૩૦૩૬૮૮) કે જેઓ નિયામક તરીકે રોટેશનથી નિવૃત્ત થાય છે તેઓને તેમની લાયકાતને ધ્યાને રાખી તેઓએ ફરીથી નિયુક્તી માટે પોતાને પ્રસ્તુત કરેલ હોય જેથી તેઓને નિયામક તરીકે નિયુક્ત કરવા સારૂ.
૪. કંપનીના નિયામકોના બોર્ડને કંપનીના વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષના હિસાબોના ઓડીટ માટે ભારતના સીએજી દ્વારા નિયુક્ત કરવામાં આવેલ સ્ટેચ્યુટરી ઓડીટરોના પગર / ભથ્થા નક્કી કરવા માટે પરવાનગી આપવા સારૂ.

રજીસ્ટર્ડ ઓફિસ:-

બ્લોક નં. ૬, ૭ મો માળ,
ઉદ્યોગ ભવન,
સેક્ટર - ૧૧,
ગાંધીનગર - ૩૮૨૦૧૧.
તારીખ: ૨૨-૦૮-૨૦૨૨

બોર્ડના નિયામકોના હુકમ મુજબ

સહી/-
ચેરમેન/નિયામક

નોંધ:-

૧. જો કોઈ પણ શેર ધારકે આ અહેવાલને લગત કોઈપણ પ્રકારની માહિતી પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો તેઓ તેની વિગત અગાઉથી જ વહિવટી તંત્રને ઉપલબ્ધ કરાવવાની રહેશે કે જેથી વહિવટી તંત્ર તે માહિતી તૈયાર કરી શકે.

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ

સીઆઈએન : યુ૪૫૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨

રજીસ્ટર્ડ ઓફિસ: બ્લોક નં. ૬, ૭ મો માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧

બોર્ડનો અહેવાલ

પ્રતિ,

સભ્યો,

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ,

ગાંધીનગર, ગુજરાત

તમારા નિયામકોને બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ (“કંપની”)ની કામગીરી અને ધંધા બાબતે અને ૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતિતના હિસાબોનો પાંચમી વાર્ષિક અહેવાલ આપની સમક્ષ પ્રસ્તુત કરતા ખૂબ જ આનંદ થાય છે.

૧. નાણાંકીય વિગતો અથવા કંપનીની કામગીરીને લગત અગત્યની બાબતો:-

૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતિતના સમયગાળા માટે કંપનીની નાણાંકીય સ્થિતિ નીચે મુજબ છે.

(રકમ રૂપિયામાં)

વિગત	૨૦૨૨-૨૩	૨૦૨૧-૨૨
ઓપરેશન્સમાંથી આવક	૨૦,૧૪,૨૨,૨૨૫	૪૩,૯૨,૪૫,૫૩૬
અન્ય આવક	૭,૯૫,૧૧,૪૫૨	૩,૫૯,૭૪,૯૫૬
કુલ આવક	૨૮,૦૯,૩૩,૬૭૭	૪૭,૫૨,૨૦,૪૯૨
ઓછા : કુલ ખર્ચ	(૨૨,૧૮,૬૨,૭૮૯)	(૪૬,૦૬,૩૦,૬૯૨)
નફો / (નુકશાન) ટેક્ષ પહેલા	૫,૯૦,૭૦,૭૯૮	૧,૪૫,૮૯,૮૦૦
ઓછા : ટેક્ષ ખર્ચ	(૮,૪૯,૩૨,૬૮૦)	૯૩,૦૬,૨૧૬
નફો / (નુકશાન) ટેક્ષ બાદ	(૨,૫૮,૬૧,૮૮૨)	૫૨,૮૩,૫૮૪

૨. આ સમયગાળા દરમિયાન કંપનીની કામગીરીની વિગતો:-

કંપની દ્વારા નીચે મુજબની ધંધાકીય કામગીરીઓ હાથ ધરવામાં આવેલ છે.

- એ) ચાલુ સાલે પ્રોજેક્ટના ફેઝ - ૧ માટે એન્જીનનું એનરોલીંગ સફળતાથી પૂર્ણ કરવામાં આવેલ છે અને એસએજીનું ઈન્સપેક્શન પણ સફળતાથી પૂર્ણ કરવામાં આવેલ છે અને ચાલુ સાલે ઓટોમોબાઈલ રેક લોડીંગ પણ શરૂ કરવામાં આવેલ છે.

- બી) ફીલ્ડ સુપરવીઝન અને કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એજન્સીને નક્કિ કરવામાં આવેલ છે.
- સી) કંપની દ્વારા રોજબરોજના ઈનહાઉસ કામગીરીના સુચારુ અમલીકરણ માટે આયોજન કરવામાં આવેલ છે.
- ડી) રાજ્ય સરકાર અને જીલ્લા વહીવટ દ્વારા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે.
- ઈ) જુદી જુદી કામગીરીઓ માટે પ્રોજેક્ટના પ્રોગ્રેસને ચકાસવામાં આવી રહેલ છે.
- એફ) પ્રોજેક્ટની તમામ બાબતો માટે રેલ્વે અને રાજ્ય સરકાર વચ્ચે લાઈઝન કરવામાં આવી રહેલ છે. મેનેજમેન્ટને એવી આશા છે કે તેઓ કામગીરીમાં વેગ લાવી શકશે અને આવનાર વર્ષોમાં પ્રોજેક્ટના અમલીકરણમાં ગતિ લાવી શકશે.

૩. ધંધામાં ફેરફારો જો કોઈ હોય તો:-

હાલના નાણાંકીય વર્ષના સમયગાળામાં કંપનીના ધંધામાં કોઈ પણ જાતના ફેરફારો થયેલ નથી.

૪. ડીવીડન્ડ:-

હાલના રિવ્યુના સમયગાળા દરમ્યાન બોર્ડના નિયામકોએ કંપનીના ઈકવીટી શેરોમાં કોઈપણ પ્રકારનો ડીવીડન્ડ સૂચવેલ નથી.

૫. રીઝર્વમાં ટ્રાન્સફર:-

હાલના નાણાંકીય વર્ષના સમયગાળા માટે કંપનીએ કોઈ પણ રકમને જનરલ રીઝર્વમાં ટ્રાન્સફર કરેલ નથી.

૬. રોકાણ:-

સમીક્ષા હેઠળના વર્ષ માટે કંપનીએ કોઈ કોઈપણ પ્રકારના રોકાણ જનતા પાસેથી મેળવેલ નથી અને તેથી તેઓ ઉપર કંપનીઝ (એકાઉન્ટ) નિયમો, ૨૦૧૪ લાગુ પડતુ નથી.

૭. લોન, ગેરેન્ટી અને નિવેશની વિગતો:-

સમીક્ષા હેઠળના વર્ષ માટે કંપનીએ કોઈ પણ લોન આપેલ નથી અને કોઈ પણ પ્રકારના રોકાણ કે ગેરેન્ટી કોઈપણ પ્રકારના લોન માટે આપેલ નથી કે જે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૪ (૩) (જી) હેઠળ પડતી હોય અને તેથી તેઓએ તે બાબતે કોઈપણ પ્રકારનો ખુલાસો કરવાનો રહેતો નથી.

૮. સબસીડરીઓ, સંયુક્ત સાહસો અને એસોસીએટ્સ કંપનીઓ:-

કંપનીએ ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન અને માડ્રૂતી સુઝુકી ઈન્ડીયા લિમિટેડનું એક સંયુક્ત અભિગમ છે. તેથી શેર હોલડીંગ પદ્ધતિ અનુસાર કંપની જે. વી. પાર્ટનર્સનો એક એસોસીયેટ કંપની છે.

૯. વાર્ષિક રીટર્નની વિગતો:-

કંપની પાસે કોઈ પણ વેબસાઈટ રહેલ નથી અને તેથી કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૪ (૩) (એ) અને તેને લગત

નિયમો કંપનીને લાગુ પડતુ નથી કે જે વાર્ષિક રીટર્ન (ફોર્મ એમજીટી ૭) માં વેબ સાઈટની વિગતને લગત છે.

૧૦. કંપનીના શેર ભંડોળ અને કંપનીના શેર ભંડોળમાં કોઈ ફેરફાર હોય તો તે:-

કંપનીનું ૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતિત ઓથોરાઈઝ, બહાર પાડેલ, સબસ્ક્રાઈબડ અને પેડ અપ શેર ભંડોળ નીચે મુજબ છે.

શેર ભંડોળની રૂપરેખા	
ઓથોરાઈઝડ શેર કેપીટલ	રૂ. ૭,૮૬,૨૨,૦૦,૦૦૦/- (રૂપીયા સાતસો છ્યાસી કરોડ બાવીસ લાખ પૂરા) ને રૂ. ૧૦ ના ૭૮,૬૨,૨૦,૦૦૦ (ઈઠ્યોતેર કરોડ બાસઠ લાખ વીસ હજાર) ઈકવીટી શેરોમાં વિભાજીત કરવામાં આવેલ છે.
ઈશ્યુ, સબસ્ક્રાઈબ અને પેઈડ અપ શેર કેપીટલ **	રૂ. ૬,૧૨,૧૨,૨૪,૦૨૦/- (રૂપીયા છ કરોડ બાર લાખ ચોવીસ હજાર વીસ પૂરા) ને રૂ. ૧૦ ના ૬૧,૨૪,૨૨,૪૦૨ (એકસઠ કરોડ ચોવીસ લાખ બાવીસ હજાર ચારસો બે) ઈકવીટી શેરોમાં વિભાજીત કરવામાં આવેલ છે.

****** કંપનીના દરેક ઈકવીટી શેર ધારકને રૂ. ૧૦/- (દસ) ના ૧૧,૫૨,૦૫,૨૦૨ (અગીયાર કરોડ બાવણ લાખ પાંચ હજાર બસો બે પૂરા) ઈકવીટીના રાઈટ બેઝીસ પર ફાળવવામાં આવેલ છે, જે ૨૨ મી એપ્રિલ, ૨૦૨૨, ૨૦ મી જુલાઈ, ૨૦૨૨, ૨૨ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ અને ૩ જી નવેમ્બર, ૨૦૨૨ ના રોજના અસરથી હાલના શેર ધારકોને પારી પાસુની અસરથી ફાળવવામાં આવેલ છે.

૧૧. ફેરબદલીના હકકો સાથે ઈકવીટી શેરો બાબતેના ખુલાસાઓ:-

આ સમયગાળા દરમ્યાન કંપનીએ ડીફરન્શીયલ વોટીંગ હકકો સાથે કોઈ પણ ઈકવીટી શેરો ઈશ્યુ કરેલ નથી અને તેથી કંપનીને કંપનીઝ (શેર કેપીટલ એન્ડ ડીબેન્ચર) નીયમો, ૨૦૧૪ ના નીયમ ૪ (૪) મુજબ કોઈ પણ પ્રકારના ખુલાસા કરવાના રહેતા નથી.

૧૨. સ્વેટ ઈકવીટી શેરો બાબતેના ખુલાસાઓ:-

આ સમયગાળા દરમ્યાન કંપનીએ કોઈ સ્વેટ ઈકવીટી શેરો બહાર પાડેલ નથી અને તેથી કંપનીએ કંપનીઝ (શેર કેપીટલ એન્ડ ડીબેન્ચર) નીયમો, ૨૦૧૪ ના નીયમ ૮ (૧૩) મુજબ કોઈ પણ પ્રકારના ખુલાસા કરવાના રહેતા નથી.

૧૩. કર્મચારી સ્ટોક વિકલ્પ બાબતેના ખુલાસાઓ:-

આ સમયગાળા દરમ્યાન કંપનીએ કર્મચારી સ્ટોક વિકલ્પ સ્કીમ અંતરગત કોઈ શેરો બહાર પાડેલ નથી તેથી કંપનીને કંપનીઝ (શેર કેપીટલ એન્ડ ડીબેન્ચર) નીયમો, ૨૦૧૪ ના નીયમ ૧૨ (૯) મુજબ કોઈ પણ પ્રકારના ખુલાસા કરવાના રહેતા નથી.

૧૪. કર્મચારીઓની વિગતો:-

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ એક લીસ્ટેડ કંપની ન હોવાથી કલમ ૧૯૭ (૧૨) અને કંપનીઝ (એપોઈન્ટમેન્ટ એન્ડ રેમ્યુનેશન ઓફ મેનેજેરીયલ પર્સનલ) નીયમો, ૨૦૧૪ મુજબ કર્મચારીઓના વિગતની બાબત કંપનીને લાગુ પડતી નથી.

૧૫. નિયામકો અને ખાસ મેનેજેરીયલ અધિકારીઓ:-

હાલના સમીક્ષાના નાણાંકીય વર્ષમાં રીપોર્ટની તારીખે નિયામક મંડળ અને ખાસ મેનેજેરીયલ પર્સનલ ની વિગતો અને નિયામક મંડળ અને ખાસ મેનેજેરીયલ પર્સનલ (કેએમપીઓ)ના બાંધામાં થયેલ ફેરફારોની વિગતો નીચે મુજબ છે :-

ક્રમ	નિયામકોના નામ/ નિયુક્ત થયેલ કેએમપી	ડીઆઈએન	હોદ્દો	નિયુક્તિની તારીખ	સીસેઝનની તારીખ
૧	સંતોષ કુમાર, આઈઆરએસઈ	૦૭૮૫૪૧૭૯	નિયામક	૧૩/૧૨/૨૦૧૮	ચાલુ
૨	બજરંગ વર્લી	૦૭૧૩૩૯૪૨	નિયામક	૧૩/૧૨/૨૦૧૮	ચાલુ
૩	જવલેશ ઝવેરી	૦૯૫૦૭૨૨૪	નોમીની નિયામક	૧૬/૦૨/૨૦૨૨	ચાલુ
૪	રાજ સ્વરૂપ કપુર	૦૮૩૦૩૬૮૮	નિયામક	૧૩/૧૨/૨૦૧૮	ચાલુ
૫	પવન અગ્રવાલ	૦૯૬૫૦૭૪૦	નિયામક	૨૦/૦૭/૨૦૨૨	ચાલુ
૬	બાચ્યુ વેનુગોપાલ	૦૮૩૦૩૬૮૭	નિયામક	૧૩/૧૨/૨૦૧૮	૨૦/૦૭/૨૦૨૨
૭	સંતોષ કુમાર આઈઆરએસઈ	એએફપીપીકે૫૭૭૬ડી	સીઈઓ	૨૨/૦૯/૨૦૨૦	ચાલુ
૮	શંભુપ્રસાદ જોષી	આબીઈપીજે૬૫૩૮કે	સીએફઓ	૨૨/૦૯/૨૦૨૦	ચાલુ

૧૬. રોટેશન મુજબ નિવૃત્ત થનાર નિયામકો:-

કંપીન ધારા, ૨૦૧૩ ની કલમ ૧૫૨(૬) મુજબ શ્રી સંતોષ કુમાર (ડીઆઈએન : ૦૭૮૫૪૧૭૯) અને શ્રી પવન કુમાર અગ્રવાલ (ડીઆઈએન : ૦૯૬૫૦૭૪૦) કંપનીના એજીએમમાં રોટેશનથી નિવૃત્ત થાય છે અને તેઓએ ફેર નિમણુંક માટે પોતાની લાયકાત દર્શાવેલ છે. કંપનીને ફોર્મ ડીઆઈઆર - ૮ માં ડીસ્ક્લોશર પ્રાપ્ત થયેલ છે અને તેમાં જણાવેલ છે કે તેઓ આવનારી કંપનીની એજીએમમાં ફરી નિમણુંક માટે લાયકાત ધરાવે છે.

૧૭. મેનેજેરીયલ રીમ્યુનરેશન:-

આ કંપનીએ મેનેજેરીયલ રીમ્યુનરેશન બાબતે કંપનીઝ (એપોઈન્ટમેન્ટ એન્ડ રીમ્યુનરેશન ઓફ મેનેજેરીયલ પર્સનલ), નીયમ, ૨૦૧૪ ના નિયમ ૫ મુજબ ખુલાસો કરવાનો રહેતો નથી કારણે કંપની એક અનલીસ્ટેડ કંપની છે.

૧૮. નિયામકોની જવાબદારી બાબતેનો ખુલાસો:-

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૪ ના પેટા કલમ (૩) ના કલોઝ (સી) અન્વયેના નિયમકોની જવાબદારી બાબતેનો ખુલાસો નીચે મુજબ છે.

- (એ) વાર્ષિક હિસાબો તૈયાર કરવા બાબતે, લગુ પડતા હિસાબી સીધાન્તોનું પાલન કરવામાં આવેલ છે અને મટીરીયલ ડીપાર્ટમેન્ટ બાબતે જરૂરી ખુલાસા પણ આપવામાં આવેલ છે.
- (બી) નિયામકો દ્વારા એવા વ્યવસ્થિત સીસ્ટમો રચવામાં આવેલ છે કે જે લાગુ પડતા નિયમોના પ્રાવધાનો મુજબ છે અને આ સીસ્ટમો સારી રીતે કામગીરી કરે છે અને જરૂરીયાત મુજબના છે.
- (સી) નિયામકોએ હિસાબી પોલીસીને પસંદ કરેલ છે અને તેને સત્પણે લાગુ પણ કરેલ છે અને જરૂરી ચુકાદાઓ અને અદાજો પણ કરેલ છે કે જે યોગ્ય અને બરાબર છે કે જેથી કંપનીને લગત લાગુ પડતા સમયગાળાની ચોખ્ખી પરિસ્થિતી દર્શાવી શકાય અને કંપનીના નફા નુકશાન બાબતે પણ જરૂરી સમજણ પ્રાપ્ત કરી શકાય.
- (ડી) નિયામકોએ હિસાબી રેકર્ડ જાળવતી વખતે ઉપર દર્શાવેલ ધારાના અનુસંધાને જરૂરી કાળજી અને સાવચેતી રાખેલ છે કે જેથી કંપનીના હિતોને જાળવી શકાય અને કોઈપણ પ્રકારના ફોડ અને ગેરરીતીઓને દૂર કરી શકાય.
- (ઈ) કંપનીના નિયામકોએ વાર્ષિક હિસાબોને ચાલુ કર્નર્ન મુજબ તૈયાર કરેલ છે.

૧૯. બોર્ડની બેઠક:-

બેઠકની નોટીસ તૈયાર કરવામાં આવેલ છે અને તે અગાઉથી જ નિયામકોને સેક્રેટરીય ધોરણો મુજબ પાઠવવામાં આવેલ છે. હાલના વર્ષ દરમ્યાન ચાર બોર્ડની બેઠકોનું આયોજન કરવામાં આવેલ છે અને તે ૨૦ મી જુલાઈ, ૨૦૨૨, ૨૨ મી સપ્ટેમ્બર, ૨૦૨૨, ૧૯ મી ડીસેમ્બર, ૨૦૨૨ અને ૧૪ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ યોજવામાં આવેલ છે.

૨૦. બોર્ડનું ઈવેલ્યુએશન:-

કોર્પોરેટ અફેર્સ મંત્રાલય, ભારત સરકારનો અહેવાલ કે જે ૫ મી જુન, ૨૦૧૫ નો છે તેના અનુસાર કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૪ ના પેટા કલમ ૩ ના કલોઝ (પી) માંથી સરકારી કંપનીઓને છુટ આપવામાં આવેલ છે. તમારી કંપની સરકારી કંપની હોવાથી બોર્ડ ઈવેલ્યુએશન તમોને લાગુ પડતુ નથી.

૨૧. ઓડીટ સમિતિ:-

હાલના રીવ્યના સમયગાળા દરમ્યાન કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૭૮ અને કંપનીઝ (મીટીંગ ઓફ બોર્ડ એન્ડ ઈટસ પાવર્સ) ધારા, ૨૦૧૪ ના નિયમ (૬) હેઠળ ઓડીટ સમિતિના સંદર્ભે કોઈપણ બાબતો કંપનીને લાગુ પડતી

નથી.

૨૨. નોમીનેશન અને રીમ્યુનરેશન સમિતિ:-

હાલના રીવ્યુના સમયગાળા દરમ્યાન કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૭૮ અને કંપનીઝ (મીટીંગઝ ઓફ બોર્ડ એન્ડ ડીટસ પાવર) નિયમો, ૨૦૧૪ ના નિયમ (દ) ના અનુસંધાને નોમીનેશન અને રીમ્યુનરેશન સમિતિને લગત બાબતો કંપનીને લાગુ પડતી નથી.

૨૩. આંતરિક ઓડીટ અને કન્ટ્રોલ:-

કંપની પાસે તેઓના વ્યાપ અને ધંધાના પ્રકાર પ્રમાણે પૂર્તા આંતરીક નાણાંકીય નિયંત્રણો રહેલ છે. મેસર્સ તૃપલ જે. પટેલ એન્ડ એસોસીયેટસ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કે જેઓ કંપનીના આંતરીક ઓડીટર છે તેઓ દ્વારા આપવામાં આવેલ આંતરીક ઓડીટ અહેવાલ સ્વયમ સ્પષ્ટ છે અને તેથી તેના ઉપર વધુ ટીપ્પણી આપવાની રહેતી નથી. મેસર્સ તૃપલ જે. પટેલ, ચાર્ટડ એકાઉન્ટન્ટની સેવાઓ સંતોષકારી જણાઈ આવેલ છે અને તેથી તેઓને વધુ એક વર્ષ માટે એટલે કે નાણાંકીય વર્ષ ૨૦૨૩ - ૨૪ માટે બોર્ડ દ્વારા ફરી નિયુક્ત કરવામાં આવેલ છે.

૨૪. ઓડીટરો:-

ઓડીટરો મેસર્સ નઉતમ આર. વકીલ એન્ડ કંપની (એફઆરએન : ૧૦૬૯૮૦૩બલ્યુ), ચાર્ટડ એકાઉન્ટન્ટ, અમદાવાદ ને નાણાકીય વર્ષ ૨૦૨૩ - ૨૪ માટે કંપનીના સેટ્યુટરી ઓડીટર તરીકે ભારતના કમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયા દ્વારા તેઓના પત્ર ક્રમાંક : સીએ.વી/ સીઓવાય/ ગુજરાત. બીઆરસીએલ(૧)/૭૧૬, તા. ૧૮/૦૮/૨૦૨૩ થી નિયુક્ત કરવામાં આવેલ છે.

૨૫. ઓડીટરોનો અહેવાલ:-

ઓડીટરોના અહેવાલમાં કોઈ પણ પ્રકારની લાયકાતનો સમાવેશ કરવામાં આવેલ નથી. તેઓના અહેવાલના એકાઉન્ટ અને ઓડીટરના નોટ સ્વયમ સ્પષ્ટ છે અને તે બાબતે વધુ કોઈ ટીપ્પણી આપવાની રહેતી નથી.

૨૬. કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) (બી) મુજબ કોમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયાની ટીપ્પણીઓ:-

કંપનીને પત્ર ક્રમાંક નં. એ.એમ.જી.૧/એકાઉન્ટ/બીઆરસીએલ/૨૦૨૨-૨૩/ઓડબલ્યુ.૧૩૫૦ તારીખ ૬ મી ડીસેમ્બર, ૨૦૨૩ થી કમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયા પાસેથી પ્રાપ્ત થયેલ છે અને તે કંપનીના ૩૧/૦૩/૨૦૨૩ અંતિતના ઓડીટેડ હિસાબો બાબતેનો છે અને તેમા જણાવેલ છે કે એવી કોઈ પણ બાબત ધ્યાન પર આવેલ નથી કે જેથી કરીને સી એન્ડ એજ ના સેટ્યુટરી ઓડીટર્સ રીપોર્ટ પર કોઈ ખાસ ટીપ્પણી કરવાની જરૂર રહેલ છે.

૨૭. સેક્રેટેરીયલ ઓડીટ અહેવાલ:-

આથી કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૨૦૪ (૧) અને કંપનીઝ (એપોઈન્ટમેન્ટ એન્ડ રીમ્યુનરેશન ઓફ મેનેજરીયલ

પર્સનલ) નિયમ, ૨૦૧૪ ના નિયમ (૯) મુજબ કંપનીએ સેક્ટેરીયલ ઓડીટ અહેવાલનું ફોર્મ નં. એમઆર - ૩ મેસર્સ કિરણ પટેલ એન્ટ એસોસીયેટ, કે જેઓ એક પ્રેક્ટીસીંગ કંપની સેક્ટરી છે તેઓ પાસેથી પ્રાપ્ત કરેલ છે. આ અહેવાલની એક નકલ નિયામકના અહેવાલ સાથે જોડેલ છે.

૨૮. કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર):)

ચકાસણીના સમયગાળા દરમ્યાન કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૫ મુજબ કોર્પોરેટ સામાજિક જવાબદારીની કલમ કંપનીને લાગુ પડે છે.

કંપનીની નેટ વર્થ તા.૩૧ મી માર્ચ, ૨૦૨૩ મુજબ રૂ.૫૦૦ કરોડથી વધારે છે અને આ નેટ વર્થના આધારે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે સીએસઆર કંપની પર લાગુ પડે છે.

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૫ મુજબ જો કઈપણ કંપની પર આ લાગુ પડતુ હોય તો તેને તેના આવનારા ત્રણ નાણાંકીય વર્ષના સરેરાશ નેટ નફામાંથી ૨% કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) ની કામગીરીઓમાં ૩૧ મી માર્ચ, ૨૦૨૪ સુધી વાપરવાની રહે છે.

સીએસઆરની કામગીરીઓમાં ભુખમરો અને કુપોશણ દુર કરવાની કામગીરી, શિક્ષણમાં વધારાની કામગીરી, આર્ટ અને કલ્ચર, સ્વાસ્થ્ય વર્ધક કામગીરી, સફાઈ કામગીરી, પછાત વર્ગની સારવાર અને તેઓનો પૂનરવસ્વાટ, પર્યાવરણ સુધારો, ડીસાસ્ટર રીલીફ અને ગ્રામીણ વિકાસ કામગીરીનો સમાવેશ થાય છે.

૨૯. રીસ્ક મેનેજમેન્ટ પોલીસી:-

બીઆરસીએલ દ્વારા તેઓના ધંધાને લગત ખતરાઓને શોધી કાઢશે અને તેઓ એક રીસ્ક મેનેજમેન્ટ રૂપરેખાને લાગુ કરશે કે જેથી આવા ખતરાઓનો સામનો કરી શકે જેથી કે ધંધાના ઉદ્દેશ્યોને કોઈ જાતના અડજણ સીવાય પૂર્ણ કરી શકાય. બીઆરસીએલ દ્વારા આવા ખતરાઓને તેઓના એક્ષપોશર નિયંત્રીત કરી અને ધંધાને થનાર નુકશાનને ઘટાડશે.

૩૦. ઉર્જનો બચાવ, ટેકનોલોજીની સ્વીકૃતિ અને વિદેશી નાણા પ્રાપ્ત કરવા સારૂ:-

કંપની દ્વારા એવી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી કે જે ઉર્જના બચાવ, ટેકનોલોજીની સ્વીકૃતિ બાબતે ખુલાસો કરવાની જરૂરીયાત રહેલ છે કારણે કે તે કે ઉત્પાદન કરતી કંપની નથી. રીવ્યુના સમયગાળા દરમ્યાન કંપનીએ કોઈ પણ પ્રકારના વિદેશી નાણાં પ્રાપ્ત કરેલ નથી.

૩૧. સમયગાળાના અંત અને અહેવાલની તારીખ દરમ્યાન થયેલ કોઈપણ પ્રકારના મેટીરીયલ ફેરફારો કે કમીટમેન્ટસ કે જેથી નાણાકીય સ્થિતિમાં કોઈ ફેરફાર થઈ શકે:-

સમયગાળાના અંતે અને અહેવાલની તારીખ સુધીમાં ઉપર રીપોર્ટમાં જણાવ્યા સિવાય કોઈપણ પ્રકારના મેટીરીયલ ફેરફાર થયેલ નથી કે જેથી કંપનીના નાણાંકીય સ્થિતિને કોઈ પણ પ્રકારની અસર થઈ શકે. પરંતુ કંપનીએ ૪૯,૦૧,૯૬૧ અને ૧૬,૨૭,૫૦,૦૦૦ ના રૂ. ૧૦/- પ્રતિ શેરની ફાળવણી તારીખ ૧ લી ઓગષ્ટ, ૨૦૨૩ અને ૨૧ મી ઓગષ્ટ, ૨૦૨૩ ના રોજ અનુક્રમે કરેલ છે કે જે ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ

(જી - રાઈડ) અને ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી) ને લગત છે.

૩૨. કંપનીની હાલની પરિસ્થિતિ કે ભવિષ્યની કામગીરીને અસર કરે તેવા કોઈ મેટીરીયલ હુકમો જે કોઈ રેગ્યુલેટરો કે અદાલતો કે ટ્રીબ્યુનલો દ્વારા પસાર કરવામાં આવેલ હોય તો તેની વિગત:-

કોઈપણ રેગ્યુલેટરો કે અદાલતો કે ટ્રીબ્યુનલો દ્વારા એવા કોઈ પણ ખાસ મેટીરીયલ હુકમ પસાર કરવામાં આવેલ નથી કે જેથી કંપનીની હાલની પરિસ્થિતિ કે ભવિષ્યની કામગીરીઓ ઉપર કોઈપણ પ્રકારની અસર થઈ શકે.

૩૩. ધ સેક્યુયલ હેરેસમેન્ટ ઓફ વુમેન એટ વર્કપ્લેસ (પ્રીવેન્શન, પ્રોહિબીશન એન્ડ રીડ્રેસલ) એક્ટ, ૨૦૧૩ અન્વેય કંપનીની રહેલ જવાબદારીઓ:-

કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાવવા માટે એક નવો કાયદો ધ સેક્યુયલ હેરેસમેન્ટ ઓફ વુમેન એટ વર્કપ્લેસ (પ્રીવેન્શન, પ્રોહિબીશન એન્ડ રીડ્રેસલ) એક્ટ, ૨૦૧૩ તા.૯ મી ડીસેમ્બર, ૨૦૧૩ ના રોજ પસાર કરવામાં આવેલ છે. આ કાયદા હેઠળ દરેક કંપનીએ એક આંતરીક ફરીયાદ સમિતીની રચના કરવી જરૂરી છે કે જે કોઈ પણ સ્ત્રી કર્મચારી દ્વારા તેઓ સાથે કામકાજના સ્થળે થયેલ જાતીય સતામણી બાબતેના ફરીયાદો સાભળે.

કંપની દ્વારા ભવિષ્યમાં એવી નીતી અપનાવશે કે જેથી સ્ત્રીઓ સાથે નોકરીના સ્થળે જાતીય સતામણ ન થાય અને આ નીતી લાગુ કરવા માટે એક સમિતિની પણ રચના કરશે. આ રીવ્યુના સમયગાળા દરમ્યાન કંપનીને સતામણી બાબતે કોઈ પણ ફરીયાદ મળેલ નથી.

૩૪. સંબંધિત પક્ષકારોને લગત કરારો અને એગ્રીમેન્ટોની વિગતો:-

હાલના રીવ્યુના સમયગાળા દરમ્યાન કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૮૮(૧) અન્વયે કંપની દ્વારા સંબંધિત પક્ષકારો સાથે કરવામાં આવેલ રીવ્યુ, કરારો અને વ્યવસ્થાઓની વિગતો કંપનીના ઓડીટ થયેલ બેલેન્સ શીટમાં દર્શાવવામાં આવેલ છે.

૩૫. ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ, ૨૦૧૬ હેઠળ થયેલ અરજી કે જે ચાલી રહેલ તેની વિગતો:-

રીવ્યુના હાલના સમયગાળા દરમ્યાન ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ, ૨૦૧૬ કંપનીના નામે કોઈ પણ અરજીઓ થયેલ નથી કે કોઈ પણ કાર્યવાહીઓ હાલ ચાલી રહેલ નથી.

૩૬. બેન્કો પાસેથી કે નાણાંકીય સંસ્થાઓ પાસેથી લોન લેતી કે વન ટાઈમ સેટલમેન્ટના વેલ્યુએશન રકમાં રહેલ ફેરફારની વિગતો:-

સમીક્ષાના સમયગાળા દરમ્યાન બેન્કો પાસેથી કે નાણાંકીય સંસ્થાઓમા પાસેથી લેવામાં આવેલ લોનનો કોઈપણ વન ટાઈમ સેટલમેન્ટ કરવામાં આવેલ નથી.

૩૭. રકમનો એડયુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં ટ્રાન્સફર કરવા બાબત:-

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૨૪ અને ઈન્વેસ્ટર એડીયુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ એથોરીટી (એકાઉન્ટીંગ, ઓડીટ, ટ્રાન્સફર એન્ડ રીફંડ) નિયમો, ૨૦૧૬ અન્વયે સાત વર્ષ કે તેથી વધારે સમયગાળા માટે ડીવીડન્ટની

ફાળવણી માટે કંપનીના શેરો કલેમ થયા વગર કે ચૂકવણા થયા વગર બાકી રહેલ હોય તો તેને કંપની દ્વારા ભારત સરકારના ઈન્વેસ્ટર એડ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઈઈપીએફ) માં ટ્રાન્સફર કરવું જરૂરી છે. આવા કોઈ પણ કિસ્સાઓ નથી કે જેમાં અમલીકરણ બાકી રહેલ છે.

૩૮. લાગુ પડતા સેક્ટેરીયલ સ્ટેન્ડર્ડોના અમલીકરણ બાબતેની વિગત:-

સમીક્ષાના સમયગાળા દરમ્યાન કંપનીએ સેક્ટેરીયલ સ્ટેન્ડર્ડ - ૧ અને સેક્ટેરીયલ સ્ટેન્ડર્ડ - ૨ ના તમામ પ્રાવધાનોનું પાલન કરેલ છે કે જે ભારતના ઈન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્ટેરીસ દ્વારા બહાર પાડવામાં આવેલ છે અને જે કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા નોટીફાઇ કરવામાં આવેલ છે.

૩૯. એકનોલેજમેન્ટ:-

કંપનીના નિયામકો રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ, કંપટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયાને અને સ્ટેચ્યુટરી ઓડીટરોને તેઓ ધ્વારા આપવામાં આવેલ સહકાર બાબતે આભાર પ્રકટ કરે છે. કંપનીના નિયમકો ગુજરાત સરકાર, જી - રાઈડ, એમએસઆઈએલ, જીઆઈડીસીના અધિકારીઓ અને કંપનીના કર્મચારીઓને તેઓ દ્વારા આપવામાં આવેલ સહકાર અને સત્તત ટેકા બદલ આભાર પ્રકટ કરે છે.

બોર્ડ ઓફ ડાયરેક્ટરોના વતી અને તેમના દ્વારા
બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૨૮/૧૨/૨૦૨૩

સહી/-
સંતોષ કુમાર
નિયામક અને સીઈઓ
ડીઆઈએન : ૦૭૮૫૪૧૭૯

સહી/-
જવલેશ ઝવેરી
નિયામક
ડીઆઈએન : ૦૮૫૦૭૨૨૪

સેક્ટેરીયલ ઓડીટ અહેવાલ

તા. ૩૧-૦૩-૨૦૨૩ ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષનું
(કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ - ૨૦૧૪ (૧) અને કંપની (વ્યક્તિગત નિમણૂક અને મહેનતાણું)
નિમયો, ૨૦૧૪ ના નિયમ નં. ૯ અન્વયે)

પ્રતિ,

સભ્યો,

બહુચરાણ રેલ કોર્પોરેશન લિમીટેડ,

બ્લોક નં. ૬, ૭ મો માળ, ઉદ્યોગ ભવન,

સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧.

અમોએ બહુચરાણ રેલ કોર્પોરેશન લિમીટેડનો સેક્ટેરીયલનો ઓડીટ કરી ચકાસેલ છે કે તેઓએ લાગુ પડતા સેટ્યુટરી પ્રાવધાનો અને તેઓ દ્વારા લાગુ પડતી ધારાઓનું પાલન કરેલ છે કે નહીં અને તેઓએ સારી કોર્પોરેટ નીતીઓનું પાલન કરેલ છે તે ચકાસવા માટે તેઓનું સેક્ટેરીયલ ઓડીટ કરેલ છે. સેક્ટેરીયલ ઓડીટ તે રીતે કરવામાં આવેલ છે કે જેથી અમોને કોરપોરેટ વ્યવહારો અને નિયમોના પાલન બાબતે જરૂરી માહિતી પ્રાપ્ત થઈ શકે અને તે બાબતે અમો અમારા અભિપ્રાય આપી શકીએ.

અમો દ્વારા કરવામાં આવેલ કંપનીના ચોપડા, પેપર્સ, મીનીટના ચોપડા, ફોર્મો અને ભરેલ રીટર્ન અને કંપનીના અન્ય રેકર્ડની ચકાસણીના આધારે અને કંપની, તેના અધિકારીઓ, એજન્ટો અને અન્ય સત્તાધિકારીઓ દ્વારા સેક્ટેરીયલ ઓડીટ દરમ્યાન આપવામાં આવેલ માહિતીના આધારે અમો અમારો અભિપ્રાય આપીએ છીએ કે કંપનીએ હાલના ઓડીટ સમયગાળા દરમ્યાન કે જે ૩૧ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ અંત થતા નાણાંકીય વર્ષને લગત છે તેમાં તેઓએ નીચે જણાવેલ સેટ્યુટરી પ્રાવધાનોનો પાલન કરેલ છે અને તે ઉપરાંત કંપની પાસે યોગ્ય બોર્ડ કાર્યરત છે કે જેથી પ્રોસેસો અને કમ્પલાયન્સની કામગીરી કરી શકાય અને તેને લગત વિગતો નીચે દર્શાવવામાં આવેલ છે.

અમોને ચોપડાઓ, કાગળીયા, મીનીટની ચોપડીઓ, ફોર્મ અને ભરાયેલ રીટર્ન અને કંપની દ્વારા જાળવવામાં આવેલ અન્ય રેકર્ડની ચકાસણી કરેલ છે કે જે ૩૧ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ અંત થનાર નાણાંકીય વર્ષ માટે છે અને તેને લગત વિગતો નીચે મુજબ છે:-

૧. કંપની ધારા, ૨૦૧૩ અને તે હેઠળ બનાવેલા નિયમો.
૨. ધી સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટસ (રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૬ અને તે હેઠળ બનાવેલા નિમયો અને પેટા કાયદાઓ.
૩. ધી ડીપોઝીટરી ધારા, ૧૯૯૬ અને તેના રેગ્યુલેશન્સ અને પેટા નિયમો - તેના અંતર્ગતના નિયમોનું પાલન જયા સુધી લાગુ પડે છે ત્યા સુધી કરેલ છે. વધુમાં એમસીએએ તેઓના ૨૨ મી જાન્યુઆરી, ૨૦૧૯ ના ઠરાવ મુજબ સરકારી કંપનીઓને તેઓના શેરો ડીમેટરીયલાઈઝ કરવાથી છુટ આપેલ છે અને તેથી તે કંપનીને લાગુ પડતુ નથી.

૪. ફોરીન એક્ષચેન્જ મેનેજમેન્ટ ધારા, ૧૯૯૯ અને તેને લગત નિયમો અને રેગ્યુલેશન કે જેના અનુસાર વિદેશી સીધો નિવેશ, ઓવરસીઝ સીધો નિવેશ અને એક્ષટર્નલ કોમર્શીયલ બોરોઈંગ.
૫. સેક્યુરીટીઝ અને એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ધારા, ૧૯૯૨ (સેબી ધારા) અને નીચે મુજબના રેગ્યુલેશનસ અને ગાઈડલાઈન્સ સૂચવેલ છે જે આ ઓડીટના સમયગાળા દરમ્યાન કંપનીને લાગુ પડતુ નથી.
- (એ) ધી સેક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (શેરો અને ટેકઓવરના મોટા પાયાના એકવેલેશનને લગત) રેગ્યુલેશનસ, ૨૦૧૧;
- (બી) ધી સેક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (આંતરીક વ્યાપાર પ્રતિબંધ) રેગ્યુલેશનસ, ૧૯૯૨;
- (સી) ધી સેક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (કેપીટલ ઈશ્યુ કરવા બાબત અને ડીઝકલોઝરને લગત જરૂરીયાતો) રેગ્યુલેશનસ, ૨૦૦૯;
- (ડી) ધી સેક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (કર્મચારીઓના સ્ટોક ઓપશન સ્કીમ અને કર્મચારીઓના સ્ટો ખરીદને લગત સ્કીમ) ગાઈડલાઈન્સ, ૧૯૯૯;
- (ઈ) ધી સેક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ટેબ્ટ સેક્યુરીટીઝ ઈશ્યુ અને લીસ્ટીંગ) રેગ્યુલેશનસ, ૨૦૦૮;
- (એફ) ધી સેક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઈશ્યુ રજીસ્ટર કરવા અને શેર ટ્રાન્સફર એજન્ટ) રેગ્યુલેશન, ૧૯૯૩ જે કંપની ધારાને લગત છે અને તે કલાન્ટ ને લગતુ છે.
- (જી) ધી સેક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઈકવીટી શેરો ડીલીસ્ટ કરવા બાબત) રેગ્યુલેશનસ, ૨૦૦૯;
- (એચ) ધી સેક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેક્યુરીટીઝનું બાય બેક) રેગ્યુલેશનસ, ૨૦૦૯;
૬. હુ વધુમાં જણાવું છું કે કંપનીમાં હાલ લાગુ કરવામાં આવેલ કમ્પલાયન્સ પ્રણાલી અનુસાર અને લાગુ પડતા દસ્તાવેજો અને રેકર્ડ જોતા અને તેને ચકાસતા કંપનીએ તેને લાગુ પડતા નીચે મુજબના કાયદાઓનું પાલન કરેલ છે:
- (૧) ધી કોન્ટ્રાક્ટ લેબર (રેગ્યુલેશન એન્ડ એબોલીશન) એક્ટ, ૧૯૭૦
આ સાથે લાગુ પડતી જોગવાઈઓ પણ અમે ચકાસી છે કે જે નીચે મુજબ છે.
- (૧) ઈન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્ટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ સેક્ટેરીયલ સ્ટેન્ડર્ડ.
- (૨) કંપની અનલીસ્ટેડ હોવાથી તેઓએ લીસ્ટીંગ એગ્રીમેન્ટ ઓફ સ્ટોક એક્ષચેન્જસ / એસઈબીઆઈ (એલઓડીઆર) રેગ્યુલેશનસું, ૨૦૧૫ નું પાલન કરવાનું રહેતુ નથી.
- રીવ્યુના સમયગાળા દરમ્યાન કંપનીએ સામાન્ય રીતે ઉપર જણાવેલ ધારા, નીયમો, ઠરાવો, સૂચનોનુ, પદ્ધતિઓનું પાલન કરેલ છે અને તે નીચે મુજબના ઓબ્ઝર્વેશન્સ પર આધારીત છે:-

૧. અમો વધુમાં જણાવીએ છીએ કે કંપનીએ એક યોગ્ય વ્યક્તિને કંપની સેક્રેટરી એટલે કે ખાસ મેનેજેરીયલ પર્સનલ (કેએમપી) તરીકે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૨૦૩ મુજબ નિયુક્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દિધેલ છે અને તે ચકાસણીના સમયગાળા દરમ્યાન મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલ માહિતીના આધારે દર્શાવવામાં આવે છે.
૨. શ્રીમતી કવીતા શાહ દ્વારા તા.૨૮/૦૩/૨૦૨૨ ના રોજ સ્ત્રી નિયામકના પદ ઉપરથી રાજીનામું આપવાથી ખાલી પડેલ જગ્યા હજુ સુધી કંપની દ્વારા ભરવામાં આવેલ નથી. કંપની દ્વારા કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૯ મુજબ સ્ત્રી નિયામકોની નિમણૂક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તે સમીક્ષાના સમયગાળા દરમ્યાન કંપનીના વહીવટ દ્વારા આપવામાં આવેલ માહિતીના આધારે જણાવવામાં આવેલ છે.

અમો વધુમાં જણાવીએ છીએ કે:-

કંપનીના નિયામક મંડળની નિમણૂક ૩૧ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ છે અને તે નિગરાણીમાં છે. ધારાના પ્રાવધાનો મુજબ સમીક્ષાના સમયગાળા દરમ્યાન નિયામક મંડળમાં થયેલ ફેરફારો ચકાસવામાં આવશે.

કંપનીના નિયામકોને બોર્ડની બેઠકો કરવા માટે જરૂરી નોટીસ પાઠવામાં આવેલ છે અને એજન્ડા અને એજન્ડાને લગત વિસ્તૃત નોંધો સાત દિવસ અગાઉ મોકલવામાં આવેલ છે અને જો કંપની ધારા, ૨૦૧૩ મુજબ ટુકી નોટીસ આપવાની થાય તો તે પણ કરવામાં આવશે.

વધારે નિર્ણયો બેઠકમાં કેરી કરવામાં આવે છે અને તેની નોંધ મીનીટસમાં કરવામાં આવેલ છે.

અમો વધુમાં જણાવીએ છીએ કે

કંપનીમાં જરૂરી એવી પદ્ધતિઓ અને પ્રણાલીઓ લાગુ કરવામાં આવે છે કે જે તેના વ્યાપ અને કામગીરી પ્રમાણે બરોબર છે અને તેના દ્વારા જરૂરી નિયમો, કાયદાઓ, રેગ્યુલેશન અને ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવે છે કે નહિ તે ચકાસવામાં આવેલ છે.

અમો વધુમાં જણાવીએ છીએ કે:-

૧. ઓડીટના સમયગાળા દરમ્યાન કંપનીને:-

(૧) હાલના શેર ધારકોને રાઈટ બેઝીસ પર તા.૨૨/૦૪/૨૦૨૨ ના બોર્ડના ઠરાવ મુજબ રૂ. ૧૦ પ્રતિ ઈકવીટી શેરના ૩,૬૭,૭૩,૮૩૧ ઈકવીટી શેર ફાળવવામાં આવેલ છે અને તેનાથી રૂ. ૩૬,૭૭,૩૮,૩૧૦ પ્રાપ્ત થયેલ છે.

(૨) હાલના શેર ધારકોને રાઈટ બેઝીસ પર તા.૨૦/૦૭/૨૦૨૨ ના બોર્ડના ઠરાવ મુજબ રૂ. ૧૦ પ્રતિ ઈકવીટી શેરના ૧,૯૬,૦૭,૮૪૩ ઈકવીટી શેર ફાળવવામાં આવેલ છે અને તેનાથી રૂ. ૧૯,૬૦,૭૮,૪૩૦ પ્રાપ્ત થયેલ છે.

(૩) હાલના શેર ધારકોને રાઈટ બેઝીસ પર તા.૨૨/૦૮/૨૦૨૨ ના બોર્ડના ઠરાવ મુજબ રૂ. ૧૦ પ્રતિ ઈકવીટી

શેરના ૯૫,૮૪,૩૧૩ ઈકવીટી શેર ફાળવવામાં આવેલ છે અને તેનાથી રૂા.૯,૫૮,૪૩,૧૩૦ પ્રાપ્ત થયેલ છે.

(૪) હાલના શેર ધારકોને રાઈટ બેઝીસ પર તા.૦૩/૧૧/૨૦૨૨ ના બોર્ડના ઠરાવ મુજબ રૂા.૧૦ પ્રતિ ઈકવીટી શેરના ૪,૯૨,૩૯,૨૧૫ ઈકવીટી શેર ફાળવવામાં આવેલ છે અને તેનાથી રૂા.૪૯,૨૩,૯૨,૧૫૦ પ્રાપ્ત થયેલ છે.

તારીખ: ૩૦/૦૯/૨૦૨૩
સ્થળ : ગાંધીનગર

કે. કે. પટેલ એન્ડ એસોસીએટ્સ

સહી/-
સીએસ કિરન કુમાર પટેલ
પ્રોપરાઈટર
સભ્ય નં. ૬૩૮૪, સી. પી. નં. ૬૩૫૨
યુડીન : એફ૦૦૬૩૮૪ઈ૦૦૧૧૪૫૦૪૯

(આ રીપોર્ટને અમારા ઈવન તારીખના પત્રને સાથે લઈને વાંચવાનું છે કે જે એનેક્સર એ (પાના પ) તરીકે જોડવામાં આવેલ છે તે આ રીપોર્ટનો આંતરીક ભાગ છે.)

‘એનેક્ષર એ’

પ્રતિ,
સભ્યો,
બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ,
બ્લોક નં. ૬, ૭ મો માળ, ઉદ્યોગ ભવન,
સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧.

અમારો આજ તારીખનો અહેવાલ આ પત્ર સાથે વાંચવો.

- (૧) સેક્ટેરીયલ રેકર્ડની જાળવણી તે કંપનીના ના મેનેજમેન્ટની જવાબદારી છે. અમારી જવાબદારી ફક્ત સેક્ટેરીયલ રેકર્ડો પર અમારા ઓડીટના અભિપ્રાય આપવાનો છે.
- (૨) અમારા દ્વારા તમામ ઓડીટ પ્રેક્ટીસ અને પ્રોસેસોનું પાલન કરવામાં આવેલ છે કે જેથી સેક્ટેરીયલ રેકર્ડોની ખરાઈ બાબતે સામાન્ય ખાત્રી પ્રાપ્ત કરી શકાય. આ ચોકસાઈ ટેસ્ટ બેઝ પર કરવામાં આવેલ છે કે જેથી તે નક્કી કરી શકાય કે સેક્ટેરીયલ રેકર્ડોમાં દર્શાવેલ હકીકતો સાચાં છે. અમો માનીએ છીએ કે અમારા દ્વારા પાલન કરવામાં આવેલ પ્રોસેસ અને પ્રેક્ટીસથી અમારા અભિપ્રાયને યોગ્ય સમર્થન મળે છે.
- (૩) અમારા દ્વારા નાણાંકીય રેકર્ડ અને કંપનીના હિસાબી ચોપડાઓની ખરાઈ અને યોગ્યતાની ચકાસણી કરવામાં આવેલ છે.
- (૪) કોરપોરેટના પ્રાવધાનો અને અન્ય લાગુ પડતા નિયમો, કાદયાઓ, રેગ્યુલેશનો અને સ્ટેન્ડરડનું પાલન કરવાની જવાબદારી મેનેજમેન્ટની રહેલ છે. અમારી ચકાસણી ટેસ્ટ આધારે રેકર્ડોનું અને પ્રોસીઝરોનું વેરીફીકેશન સુધી જ સીમીત છે.
- (૫) આ સેક્ટેરીયલ ઓડીટ રીપોર્ટ કંપનીના ભિવષ્યની વાયબલીટી બાબતે કોઈ ખાત્રી આપતી નથી કે તેના ઉપરાંત કંપનીના મેનેજમેન્ટ દ્વારા કંપનીની કામગીરી સારી રીતે અને ચોકસાઈથી કરેલ છે તેની પણ ખાત્રી આપતી નથી.

તારીખ: ૩૦/૦૮/૨૦૨૩
સ્થળ : ગાંધીનગર

કે. કે. પટેલ એન્ડ એસોસીએટ્સ

સહી/-

સીએસ કિરન કુમાર પટેલ

પ્રોપરાઈટર

સભ્ય નં. ૬૩૮૪, સી. પી. નં. ૬૩૫૨

યુડીઆઈએન : એફ૦૦૬૩૮૪૬૦૦૧૧૪૫૦૪૯

એનેક્ષર - ૧

પ્રિન્સીપલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડીટ) - ૨, ગુજરાતની કચેરી

નં. એએમજી-૧ / એકાઉન્ટસ / બીઆરસીએલ / ૨૦૨૨-૨૩ / ૦ ડબલ્યુ ૧૩૫૦ / ૦૬.૧૨.૨૦૨૩

પ્રતિ,

મેનેજિંગ ડિરેક્ટર,

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ,

૭ મો માળ, બ્લોક નં. ૬, ઉદ્યોગ ભવન,

સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧.

વિષય:- કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) (બી) હેઠળ ૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતિતના બહુચરાજી રેલ કોર્પોરેશન લીમીટેડના નાણાંકીય પત્રકો પર કમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયાની ટીપ્પણીઓ.

સાહેબશ્રી,

આ સાથે ૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતિત કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) (બી) હેઠળનું બહુચરાજી રેલ કોર્પોરેશન લીમીટેડની નાણાંકીય પત્રકોને લગત ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલની ટીપ્પણીઓ બાબતે નીલ કમેન્ટ પ્રમાણપત્ર કંપનીના વાર્ષિક સામાન્ય બેઠકમાં રજૂઆત સારું સામેલ રાખેલ છે.

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) અન્વયે કંપની દ્વારા ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલની ટીપ્પણીઓ દરેક વ્યક્તિઓને મોકલવી જરૂરી છે કે જેઓને કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૬ (૧) મુજબ ઓડીટેડ નાણાંકીય પત્રકો મોકલવામાં આવે છે, અને તેજ સમયે તે રીપોર્ટને કંપનીના સ્ટેચ્યુટરી ઓડીટર રીપોર્ટમાં દર્શાવેલ હોય તેજ પ્રમાણે તેને કંપનીના વાર્ષિક સામાન્ય બેઠકમાં પણ પ્રસ્તુત કરવું જરૂરી છે. ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલના એહવાલને વાર્ષિક સામાન્ય બેઠકમાં રજૂ કરતી તારીખ ઓફિસમાં અગાઉથી જાણ કરવી જરૂરી છે.

છાપેલા હિસાબોની છ નકલો ઓફિસમાં કામકાજ અને રેકોર્ડ માટે મોકલવી જરૂરી છે.

આ પત્ર અને તેના સલગન જોડાણો મળ્યા બાબતે જરૂરી રસીદ આપવા વિનંતી છે.

આપનો વિશ્વાસુ

સીનીયર ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ (એએમજી-૧)

બીડાણ:- ઉપર મુજબ

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) (બી) અન્વયે ૩૧ માર્ચ, ૨૦૨૩ અંતિત બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડના નાણાંકીય પત્રકો અન્વયે ભારતના કંમ્પ્ટ્રોલર અને એકાઉન્ટન્ટ જનરલની ટીપ્પણીઓ

કંપની ધારા, ૨૦૧૩ અન્વયે ૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતિત નાણાકીય સિધ્ધાન્તો મુજબ બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડના નાણાંકીય પત્રકો તૈયાર કરવાની જવાબદારી કંપનીના મેનેજમેન્ટની છે. ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલ દ્વારા નિયુક્ત કરેલ સ્ટેચ્યુટરી ઓડીટરોએ તે ધારાની કલમ ૧૩૯ (૫) અને કલમ ૧૪૩ મુજબ આ નાણાંકીય પત્રકો પર તેઓનો સ્વતંત્ર અભિપ્રાય આપવો જરૂરી છે અને તેનો આધાર તે ધારાની કલમ ૧૪૩ (૧૦) માં દર્શાવેલ ઓડીટીંગના સિધ્ધાન્તો મુજબ થવી જોઈએ. તેઓએ દ્વારા તેમ કરવામાં આવેલ છે તેવું તેઓના તારીખ ૨૯ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના ઓડીટ અહેવાલથી સ્પષ્ટ કરેલ છે.

અમોએ ભારતના કોમ્પ્ટ્રોલર અને જોડીટર જનરલના વતી તે ધારાની કલમ ૧૪૩ (૬) (એ) મુજબ ૩૧ માર્ચ, ૨૦૨૩ અંતિત બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડના નાણાંકીય પત્રકોનું સપ્લીમેન્ટ્રી ઓડીટ કરેલ છે. આ સપ્લીમેન્ટ્રી ઓડીટ સ્વતંત્ર રીતે સ્ટેચ્યુટરી ઓડીટરોના કામકાજના કાગળો ચકાસ્યા સીવાય આપેલ છે અને ફક્ત સેટ્યુટરી ઓડીટરોની તપાસ અને કંપની કર્મચારીઓના અને અમુક હિસાબી રેકર્ડની ચકાસણી પર આધારિત છે.

અમારા ઓડીટ મુજબ કોઈ એવી બાબત માલુમ પડેલ નથી કે જેથી સ્ટેચ્યુટરી ઓડીટરના રીપોટ પર કોઈ ટીપ્પણી કરી શકાય કે કોઈ સપ્લીમેન્ટ કરી શકાય.

તેમના દ્વારા અને તેમના વતી

ભારતના કંમ્પ્ટ્રોલર એન ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયા

સહી/-

(સૌરવ કુમાર જયપુરીયાર)

પ્રિન્સીપલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડીટ - ૨), ગુજરાત

સ્થળ:- અમદાવાદ

તારીખ:-૦૬/૧૨/૨૦૨૩

સ્વતંત્ર ઓડીટરોનો અહેવાલ

પ્રતિ

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડના

સભ્યોને

નાણાંકીય પત્રકો પર અહેવાલ

અભિપ્રાય:-

અમોએ ૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતિત ભહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડના (કંપનીના) બેલેન્સ શીટની ચકાસણી કરેલ છે અને તેમાં વર્ષ અંતિત નફા અને નુકશાનના પત્રકો (જેમાં કોમ્પ્રીહેન્સીવ આવકનો સમાવેશ થાય છે), વર્ષ અંતિત કેશ ફ્લોના પત્રકો, વર્ષ અંતિત ઈન્વીટીમાં ફેરફારના પત્રકો અને નાણાકિય પત્રકોના નોંધોનો સમાવેશ થાય છે અને તે ઉપરાંત તેમાં અગત્યના હિસાબી પધ્ધતિઓ અને અન્ય સમજણોનો સમાવેશ થાય છે (જેઓને હવે પછી “નાણાકીય પત્રકો” તરીકે ઉલ્લેખવામાં આવશે).

અમારા મત અનુસાર અને અમને આપવામાં આવેલ માહિતી અને સમજણ અનુસાર ઉપર જણાવેલ નાણાંકીય પત્રકો કંપની ધારા, ૨૦૧૩ અને તેમા (ધારામાં) સમય સમય પર થયેલ સુધારાના જરૂરી કલમો અનુસારની માહિતી આપે છે અને તે એક સાચો અને ખરો ચિત્ર દર્શાવે છે કે જે ભારતમાં ચાલતા હિસાબી પધ્ધતિઓ અનુસાર છે અને તેમાં ઈન્ડ એએસનો સમાવેશ થાય છે અને ૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતિત કંપનીની સ્થિતિ દર્શાવે છે અને કંપનીની નાણાકિય કામગીરી કે જેમાં કોમ્પ્રીહેન્સીવ આવક અને કેશ ફ્લો અને વર્ષના અંતે રહેલ ઈકવીટીમાં ફેરફાર દર્શાવે છે.

અભિપ્રાયનો આધાર:-

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૧૦) માં દર્શાવેલ ઓડીટીંગની પધ્ધતિ (એસએ) મુજબ અમોએ ઓડીટ કરેલ છે. તે પધ્ધતિ અનુસારની અમારી જવાબદારીઓને અમારા રીપોર્ટમાં દર્શાવેલ ઓડીટના નાણાંકીય પત્રકોમાં ઓડીટરની જવાબદારીઓમાં વધુ સારી રીતે દર્શાવેલ છે. અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના કોડ ઓફ એથીકસમાં દર્શાવ્યા મુજબ કંપનીથી સ્વતંત્ર છીએ અને અમારા એથીકલ જવાબદારીઓ અનુસાર કે જે અમારા દ્વારા કરવામાં આવેલ નાણાંકીય પત્રકોના ઓડીટ ને લગત છે તેનું પાલન અમોએ કંપની ધારા, ૨૦૧૩ મુજબ કરેલ છે અને તેના નીયમોનું પાલન કરેલ છે અને કોડ ઓફ એથીકસ મુજબની તમામ એથીકલ જવાબદારીઓ પૂર્ણ કરેલ છે. અમો માનીયે છીએ કે જે ઓડીટને લગત

પૂરાવાઓ અમોને પ્રાપ્ત થયેલ છે તે અમારા નાણાંકીય પત્રકોને લગત અમારા દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય માટે બરોબર છે.

નાણાંકીય પત્રકો માટે મેનેજમેન્ટની અને તેના વહીવટકર્તાઓની જવાબદારીઓ:-

કંપની ધારા, ૨૦૧૩ (ધારા) ની કલમ ૧૪૩ (૫) માં દર્શાવેલ બાબતેની જવાબદારી કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરોની છે કે તે તૈયાર કરવામાં આવેલ નાણાંકીય પત્રકો કે જે નાણાંકીય સ્થિતિ, નાણાંકીય કામગીરી અને કંપનીના કેશ ફ્લોનો સાચો ચિત્ર દર્શાવે છે તે ભારતમાં ચાલતા હિસાબી સિધ્ધાંતોને અનુરૂપ હોવો જોઈએ અને તેમાં ભારતીય હિસાબી પદ્ધતિ (ઈન્ડ એએસ) કે જે તે ધારાની કલમ ૧૩૩, કે જે કંપનીઝ (ભારતીય એકાઉન્ટીંગ સ્ટેન્ડર્ડ્સ) નીયમો, ૨૦૧૫ માં દર્શાવેલ છે.

જવાબદારીઓમાં જરૂરી હિસાબો રકર્ડનોની જાળવણી કે જે ધારાના પ્રાવધાનુ મુજબ હોવી જોઈએ કે જેથી કંપનીના મીલકતોની સુરક્ષા જળવાઈ રહે અને ગેરરીતિ અને છેતરપીંડીને અટકાવી શકાય, જરૂરી હિસાબી પદ્ધતિઓનું અમલીકરણ કરી શકાય, તેવા નિર્ણયો કરી શકાય કે જે વ્યાજબી અને બરોબર હોય અને જરૂરી આંતરીક નાણાંકીય નિયંત્રણો લાગુ કરી શકાય તે માટે જરૂરી વ્યવસ્થા તૈયાર કરી તેનું અમલીકરણ કરી શકાય અને નાણાંકીય રેકર્ડોની ચોકસાઈ અને પૂર્ણતા પણ જાળવી શકાય અને સાચા અને ખરા નાણાંકીય ચિત્રની પ્રાપ્તિ માટે નાણાંકીય પત્રકો તૈયાર કરી શકાય જેથી ભુલ કે છેતરપીંડીથી ખોટા પત્રકો તૈયાર કરવામાં ન આવે.

નાણાંકીય પત્રકો તૈયાર કરવાએ, મેનેજમેન્ટની જવાબદારી છે કે તે કંપનીના કામગીરીની ક્ષમતાની ચકાસણી કરે અને તેને લગત મુદ્દાઓનો અભ્યાસ કરે જો મેનેજમેન્ટ કંપનીને લીકવીડેટ કરવા ન માંગતી હોય અથવા તો તેની કામગીરીઓ બંધ કરવા ન માંગતી હોય તો કંપનીને ચાલુ રાખવા માટે લગત હિસાબી બાબતોને સ્પષ્ટપણે દર્શાવવી જરૂરી છે.

કંપનીના નાણાંકીય પ્રગતિની વિગતોની ચકાસવાની જવાબદારીઓ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરોની રહેલ છે.

નાણાંકીય પત્રકોના ઓડીટ બાબતે ઓડીટરની જવાબદારી:-

અમરો ઉદ્દેશ્ય એ છે કે તે બાબતે ખાતરી કરવી કે નાણાંકીય પત્રકોમાં ઉચાપત કે ભૂલને કારણે કોઈ મટીરીયલ મીસમેચથી મુક્ત છે કે કેમ. રીઝનેબલ એશ્યુરન્સ એક ઉચ્ચ સ્તરનું એશ્યુરન્સ છે, પરંતુ તે એ બાબતની ગેરેન્ટી નથી કે એસએ મુજબ કરવામાં આવેલ ઓડીટ હંમેશા રહેલ મટીરીયલ ગેરરીતિને હંમેશા ઓળખી બતાવે. ખોટી રજુઆતો અને ઉચાપત કે ભુલ જો કોઈ થયેલ હોય તો તેને ધ્યાને લીધેલ છે અને વ્યક્તિગત રીતે કે એગ્રીગેટમાં નાણાંકીય સ્ટેટમેન્ટ ઉપર યુઝર દ્વારા લેવામાં આવેલ નાણાંકીય નિર્ણયો પરની અસરને પણ ધ્યાને લીધેલ છે.

એસએ મુજબના ઓડીટના ભાગરૂપે, અમોએ પ્રોફેશનલ જજમેન્ટ રાખેલ છે અને ઓડીટમાં પ્રોફેશનલ સ્કેપટીસમ પણ રાખેલ છે. ઉપરાંત અમોએ:-

- નાણાંકીય પત્રકોમાં રહેલ મટીરીયલ મીસસ્ટેટમેન્ટને ઓળખી તેની ચકાસણી કરેલ છે કે જે કોઈ પણ ગેરરીતિ કે ભૂલ,

ડીઝાઈનને કારણે થયેલ હોય અને ખતરાઓને લગત ઓડીટ પધ્ધતિઓનું પાલન કરેલ છે અને અમારા અભિપ્રાય માટે જરૂરી ઓડીટ પૂરાવાઓ પ્રાપ્ત કરેલ છે અને તે અમારા અભિપ્રાયનો આધાર છે. કોઈ પણ છેતરપીડીને કારણે થયેલ મટીરીયલ મીસસ્ટેટમેન્ટને ઓળખવામાં રહેલ ખતરો એક ભુલના પરીણામે થયેલ ખતરા કરતા વધારે છે, કારણ કે છેતરપીડીમાં મીલીભગત, ફોર્જરી, જાણી જોઈને કરવામાં આવેલ ઓમીશન, ખોટી રજુઆતો કે આંતરિક નિયંત્રણના ઓવર રાઈડનો સમાવેશ થાય છે.

- આંતરિક નિયંત્રણને લગત સમજણ પ્રાપ્ત કરેલ છે કે જેની મદદથી પરીસ્થિતી અનુસાર ઓડીટ પધ્ધતિઓ તૈયાર કરી શકાય. કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩(૩)(૧) મુજબ અમારા જવાબદારી છે કે અમો તેવો અભિપ્રાય આપીએ કે શું કંપની પાસે જરૂરી આંતરિક નાણાંકીય નિયંત્રણ વ્યવસ્થા રહેલ છે અને તેની કામગીરી આવી વ્યવસ્થાને અનુરૂપ છે.
- વાપરવામાં આવેલ હિસાબી પધ્ધતિઓના વ્યાજબીપણાને ચકાસવી અને હિસાબ અંદાજોની યોગ્યતા ચકાસવી અને મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલ ખુલાસાની ચકાસણી કરવી.
- ગોઈંગ કન્સર્નના આધારે મેનેજમેન્ટના દ્વારા કરવામાં આવેલ તેના ઉપયોગને ચકાસવી અને ઓડીટના પૂરાવાના આધારે ઈવેન્ટ અને કંન્ડીશનોને લગત મટીરીયલ અનીશ્ચિત્તા રહેલ છે કે કેમ તે ચકાસવી કે જે કંપીનના ચાલુ રહેવાની ક્ષમતા પર અસર કરી શકે. જો અમોને તેમ જણાઈ આવે કે મટીરીયલ અનીશ્ચિત્તા રહેલ છે તો નાણાંકીય પત્રકોના અમારા ઓડીટ રીપોર્ટમાં અમારે તે બાબતે ધ્યાન દોરવાની રહે અને જો આવા ખુલાસાઓ બરોબર ન હોય તો અમારા અભિપ્રાયમાં પરીવર્તન લાવવું. પરંતુ, ભવિષ્યની પરીસ્થિતિઓ અને સંજોગોને કારણે કંપની ચાલુ ન પણ રહી શકે.
- અમોએ નાણાંકીય પત્રકોને લગત તમામ પ્રેઝન્ટેશન, સ્ટ્રક્ચર અને વિગતોને ચકાસેલ છે અને તેમા ખૂલાસાઓને સમાવેશ થાય છે કે જેમાં નાણાંકીય પત્રકો લેવડ દેવડો દર્શાવતી હોય અને એક સાચો પ્રેઝન્ટેશન દર્શાવે છે.

વહિવટ કરનાર વ્યક્તિઓનો અમોએ સંપર્ક કરેલ છે અને તેમની પાસે અન્ય બાબતો ઉપરાંત ઓડીટમાં પ્રાપ્ત થયેલ વિગતો બાબતે ચર્ચા કરેલ છે અને તેમાં આંતરિક નિયંત્રણમાં રહેલ ખામીઓ કે જે અમારા ઓડીટમાં જણાઈ આવેલ છે તેની પણ ચર્ચા કરેલ છે.

તેના ઉપરાંત વહીવટમાં રહેલ વ્યક્તિઓને અમોએ એવો પત્રક આપેલ છે કે અમોએ અમારી એથીકલ જરૂરીયાતો કે જે સ્વતંત્રતાને લગત છે તેનું પાલન કરેલ છે અને તેઓને તમામ સંબંધો બાબતે અને અન્ય બાબતે માહિતી આપેલ છે કે જે અમારા ઓડીટની સ્વતંત્રતા ને લગત અને તેના સેફગાર્ડને લગત છે.

વહીવટમાં રહેલ વ્યક્તિઓને આપેલ બાબતોમાં અમોએ નાણાંકીય પત્રકોને લગત સૌથી વધારે અગત્ય બાબતો નક્કિ કરેલ છે કે જે હાલના સમયગાળાને લગત છે અને ખાસ ઓડીટ બાબતોને લગત છે. અમારા ઓડીટ રીપોર્ટમાં તમામ બાબતો દર્શાવેલ છે સીવાય કે પબ્લીક ડીસક્લોશરને લગત બાબતો કે જે રોજબરોજની ન હોય અને અમારા દ્વારા કઈ બાબતો રીપોર્ટમાં

દર્શાવવાની છે તે નક્કી કરવામાં આવેલ છે કારણે કે જો તેમ ન કરવામાં આવે તો તેના વિપરીત પરીણામો આવી શકે અને તેના કારણ પબ્લીક ઈન્ટરેસ્ટ પર ખોટી અસર થઈ શકે.

અન્ય કાયદાકીય અને રેગ્યુલેટરી જરૂરીયાતો પરનો અહેવાલ:-

૧. કંપનીની (ઓડીટર અહેવાલ) ઓર્ડર, ૨૦૨૦ (ધી ઓર્ડર) મુજબની કંપનીની જરૂરીયાતો કે જે ભારત સરકાર દ્વારા ધારાની કલમ ૧૪૩ ની પેટા કલમ (૧૧) મુજબ છે તેના અનુસંધાને અમો એનેક્સર - એ આપીયે છીએ કે જે ઓર્ડર મુજબ એક સ્ટેટમેન્ટ છે અને તે ફકરા ૩ અને ૪ માં દર્શાવેલ છે.
૨. ધારાની કલમ ૧૪૩ (૫) મુજબ અમોએ “એનેક્સર સી” આપેલ છે કે જે તે ધારા અનુસાર કોમ્પ્યુટર અને ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયા દ્વારા આપવામાં આવેલ નિર્દેશોને અનુસાર છે.
- ૩) ધારાની કલમ ૧૪૩ (૩) મુજબ અમો જણાવીએ છીએ કે:-
 - (એ) અમારી જરૂરીયાત પ્રમાણે અમોએ ઓડીટને લગતી તમામ માહિતી અને સ્પષ્ટીકરણો પ્રાપ્ત કરેલ છે કે જે અમારા સંપૂર્ણ જ્ઞાન અને માન્યતા અનુસાર ઉપર જણાવેલ નાણાંકીય પત્રકોના અમારા ઓડીટ માટે જરૂરી છે.
 - (બી) અમારા મત પ્રમાણે ચોપડાઓની ચકાસણીથી જણાઈ આવેલ છે કે કંપની દ્વારા હાલના કાયદા પ્રમાણે હિસાબોના ચોપડાઓ ખરી રીતે નિભાવવામાં આવેલ છે.
 - (સી) આ રીપોર્ટને લગતા બેલેન્સ શીટ, નફા નુકશાનના પત્રકો કે જેમાં અન્ય કોમ્પ્રીહેન્સીવ આવકના પત્રકોનો સમાવેશ થાય છે અને ઈકવીટીમાં ફેરફારના પત્રકો અને કેશ ફ્લો પત્રકો કે જે આ અહેવાલને લગત છે તે હિસાબી ચોપડા પ્રમાણે નિભાવવામાં આવેલ છે કે જે આ નાણાંકીય પત્રકો માટે જરૂરી છે.
 - (ડી) અમારા મત પ્રમાણે, ઉપર જણાવેલ નાણાક્રિય પત્રકોની જાળવણી કરતી વખતે ભારતીય એકાઉન્ટીંગ સ્ટેન્ડર્ડ (ઈન્ડ એએસ) કે જે ધારાની કલમ ૧૩૩ અને કંપની (ઈન્ડીયન એકાઉન્ટીંગ સ્ટેન્ડર્ડસ) રૂલ્સ, ૨૦૧૫ અને તેમાં સમય સમયમાં થયેલ ફેરફારોના પ્રાવધાનોનું પાલન કરવામાં આવેલ છે.
 - (ઈ) આ કંપની એક સરકારી કંપની હોવાથી માનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના તારીખ ૫ મી જુન, ૨૦૧૫ ના ઠરાવ નં. જી.એસ.આર.૪૬૩ (ઈ) મુજબ કંપની ધારા, ૨૦૧૩ નં કલમ ૧૬૪ નુ પેટા કલમ ૨ લાગુ પડતુ નથી.
 - (એફ) અમારા કંપનીના નાણાંકીય અહેવાલને લગત આંતરીક નાણાકીય નિયંત્રણની જરૂરીયાત મુજબ અને નિયંત્રણના કાર્યક્ષમતા મુજબની વિગતો અમોએ અલગ અહેવાલથી “એનેક્સર બી” માં રજુ કરેલ છે.
 - (જી) કંપની એક સરકારી કંપની હોવાથી માનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના તારીખ ૫ મી જુન, ૨૦૧૫ ના ઠરાવ નં. જી.એસ.આર.૪૬૩ (ઈ) મુજબ કંપની ધારા, ૨૦૧૩ નં કલમ ૧૯૭ નુ પેટા કલમ ૧૬ લાગુ પડતુ નથી.

- (એચ) ઓડીટર અહેવાલની અન્ય બાબતો કે જે કંપનીઝ (ઓડીટ એન્ડ ઓડીટર્સ) નિયમ, ૨૦૧૪ ના નીચમ ૧૧ ને લગત છે તે વિષે જણાવવાનું કે અમારી માહિતી અને અમારા અભિપ્રાય અનુસાર અને તેના અનુસંધાને મળેલ સ્પષ્ટીકરણ મુજબની વિગત નીચે પ્રમાણે છે.
- (૧) તા.૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતીતના બેલન્સ શીટમાં કોઈ પ્રકારના દાવાઓ બાકી રહેલ નથી.
- (૨) કંપનીએ લાંબા સમયના કરાર કે જેમાં ડેરીવેટીવ કરારોનો સમાવેશ થાય છે તેના અનુસંધાને હાલના નિયમો અને ભારતીય હિસાબી પદ્ધતિઓ મુજબ જરૂરી પ્રાવધાનો કરેલ છે.
- (૩) કંપની દ્વારા ઈન્વેસ્ટર એડ્યુકેશન અને પ્રોટેક્શન ફંડમાં નાણા ટ્રાન્સફર કરવામાં કે ટ્રાન્સફર કરવાની જરૂરીયાતમાં કોઈપણ પ્રકારનો વિલંબ કરેલ નથી.
- ૪ એ) મેનેજમેન્ટે અમોને જણાવેલ છે કે તેઓની પાસે રહેલ માહિતી અને મંતવ્ય અનુસાર કંપની દ્વારા કોઈપણ ભંડોળો લોન તરીકે કે રોકાણ (ઉધાર લીધેલ નાણા કે શેર પ્રીમીયમ કે કોઈ અન્ય પ્રકારના ભંડોળ) આપવામાં આવેલ નથી કે કોઈ પણ વ્યક્તિ અથવા એન્ટીટી જેમા વિદેશી એન્ટીટીનો સમાવેશ થાય છે (“ઈન્ટરમીડીયેટરી”) ને કોઈપણ જાતના સમજૂતી લેખીત કે અન્ય કોઈપણ રીતે કરવામાં આવેલ નથી કે જેમાં આવા ઈન્ટરમીડીયેટરીએ
- સીધી અને આડકતરી રીતે કોઈ પણ અન્ય વ્યક્તિ કે એન્ટીટીમાં ઉધાર કે રોકાણ કોઈ પણ રીતે કંપનીના વતી (“અલ્ટીમેટ બેનીફીશયરી”) રોકાણ કરશે કે
 - કોઈપણ એવી ગેરેન્ટી, સિક્યુરીટી કે એવી કોઈ પણ કામગીરી અંતિમ લભાર્થી વતી કરશે.
- બી) મેનેજમેન્ટે અમોને જણાવેલ છે કે તેઓની પાસે રહેલ માહિતી અને મંતવ્ય અનુસાર કંપનીને કોઈ પણ વ્યક્તિ અથવા એન્ટીટી જેમા વિદેશી એન્ટીટીનો સમાવેશ થાય છે (“ફંડીટ પાર્ટીઝ”) તેઓ પાસેથી કોઈપણ ભંડોળ માટે કોઈ પણ સમજૂતી કે જે લેખીત અથવા અન્ય કોઈ રીતે કરેલ જેમાં,
- સીધી અને આડકતરી રીતે કોઈ પણ અન્ય વ્યક્તિ કે એન્ટીટીમાં ઉધાર કે રોકાણ કોઈ પણ રીતે કંપનીના વતી (“અલ્ટીમેટ બેનીફીશયરી”) રોકાણ કરશે કે
 - કોઈપણ એવી ગેરેન્ટી, સિક્યુરીટી કે એવી કોઈ પણ કામગીરી અલ્ટીમેટ બેનીફીશયરી વતી કરશે.
- સી) તેઓ ઓડીટ પદ્ધતિઓના આધારે કે જેને બરોબર અને યોગ્ય પરિસ્થિતીમાં કરેલ માની શકાય તેઓ કોઈ પણ બાબત અમારા ધ્યાન પર આવેલ નથી કે જેનાથી અમો એમ માની શકીએ કે ઉપર જણાવેલ પેટા કલમ (એ) અને (બી) મુજબ કોઈ પણ મટીરીયલ મીસ સ્ટેટમેન્ટ રહેલ છે.
- ૫) કંપનીએ વર્ષ દરમ્યાન કોઈ પણ ડીવીડન્ટ જાહેર કરેલ નથી કે ચૂકવેલ નથી અને વર્ષ માટે કોઈપણ આખરી ડીવીડન્ટ સૂચવેલ નથી.

- ૧) કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૨૦૩(૧) અને તેની સાથે કંપનીઝ (મેનેજેરીયલ પ્રસનલની નિયુક્તિ અને પગાર) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૮ મુજબ કે જેથી ખાસ મેનેજેરીયલ પર્સનલ (કેએમપી) ની નિયુક્તિ કરવાની થાય છે. કંપનીએ કોઈ પણ ફુલ ટાઈમ કોલીફાઈડ કંપની સેક્ટરીને અહેવાલની તારીખ સુધી નિયુક્ત કરેલ નથી. પરંતુ અમારી માહિતી અનુસાર અને મેનેજમેન્ટ દ્વારા અમોને આપવામાં આવેલ સમજ અનુસાર કંપનીએ પ્રેક્ટીસ કરનાર કંપની સેક્ટરીઓની સેવાઓ પ્રાપ્ત કરેલ છે.

શાહ એન્ડ દલાલ વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ
એફઆરએન : ૧૦૯૪૩૨૬બલ્યુ

સહી/-

મલય દલાલ

ભાગીદાર

સભ્ય. નં. ૦૩૬૭૭૬

યુડીઆઈએન : ૨૩૦૩૬૭૭૬બીજીડબલ્યુજેજેડેડ૪૫૫૧

સ્થળ:- અમદાવાદ

તારીખ:- ૨૯/૦૯/૨૦૨૩

સ્વતંત્ર ઓડીટરના અહેવાલને લગત એનેક્ષર - એ

(કાયદાકીય અને રેગ્યુલેટરી જરૂરીયાતોના રીપોર્ટના ફકરા નંબર - ૧ ના અનુસંધાને)

૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતિતના નાણાકીય પત્રકો ઉપર બહુચરાણુ રેલ કોર્પોરેશન લીમીટેડના સભ્યોને અહેવાલ કરવામાં આવે છે અને આ એનેક્ષર સ્વતંત્ર ઓડીટરોને સંબંધિત છે.

અમો અહેવાલ આપીએ છીએ કે:-

૧. કંપનીની ફીક્સ એસેટના સંદર્ભમાં:

(એ) કંપની પાસે કોઈ ફીક્સ એસેટ રહેલ નથી અને તેથી આ કલમ લાગુ પડતુ નથી.

(બી) કંપની દ્વારા બધા જ રેકોર્ડ સારી રીતે જાળવવામાં આવેલ છે કે જે નાણાકીય પત્રકોમાં રાઈટ ટુ યુઝ એસેટસની તમામ વિગતો દર્શાવે છે.

(સી) અમોને આપવામાં આવેલ માહિતી અને સમજણ અનુસાર અને અમારા દ્વારા ચકાસવામાં આવેલ કંપનીના રેકર્ડ અનુસાર કંપની પાસે રહેલ તમામ ઈમુવેબલ મીલકત કંપનીના નામે જ છે.

(ઈ) અમોને આપવામાં આવેલ માહિતી અને સમજણ અનુસાર, કંપની સામે એવા કોઈ પણ કાર્યવાહીઓ કરવામાં આવી નથી કે પડતર નથી કે જે કંપની દ્વારા કોઈ પણ બેનામી પ્રોપર્ટી કે જે બેનામી ટ્રાન્ઝેક્શન (પ્રોડીબીશન) ધારા, ૧૯૮૮ (૪૫ ઓફ ૧૯૮૮) કે તેના નીચમો અંતર્ગત છે. આથી આ કલમ કંપનીને લાગુ પડતુ નથી.

૨. ચાલુ નાણાકીય વર્ષમાં કંપની પાસે કોઈપણ પ્રકારની ઈન્વેન્ટરી નથી અને તેથી આ કલમ લાગુ પડતુ નથી.

૩. અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ અને અમારા દ્વારા ચાલુ વર્ષે કંપનીના રેકર્ડની ચકાસણી મુજબ કંપનીએ કોઈ પણ રોકાણ કરેલ નથી કે, કોઈ પણ ગેરેન્ટી કે સેક્યુરીટી કે લોન આપેલ નથી કે જે કોઈ પણ લોન કે જે તારણવાળી કે તારણ વગરની કંપનીને હોય, કે ફર્મને હોઈ કે લીમીટેડ લાયબલીટી પાર્ટનરશીપને લગત હોય કે જે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૮૯ મુજબ રાખવામાં આવેલ રજીસ્ટરમાં દર્શાવવામાં આવતી હોય. તેથી ફકરા નંબર ૩ ની કલમ (૩) કંપનીને લાગુ પડતુ નથી.

૪. અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ કંપનીએ કોઈ પણ લોન આપેલ નથી કે કોઈ પણ ગેરેન્ટી કે સિક્યુરીટી કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૮૫ અને ૧૮૬ મુજબ આપેલ નથી. તેથી ફકરા નંબર ૩ ની કલમ (૪) કંપનીને લાગુ પડતુ નથી.

૫. કંપનીએ આપેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ કંપનીએ કોઈપણ જાતનું નિવેશ કે નાણાં સ્વીકારેલ નથી કે જે હાલના વર્ષમાં રોકાણ તરીકે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા આપવામાં આવેલ આદેશો મુજબ માની શકાય અને જે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૭૩ થી ૭૬ માં દર્શાવેલ છે અને તેના નીચેના નિયમોમાં દર્શાવેલ છે અને તેથી ફકરા નંબર ૩ ની કલમ (૫) કંપનીને લાગુ પડતુ નથી.

૬. કેન્દ્ર સરકાર દ્વારા કંપની ધારા, ૨૦૧૩ ના કલમ ૧૪૮ ના પેટા કલમ (૧) માં જણાવેલ કોસ્ટ રેકોર્ડની જાળવણી કંપનીને લાગુ પડતુ નથી. આથી ફકરા નંબર ૩ ની કલમ (૬) કંપનીને લાગુ પડતુ નથી.
૭. અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ સ્ટેચ્યુટરી લેણાની માહિતી નીચે મુજબ છે:-
- એ) કંપની અનડીસ્પુટેડ સ્ટેચ્યુટરી લેણા ભરવામાં નિયામિત છે જેમાં ઈનકમ ટેક્સ, ગુડ્સ અને સર્વિસ ટેક્સ અને અન્ય મટીરીયલ સ્ટેચ્યુટરી લેણાના સમાવેશ થાય છે કે જે લાગતી વળગતી સત્તાઓને ચુકવવાની થાય છે.
- બી) કોઈ પણ પ્રકારની ડ્યુટી કે ટેક્સ બાબતે કોઈપણ રેવન્યુ સત્તા સાથે કોઈ પણ પ્રકારની તકરારો હાલમાં ચાલુ નથી.
૮. અમોને આપવામાં આવેલ માહિતી અને સમજણ અનુસાર અને અમારા દ્વારા કંપનીના રેકોર્ડની ચકાસણી કરવાથી જણાઈ આવે છે કે કંપની દ્વારા કોઈ પણ લેવડ દેવડને સરન્ડર કે ડીઝકલોજ કરવામાં આવેલ નથી કે જે હિસાબી ચોપડામાં અગાઉ આવક તરીકે દર્શાવવામાં આવેલ નથી કે જે ચાલુ વર્ષે ઈન્કમ ટેક્સ ધારા, ૧૯૬૧ ના એસેસમેન્ટમાં આવે છે.
૯. (એ) કંપનીએ કોઈપણ નાણાકીય સંસ્થા, બેન્ક, સરકાર કે ડીબેન્ટર ધારક દ્વારા ચાલુ વર્ષે કોઈપણ લોન કે ઉધાર લીધેલ નથી. આથી ફકરા નંબર ૩ ની કલમ (૯) અત્રે લાગુ પડતુ નથી.
- (બી) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર અને અમારા દ્વારા કંપનીના હિસાબોની ચકાસણી અનુસાર કંપનીને કોઈ પણ બેન્ક કે નાણાંકીય સંસ્થા કે સરકાર કે સરકારી સંસ્થા દ્વારા વીલીગ ડીફોલ્ટર જાહેર કરવામાં આવેલ નથી.
- (સી) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર કંપનીએ હાલના વર્ષમાં કોઈ પણ ટર્મ લોન પ્રાપ્ત કરેલ નથી. તેથી ઓર્ડરની કલમ ૩ (૯) (સી) કંપનીને લાગુ પડતુ નથી.
- (ડી) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર અને કંપનીના બેલેન્સ શીટની ચકાસણી કરવાથી અમો જણાવીએ છે કે ટુકા ગાળા માટે લેવામાં આવેલ કોઈ પણ ફંડને લાબા ગાળાની કામગીરી માટે કંપની દ્વારા વાપરવામાં આવેલ નથી.
- (ઈ) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર અને કંપનીના નાણાંકીય પત્રકોની ચકાસણીથી અમો જણાવીએ છીએ કે કંપનીએ કોઈ પણ દ્વારા કોઈ પણ એન્ટીટી કે વ્યક્તિ પાસેથી તેના સબસીડીરીની જવાબદારી માટે કંપની ધારા, ૨૦૧૩ ની જવાબદારીઓ અનુસાર કોઈ પણ ફંડ લીધેલ નથી. કંપની કોઈપણ એસોસિયેટ કંપની કે સૈયુક્ત એકમમાં કોઈ પણ પ્રકારનો રોકાણ કરેલ નથી કે જે કંપની ધારા, ૨૦૧૩ મુજબ છે.
- (એફ) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર અને અમારા દ્વારા કરવામાં આવેલ પદ્ધતિઓ અનુસાર અમો જણાવીએ છીએ કે ચાલુ વર્ષે કંપનીએ કોઈપણ લોન ઉભુ કરેલ નથી કે કંપની ધારા, ૨૦૧૩ માં જણાવ્યા મુજબ તેના સબસીડીરીમાં રહેલ સેક્યુરીટીના પ્લેજથી ઉભા કરેલ છે.

૧૦. (એ) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર આ વર્ષે કંપનીએ કોઈ પણ શરૂઆતી પબ્લીક ઓફર કે વધુના પબ્લીક ઓફર (જેમાં ડેબ્ટ ઈન્સ્ટ્રુમેન્ટ) થી કોઈ પણ નાણાં પ્રાપ્ત કરેલ નથી અને વધુમાં કંપનીએ કોઈ પણ પ્રકારની ટર્મ લોન પ્રાપ્ત કરેલ નથી અને તેથી આ કલમ કંપનીને લાગુ પડતુ નથી. પરંતુ કંપનીએ ઈકવીટી શેરોથી પ્રાપ્ત થયેલ નાણાંનો ઉપયોગ કરેલ છે અને તે નાણાં જેના માટે ઉભા કરેલ છે તે જ હેતુ માટે વાપરવામાં આવેલ છે.
- (બી) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર, ઓડીટરો દ્વારા કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ ના પેટા કલમ (૧૨) મુજબ કોઈ પણ અહેવાલ ફોર્મ એડીટી - ૪ મુજબ કરવામાં આવેલ નથી કે જે કંપનીઝ (ઓડીટ એન્ડ ઓડીટર્સ) રૂલ્સ, ૨૦૧૪ ના નીયમ ૧૩ માં દર્શાવવામાં આવેલ છે અને જે સમય સમયમાં એમેન્ડ કરવામાં આવેલ છે.
૧૧. (એ) અમારા દ્વારા કંપનીના ચોપડા અને રેકર્ડની ચકાસણીના આધારે અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણના આધારે કંપની દ્વારા કોઈ પણ છેતરપીડી કે કંપનીના અધિકારીઓ કે તેના કર્મચારીઓ દ્વારા ચાલુ સમયગાળામાં કોઈ પણ જાતની છેતરપીડી નજરે આવેલ નથી.
- (બી) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર, ઓડીટરો દ્વારા કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ ના પેટા કલમ (૧૨) મુજબ કોઈ પણ અહેવાલ ફોર્મ એડીટી - ૪ મુજબ કરવામાં આવેલ નથી કે જે કંપનીઝ (ઓડીટ એન્ડ ઓડીટર્સ) નિયમ, ૨૦૧૪ ના નીયમ ૧૩ માં દર્શાવવામાં આવેલ છે અને જે કેન્દ્ર સરકાર સાથેના સુધારા મુજબ છે.
- (સી) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કોઈ પણ જાતની ખુલાસા આપનાર ફરીયાદ કંપનીને વર્ષ દરમ્યાન પ્રાપ્ત થયેલ નથી.
૧૨. અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપની એક નીધી કંપની નથી. તેથી ઓર્ડરની કલમ ૩ (૧૨) લાગુ પડતુ નથી.
૧૩. અમારા મતે અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૮૮ અને ૧૭૭ નું જે સ્થાને લાગુ પડે ત્યાં કંપની પાલન કરે છે. લાગતા વળગતા પાર્ટીઓના તમામ લેવડદેવડ અને પક્ષકારોના લેવડદેવડની વિગતો નાણાંકીય પત્રકોમાં દર્શાવેલ છે કે જે ભારતીય હિસાબી સિધ્ધાંતોમાં દર્શાવેલ છે.
૧૪. (એ) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ અને અમારી ઓડીટ પદ્ધતિ મુજબ અમારા મતે કંપની પાસે તેની સાર્થક અને ધંધાના પ્રકાર મુજબ એક આંતરીક ઓડીટ સીસ્ટમ રહેલ છે.
- (બી) અમારા દ્વારા ઓડીટના સમયગાળા માટે કંપનીના આંતરીક ઓડીટ રીપોર્ટો ચકાસેલ છે.
૧૫. અમારા મત અનુસાર અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ આ સમયગાળા દરમ્યાન કંપનીએ તેના કોઈપણ નિયામક કે તેઓ સાથે જોડાયેલ વ્યક્તિઓ સાથે કોઈ પણ બીન રોકડ લેવડ દેવડ કરેલ નથી.

૧૬. (એ અને બી) કંપનીએ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ, ૧૯૩૪ ની કલમ ૪૫ - આઈ એ મુજબ નોંધાયેલ હોવાની જરૂરીયાત રહેલ નથી. તેથી ઓર્ડરની કલમ ૩ (૧૬) (એ) અને (બી) અત્રે લાગુ પડતુ નથી.
- (સી અને ડી) રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયમો મુજબ કંપની એક કોર ઈન્વેસ્ટમેન્ટ કંપની (સીઆઈસી) નથી. તેથી ઓર્ડરની કલમ ૩ (૧૬) (સી) અને (ડી) અત્રેને લાગુ પડતુ નથી.
૧૭. કંપનીએ ચાલુ સાલે કે આવનાર નાણાકીય વર્ષમાં કોઈ પણ કેશ લોસનો સામનો કરવો પડેલ નથી.
૧૮. આ સમયગાળા દરમ્યાન કોઈ પણ સ્ટેચ્યુટરી ઓડીટરોએ રાજીનામુ આપેલ નથી.
૧૯. નાણાકીય રેશીઓ, એજીગ અને નાણાકીય એસેટોના રીવલાઈજેશનની તારીખ અને નાણાકીય જવાબદારીઓના ચુકવણા અને નાણાકીય પત્રકો સાથેની અન્ય માહિતી અને નિયામક મંડળના પ્લાનો અને મેનેજમેન્ટ અનુસાર અમારો એવો મત છે કે ઓડીટ રીપોર્ટની તારીખે મટીરીયલ અનીશ્ચિત્તા ઓડીટ રીપોર્ટની તારીખે રહેલ નથી, અને કંપની તેની જવાબદારીઓ પૂરી કરી શકે છે કે જે બેલેન્સ શીટની તારીખે રહેલ છે અને બેલેન્સ શીટની તારીખથી એક વર્ષમાં જ્યારે પણ તે સામે આવે.
૨૦. અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર વપરાયા સીવાયની જે રકમ કંપની ધારાના શેડ્યુલ ૭ માં દર્શાવેલ ફંડમાં ટ્રાન્સફર કરવાના હોય છે કે જે આ ધારાની કલમ ૧૩૫ ના પેટા કલમ (૫) ના બીજા પ્રોવીઝોમાં દર્શાવેલ છે તે કંપનીને લાગુ પડતુ નથી. તેથી ઓર્ડરની કલમ ૩ (૨૦) (એ) અને ૩ (૨૦) (બી) લાગુ પડતુ નથી.
૨૧. અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપની પાસે કોઈપણ એસોસિયેટ કે જોઈન્ટ વેન્યર કંપની નથી. તેથી ઓર્ડરના ફકરા નંબર ૩ ની કલમ (૨૧) કંપનીને લાગુ પડતુ નથી.

શાહ એન્ડ દલાલ વતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

એફઆરએન : ૧૦૯૪૩૨૩બલ્યુ

સહી/-

મલય દલાલ

ભાગીદાર

સભ્ય નં. ૦૩૬૭૭૬

યુડીઆઈએન : ૨૩૦૩૬૭૭૬બીજીડબલ્યુજેજેઝેડ૪૫૫૧

સ્થળ:- અમદાવાદ

તારીખ:- ૨૯/૦૯/૨૦૨૩

સ્વતંત્ર ઓડીટર્સના અહેવાલને લગત એનેક્સર - બી

(અહેવાલના અન્ય કાયદાકીય અને રેગ્યુલેટરી જરૂરીયાત વિભાગમાં ફકરા નંબર ૩ (એફ) માં દર્શાવેલ છે કે જે અમારા અહેવાલની તારીખ મુજબ છે.)

નાણાકીય અહેવાલ ઉપર આંતરીક નાણાકીય નિયંત્રણો પરનો અહેવાલ

આંતરીક નાણાકીય નિયંત્રણો પરનો અહેવાલ કે જે કંપની ધારા, ૨૦૧૩ (તે ધારા) ની કલમ ૧૪૩ ના પેટા કલમ ૩ ના કલોઝ (૧) નીચે આવે છે.

અમોએ ૩૧ મી માર્ચ, ૨૦૨૩ મુજબ બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ (તે કંપની) ના નાણાકીય રીપોર્ટીંગ પરના આંતરીક રીપોર્ટીંગ કરેલ છે અને તે અમારા નાણાકીય પત્રકો પરના અમારા ઓડીટ મુજબ છે કે જે વર્ષના અંતેની તારીખે છે.

આંતરીક નાણાકીય નિયંત્રણો માટે મેનેજમેન્ટની જવાબદારી:-

આંતરીક નાણાકીય નિયંત્રણની જાળવાણી જવાબદારી કંપનીના મેનેજમેન્ટની છે અને તેનો આધાર કંપનીના ફાઈનાન્શીયલ રીપોર્ટીંગ કાઈટેરીનું આંતરીક નિયંત્રણ છે જે ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા જારી કરવામાં આવેલ ઓડીટ ઓફ ઈન્ટરનલ ફાઈનાન્શીયલ કંટ્રોલ ઓવર રીપોર્ટીંગના ગાઈડન્સ નોટમાં દર્શાવવામાં આવેલ છે. આ જવાબદારીઓમાં ડીઝાઈન, અમલીકરણ અને આંતરીક નાણાકીય નિયંત્રણોની જાળવણીનો સમાવેશ થાય છે કે જેથી ધંધો સારી અને સમયબધ રીતે ચાલી શકે, કંપનીની નિતીઓનું પાલન થાય, તેના હેતુઓ સચવાય, ઉચાપત અને ભુલોને અટકાવી શકાય અને ઓળખી શકાય, હિસાબી રેકર્ડને બરાબર અને સંપૂર્ણ રીતે જાળવી શકાય અને કંપની ધારા, ૨૦૧૩ અંતરગત જરૂરી નાણાકીય માહિતી સમયસર તૈયાર કરી શકાય તેવી બાબતોનો સમાવેશ થાય છે

ઓડીટરોની જવાબદારી:-

અમારી જવાબદારી અમારા ઓડીટના આધારે કંપનીના આંતરીક નાણાકીય નિયંત્રણો દ્વારા કંપનીના ફાઈનાન્શીયલ રીપોર્ટીંગ બાબતે અભિપ્રાય આપવાનો છે. અમોએ અમારૂં ઓડીટ નાણાકીય રીપોર્ટીંગ (ધી ગાઈડ નોટ) પર આંતરીક નાણાકીય નિયંત્રણના ગાઈડન્સ નોટના આધારે અને કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૧૦) કે જે ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરેલ સ્ટેન્ડર્ડ ઓન ઓડીટીંગ પર આધારિત છે કે જેથી આંતરીક નાણાકીય નિયંત્રણો પર એપ્લીકેબીલીટી વધારી શકાય. આ સ્ટેન્ડર્ડ અને ગાઈડન્સ નોટ મુજબ અમોએ એથીકલ જરૂયાતોનું પાલન કરવું પડે અને ઓડીટ તે રીતે કરવું પડે કે જેથી તે સાબીત થાય કે ફાઈનાન્શીલ રીપોર્ટીંગ પર આંતરીક નાણાકીય નિયંત્રણો લાગે કરવામાં આવેલ છે અને તે જાળવવામાં આવેલ છે અને તે મટીરીયલ સંદર્ભમાં સારી રીતે લાગુ કરવામાં આવેલ છે.

અમારા ઓડીટમાં તેની પ્રક્રિયા સામેલ છે કે જેથી અમો નાણાંકીય રીપોર્ટિંગ અને તેની અસરકારકતા ઉપર આંતરીક નાણાંકીય નિયંત્રણ વ્યવસ્થાની કામગીરી જાણી શકાય.

અમારા ઓડીટમાં એવી પ્રક્રિયાઓ લાગુ કરવામાં આવેલ છે કે જેથી નાણાકીય રીપોર્ટિંગ પર આંતરીક નાણાંકીય નિયંત્રણો લાગુ કરવામાં આવેલ છે તે બાબતે ઓડીટમાં સાબીતી પ્રાપ્ત કરી શકાય. અમારા ઓડીટમાં નાણાંકીય રીપોર્ટિંગ પર થયેલ આંતરીક નાણાંકીય નિયંત્રણો અને મેટીરીયલ રીસ્કની ચકાસણી અને એસેસ રીસ્ક પર ડીઝાઈનનું ટેસ્ટિંગ અને ઈવેલ્યુએશનની અસર વગેરે સામેલ છે. લાગુ કરવામાં આવેલ પ્રક્રિયા ઓડીટરના જજમેન્ટ પર આધારિત છે જેમાં નાણાંકીય પત્રકો પર મેટીરીય મીસસ્ટેટમેન્ટના ખતરાઓનો પણ સમાવેશ થાય છે કે જે છેપરપીડી કે ભુલના કારણે હોય શકે.

અમો માનીએ છીએ કે અમારા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ ઓડીટની વિગતો કંપનીના નાણાંકીય રીપોર્ટિંગ પર રહેલ આંતરીક નાણાંકીય નિયંત્રણો બાબતે ઓડીટ અભિપ્રાય પ્રાપ્ત કરવા માટે યોગ્ય અને બરાબર છે.

નાણાંકીય અહેવાલ પર આંતરીક નાણાંકીય નિયંત્રણનું અર્થ:-

એક કંપનીનું નાણાકીય રીપોર્ટિંગ પરનું આંતરીક નાણાંકીય નિયંત્રણ તે પ્રક્રિયા છે કે જેથી નાણાંકીય રીપોર્ટિંગ બાબતે ખાત્રી પ્રાપ્ત કરી શકાય અને હિસાબી નીતીઓ મુજબ એક્ષટરનલ કામગીરી માટે નાણાંકીય પત્રકો તૈયાર કરી શકાય. એક કંપનીના નાણાંકીય રીપોર્ટિંગ પરના આંતરીક નાણાકીય નિયંત્રણમાં તે નિતીઓ અને પદ્ધતિઓનો સમાવેશ થાય છે કે:-

- (૧) રેકોર્ડની જાળવણી કરવા સારૂ કે જે વિગતવાર, ચોકસાઈથી અને તે રીતે કે કંપનીના એસેટની વિગતો દર્શાવી શકાય,
- (૨) એવી ખાત્રી આપી શકે કે નાણાંકીય પત્રકો માટેના લેવડ દેવડ કરવા માટે માન્યતાપ્રાપ્ત હિસાબી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવેલ છે અને કંપનીના રસીદો અને ખર્ચાઓ કંપનીના મેનેજમેન્ટ અને નિયામકોના હુકમ મુજબ કરવામાં આવેલ છે,
- (૩) એવી ખાત્રી પ્રાપ્ત કરી શકાય કે કોઈ ગેરકાયદેસર એકવેઝીશન કે કંપનીના એસેટનું ખોટી રીતે ઉપયોગ કે જે નાણાંકીય પત્રક પર અસર કરી શકે તેની સમયસર માહિતી પ્રાપ્ત કરી શકાય.

નાણાંકીય અહેવાલ પર આંતરીક નાણાંકીય નિયંત્રણની મર્યાદાઓ:-

નાણાંકીય રીપોર્ટિંગ પર આંતરીક નાણાંકીય નિયંત્રણની મર્યાદાઓ સિમિત હોવાથી, કે જેમાં કોલ્યુશનની કે ખોટા મેનેમેન્ટની સંભાવના રહેલ હોવાથી ભૂલ કે ગેરરીતીથી થયેલ મેટીરીયલ મીસસ્ટેટમેન્ટને ઓળખી ન શકાય. વધુમાં ભવિષ્યના સમયગાળા માટેના નાણાંકીય રીપોર્ટિંગ પરના આંતરીક નાણાંકીય નિયંત્રણોના વિશલેષણમાં તે ખતરો રહેલ છે કે પરીસ્થિતિમાં ફેરફારથી કે અન્ય કારણોથી તેનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી શકાય નહી.

અભિપ્રાય:-

અમારા મતે ને અમારી પાસે રહેલ માહિતી અને અમોને આપવામાં આવેલ સ્પષ્ટતા મુજબ કંપની પાસે તમામ મેટીરીયલ સંદર્ભમાં, નાણાંકીય રીપોર્ટિંગ પર આંતરીક નાણાંકીય નિયંત્રણ છે અને નાણાંકીય રીપોર્ટિંગ પર આવા આંતરીક નાણાંકીય નિયંત્રણો ૩૧ મી માર્ચ, ૨૦૨૩ થી અમલમાં છે અને કંપની દ્વારા નાણાંકીય રીપોર્ટિંગ પર મુકવામાં આવેલ આંતરીક

નિયંત્રણના આધારે અને આંતરીક નિયંત્રણના જરૂરી કોમ્પોનન્ટના આધારે તેમ કહી શકાય કે તે ઈન્સ્ટીટ્યુટર ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડીયાના ઓડીટ ઓફ ઈન્ટરનલ ફાઈનાન્શીયલ કંટ્રોલ ઓવર ફાઈનાન્શીયલ રીપોર્ટીંગના ગાઈડન્સ નોટ મુજબ છે.

શાહ એન્ડ દલાલ વતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ

એફઆરએન : ૧૦૯૪૩૨૩બલ્યુ

સ્થળ:- અમદાવાદ

તારીખ:- ૨૯/૦૯/૨૦૨૩

સહી/-

મલય દલાલ

ભાગીદાર

સભ્ય. નં. ૦૩૬૭૭૬

યુડીઆઈએન : ૨૩૦૩૬૭૭૬બીજીડબલ્યુજેજેઝેડ૪૫૫૧

સ્વતંત્ર ઓડીટર્સના અહેવાલને લગત એનેક્ષર - સી

પ્રતિ,
સભ્યો,

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ (તે કંપની) ના નાણાંકીય પત્રકો ઉપરના સ્વતંત્ર ઓડીટર અહેવાલના સાથેનું જોડાણ કે જેથી અમો આદેશો અને પેટા આદેશોમાં જણાવેલ છે કે જે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (પ) મુજબ વર્ષ ૨૦૨૨ - ૨૦૨૩ માટે લાગુ કરવામાં આવેલ છે તે નીચે મુજબ છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૨ - ૨૩ માટે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩(પ) મુજબનો અહેવાલ.

૧. મુખ્ય સુચનો

ક્રમ નં.	માર્ગદર્શન	પ્રત્યોત્તર
૧.	શુ કંપની એવી કોઈ પ્રક્રિયા અમલમાં રાખેલ છે કે જેથી કે તમામ હિસાબીય લેવડ દેવડ આઈટી પ્રક્રિયાથી થઈ શકે ? જો ના, તો આઈટી પ્રક્રિયા સિવાય કરવામાં આવેલ હિસાબી લેવડ દેવડ અને અન્ય કામગીરી અને તેની હિસાબો પર અસર અને તેની નાણાકીય અસરો જો કોઈ હોય તો તે દર્શાવવો.	હા, કંપને તમામ નાણાકીય લેવડ દેવડ માટે આઈટી સીસ્ટમ અમલમાં લાવેલ છે. તેથી હિસાબોની ગુણવત્તા પર કોઈ નાણાંકીય અસર રહેલ નથી.
૨.	શુ કોઈ લેન્ડર દ્વારા કંપની દ્વારા લોન ન ભરવાના કારણે કોઈ ચાલુ લોન પર રીસ્ટ્રક્ચરીંગ કરવામાં આવેલ છે કે ડેબીટ/લોન/વ્યાજ વિગેરેના કોઈ વેઈવર/રાઈટઓફ ના કિસ્સા બનેલ છે ? જો હા તો તેની નાણાંકીય અસરો દર્શાવો.	ઓડીટના સમય દરમ્યાન કંપનીએ કોઈ વેઈવર / રાઈટ ઓફ કરેલ નથી.
૩.	શું કેન્દ્રીય / રાજ્ય એજન્સી તરફથી કોઈ ખાસ સ્કીમ માટે મળેલ / મળવા પાત્ર ભંડોળનો હિસાબ પ્રમાણે / તેની શરતો અને નિયમો મુજબ વાપરવામાં આવેલ છે. જે તેમ ન કરવામાં આવેલ હોય તો તેની યાદી.	અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપનીને કોઈ પણ ખાસ પ્રોજેક્ટ માટે કેન્દ્ર / રાજ્ય એજન્સીઓ પાસેથી કોઈ નાણાં મળેલ નથી સીવાય કે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન અને જી-રાઈડ પાસેથી પ્રાપ્ત થયેલ શેર કેપીટલની રકમ અને તેનો હિસાબ બરાબર રાખવામાં આવેલ છે અને તે બેન્ક ખાતામાં જમા કરવામાં આવેલ છે.

૨. શાખાને લગત સૂચનો : માળખાકીય શાખાઓ:-

ક્રમ નં.	પેટા માર્ગદર્શન	પ્રત્યોત્તર
૧.	કંપની પાસે રહેલ જમીન પર દબાણ ન થાય તે માટે કંપની તરફથી યોગ્ય પગલાઓ લેવામાં આવેલ છે કે કેમ. શુ કંપનીના કોઈ જમીન પર દબાણ થયેલ છે કે તે દાવા અંતર્ગત છે કે તેનો ઉપયોગ કરવામાં આવેલ નથી કે તેને સર્પલ્સ જાહેર કરવામાં આવેલ છે. વિગતો આપવી.	અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ પ્રમાણે ઓડીટના સમયગાળામાં અમારા જાણ પર આવેલ કે કંપની પાસે કોઈ પણ પ્રકારની જમીન રહેલ નથી.
૨.	શુ સરકારના સૂચનો / નીતીઓ મુજબ પબ્લીક પ્રાઈવેટ ભાગીદારી મુજબ કોઈ પણ પ્રોજેક્ટનું વેગ માટે ઓળખાણ કરવામાં આવેલ છે. જો કોઈ ફેરબદલી હોય તો જણાવો.	લાગુ પડતુ નથી.
૩.	શુ કોઈ ચાલુ કરાર કે જેમાં કામગીરીના લક્ષ્યાંકો દર્શાવેલ છે તેમા ભાવ વધારા કે અન્ય કારણોસર કોઈ રેવન્યુ / નુકશાન કરારોના કારણે થયેલ છે અને શુ તે ચોપડાઓમાં બરોબર દર્શાવવામાં આવેલ છે.	અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ અમો નીચે મુજબ જણાવીએ છીએ:- ૧. કામગીરીના અમલીકરણની ચકાસણી માટેની વ્યવસ્થા:- એ) કંપનીએ તેઓના પહેલા બોર્ડ મીટીંગમાં કે જે ૦૯/૦૧/૨૦૧૯ ના રોજ થયેલ છે તેમાં ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (જી - રાઈડ) ને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટ (પીએમસી) તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે અને આ પીએમસી માટેનો કરાર તા.૨૮/૦૮/૨૦૨૦ ના રોજ કરવામાં આવેલ છે. બ) આથી કંપનીએ પ્રોજેક્ટની કામગીરીની ચકાસણી માટે સચોટ વ્યવસ્થા કરેલ છે કે જેમાં જી - રાઈડ સેવાઓ આપે છે કે જે પીએમસી કરારના ફકરા નંબર ૧.૧ માં જણાવેલ છે અને તેમાં કંપનીના પ્રોજેક્ટની ચકાસણીની વ્યવસ્થા કરેલ છે. ૨. એગ્રીમેન્ટ લક્ષ્યાંકની સ્થિતિ:- એ) કંપનીએ ઈપીસી કોન્ટ્રાક્ટ કલ્પતરુ પાવર ટ્રાન્સમીશન લીમીટેડ (કેપીટીએલ) ને સોંપેલ છે કે જે કોટાસણ રોડ - બેચરાજી (૨૬.૬ કિ મી) ના

		<p>ફેઝ ૧ માટે છે અને આ પ્રોજેટક માટેનો લક્ષ્યાક (એમએસ) નીચે મુજબ છે, અને તેને એક પત્રથી લંબાવવામાં આવેલ છે અને તેનો ક્રમાંક:- જી - રાઈટ/ટ્રાન્સેક્શન એડવાઈઝરી / ૨૦૧૯-૨૦ / ૦૩૮ / ૪૬૬૨ તારીખ ૧૩/૦૪/૨૦૨૩ ના ઓફીસ મેમોરેન્ડમ થી મીનીસ્ટ્રી ઓફ ફાયનાન્સ, ડીપાર્ટમેન્ટ ઓફ એક્ષપેન્ડીચર, પ્રોક્યોરમેન્ટ પોલીસી વિભાગ દ્વારા કેપીટીએલને પાઠવવામાં આવેલ છે:-</p> <table border="1"> <thead> <tr> <th>ક્રમ</th> <th>માઈલસ્ટોન</th> <th>કરાર પ્રમાણે કાર્ય પૂર્ણ કરવાની તારીખ</th> <th>રીવાઈજ થયેલ પુરુ થનાર તારીખ</th> <th>ટીપ્પણીઓ</th> </tr> </thead> <tbody> <tr> <td>૧</td> <td>એમએસ - ૧</td> <td>૧૯-૦૮-૨૦૨૦</td> <td>૧૪-૦૨-૨૦૨૧</td> <td>લક્ષ્યાંક ડીસેમ્બર - ૨૦૨૦ ના રોજ પ્રાપ્ત થયેલ છે.</td> </tr> <tr> <td>૨</td> <td>એમએસ - ૨</td> <td>૧૯-૦૬-૨૦૨૧</td> <td>૧૯-૦૪-૨૦૨૨</td> <td>લક્ષ્યાંક ફેબ્રુઆરી - ૨૦૨૨ ના રોજ પ્રાપ્ત થયેલ છે.</td> </tr> <tr> <td>૩</td> <td>એમએસ - ૩</td> <td>૧૯-૧૦-૨૦૨૧</td> <td>૧૯-૦૪-૨૦૨૨</td> <td>લક્ષ્યાંક મે - ૨૦૨૨ ના રોજ પ્રાપ્ત થયેલ છે.</td> </tr> <tr> <td>૪</td> <td>એમએસ - ૪</td> <td>૧૯-૦૨-૨૦૨૨</td> <td>૩૦-૦૮-૨૦૨૩</td> <td>લક્ષ્યાંક ઓગષ્ટ - ૨૦૨૩ ના રોજ પ્રાપ્ત થયેલ છે.</td> </tr> </tbody> </table>	ક્રમ	માઈલસ્ટોન	કરાર પ્રમાણે કાર્ય પૂર્ણ કરવાની તારીખ	રીવાઈજ થયેલ પુરુ થનાર તારીખ	ટીપ્પણીઓ	૧	એમએસ - ૧	૧૯-૦૮-૨૦૨૦	૧૪-૦૨-૨૦૨૧	લક્ષ્યાંક ડીસેમ્બર - ૨૦૨૦ ના રોજ પ્રાપ્ત થયેલ છે.	૨	એમએસ - ૨	૧૯-૦૬-૨૦૨૧	૧૯-૦૪-૨૦૨૨	લક્ષ્યાંક ફેબ્રુઆરી - ૨૦૨૨ ના રોજ પ્રાપ્ત થયેલ છે.	૩	એમએસ - ૩	૧૯-૧૦-૨૦૨૧	૧૯-૦૪-૨૦૨૨	લક્ષ્યાંક મે - ૨૦૨૨ ના રોજ પ્રાપ્ત થયેલ છે.	૪	એમએસ - ૪	૧૯-૦૨-૨૦૨૨	૩૦-૦૮-૨૦૨૩	લક્ષ્યાંક ઓગષ્ટ - ૨૦૨૩ ના રોજ પ્રાપ્ત થયેલ છે.
ક્રમ	માઈલસ્ટોન	કરાર પ્રમાણે કાર્ય પૂર્ણ કરવાની તારીખ	રીવાઈજ થયેલ પુરુ થનાર તારીખ	ટીપ્પણીઓ																							
૧	એમએસ - ૧	૧૯-૦૮-૨૦૨૦	૧૪-૦૨-૨૦૨૧	લક્ષ્યાંક ડીસેમ્બર - ૨૦૨૦ ના રોજ પ્રાપ્ત થયેલ છે.																							
૨	એમએસ - ૨	૧૯-૦૬-૨૦૨૧	૧૯-૦૪-૨૦૨૨	લક્ષ્યાંક ફેબ્રુઆરી - ૨૦૨૨ ના રોજ પ્રાપ્ત થયેલ છે.																							
૩	એમએસ - ૩	૧૯-૧૦-૨૦૨૧	૧૯-૦૪-૨૦૨૨	લક્ષ્યાંક મે - ૨૦૨૨ ના રોજ પ્રાપ્ત થયેલ છે.																							
૪	એમએસ - ૪	૧૯-૦૨-૨૦૨૨	૩૦-૦૮-૨૦૨૩	લક્ષ્યાંક ઓગષ્ટ - ૨૦૨૩ ના રોજ પ્રાપ્ત થયેલ છે.																							
		<p>બી) કંપનીએ ઈપીસી કોન્ટ્રાક્ટ અશોકા બીલ્ડકોન લિમિટેડ (એબીએલ) ને સોપેલ છે કે જે બેચરાજી - રાનુજ (૩૮.૧૫૩ કિ મી) ના ફેઝ ૨ માટે છે અને આ પ્રોજેટક માટેનો લક્ષ્યાક (એમએસ) નીચે મુજબ છે:-</p> <table border="1"> <thead> <tr> <th>ક્રમ</th> <th>માઈલસ્ટોન</th> <th>કરાર પ્રમાણે કાર્ય પૂર્ણ કરવાની તારીખ</th> <th>રીવાઈજ થયેલ પુરુ થનાર તારીખ</th> <th>ટીપ્પણીઓ</th> </tr> </thead> <tbody> <tr> <td>૧</td> <td>એમએસ - ૧</td> <td>૩૧-૦૮-૨૦૨૨</td> <td>-</td> <td>લક્ષ્યાંક મે - ૨૦૨૩ ના રોજ પ્રાપ્ત થયેલ છે.</td> </tr> <tr> <td>૨</td> <td>એમએસ - ૨</td> <td>૨૮-૦૨-૨૦૨૩</td> <td>-</td> <td>લક્ષ્યાંક ફેબ્રુઆરી - ૨૦૨૩ ના રોજ પ્રાપ્ત થયેલ છે.</td> </tr> <tr> <td>૩</td> <td>એમએસ - ૩</td> <td>૩૦-૦૭-૨૦૨૩</td> <td>-</td> <td>લક્ષ્યાંક જુલાઈ - ૨૦૨૩ ના રોજ પ્રાપ્ત થયેલ છે.</td> </tr> <tr> <td>૪</td> <td>એમએસ - ૪</td> <td>૩૦-૧૧-૨૦૨૩</td> <td>-</td> <td>-</td> </tr> </tbody> </table> <p>૩. ખર્ચમાં ભાવ વધારાની અસરો:- અહેવાલના વર્ષ દરમિયાન ઈપીસી કોન્ટ્રાક્ટર દ્વારા હિસાબી ચોપડામાં કલેમ કરવામાં આવેલ હોય તે</p>	ક્રમ	માઈલસ્ટોન	કરાર પ્રમાણે કાર્ય પૂર્ણ કરવાની તારીખ	રીવાઈજ થયેલ પુરુ થનાર તારીખ	ટીપ્પણીઓ	૧	એમએસ - ૧	૩૧-૦૮-૨૦૨૨	-	લક્ષ્યાંક મે - ૨૦૨૩ ના રોજ પ્રાપ્ત થયેલ છે.	૨	એમએસ - ૨	૨૮-૦૨-૨૦૨૩	-	લક્ષ્યાંક ફેબ્રુઆરી - ૨૦૨૩ ના રોજ પ્રાપ્ત થયેલ છે.	૩	એમએસ - ૩	૩૦-૦૭-૨૦૨૩	-	લક્ષ્યાંક જુલાઈ - ૨૦૨૩ ના રોજ પ્રાપ્ત થયેલ છે.	૪	એમએસ - ૪	૩૦-૧૧-૨૦૨૩	-	-
ક્રમ	માઈલસ્ટોન	કરાર પ્રમાણે કાર્ય પૂર્ણ કરવાની તારીખ	રીવાઈજ થયેલ પુરુ થનાર તારીખ	ટીપ્પણીઓ																							
૧	એમએસ - ૧	૩૧-૦૮-૨૦૨૨	-	લક્ષ્યાંક મે - ૨૦૨૩ ના રોજ પ્રાપ્ત થયેલ છે.																							
૨	એમએસ - ૨	૨૮-૦૨-૨૦૨૩	-	લક્ષ્યાંક ફેબ્રુઆરી - ૨૦૨૩ ના રોજ પ્રાપ્ત થયેલ છે.																							
૩	એમએસ - ૩	૩૦-૦૭-૨૦૨૩	-	લક્ષ્યાંક જુલાઈ - ૨૦૨૩ ના રોજ પ્રાપ્ત થયેલ છે.																							
૪	એમએસ - ૪	૩૦-૧૧-૨૦૨૩	-	-																							

		માટેના એસ્કેલેશન રકમોનું પ્રાવધાન રાખેલ છે, કે જે કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ મુજબ છે અને તે લાગતા વળગતા સત્તાઓ દ્વારા મંજૂર કરવામાં આવેલ હોય તે મુજબ છે.
૪.	શુ કોઈ કોઈ ખાસ સ્કીમ માટે કેન્દ્ર / રાજ્ય સરકાર પાસેથી મળેલ / મળવા પાત્ર ભંડોળનું બરાબર હિસાબ રાખવામાં આવેલ છે / ઉપયોગ કરવામાં આવેલ છે. જો ન કરવામાં આવેલ હોય તો તેની વિગતો.	અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપની દ્વારા કોઈ ખાસ પ્રોજેક્ટ માટે કેન્દ્ર / રાજ્ય એજન્સીઓ પાસેથી કોઈ નાણાં પ્રાપ્ત થયેલ નથી સીવાય કે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન અને જી-રાઈડ પાસેથી પ્રાપ્ત થયેલ શેર કેપીટલની રકમ અને તેનું હિસાબ સારી રીતે રાખવામાં આવેલ છે અને તેને બેંક ખાતામાં જમા કરવામાં આવેલ છે.
૫.	શુ આ સમયગાળામાં કોઈ બેંક ગેરેન્ટી રીવેલીડેટ કરવામાં આવેલ છે.	અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ ચાલુ સાલે કંપની દ્વારા કોઈ બેંક ગેરેન્ટી સુવિધાનો ઉપયોગ કરવામાં આવેલ નથી અને તેથી આ મુદ્દો લાગુ પડતો નથી.
૬.	ટ્રેડ રીસીવેબલ, ટ્રેડ પેયેબલ, ટર્મ ડીપોઝીટ, બેંક ખાતાઓ અને પ્રાપ્ત થયેલ રોકડના બેલેન્સના કન્ફર્મેશન પર ટીપ્પણીઓ.	અમોને નીચે મુજબના કન્ફર્મેશન પ્રાપ્ત થયેલ છે અને તે નાણાંકીય પત્રકોના આંકડાઓને અનુરૂપ છે. ૧) યસ બેન્ક અને યુનીયન બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી બેન્ક બેલેન્સ પ્રમાણપત્ર. ૨) જીએસએફએસ પાસેના ડીપોઝીટ માટે બેલેન્સ અને ઈન્ટરેસ્ટ પ્રમાણપત્ર. ૩) ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ લિમીટેડ પાસેથી બેલેન્સ કન્ફર્મેશન. ૪) મોબીલાઈઝેશન એડવાન્સ અને યુકવવાપાત્ર ટ્રેડ પરના બેલેન્સ અને ઈન્ટરેસ્ટ કે જે ઈપીસી કોન્ટ્રાક્ટર (એમ/એસ કલપાતરુ પાવર ટ્રાન્સમીશન લીમીટેડ અને એમ/એસ અશોકા બીલ્ડકોન લીમીટેડ) પાસેથી પ્રાપ્ત થશે. ૫) મેનેજમેન્ટ પાસેથી તારીખ ૩૧/૦૩/૨૦૨૩ નો કેશ બેલેન્સ. ૬) બેલેન્સ શીટની તારીખે ટ્રેડ રીસીવેબલ (એમ/એસ માડુતી સુઝુકી ઈન્ડિયા લીમીટેડ) માંથી બેલેન્સ કન્ફર્મેશન.

૭.	એબોન્ડન કરવામાં આવેલ પ્રોજેક્ટ માટે થયેલ ખર્ચા અને ખરેખર રાઈટ ઓફ કરવામાં આવેલ રકમ દર્શાવો.	અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કોઈ પણ પ્રોજેક્ટ એબોન્ડન કરવામાં આવેલ નથી. તેથી આ કલમ લાગુ પડતી નથી.
----	--	--

શાહ એન્ડ દલાલ વતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

એફઆરએન : ૧૦૯૪૩૨૩બલ્યુ

સ્થળ:- અમદાવાદ

તારીખ:- ૨૯/૦૯/૨૦૨૩

સહી/-

મલય દલાલ

ભાગીદાર

સભ્ય. નં. ૦૩૬૭૭૬

યુડીઆઈએન : ૨૩૦૩૬૭૭૬બીજીડબલ્યુજેજેડ૪૫૫૧

બહુચરાણ રેલ કોર્પોરેશન લિમીટેડ (જી - રાઈડ, જીઆઈડીસી અને એમએસઆઈએલ નો સૈયુક્ત સાહસ) સીઆઈએન:- યુ૪૫૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨ ૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતિત બેલેન્સ શીટ			
(રકમ રૂ.માં)			
વિગત	નોંધ નંબર	૩૧-૩-૨૦૨૩ ના રોજ	૩૧-૩-૨૦૨૨ ના રોજ
એસેટ્સ			
નોન - કરન્ટ એસેટ			
પ્રોપર્ટી, પ્લાન્ટ એન્ડ ઈકવીપમેન્ટ	૪	૧૦૦૬ ૧૯ ૮૭૩	-
ઈન્ટેન્જેબલ એસેટ	૫	૩૪૮ ૧૯ ૯૧ ૪૭૯	-
રાઈટ ટુ યુઝ એસેટ - લીઝહોલ્ડ ઓફીસ	૬	૫૩ ૪૨ ૩૬૦	૬૮ ૬૮ ૭૪૯
ચાલુ કામગીરીની મુળી	૭	૮ ૮૬ ૩૨ ૪૭૮	૬ ૧૨ ૦૪ ૮૭૫
વિકાસ હેઠળનો ઈન્ટેન્જેબલ એસેટ	૮	૨ ૨૦ ૫૭ ૯૯ ૧૭૭	૨ ૨૭ ૫૧ ૬૫ ૯૬૦
અન્ય નોન - કરન્ટ એસેટ	૯	૨૬ ૫૪ ૩૧ ૬૭૬	૪૪ ૯૭ ૮૦ ૦૯૬
આવક વેરો એસેટ (નેટ)	૧૩	૨ ૪૮ ૯૮ ૭૨૯	૮૯ ૮૮ ૪૮૮
કુલ નોન કરન્ટ એસેટ		૬ ૧૭ ૨૭ ૧૫ ૭૭૨	૨ ૮૦ ૨૦ ૦૮ ૧૬૮
કરન્ટ એસેટ			
નાણાંકીય એસેટ			
(૧) મળવાપાત્ર લેણા	૧૦	૮ ૯૧ ૨૪ ૮૪૪	૧૩ ૬૭ ૯૯ ૧૯૬
(૨) રોકડ અને રોકડનો સમાન્તર	૧૧	૨૧ ૯૪ ૩૫ ૪૯૨	૩૯ ૫૯ ૨૫ ૧૭૪
(૩) બેન્ક સાથેના અન્ય શિલ્લકો	૧૨	-	૨૦૦ ૦૦ ૦૦ ૦૦૦
અન્ય કરન્ટ એસેટ	૧૫	૯૫ ૧૦ ૫૬૫	૮૨ ૨૭ ૧૯૫
કુલ કરન્ટ એસેટ		૩૧ ૮૦ ૭૦ ૯૦૧	૨૫૪ ૦૯ ૫૧ ૫૬૫
કુલ એસેટ		૬૪૯ ૦૭ ૮૬ ૬૭૩	૫૩૪ ૨૯ ૫૯ ૭૩૩
ઈકવીટી અને જવાબદારીઓ			
ઈકવીટી			
ઈકવીટી શેર ભંડોળ	૧૬	૬૧૨ ૧૨ ૨૪ ૦૨૦	૪૯૬ ૯૧ ૭૨ ૦૦૦
અન્ય ઈકવીટી	૧૭	(૫ ૬૨ ૭૬ ૯૧૩)	(૩ ૦૪ ૧૫ ૦૩૦)
કુલ ઈકવીટી		૬ ૦૬ ૪૯ ૪૭ ૧૦૭	૪ ૯૩ ૮૭ ૫૬ ૯૭૦

વિગત	નોંધ નંબર	૩૧-૩-૨૦૨૩ ના રોજ	૩૧-૩-૨૦૨૨ ના રોજ
જવાબદારીઓ			
નોન કરન્ટ જવાબદારીઓ			
નાણાંકીય જવાબદારીઓ			
(૧) અન્ય નાણાકીય જવાબદારીઓ	૧૮	૭ ૪૪ ૬૨ ૭૩૦	૭ ૯૯ ૦૪ ૮૨૯
કુલ નોન કરન્ટ જવાબદારીઓ	૧૯	૧૫ ૯૫ ૨૫૦	૧ ૦૭ ૨૫૦
ડીફર થયેલ ટેક્સ જવાબદારીઓ	૨૦	૮ ૪૯ ૩૨ ૬૮૦	-
કુલ નોન - કરન્ટ જવાબદારીઓ		૧૬ ૦૯ ૯૦ ૬૬૦	૮ ૦૦ ૧૨ ૦૭૯
કરન્ટ જવાબદારીઓ			
નાણાંકીય જવાબદારીઓ			
(૧) ચૂકવવાપાત્ર ટ્રેડ	૨૧		
એમએસએમઈ		-	-
અન્ય		૨૦ ૬૯ ૪૦ ૩૪૯	૩૦ ૨૪ ૪૯ ૪૫૫
તકરારી ઉધાર - એમએસએમઈ		-	-
તકરારી ઉધાર - અન્ય		-	-
(૨) અન્ય નાણાકીય જવાબદારીઓ	૨૨	૧૪ ૪૨ ૯૦૦	૧૩ ૧૨ ૬૨૫
અન્ય કરન્ટ જવાબદારીઓ	૨૩	૫ ૬૪ ૬૫ ૬૫૭	૨ ૦૪ ૨૮ ૬૦૪
કુલ કરન્ટ જવાબદારીઓ		૨૬ ૪૮ ૪૮ ૯૦૬	૩૨ ૪૧ ૯૦ ૬૮૪
કુલ ઈકવીટી અને જવાબદારીઓ		૬ ૪૯ ૦૭ ૮૬ ૬૭૩	૫ ૩૪ ૨૯ ૫૯ ૭૩૩
ખાસ હિસાબી પદ્ધતિઓ			
જુઓ નાણાકીય પત્રકો સાથેની નોંધો	૧ થી ૪૭		
હિસાબી ફોર્મ પરની નોંધો નાણાંકીય પત્રકોનો આતરીક ભાગ છે. સમાન તારીખના અમારા અહેવાલ પ્રમાણે			
શાહ અને દલાલ વતી	નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા		
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ			
એફઆરએન ૧૦૯૪૩૨૬બલ્યુ			
સહી/-	સહી/-	સહી/-	સહી/-
મલય દલાલ	એસ. એન. જોષી	જવલેશ ઝવેરી	આર. એસ. કપુર
ભાગીદાર,	સીએફઓ	નિયામક	નિયામક
સભ્ય નં.૦૩૬૭૭૬		ડીઆઈએન: ૦૯૫૦૭૨૨૪	ડીઆઈએન : ૦૮૩૦૩૬૮૮
યુડીઆઈએન:૨૩૦૩૬૭૭૬બીજીડબલ્યુજેજેડેડ૪૫૫૧			
સ્થળ:- અમદાવાદ	સ્થળ:- ગાંધીનગર		
તારીખ:- ૨૯/૦૯/૨૦૨૩	તારીખ:- ૨૯/૦૯/૨૦૨૩		

<p align="center">બહુચરાત્ર રેલ કોર્પોરેશન લિમીટેડ (જી - રાઈડ, જીઆઈડીસી અને એમએસઆઈએલ નો સૈયુક્ત સાહસ) સીઆઈએન:- યુ૪૫૧૦૧જી૪૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨ ૩૧ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ પુરા પતા વર્ષનું નફા - નુકશાનનું પત્રક (રકમ રૂ.માં)</p>			
વિગત	નોંધ નંબર	૦૧-૦૪-૨૦૨૨ થી ૩૧-૩-૨૦૨૩ ના સમયગાળા માટે	૦૧-૦૪-૨૦૨૧ થી ૩૧-૩-૨૦૨૨ ના સમયગાળા માટે
આવક			
કામગીરીમાંથી આવક	૨૫	૨૦ ૧૪ ૨૨ ૨૨૫	૪૩ ૯૨ ૪૫ ૫૩૬
અન્ય આવક	૨૬	૭ ૯૫ ૧૧ ૪૫૨	૩ ૫૯ ૭૪ ૯૫૬
કુલ આવક		૨૮ ૦૯ ૩૩ ૬૭૭	૪૭ ૫૨ ૨૦ ૪૯૨
ખર્ચ			
વપરાયેલ મટીરીયલની કિંમત	૨૭	૧૯ ૯૯ ૦૩ ૦૬૬	૪૪ ૨૦ ૪૭ ૩૪૯
કર્મચારીઓનો ખર્ચ, કોન્ટ્રાક્ટરોને અને કન્સલ્ટન્ટને ચુકવણું	૨૮	૭૭ ૯૩ ૭૭૧	૩૦ ૯૫ ૮૦૬
નાણાકીય કિંમત	૨૯	૬ ૧૦ ૭૯૫	૩ ૫૦ ૫૩૨
ઘસારો અને અમોરાઈઝેશન ખર્ચ	૩૦	૬૯ ૨૧ ૫૮૯	૭ ૬૩ ૧૯૪
અન્ય ખર્ચાઓ	૩૧	૬૬ ૩૩ ૬૫૮	૧ ૪૩ ૭૩ ૮૧૧
કુલ ખર્ચ		૨૨ ૧૮ ૬૨ ૮૭૯	૪૬ ૦૬ ૩૦ ૬૯૨
છુટ આપેલ વસ્તુઓ અને વેરાઓ પહેલાનો નફા / (નુકશાન)		૫ ૯૦ ૭૦ ૭૯૮	૧ ૪૫ ૯૯ ૮૦૦
છુટ આપેલ વસ્તુઓ (ટેક્ષ નો નેટ)		-	-
વેરા પહેલા નફો / (નુકશાન)		૫ ૯૦ ૭૦ ૭૯૮	૧ ૪૫ ૯૯ ૮૦૦
ટેક્ષ ખર્ચ	૧૪		
કરન્ટ વેરો		-	૯૨ ૨૮ ૭૬૮
ગત વર્ષનો વેરો		-	૭૭ ૪૪૮
ડીફર થયેલ વેરો		૮ ૪૯ ૩૨ ૬૮૦	-
કુલ વેરા ખર્ચ		૮ ૪૯ ૩૨ ૬૮૦	૯૩ ૦૬ ૨૧૬
ચાલુ સમયગાળા માટે વેરા પછી નફો / (નુકશાન)		(૨ ૫૮ ૬૧ ૮૮૨)	૫૨ ૮૩ ૫૮૪

વિગત	નોંધ નંબર	૦૧-૦૪-૨૦૨૨ થી ૩૧-૩-૨૦૨૩ ના સમયગાળા માટે	૦૧-૦૪-૨૦૨૧ થી ૩૧-૩-૨૦૨૨ ના સમયગાળા માટે
અન્ય કોમ્પ્રીહેન્સીવ આવક			
(૧) તેવી વસ્તુઓ કે જેને નફા અને નુકશાનમાં રીકલાસીફાઈ કરવામાં આવેલ નથી.		-	-
(૨) નફા અને નુકશાનમાં રીકલાસીફાઈ ન કરવામાં આવેલ હોય તેવી વસ્તુઓને લગત આવક વેરો		-	-
(૩) નફા અને નુકશાનમાં રીકલાસીફાઈ થયેલ વસ્તુઓ		-	-
(૪) નફા અને નુકશાનમાં રીકલાસીફાઈ કરવામાં આવેલ વસ્તુઓ ને લગત આવક વેરો.		-	-
વર્ષ માટે કુલ કોમ્પ્રીહેન્સીવ આવક / (નુકશાન) (ટેક્સ નો નેટ)			--
આ સમયગાળા માટે કુલ કોમ્પ્રીહેન્સીવ આવક		<u>(૨ ૫૮ ૬૧ ૮૮૨)</u>	<u>૫૨ ૮૩ ૫૮૪</u>
રૂ.૧૦ પ્રતિ ઈકવીટી શેરના ફેસ વેલ્યુ	૩૨		
ઘરાવતા ઈકવીટી શેર પરની આવક			
બેઝીક		(૦.૦૫)	૦.૦૨
ડાયલ્યુટેડ		(૦.૦૫)	૦.૦૨
ખાસ હિસાબી પદ્ધતિઆ			
જુઓ નાણાકીય પત્રકો સાથેની નોંધો	૧ થી ૪૭		
હિસાબી ફોર્મ પરની નોંધો નાણાંકીય પત્રકોનો આતરીક ભાગ છે. સમાન તારીખના અમારા અહેવાલ પ્રમાણે			
શાહ અને દલાલ વતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એફઆરએન: ૧૦૮૪૩૨૩બલ્યુ	નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા		
સહી/- મલય દલાલ ભાગીદાર, સભ્ય નં.૦૩૬૭૭૬ યુડીઆઈએન:૨૩૦૩૬૭૭૬બીજીડબલ્યુજેજેડેડ૪૫૫૧	સહી/- એસ. એન. જોષી સીએફઓ	સહી/- જવલેશ ઝવેરી નિયામક ડીઆઈએન: ૦૮૫૦૭૨૨૪	સહી/- આર. એસ. કપુર નિયામક ડીઆઈએન : ૦૮૩૦૩૬૮૮
સ્થળ:- અમદાવાદ તારીખ:- ૨૮/૦૮/૨૦૨૩	સ્થળ:- ગાંધીનગર તારીખ:- ૨૮/૦૮/૨૦૨૩		

બહુચરાત્રુ રેલ કોર્પોરેશન લિમીટેડ

(ત્રુ - રાઈડ, ત્રુઆઈડીસી અને એમએસઆઈએલ નો સૈયુક્ત સાહસ)

સીઆઈએન:- યુઠપ૧૦૧ત્રુજે૨૦૧૮એસત્રુસી૧૦પ૬૦૨

૩૧ મી માર્ચ, ૨૦૨૩ ના રોજનું ઈકવીટીમાં ફેરફારનું પત્રક

એ. ઈકવીટી શેર કેપીટલ

(રકમ રૂ.માં)

વિગત	રકમ
૧ લી એપ્રિલ, ૨૦૨૧ અંતિત	૧૯૨ ૩૭ ૫૦ ૦૦૦
ત્રુના સમયની ભુલોને કારણે ઈકવીટી શેર ભંડોળમા ફેરફાર	-
૧ લી એપ્રિલ, ૨૦૨૧ મુજબ રીસ્ટેટેડ સિલક વર્ષ ૨૦૨૧ - ૨૨ માં થયેલ ફેરફારો	૩૦૪ ૫૪ ૨૨ ૦૦૦
૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતિત	૪૯૬ ૯૧ ૭૨ ૦૦૦
ત્રુના સમયની ભુલોને કારણે ઈકવીટી શેર ભંડોળમા ફેરફાર	-
૧ લી એપ્રિલ, ૨૦૨૨ મુજબ રીસ્ટેટેડ સિલક વર્ષ ૨૦૨૨ - ૨૩ માં થયેલ ફેરફારો	૧૧૫ ૨૦ ૫૨ ૦૨૦
૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતિત	૬૧૨ ૧૨ ૨૪ ૦૨૦

બી. અન્ય ઈકવીટી

વિગત	રીઝર્વ અને સર્પલસ				ઈકવીટી ઈન્સ્ટ્રુમેન્ટસ અન્ય કોમપ્રિહેન્સીવ આવકમાંથી	કુલ
	સામાન્ય રીઝર્વ	કેપીટલ રીઝર્વ	કેપીટલ રીડમશન રીઝર્વ	રીટેઈનડ આવક		
૧ એપ્રિલ, ૨૧ મુજબ સિલક વર્ષ માટે નફા / (નુકશાન)	-	-	-	(૩૫૬૯૮૬૧૪)	-	(૩૫૬૯૮૬૧૪)
ડીફાઈન થયેલ બેનીફીટ યોજનાનું ફેરગણત્રી (વેરાનું નેટે)	-	-	-	૫૨ ૮૩ ૫૮૪	-	૫૨ ૮૩ ૫૮૪
વર્ષ માટે અન્ય કોમપ્રિહેન્સીવ આવક	-	-	-	-	-	-
વર્ષ માટે કુલ કોમપ્રિહેન્સીવ આવક	-	-	-	(૩ ૦૪ ૧૫ ૦૩૦)	-	(૩ ૦૪ ૧૫ ૦૩૦)

ડીવીડેન્ડનું ચુકવણું	-	-	-	-	-	-
જનરલ રીઝર્વનું ટ્રાન્સફર	-	-	-	-	-	-
૩૧ મી માર્ચ, ૨૦૨૨ મુજબ સીલક	-	-	-	(૩ ૦૪ ૧૫ ૦૩૦)	-	(૩ ૦૪ ૧૫ ૦૩૦)
વર્ષ માટે (નૂકશાન)/નફો	-	-	-	(૨ ૫૮ ૬૧ ૮૮૨)	-	(૨ ૫૮ ૬૧ ૮૮૨)
ડીફાઈન થયેલ	-	-	-	-	-	-
બેનીફીટ યોજનાનું ફેરગણત્રી (વેરાનું નેટે)	-	-	-	-	-	-
વર્ષ માટે અન્ય કોમ્પ્રીહેન્સીવ આવક	-	-	-	-	-	-
વર્ષ માટે કુલ કોમ્પ્રીહેન્સીવ આવક	-	-	-	(૫ ૬૨ ૭૬ ૯૧૩)	-	(૫ ૬૨ ૭૬ ૯૧૩)
ડીવીડેન્ડનું ચુકવણું	-	-	-	-	-	-
જનરલ રીઝર્વનું ટ્રાન્સફર	-	-	-	-	-	-
૩૧ મી માર્ચ, ૨૦૨૩ મુજબ સીલક	-	-	-	(૫ ૬૨ ૭૬ ૯૧૩)	-	(૫ ૬૨ ૭૬ ૯૧૩)

જુઓ નાણાકીય પત્રકો સાથેની નોંધો

હિસાબી ફોર્મ પરની નોંધો નાણાંકીય પત્રકોનો આતરીક ભાગ છે.
સમાન તારીખના અમારા અહેવાલ પ્રમાણે

શાહ અને દલાલ વતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

એફઆરએન: ૧૦૮૪૩૨૩બલ્યુ

નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા

સહી/-

મલય દલાલ

ભાગીદાર,

સભ્ય નં.૦૩૬૭૭૬

યુડીઆઈએન: ૨૩૦૩૬૭૭૬બીજીડબલ્યુજેજેડેડ૪૫૫૧

સહી/-

એસ. એન. જોષી

સીએફઓ

સહી/-

જવલેશ ઝવેરી

નિયામક

ડીઆઈએન: ૦૮૫૦૭૨૨૪

સહી/-

આર. એસ. કપુર

નિયામક

ડીઆઈએન: ૦૮૩૦૩૬૮૮

સ્થળ:- અમદાવાદ

તારીખ:- ૨૮/૦૮/૨૦૨૩

સ્થળ:- ગાંધીનગર

તારીખ:- ૨૮/૦૮/૨૦૨૩

બહુચરાત્રુ રેલ કોર્પોરેશન લિમીટેડ (ત્રુ - રાઈડ, ત્રુઆઈડીસી અને એમએસઆઈએલ નો સૈયુક્ત સાહસ) સીઆઈએન:- યુ૪૫૧૦૧ત્રુજે૨૦૧૮એસત્રુસી૧૦૫૬૦૨ ૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતિત કેશ ફ્લોનો પત્રક		
વિગત	૦૧-૦૪-૨૦૨૨ થી ૩૧-૩-૨૦૨૩ ના સમયગાળા માટે	૦૧-૦૪-૨૦૨૧ થી ૩૧-૩-૨૦૨૨ના સમયગાળા માટે
૧. ઓપરેટીંગ કામગીરીમાંથી કેશ ફ્લો		
નફા નુકશાનના પત્રક મુજબ વેરા પહેલા નફા/(નુકશાન)	૫ ૯૦ ૭૦ ૭૯૮	૧ ૪૫ ૮૯ ૮૦૦
એટજેસ્ટ કરેલ:-		
ઘસારો અને એમોરટાઈઝેશન	૬૯ ૨૧ ૫૮૯	૭ ૬૩ ૧૯૪
વ્યાજની આવક	(૭ ૯૪ ૯૮ ૭૪૦)	(૩ ૫૮ ૫૬ ૩૧૨)
નાણાકીય ખર્ચ	૬ ૧૦ ૭૯૫	૩ ૫૦ ૫૩૨
વર્કીંગ કેપીટલમાં ફેરફાર પહેલા ઓપરેટીંગ નફો/(નુકશાન)	(૧ ૨૮ ૯૫ ૫૫૮)	(૨ ૦૧ ૫૨ ૭૮૬)
વર્કીંગ કેપીટલના મુવમેન્ટ માટે એટજેસ્ટમેન્ટ:-		
મળવાપાત્ર લેણામાં (વધારો)/ઘટાડો	૪ ૭૬ ૭૪ ૩૫૨	(૧૩ ૬૭ ૯૯ ૧૯૬)
નાણાકીય એસેટમાં (વધારો)/ઘટાડો	-	૨ ૦૬ ૩૦ ૭૭૭
અન્ય કરન્ટ એસેટમાં (વધારો)/ઘટાડો	(૧૨ ૪૪ ૯૬૨)	૧ ૦૧ ૬૬ ૦૪૮
કરન્ટ ટેક્ષ એસેટમાં (વધારો)/ઘટાડો	-	(૮૯ ૮૮ ૪૮૮)
ચૂકવવા પાત્ર ટ્રેડમાં વધારો/(ઘટાડો)	(૯ ૫૫ ૦૯ ૧૦૭)	૪૫ ૬૪ ૨૫૯
અન્ય કરન્ટ જવાબદારીઓમાં વધારો/(ઘટાડો)	૩ ૬૦ ૩૭ ૦૫૩	૪૭ ૫૫ ૬૯૮
અન્ય નાણાકીય જવાબદારીઓમાં વધારો/(ઘટાડો)	(૫૩ ૧૧ ૮૨૪)	-
અન્ય નોન કરન્ટ જવાબદારીઓમાં વધારો/(ઘટાડો)	૧૪ ૮૮ ૦૦૦	-
કરન્ટ વેરાની જવાબદારીઓમાં વધારો/(ઘટાડો)	-	(૧૯ ૯૭ ૩૫૨)
વર્કીંગ કેપીટલમાં ફેરફારો બાદનો ઓપરેટીંગ નફો	(૧ ૬૮ ૬૬ ૪૮૮)	(૧૦ ૭૬ ૬૮ ૨૫૪)
ચૂકવેલ વેરો (રીફંડનો નેટ)	(૧ ૫૯ ૧૦ ૨૪૧)	(૯૩ ૦૬ ૨૧૬)
ઓપરેટીંગ કામગીરીમાં નેટ કેશ ફ્લો કે જે વપરાયેલ છે (એ)	(૪ ૫૬ ૭૨ ૨૮૭)	(૧૩ ૭૧ ૨૭ ૨૫૬)
૨. રોકાણની કામગીરીમાં કેશ ફ્લો:-		
પીપીઈમાં (વધારો)/ઘટાડો	(૫ ૮૮ ૨૪ ૯૨૮)	-
ઈન્ટેન્જેબલ એસેટમાં (વધારો)/ઘટાડો (ફિઈટ શેરીંગ હકકો)	(૧૬ ૫૪ ૭૬ ૬૦૩૫)	-
ચાલી રહેલ કેપીટલ વર્કમાં (વધારો)/ ઘટાડો	(૭ ૨૦ ૧૩ ૭૭૦)	(૬ ૦૪ ૩૧ ૬૧૩)
વિકાસ હેઠળના ઈન્ટેન્જેબલ એસેટમાં (વધારો)/ઘટાડો	(૧૭૬ ૦૪ ૬૨ ૬૩૯)	(૧૩૨ ૦૪ ૬૩ ૭૪૩)
નોન કરન્ટ એસેટમાં (વધારો)/ ઘટાડો	૧૮ ૪૩ ૪૮ ૪૨૦	(૧૫ ૧૪ ૮૭ ૦૧૭)
નાણાકીય એસેટમાં (વધારો)/ઘટાડો	૨૦૦ ૦૦ ૦૦ ૦૦૦	(૧૦૪ ૦૦ ૦૦ ૦૦૦)

વ્યાજની આવક	૭૮૪ ૬૦ ૩૩૨	૭૦ ૦૧ ૭૧૬	
રોકાણની કામગીરીમાં (હાલમા ચાલુ) નેટ કેશ ફ્લો (બી)	(૧૨૮૨૨૫૮૬૨૦)	(૨૫૬૫૩૮૦૬૫૭)	
૩. નાણાકીય કામગીરીમાંથી કેશ ફ્લો:-			
શેર કેપીટલમાંથી પ્રોસીડસ	૧૧૫ ૨૦ ૫૨ ૦૨૦	૩૦૪ ૫૪ ૨૨ ૦૦૦	
લીઝની જવાબદારીના કારણે વ્યાજનો ખર્ચ	(૬ ૧૦ ૭૮૫)	(૩ ૫૦ ૫૩૨)	
નાણાકીય કામગીરીમાં (હાલમા ચાલુ) નેટ કેશ ફ્લો (સી)	૧૧૫ ૧૪ ૪૧ ૨૨૫	૩૦૪ ૫૦ ૭૧ ૪૬૮	
કેશ અને કેશ ઇકવેલેન્ટમાં નેટ વધારો (એ) + (બી) + (સી)	(૧૭ ૬૪ ૮૯ ૬૮૨)	૩૪ ૨૫ ૬૩ ૫૫૬	
વર્ષની શરૂઆતમાં કેશ અને કેશ ઇકવિલીએન્ટ	૩૮ ૫૮ ૨૫ ૧૭૪	૫ ૩૩ ૬૧ ૬૧૮	
વર્ષના અંતે કેશ અને કેશ ઇકવિલીએન્ટ	૨૧ ૯૪ ૩૫ ૪૯૨	૩૯ ૫૯ ૨૫ ૧૭૪	
વર્ષના અંતે કેશ અને કેશ ઇકવિલીએન્ટનો બ્રેકઅપ	-	-	
કરન્ટ ખાતામાં બેક સાથે રહેલ સિલક	૧૨ ૯૪ ૩૫ ૪૯૨	૮ ૧૫ ૭૫ ૨૨૭	
જીએસએફએસ પાસે રહેલ સિલક - લીકવીડ ડીપોઝીટ	૮ ૦૦ ૦૦ ૦૦૦	૩૧ ૪૩ ૪૯ ૯૪૭	
	૨૧ ૯૪ ૩૫ ૪૯૨	૩૯ ૫૯ ૨૫ ૧૭૪	
નોંધો:-			
૧. કેશ અને કેશ ઇકવેલેન્ટમાં કેશ અને બેકની સીલક અને બેકમાં રહેલ ડીપોઝીટ (જેમાં મેચ્યુરીટી ૩ મહિના કરતા ઓછા હોય).			
૨. ઈએનડી એએસ-૭ સ્ટેટમેન્ટ ઓફ કેશ ફ્લોમાં દર્શાવેલ 'ઈનડાયરેક્ટ મેથડ' મુજબ ઉપર દર્શાવેલ કેશ ફ્લો પત્રક તૈયાર કરવામાં આવેલ છે.			
૩. જરૂરીયાત મુજબ ગત વર્ષના આકડાઓને રીગ્રુપ અને રી કલેસીફાઈ કરવામાં આવેલ છે જેથી કરીને હાલના વર્ષના આકડાઓ સાથે સમતુલા જળવાઈ રહે.			
હિસાબી ફોર્મ પરની નોંધો નાણાંકીય પત્રકોનો આતરીક ભાગ છે. સમાન તારીખના અમારા અહેવાલ પ્રમાણે			
શાહ અને દલાલ વતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એફઆરએન: ૧૦૮૪૩૨૩બલ્યુ	નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા		
સહી/- મલય દલાલ ભાગીદાર, સભ્ય નં.૦૩૬૭૭૬ યુડીઆઈએન:૨૩૦૩૬૭૭૬બીજીડબલ્યુજેજેડેડ૪૫૫૧	સહી/- એસ.એન.જોષી સીએફઓ	સહી/- જવલેશ ઝવેરી નિયામક ડીઆઈએન: ૦૮૫૦૭૨૨૪	સહી/- આર. એસ. કપુર નિયામક ડીઆઈએન : ૦૮૩૦૩૬૮૮
સ્થળ:- અમદાવાદ તારીખ:- ૨૯/૦૮/૨૦૨૩	સ્થળ:- ગાંધીનગર તારીખ:- ૨૯/૦૮/૨૦૨૩		

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ ૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતિત નાણાકીય પત્રકોને લગત નોંધો

૧. કંપનીની માહિતી:

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ એક સ્પેશીયલ પર્પસ વેહીકલ (એસપીવી) છે કે જે એક રેલવે પ્રોજેક્ટ છે અને તે ગુજરાત સરકાર દ્વારા તેઓના ઠરાવ ક્રમાંક નંબર - એમઆઈએસ - ૧૦ - ૨૦૧૭ - ૧૬૬૫ - ૧ - ૧ થી તારીખ ૦૫/૦૨/૨૦૧૮ ના રોજ જાહેર કરવામાં આવેલ છે અને તે ગુજરાત રાજ્યમાં માં કોટાસણ રોડ - બેચરાજી - ચાણસમા - રણુજના ૬૫ કિલોમીટરના લાઈનનો ગેજ પરીવર્તનના પ્રોજેક્ટની કામગીરીઓ જેવી કે વિકાસ, નાણાકીય કામગીરી, પ્લાનીંગ અને અમલીકરણ માટે રચવામાં આવેલ છે.

૨. નિયામક બોર્ડના ૨૮ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજના ઠરાવથી આ નાણાંકીય પત્રકોને ઓથોરીટી આપવામાં આવેલ છે.

૩(૧) તૈયારીનો આધાર:

આ નાણાંકીય પત્રકોને હિસ્ટોરીક કોસ્ટ બેઝીસના આધારે તૈયાર કરવામાં આવેલ છે, સીવાય કે અમુક નાણાંકીય ઉપકરણો કે જેનું ફેર વેલ્યુઆ આધારે રીપોર્ટીંગના સમયગાળાના અંતે મેઝર કરવામાં આવેલ છે. હિસ્ટોરીક કોસ્ટનો આધાર સામાન્ય રીતે માલ અને તેની સેવાઓના બદલે આવેલા ફેર વેલ્યુ કન્સીડરેશન મુજબ છે. ફેર વેલ્યુ તે કિંમત છે કે જે એક એસેટના વેચાણથી પ્રાપ્ત થયેલ કિંમત કે કોઈ પણ જવાબદારીના ટ્રાન્સફર માટે ચુકવેલ રકમ કે જે બજારમાં રહેલ ભાગીદારો અને ગણત્રીની તારીખ વચ્ચે થયેલ ઓર્ડરલી ટ્રેન્જેક્શન મુજબ છે.

એ. કમ્પલાયન્સનો પત્રક:-

આ નાણાંકીય પત્રકોને ઈન્ડીયન એકાઉન્ટીંગ સ્ટેન્ડર્ડ (ઈન્ડ એએસ) મુજબ તૈયાર કરવામાં આવેલ છે કે જેમાં કંપની ધારા, ૨૦૧૩ ના પ્રાવધાનો મુજબના નિયમો કે જેમાં સમય સયમ માં થયેલ સુધારાઓનો પણ સમાવેશ થાય છે.

કંપનીના હિસાબી પદ્ધતિઓની વિગતો નોંધ ૩ (૨) માં દર્શાવેલ છે.

બી. ફન્શનલ અને પ્રેજેન્ટેશન કરન્સી:-

આ નાણાકીય પત્રકોને ભારતીય રૂપિયામાં (આઈએનઆર) માં પ્રેસેન્ટ કરવામાં આવેલ છે અને તે કંપનીનો કાર્યરત કરન્સી પણ છે.

સી. અંદાજો અને નિર્ણયોનો ઉપયોગ :

આ નાણાંકીય પત્રકો તૈયાર કરતી વખતે મેનેજમેન્ટ દ્વારા નિર્ણયો, અંદાજો અને એસમ્પશનો કરેલ છે કે જે હિસાબી

પધ્ધતિઓના અમલને અસર કરે છે અને એસેટ, લાયબલીટી, આવક અને ખર્ચને દર્શાવેલ છે. ખરેખરના પરીણામો અને અંદાજોમાં ફેરફાર થઈ શકે છે.

ખાસ અંદાજો અને નિર્ણયોનો ઉપયોગ:-

આ નોંધમાં ઉચ્ચ સ્તરના જજમેન્ટ અને ઝટીલતાની રૂપરેખા આપે છે અને તેવી આઈટમો કે જેને અંદાજો અને એસમ્પશનોના કારણે વધારે એડજેસ્ટ કરવામાં આવે અને તે ખરેખર કરતા જુદો એસેસ થાય તેને દર્શાવવામાં આવેલ છે. દરેક અંદાજો અને જજમેન્ટની વિગતવાર માહિતી લાગતા વળગતા નોંધોમાં આપવામાં આવેલ છે અને તેના આધારે દરેક આઈટમની ગણતરી નાણાકીય પત્રકમાં કરવામાં આવેલ છે.

ખાસ અંદાજો અને નિર્ણયોને લગત બાબતો નીચે મુજબ છે:-

ઘસારો અને એમોરટાઈઝેશન:-

ઘસારો અને એમોરટાઈઝેશનનો આધાર ભવિષ્યમાં ઉપયોગમાં લાવી શકાય તેવી મીલકત, પ્લાન્ટ, ઉપકરણ અને ઈન્ટેન્જેબલ એસેટ ઉપરનો મેનેજમેન્ટ અંદાજ છે. આવા અંદાજોમાં ટેકનોલોજીકલ વિકાસ, ફરીફાઈ, બજારની પરીસ્થિતિઓને કારણે કે અન્ય બાબતોને કારણે ફેરફાર થઈ શકે છે અને અને તેના કારણે અંદાજીત ઉપયોગીતાના સમયગાળામાં અને ઘસારા અને એમોરટાઈઝેશન ચાર્જસમાં પણ ફેરફાર થઈ શકે છે.

અન્ય બાબતો નીચે મુજબ છે:-

કરન્સી અને ડીફર્ડ વેરા ખર્ચ અને ચૂકવવા પાત્રનો અંદાજ:-

જ્યાં સુધી ડીફર થયેલ ટેક્સ એસેટમાં થયેલ ડીડક્ટેબલ અસ્થાઈ ફેરફારો રીયલાઈ કરી શકાય ત્યા સુધી જ ડીફર થયેલ ટેક્સ એસેટને ઓળખી શકાય. કંપની દ્વારા ડીફર થયેલ ટેક્સ એસેટ અને જવાબદારીઓનો અંદાજ ચાલુ વેરાને લગત કાયદાઓ અને અમુક કેસો, બીઝનેસ પ્લાન પર આધારીત છે અને તેમાં આવા સંબંધિત એસેટ વસુલ કરવાની પ્રક્રિયા અને સમયગાળા પર આધારીત છે. આવા અંદાજોમાં ફેરફારને કારણે ડીફર થયેલ વેરાની જવાબદારીઓની રકમો કે આવા ડીફર થયેલ વેરાના એસટ પર અસર થઈ શકે છે અને તેના કારણે નફા અને નુકશાનના પત્રકોના ટેક્સ ચાર્જમાં પણ અસર થઈ શકે છે.

વેરાની જવાબદારીઓને પ્રાવધાનો માટે ટેક્સ લેજસ્લેશનની સમજ, કેસના કાયદાઓમાં થયેલ વિકાસ અને ટેક્સ ઓડીટો અને અપીલોના અસરકારક આઉટકમો ધ્યાને લેવા જોઈએ કે જેમાં ખુબ જ વધારે અનિશ્ચિતતા રહેલ છે. આથી, ખરેખરના પરીણામો અપેક્ષાઓ કરતા જુદી હોઈ શકે અને તેના કારણે પ્રાવધાનોમાં એડજેસ્ટમેન્ટ, ડીયર થયેલ વેરા

એસેટનું વેલ્યુએશન, કેશ સેટલમેન્ટ જરૂરી છે અને તેથી નફા નુકશાનનો પત્રક એ ટેક્ષને લગત ચાર્જસ છે.

પ્રોવીઝનો અને કન્ટ્રીજન્સીઓની ઓળખ:-

સમય સમય માં કંપની સામે કાયદાકીય કાર્યવાહી અને અન્ય કન્ટ્રીજન્સીઓ થાય છે કે જેના કારણે આવનાર પરીણામોમાં દાવાઓમાં રહેલ અનીશ્ચીત્તાનો સમાવેશ થાય છે. ખર્ચ માટે એક એવો પ્રાવધાન કરવામાં આવે છે કે જેના અનુસાર એવો અંદાજ કરવામાં આવેલ છે કે ચૂકવણું કરવાની સંભાવના રહેલ છે તેમ માનવામાં આવે છે નુકશાનની રકમનો સામાન્ય અંદાજ પ્રાપ્ત કરવામાં આવે છે.

સારી પરીણામો નહીં આવે તેની ગણતરી કરતી વખતે એક સારા જજમેન્ટનો અંદાજ કાઢવામાં આવે છે અને થનાર નુકશાનનો સારો અંદાજ પ્રાપ્ત કરવો તે અગત્યનો છે. દરેક હિસાબી સમયગાળા માટે થનાર ખર્ચના અંદાજો પ્રાપ્ત કરવામાં આવે છે અને હકિકતો અને પરીસ્થિતીઓ અનુસાર તેમાં ફેરફાર કરવામાં આવે છે.

એસેટસમાં ઈમ્પેરીમેન્ટ:-

મિલકત, પ્લાન્ટ અને ઉપકરણ અને ઈન્ટેન્જેબલ એસેટ કે જેમાં ઘસારો / અમોરાઈઝેશન થઈ શકે તેને સમય સમય પર ઈમ્પેરીમેન્ટ માટે ચકાસવામાં આવે છે તેમાં કોઈ ઈવેન્ટ કે પરિસ્થિતિમાં ફેરફારનો સમાવેશ થાય છે કે જે તે દર્શાવે છે કે જનરેટ કરતી યુનીટનો કેશ જનરેટ કરવાની ક્ષમતા તેના કેરીઈંગ વેલ્યુ કરતા ઓછી છે. કેશ જનરેટ કરતી એકમનો વસુલ થનાર રકમ તેના વેલ્યુ - ઈન - યુઝ અને ફેર વેલ્યુ કરતા ઓછી છે. આવી ગણતરીમાં ખાસ અંદાજો અને અસેમ્પ્શનોનો સમાવેશ થાય છે કે જેમાં ટર્નઓવર અને મલ્ટીપલ આવક, વિકાસનો દર અને નેટ માર્જીનનો ઉપયોગ કરી ભવિષ્યના કેશ ફ્લો, રીસ્ક - એડજેસ્ટ થયેલ વળતરોના દર, ભાવિષ્યની ઈકોનોમી અને બજારની પરીસ્થિતીઓનો સમાવેશ થાય છે.

અંદાજો અને અન્ડરલાઈગ એસમ્પ્શનો ઓગોઈન આધારે વારંવાર ચકાસવામાં આવે છે. હિસાબી અંદાજોમાં થયેલ રીવીઝનોને પ્રોગ્રેસીવ રીતે ઓળખવામાં આવે છે.

ડી. ફેર વેલ્યુની ગણતરી :

ફેર વેલ્યુ માટે કંપનીના ગણા બધા હિસાબી પધ્ધતિઓની અને ખુલાસાઓની જરૂરીયાત રહેલ છે, બન્ને નાણાકીય અને બીન - નાણાકીય એસેટસ અને જવાબદારીઓને લગત.

ફેર વેલ્યુઓને જુદા જુદા લેવલમાં વિભાજીત કરવામાં આવેલ છે અને તેનો આધાર નીચે જણાવેલ વેલ્યુએશન પધ્ધતીઓ પર રહેલ છે.

- પ્રથમ લેવલ:- ચાલુ બજારમાં કોટ કરવામાં આવેલ કિંમતો (એડજસ્ટ કર્યા સીવાયના) કે જે એકજ પ્રકારના એસેટ અને

જવાબદારીઓ માટે છે.

- બીજો લેવલ:- લેવલ ૧ માં કોટ કરેલ કિંમતો સીવાયના કે જેને એસેટ કે લાયબલીટી, સીધી રીતે (એટલે કે કિંમત તરીકે) કે આડકતરી રીતે (એટલે કે કિંમતમાંથી પ્રાપ્ત થયેલ) નોંધવામાં આવેલ છે.
- ત્રીજો લેવલ:- એસેટ કે લાયબલીટીમાંથી પ્રાપ્ત થયેલ ઈનપુટ કે ઓબઝર્વેબલ માર્કેટ ડેટા (અનઓઝરવેબલ - ઈનપુટ) પર આધારીત ન હોય.

જ્યારે કોઈ પણ એસેટ કે લાયબલીટીની ફેર વેલ્યુની ગણતરી કરવામાં આવે ત્યાર કંપની દ્વારા દર્શનીય બજાર કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈ પણ એસેટ કે લાયબલીટીના ફેર વેલ્યુ માટે ઉપયોગ કરવામાં આવેલ ઈનપુટ જુદા જુદા ફેર વેલ્યુમાં આવતી હોય તો ફેર વેલ્યુની ગણતરીને સૌથી નીચેના સ્તરના ઈનપુટ પર દર્શાવવામાં આવે છે કે સંપૂર્ણ ગણતરી માટે જરૂરી છે.

કંપની ફેર વેલ્યુના સ્તરો વચ્ચેના ટ્રાન્સફરને રીપોર્ટીંગ સમયગાળાના અંતે થયેલ ફેરફારોના આધારે ઓળખે છે.

ફેર વેલ્યુની ગણતરીના સમયે કરેલ એસમ્પ્શનો બાબતેની વિગત નીચે દર્શાવેલ નાણાંકીય ઉપકરણોની નોંધોમાં સામેલ રાખેલ છે.

૩(૨) અગત્યના હિસાબી પોલીસીઓ :

નીચે દર્શાવેલ હિસાબી પોલીસીઓ હાલના નાણાકીય પત્રકોના સમયગાળા દરમ્યાન અમલમાં મુકવામાં આવેલ છે.

એ. વિદેશી નાણાંકી લેવડ લેવડ:-

કંપની દ્વારા વિદેશી ચલણમાં થયેલ લેવડ દેવડને લેવડ દેવડની તારીખે રહેલ એક્ષચેન્જ દર મુજબ કંપનીના કાર્યરત કરન્સીમાં રૂપાંતર કરવામાં આવે છે અથવા તો તેના એવરેજ દર મુજબ જો તે એવરેજ દર લેવડ દેવડની તારીખે રહેલ ખરેખર દર મુજબ હોય તો.

વિદેશી ચલણોમાં ડીનોમીનેટ થયેલ મોનીટરી એસેટ કે લાયબલીટીને રીપોર્ટીંગની તારીખે રહેલ એક્ષચેન્જના દર મુજબ કાર્યરત કરન્સીમાં રૂપાંતર કરવામાં આવે છે. જે નોન - મોનીટરી એસેટ કે લાયબલીટીને ફોરેન કરન્સીમાં ફેર વેલ્યુ મુજબ ગણવામાં આવેલ હોય તેને જે સમય ફેર વેલ્યુ ડિટરમીન કરવામાં આવેલ હોય તે સમયના એક્ષચેન્જ દર મુજબ કાર્યરત કરન્સીમાં રૂપાંતર કરવામાં આવે છે. નોન - મોનીટરી એસેટ અને લાયબલીટીસની ગણતરીને ફોરેન કરન્સીના હિસ્ટોરીક કિંમત અનુસાર કરવામાં આવે છે અને તેને લેવડ દેવડની તારીખના એક્ષચેન્જ દર મુજબ રૂપાંતર કરવામાં આવે છે.

એક્ષચેન્જમાં રહેલ ફેરફારને નફા અને નુકશાનમાં ગણવામાં આવે છે એન ફક્ત નીચે દર્શાવેલ આઈટમોના લેવડ

દેવડથી થયેલ એક્સચેન્જ ફેરફારને ઓસીઆઈ માં ઓળખવામાં આવે છે:-

- ઓસીઆઈ (એફવીઓસીઆઈ) દ્વારા ફેર વેલ્યુ ઉપર ઈકવીટી રોકાણ;
- કેશ ફ્લો હેજસ ને કવોલીફાઈ કરવામા જ્યા સુધી તે હેજસ અસરકારક હોય.

બી. નાણાંકીય ઉપકરણો :

ઓળખ અને પ્રાથમિક ગણત્રીઓ

ટ્રેડ રીસીવેબલ પ્રાપ્ત થાય ત્યારે જ તેની ઓળખ કરવામાં આવેલ છે. અન્ય તમામ નાણાકીય એસેટ અને નાણાંકીય જવાબદારીઓને અગાઉથી જ કંપની ઓળખે છે કે જ્યારે તે ઈન્વેસ્ટમેન્ટના કરારના પ્રાવધાનોનો ભાગ બને છે.

એક નાણાકીય એસેટ કે નાણાકીય જવાબદારીને સૌ પ્રથમ તેના ફેર વેલ્યુમાં ગણવામાં આવે છે અને તેવા આઈટમો કે જે ફેર વેલ્યુમાં નથી તેને નફા નુકશાનથી (એફવીટીપીએલ) થી ગણત્રી કરવામાં આવે છે, ટ્રાન્સેક્શનની કિંમતને સીધી રીતે તેને પ્રાપ્ત કે ઈશ્યુ કરાવતી વખતે ગણત્રી કરવામાં આવે છે.

વર્ગીકરણ અને ત્યારબાદની ગણત્રી અને નફા અને નુકસાન : નાણાંકીય એસેટ

એમોરાઈઝડ કીમને આધારે નાણાંકીય એસેટ:- આવા એસેટો પાછળથી તેના એમોરાઈઝડ કીમને અસરકારક વ્યાજ પધ્ધતિથી ગણવામાં આવે છે. ઈમ્પેરડ નુકશાનથી એમોરાઈઝડ કિંમતમાં ઘટાડો થાય છે. વ્યાજની આવક, ફોરેન એક્સચેન્જની પ્રાપ્તિ અને નુકશાનોની ઓળખ નફા કે નુકશાનથી થાય છે. કોઈ પણ પ્રકારના નફા કે નુકશાન કે ડીરેકગનાઈઝેશનની અસર નફા અને નુકશાનના પત્રકો પર થાય છે.

અધર કોમ્પ્રીહેન્સીવ આવક (એફવીટીઓસીઆઈ) કે જે ફેર વેલ્યુમાં રહેલ અન્ય નાણાંકીય એસેટમા છે - તમામ ઈકવીટી રોકાણોને ફેર વેલ્યુમાં ગણત્રી કરવામાં આવે છે. જેવા રોકાણો કે જે વેચાણ માટે કરવામાં ન આવેલ હોય અને જ્યા કંપની દ્વારા તેને એફવીટીઓસીઆઈ માં વર્ગીકરીત કરવાના વિકલ્પનો ઉપયોગ કરવામાં આવેલ હોય તેવા સંજોગોમાં રોકાણમાં થયેલ તમામ ફેર વેલ્યુ ચેન્જને અધર કોમ્પ્રીહેન્સીવ ઈન્કમમાં (ઓસીઆઈ) માં દર્શાવવામાં આવે છે. એક્યુમીલેટ થયેલ નફા અને નુકશાનને ઓસીઆઈ માં દરેક ઈન્વેસ્ટમેન્ટના વેચાણથી થયેલ આવકમાં ફેરવર્ગીકરણ કરવામાં આવે છે.

નફા અને નુકશાનથી ફેર વેલ્યુને લગત નાણાંકીય એસેટસ (એફવીટીપીએલ) - આવા એસેટસ પાછળથી ફેર વેલ્યુ તરીકે આકવામાં આવે છે. નેટ નફા અને નુકશાન, જેમાં કોઈ વ્યાજ કે ડીવીડન્ડની આવકનો સમાવેશ થાય છે તેને નફા કે નુકશાન તરીકે ઓળખવામાં આવે છે.

વર્ગીકરણ, પાછળથી કરવામાં આવેલ ગણતરી અને નફો અને નુકસાન : નાણાંકીય જવાબદારીઓ

નાણાંકીય જવાબદારીઓને પાછળથી એમોરાઈઝ કિંમત પર ગણતરી કરવામાં આવે છે અને તેમાં અસરકારક વ્યાજ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વેચાણ અને એક વર્ષમાં ચૂકવવા પાત્ર રકમો માટે કે જે બેલેન્સ શીટની તારીખથી એક વર્ષમાં હોય તેમાં રકમ કિંમત ફેર આવા રોકાણોમાં રહેલ ફેર વેલ્યુ કિંમત પ્રમાણે હોય છે.

ઈકવિટી સાધનો

ઈકવિટી ઉપકરણ એક કરાર છે કે જે કોઈ પણ કંપનીના એસેટ પર રેસીડ્યુઅલ ઈન્ટરેસ્ટની સાબીતી આપે છે કે જે તેની જવાબદારીઓને બાદ કર્યા બાદ સાબીત કરે છે. વધતી જતી કિંમત સીધી રીતે ઈકવિટી ઈન્સ્ટ્રુમેન્ટના ઈશ્યુન્સ પર અસર કરે છે અને તેને કોઈ ઈકવિટી ઉપકરણમાંથી વેરાની નેટ અસરથી બાદ કરવામાં આવે છે.

ડીરેકગનાઈઝેશન : નાણાંકીય એસેટ

કંપની દ્વારા કોઈપણ નાણાંકીય એસેટને ડીરેકગનાઈઝ ત્યારે કરવામાં આવે જ્યારે આવા નાણાંકીય એસેટમાંથી રહેલ કેશ ફ્લોના કોન્ટ્રાક્યુઅલ હકક પુરા થઈ જાય કે તેના દ્વારા કોન્ટ્રાક્યુઅલ કેશ ફ્લો ના હકકોને ટ્રાન્સફર કરવામાં આવે કે જેથી રહેલ તમામ માલીકીના રીસ્ક અને ફાયદાઓને ટ્રાન્સફર કરવામાં આવે કે ત્યારે જ્યારે કંપની દ્વારા તમામ માલીકીના રીસ્ક અને ફાયદાઓને ટ્રાન્સફર કે રીટેઈન કરવામાં ન આવે અને તેના દ્વારા નાણાંકીય એસેટ પર કોઈ પણ પ્રકારનો નિયંત્રણ રહે નહીં.

જો કંપની દ્વારા તેવા લેવડ દેવડો કરવામાં આવે કે જેથી તેના દ્વારા બેલેન્સ શીટમાં દર્શાવેલ એસેટને ટ્રાન્સફર કરવામાં આવે પરંતુ તેના દ્વારા તમામ રીસ્ક અને આવકને પાતાની પાસે રાખવામાં આવે તો આવા ટ્રાન્સફર કરવામાં આવેલ એસેટને ડીરેકગનાઈઝ કરવામાં આવે છે.

ડીરેકગનાઈઝેશન : નાણાંકીય જવાબદારીઓ

કંપની દ્વારા કોઈ નાણાંકીય જવાબદારીઓને ત્યારે ડીરેકગનાઈઝ કરવામાં આવે છે કે જ્યારે તેને લગત કરારની જવાબદારીઓને પુરી કે રદ કરવામાં આવેલ હોય કે તે એક્ષપાયર થઈ ગયેલ હોય.

કંપની દ્વારા ત્યારે પણ એક નાણાંકીય જવાબદારીને ડીરેકગનાઈઝ કરવામાં આવે છે જ્યારે તેના ટર્મમાં ફેરફાર કરવામાં આવેલ હોય અને નવા ટર્મ મુજબ કેશ ફ્લોમાં ખુબજ વધારે ફેરફારો હોય. હાલના કિસ્સામાં, એક નવા નાણાંકીય જવાબદારી કે જે ફેરબદલી કરેલ ટર્મો મુજબ તેના ફેર વેલ્યુ પર ઓળખવામાં આવેલ છે. પૂરી થયેલ નાણાંકીય જવાબદારીને લગત રકમ હાથ પર રાખવા અને ફેરફાર મુજબના નવા નાણાંકીય જવાબદારીને ઓળખવામાં રહેલ

ફરકને નફા અને નુકશાન તરીકે ઓળખવામાં આવે છે.

ઓફસેટીંગ

નાણાંકીય એસેટ અને નાણાંકીય જવાબદારી એક ઓફસેટ છે અને બેલેન્સ શીટમાં દર્શાવેલ નેટ રકમ ત્યારે જ હોય જ્યારે કંપની પાસે હાલમાં રકમને ઓફસેટ કરવા માટે કાયદાકીય હકક રહેલ હોય અને તે તેને સેટલ કરવા માગતી હોય કે એસેટ રીલીઝ કરવા અને એક સાથે જવાબદારીઓ સેટલ કરવા માંગતી હોય.

સી. કરન્ટ અને નોન કરન્ટ વર્ગીકરણ :

કંપની દ્વારા બેલેન્સ શીટમાં એસેટ અને જવાબદારીઓ દર્શાવવામાં આવે છે અને તેનો આધાર કરન્ટ / નોન કરન્ટ વર્ગીકરણ છે. એક એસેટને કરન્ટ તરીકે ત્યારે દર્શાવવામાં આવે જ્યારે:-

- (એ) તેને રીયલાઈઝ કરવા, કે વહેંચવા કે કંપનીની જરૂરીયાતો માટે ઉપયોગ કરવાનું હોય ત્યારે.
- (બી) પ્રાથમિક ધોરણે ધંધા માટે રાખવામાં આવેલ હોય.
- (સી) રીપોર્ટીંગની તારીખથી ૧૨ માસમાં તેને રીયલાઈઝ કરવાની થાય તો.
- (ડી) રોકડ કે રોકડ સમાન હોય અને તેની લેવડ દેવડ કરવામાં પ્રતિબંધ ન હોય કે તેને જવાબદારી પુરી કરવા માટે રીપોર્ટીંગની તારીખથી ૧૨ માસમાં સેટલ કરવાની હોય ત્યારે.

બાકી રહેલ તમામ એસેટોને નોન - કરન્ટ તરીકે વર્ગીકરણ કરવામાં આવે છે.

લાયબલીટી ત્યારે કરન્ટ છે કે જ્યારે :

- (એ) તે કંપની દ્વારા તેના સામાન્ય ક્રમે સેટલ કરવામાં આવનાર હોય ત્યારે.
- (બી) તેને ફક્ત ધંધા માટે રાખવામાં આવેલ હોય તો.
- (સી) તેને રીપોર્ટીંગ તારીખથી ૧૨ માસમાં સેટલ કરવાની હોય તો.
- (ડી) રીપોર્ટીંગની તારીખથી ૧૨ માસમાં કંપની પાસે જવાબદારી સેટલ કરવા માટેનો બીનશરતી હકક રહેલ ન હોય ત્યારે.

બાકી રહેલ તમામ જવાબદારીઓને નોન- કરન્ટ તરીકે વર્ગીકરણ કરવામાં આવે છે.

કામગીરીની પ્રક્રિયા

પ્રોસેસ માટે પ્રાપ્ત કરવામાં આવેલ એસેટ અને તેનાથી રકમ કે તેના સમાન્તર કોઈ લાભ પ્રાપ્ત થયા વચ્ચેના સમયને

ઓપરેટીંગ સાયકલ રહેવામાં આવે છે.

ડી. પ્રોપર્ટી, પ્લાન્ટ અને ઉપકરણ :

માન્યતા અને માપદંડ :

મીલકત, પ્લાન્ટ અને ઉપકરણોની વસ્તુઓની ગણતરી કિંમત પર કરવામાં આવે છે, જેમાં કેપીટલાઈઝ થયેલ બોરોઈંગ કિંમતનો સમાવેશ થાય છે અને જો તેમા કોઈ એક્યુમલેટ થયેલ ઘસારો કે એક્યુમલેટ થયેલ ઈમ્પેરીમેન્ટ નુકશાન હોય તો તે બાદ કરવામાં આવે છે.

મિલકત, પ્લાન્ટ અને ઉપકરણની વસ્તુઓની કિંમતમાં તેની ખરીદ કિંમતનો સમાવેશ થાય છે કે જેમાં ઈપોર્ટ ડ્યુટી અને નોન - રીફન્ડેબલ ખરીદી વેરાનો સમાવેશ થાય છે અને તેમાંથી ટ્રેડનો ડીસ્કાઉન્ટ અને વળતર, અને તે વસ્તુને તેની કામગીરીમાં લાવવા માટે થયેલ કોઈ ખર્ચો કે જેથી તે તેની કામગીરી કરી શકે અને તેને ડીસમેન્ટલ કરી અને દુર કરવી અને જગ્યાને તેની જુની સ્થિતિએ લાવવાની કિંમતનો પણ સમાવેશ થાય છે.

મિકલત, પ્લાન્ટ અને ઉપકરણને લગત વસ્તુઓની કિંમતમાં મટીરીયલ અને સીધો લેબર કોસ્ટ, અને અન્ય કોઈપણ પ્રકારના ખર્ચાઓનો સમાવેશ થાય છે કે જેથી તે વસ્તુને જે કામગીરી માટે લેવાયેલ હોય તે કામગીરી કરવા માટે શરૂ કરી શકાય અને તે વસ્તુને તોડીને દુર કરી અને જે જગ્યાએ તે રહેલ હોય તે જગ્યાને તેની પુનઃ સ્થિતિમાં લાવવાની કિંમતનો પણ સમાવેશ થાય છે.

જો આવા મિલકત, પ્લાન્ટ કે ઉપકરણ જેવી વસ્તુના મુખ્યમાં ભાગોની ઉપયોગીતાનો સમયગાળા અલગ અલગ હોય તે મિલકત, પ્લાન્ટ અને ઉપકરણને અલગ અલગ વસ્તુઓ ગણવામાં આવે છે (મુખ્ય ભાગો).

આવા મિલકત, પ્લાન્ટ અને ઉપકરણની વસ્તુને દુર કરતી વખતે થયેલ નફો કે નુકશાનને નફા અને નુકશાન તરીકે ગણવામાં આવે છે.

પાછળથી થનાર ખર્ચ:-

પાછળથી થનાર ખર્ચને ત્યારે જ કેપીટલાઈઝ કરવામાં આવે છે જ્યારે તે સંભવ હોય કે કંપનીને આવા કરવામાં આવેલ ખર્ચમાંથી ભવિષ્યમાં કોઈ નાણાંકીય ફાયદો થઈ શકે.

ઘસારો:-

મિલકત, પ્લાન્ટ અને ઉપકરણો પર રહેલ ઘસારો સીધી લીટીના આધારે આપવામાં આવેલ છે કે જેનો આધાર તેવા રેટ પર છે કે જે કંપની ધારા, ૨૦૧૩ ના શેડ્યુલ ૨ માં દર્શાવ્યા પ્રમાણે તેના ઉપયોગી જીવનકાળ પર રહેલ છે. વર્ષના

કેપીટલાઈઝેશનમાં ભારતીય રૂપીયા ૨૫,૦૦૦ થી ઓછી કિંમત વાળા એસેટ માટે સંપૂર્ણ ઘસારો નાણાક્રિય વર્ષ ૨૦૨૨ - ૨૩ થી ગણવામાં આવે છે. (૧૬ મી બોર્ડ બેઠક કે જે ૧૪ મી માર્ચ, ૨૦૨૩ માં રાખેલ છે તેમાં એજન્ડા આઈટમ નં. ૧૬/૧૨ થી મંજૂર કરવામાં આવેલ છે.)

એડીશનો / ડીઝપોઝલો પરના ઘસારાને પ્રો - રેટા આધારે આપવામાં આવે છે એટલે કે તે જયારથી / જ્યા સુધી તારીખે તે વસ્તુ ઉપયોગ માટે તૈયાર બનેલ હોય / ડીઝપોઝ થયેલ હોય.

ઘસારાની પદ્ધતિમાં દરેક નાણાંકીય વર્ષના અંતે ઉપયોગી જીવનકાળ અને રેસીડ્યુઅલ વેલ્યુનો વિશ્લેષણ કરવામાં આવે છે અને તેને જરૂરી હોય તે પ્રમાણે અડજેસ્ટ કરવામાં આવે છે. જો રીવીઝનની જરૂરીયાત રહેલ હોય તો રીવાઈઝ થયેલ બાકી રહેલ જીવનકાળ ઉપર અનએમોરાઈઝ થયેલ ઘસારાની રકમ ચાર્જ કરવામાં આવે છે.

ફીક્સ એસેટના ડીઝપોઝલથી ઉત્પન્ન થતા લાભ કે નુકશાન કે તેના રીટાયરમેન્ટથી ઉત્પન્ન થતો નુકશાન કે જે કિંમતના આધારે છે તેને નફા અને નુકશાનના પત્રમાં દર્શાવવામાં આવેલ છે.

પ્રગતિમાં રહેલ કેપીટલ કામગીરીમાં તેવા એસેટ પર થયેલ ખર્ચ કે જે હજી કમીશન થવામાં બાકી હોય તેનો સમાવેશ થાય છે. તમામ સીધી રીતે ઓળખી અને એસર્ટન કરી શકાય તેવા ખર્ચાઓ જે ઈન્સીડેન્ટલ કે એસેટને સંબંધીત હોય અને જે એસેટ બનાવતી વખતે થયેલ હોય કે જ્યા સુધી તે તૈયાર થઈ જાય તેને કેપીટલ વર્ક ઈન પ્રોગ્રેસ (સીડબલ્યુઆઈપી) માં રાખવામાં આવે છે અને કમીશન થયા બાદ તેને લાગુ પડતા ફીક્સ એસેટમાં ટ્રાન્સફર / એલોટ કરવામાં આવે છે.

ઈ. લીઝ:-

કંપની એક લીઝી હોવાથી તે રાઈટ ઓફ યુઝ એસેટ અને લીઝની જવાબદારીને લીઝ શરૂ થયાના દિવસે ગણતરી કરે છે. રાઈટ - ટુ - યુઝ એસેટને પહેલા તો કોસ્ટ ઉપર ગણવામાં આવે છે, જેમાં લીઝ જવાબદારીના પ્રાથમિક રકમને લીઝની શરૂઆતની તારીખે કે પહેલા થયેલ ચૂકવણા સાથે એડજેસ્ટ કરવામાં આવે છે, અને કોઈ સીધી પ્રાથમિક કોસ્ટ જો થયેલ હોય તો તેને પણ તેમ ગણવામાં આવે છે અને તે એસેટને ડીસમેન્ટલ અને દૂર કરવાની કિંમત કે જે જગ્યાએ તે વસ્તુ મુકવામાં આવેલ હોય તેનો પણ અંદાજ કાઢવામાં આવે છે અને તેમાંથી પ્રાપ્ત થયેલ લીઝ ઈનીશીયેટીવને બાદ કરવામાં આવે છે.

આવા રાઈટ - ઓફ - યુઝ એસેટને પછીથી ડીપ્રીશીયેટ કરવામાં આવે છે અને તેના માટે તેના શરૂ થયાની તારીખથી સીધી - લીટી પદ્ધતિયો ઉપયોગ આવા રાઈટ - ઓફ - યુઝ એસેટના ઉપયોગી જીવનકાળના અંત કે લીઝના સમયગાળાના અંત મુજબ કરવામાં આવે. આવા રાઈટ - ઓફ - યુઝ એસેટના અંજાદીત જીવનકાળની ગણતરી તેજ રીતે

કરવામાં આવે છે કે જેમ મિલકત, પ્લાન્ટ અને ઉપકરણોનો કરવામાં આવે છે. આના ઉપરાંત, આવા રાઈટ - ઓફ - યુઝ એસેટને સમય સમય માં ઈમ્પેરીમેન્ટ નુકશાન, જો કોઈ હોય તેના અનુસાર ઘટાડવામાં આવે છે, અને તેને લીઝ જવાબદારીમાં રહેલ રી - મેજરમેન્ટ પ્રમાણે એડજેસ્ટ કરવામાં આવે છે.

લીઝ જવાબદારીની પ્રાથમિક ગણતરી લીઝ ચુકવણાના હાલની કિંમત અનુસાર કરવામાં આવે છે કે જે તેની શરૂઆતની તારીખે ચુકવવામાં આવેલ ન હોય, અને તેમાં સ્ટેન્ડર્ડ પ્રમાણે રહેલ વ્યાજના દર અનુસાર ડીસ્કાઉન્ટ કરવામાં આવે છે.

લીઝના ચુકવણામાં લીઝ જવાબદારીની ગણતરીનો સમાવેશ થાય છે કે જેમાં ફીક્સ ચુકવણા, અને ઈન - સબસીક્યુએન્ટ ફીક્સ ચુકવણાનો સમાવેશ થાય છે. લીઝ જવાબદારીની ગણતરી એમોરાઈઝડ કિંમતમાં એસરકારક વ્યાજ પદ્ધતિનો ઉપયોગ કરી કરવામાં આવે છે. જ્યારે લીઝ જવાબદારીની ગણતરી કરવામાં આવે છે ત્યારે આવા રાઈટ - ઓફ - યુઝ એસેટના કેરીઈંગ રકમમાં એડજેસ્ટમેન્ટ કરવામાં આવે છે અથવા તો તેને નફા અને નુકશાનમાં નોંધવામાં આવે છે જ્યારે આવા રાઈટ - ઓફ - યુઝ એસેટ ને શૂન્ય તરીકે ઘટાડવામાં આવેલ હોય. કંપની દ્વારા આવા રાઈટ - ઓફ - યુઝ એસેટને નોન કરન્ટ એસેટમાં એક અલગ લાઈન આઈટ તરીકે દર્શાવવામાં આવેલ છે અને લીઝ જવાબદારીને ‘બોરોઈંગ’ અને ‘અન્ય નાણાંકીય જવાબદારીને’ ને બેલેન્સ શીટમાં નોંધવામાં આવેલ છે.

એફ. ઈન્ટેનજેબલ એસેટ અને વિકાસ હેઠળ રહેલ ઈન્ટેનજેબલ એસેટ:-

(એ) ફાઈટ શેરીંગ હકકો (રેલવે લાઈન કે જે સર્વિસ કન્સેશન એગ્રીમેન્ટ હેઠળ હોય):-

કંપની તેવા ઈન્ટેનજેબલ એસેટને ઓળખે છે કે જે સર્વિસ કન્સેશન વ્યવસ્થામાંથી પ્રાપ્ત થાય છે કે જેને કન્સેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉપયોગના હકકથી પ્રાપ્ત કરી શકાય. તેવા ઈન્ટેનજેબલ એસેટ કે જે સર્વિસ કન્સેશન વ્યવસ્થામાં બાંધકામ કે અપગ્રેડ સેવાથી પ્રાપ્ત થાય તેને પ્રથમ ઓળખ પર ફેર વેલ્યુથી ગણવામાં આવે છે અને તેને આપેલ સેવામાં ફેર વેલ્યુમાં ગણવામાં આવે છે. પ્રથમ ઓળખ પછી ઈન્ટેનજેબલ એસેટને કોસ્ટ પર ગણવામાં આવે છે અને તેમાં કેપીટલાઈઝ થયેલ બોરોઈંગનો સમાવેશ થાય છે અને તેમાંથી એક્યુમલેટ થયેલ એમોરાઈઝેશન અને એક્યુમલેટ થયેલ ઈમ્પેરીમેન્ટ નુકશાનની ગણતરી થાય છે.

એક ઈન્ટેનજેબલ એસેટનું અંદાજિત જીવન કાળ કે જે સર્વિસ કન્સેશન એગ્રીમેન્ટમાં હોય તે એ સમયગાળો છે કે જ્યારે કંપની ઉપયોગમાં લેવાયેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કન્સેશન સમયગાળા (એટલે કે ૩૦ વર્ષની કામગીરી) સુધી પબ્લીક પાસેથી રકમ વસુલી શકે છે.

ફાઈટ શેરીંગ હકકોને સીધા - લાઈન પદ્ધતિથી પ્રો એટા આધારે ઉમેરાની તારીખ કે ૩૦ વર્ષના ઓપરેશનના અંત પછીની સેવાઓના એમોરાઈઝેશનથી પ્રાપ્ત થાય છે. એમોરાઈઝેશન પદ્ધતિઓ અને ઉપયોગી જીવન કાળનો રીવ્યુ તેના

રીપોર્ટિંગ તારીખ, અને પ્રોસ્પેક્ટીવ આધારે ફેરફારના અંદાજ પર કરવામાં આવે છે. ઈન્ટેન્જેબલ એસેટનું કેરીઈંગ વેલ્યુનું રીવ્યું વાર્ષિક ઈમ્પેરીમેન્ટ પર કરવામાં આવે છે અથવા કોઈ ફેરફાર હોય તો તે કેરેઈંગ વેલ્યુ રીકવરેબલ નથી.

માલના પરિવહન ફેઝ - ૧ માટે વેસ્ટન રેલ્વે દ્વારા તા.૨૩ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ મંજૂર કરવામાં આવે છે. તેથી તારીખ ૨૩ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ ફેઝ - ૧ ના ઈન્ટેન્જેબલ એસેટને કેપીટલાઈઝ કરવામાં આવેલ છે.

(બી) વિકાસ હેઠળના ફાઈટ શેરીંગ રાઈટ

જુના અને નવા એસેટના વિકાસ ઉપર થયેલ ખર્ચ (જેમાં રેવન્યુ શેરીંગ હકકોનો સમાવેશ થાય છે) કે જે પ્રોજેક્ટ રેલ્વે પર હોય તેને ઈન્ટેન્જેબલ માનવામાં આવે છે અને તેનો આધાર કંપની દ્વારા તેના વિકાસ પર થયેલ ખર્ચ પર આધારીત છે અને તેને સેવાઓ માટેના ફેર વેલ્યુ તરીકે માનવામાં આવે છે અને તેમાં તેવા ખર્ચનો સમાવેશ થાય છે કે જે સેવાઓને લગત જમીનના ફેર વેલ્યુ એડજેસ્ટમેન્ટ પર આધારીત હોય.

જી. ક્ષતિ :

નાણાંકીય ઉપકરણોનો ઇમ્પેરમેન્ટ:-

નાણાંકીય એસેટમાં થનાર સંભવિત કેડીટ લોસ માટે કંપનીએ લોસ એલોવન્સની ઓળખ કરેલ છે અને તેની ગણતરી એમોરાઈઝડ કોસ્ટ પર કરવામાં આવેલ છે.

દરેક રીપોર્ટિંગ તારીખે કંપની ચકાસે છે કે એમોરાઈઝડ કોસ્ટ પર કરવામાં આવેલ નાણાંકીય એસેટસ કેડીટ ઈમ્પારડ છે કે નહિ. એક નાણાંકીય એસેટને ત્યારે જ કેડીટ ઈમ્પાર્ડ ગણવામાં આવે જ્યારે નાણાંકીય એસેટના ભવિષ્યના કેશ ફ્લો પર કોઈ નિર્ધારીત એસર થયેલ હોય.

કંપની લોસ એલોવન્સની ગણતરી કેડીટ લોસના સમાન્તરના રકમમા તેના પૂર જીવન કાળમાં કરે છે. તેના જીવન કાળ દરમિયાન થનાર કેડીટ લોસ સંભવિત કેડીટ લોસ છે કે જે નાણાંકીય ઈન્સ્ટ્રુમેન્ટના જીવનકાળમાં થનાર ડીફોલ્ટ ઈવેન્ટ પર આધારીત છે.

કોઈ પણ નાણાંકીય એસેટના કેડીટ રીસ્ક કે જેમાં નોંધપાત્ર વધારો થયેલ છે તેને નિર્ધારીત કરતી વખતે કે કંપની લાગુ પડતા માહિતીની ચકાસણી કરે છે અને કોસ્ટ અને મહેનતને ધ્યાને લેતી નથી. આમા ક્વોન્ટીટેટીવ અને ક્વોલીટેટીવ માહિતી અને ચકાસણીનો સમાવેશ થાય છે કે જે કંપનીના ભુતકાળના અનુભવ અને પ્રાપ્ત થયેલ કેડીટ એસેસમેન્ટનો સમાવેશ થાય છે કે જેમાં ભવિષ્યની માહિતીનો સમાવેશ થાય છે.

સંભવિત કેડીટ લોસની ગણતરી

સંભવિત કેડીટ લોસ એટલે એટલે કે કેડીટ લોસનો પ્રોબેબલીટીના આધારે કરવામાં આવેલ અંદાજો. કેડીટ લોસની

ગણત્રી કેશ ફલો શોર્ટફોલની હાલની કિંમત પર આધારીત છે (એટલે કે કરાર મુજબ કંપનીને થયેલ કેશ ફલો અને કંપનીને મળવાપાત્ર કેશ ફલોમાં રહેલ તફાવત)

બેલેન્સ શીટમાં રહેલ સંભવિત ક્રેડીટ લોસને લગત પ્રેઝન્ટેશન:-

એમોરાઈઝડ કિંમત મુજબ નાણાકીય એસેટને લગત લોસ એલાવન્સને એસેટના ગ્રોસ કેરીયીંગ એમાઉન્ટમાંથી બાદ કરવામાં આવે છે.

રદબાતલ કરવું

નાણાકીય એસેટના ગ્રોસ રકમને રદબાતલ કરવામાં આવેલ છે (પુરી રીતે કે તેનો અમુક ભાગ) અને તે એ હદે કે વસુલાતની કોઈ ખરેખરની સંભાવના ન રહે. સામાન્ય કિસ્સામાં જ્યારે કંપની તેમ નક્કી કરે છે કે કર્જદાર પાસે કેસેટ કે આવકનો કોઈ સ્ત્રોત ન હોય કે જેથી રદબાતલ કરવાની રકમ ભરવા માટે કોઈ નાણાં રહેલ ન હોય. પરંતુ જે નાણાકીય એસેટને રદબાતલ કરવામાં આવેલ હોય તેને પણ એનફોર્સમેન્ટ કામગીરી લાગુ પડે છે કે જેનાથી કંપનીના રકમ વસુલ કરવાની કામગીરીને પૂર્ણ કરી શકાય.

નોન - ફાઈનાન્શીયલ એસેટનો ઈમ્પેરીમેન્ટ

કંપની પાસે રહેલ નોન - ફાઈનાન્શીયલ એસેટ સીવાય કે ઈન્વેન્ટરી કે ડીફર્ડ ટેક્સ એસેટ કે જે દરેક રીપોર્ટીંગની તારીખે રીવ્યુ કરવામાં આવેલ કે જેથી તે નિર્ધારીત કરવામાં આવે કે ઈમ્પેરીમેન્ટ માટે કોઈ સંકેતો રહેલ નથી. રીકવરેબલ રકમ નેટ વેચાણ કિંમત કે વેલ્યુ ઈન યુઝ કરતા વધારે હોય છે. વેલ્યુ ઈન યુઝની ગણત્રી ચાલુ રહેલ એસેટના વપરાશમાંથી પ્રાપ્ત થયેલ અંદાજીત કેશ ફલો કે જે તેના હાલની વેલ્યુ મુજબ છે તેના પર આધારીત છે.

જો કોઈ એસેટની (કે કેશ જનરેટ કરનાર યુનીટ) રીકવરેબલ રકમ અંદાજો મુજબ તેના કેરીઈંગ રકમ કરતા ઓછી હોય તો, તો આવા એસેટની રેરીઈંગ રકમ (કે કેશ જનરેટ કરનાર યુનીટ)ને તેના રીકવરેબલ રકમ પ્રમાણે ઘટાડવામાં આવે છે. કોઈ પણ ઈમ્પેરીમેન્ટ નુકશાનને નફા અને નુકશાનના પત્રકમાં નોંધવામાં આવે છે. જ્યારે કોઈ પણ ઈમ્પેરીમેન્ટ નુકશાનને પાછળથી રીવર્સ કરવામાં આવે છે, તો આવા એસેટ (કે કેશ જનરેટ કરનાર યુનીટ) નું કેરીઈંગ એમાઉન્ટને તેના રીકવરેબલ રકમના રીઈવાઈઝડ અંદાજ મુજબ કરવામાં આવે છે, પરંતુ આવો વધારવામાં આવેલ રકમ તેવા કેરીઈંગ રકમ કરતા વધારે ન હોવી જોઈએ કે જેની ગણત્રી જ્યારે આવા એસેટ (કે કેશ જનરેટ કરનાર યુનીટ) માં કોઈ ઈમ્પેરીમેન્ટ લોઝ થયેલ હોય તેવા સંજોગમાં રહેલ હોય. ઈમ્પેરીમેન્ટ લોઝનો રીવર્જલ નફા અને નુકશાનના પત્રકમાં નોંધવામાં આવે છે.

અચ. બોરોઈંગ કિંમત :

બોરોઈંગ કોસ્ટ એ વ્યાજ છે અને અન્ય કિંમતો (જેમાં ફોરેન કરન્સી બોરોઈંગ માં રહેલ એક્સચેન્જ તફાવતોનો સમાવેશ થાય છે કે જેને વ્યાજની કિંમતોના એડજેસ્ટમેન્ટ તરીકે ગણવામાં આવે છે) કે જે ફન્ડ બોરો કરવાથી થયેલ હોય. બોરોઈંગ કોસ્ટ સીધી રીતે કોઈ પણ એસેટ પ્રાપ્ત કરવા કે બનાવવા સાથે સીધો સંબંધ રાખે છે કે જે તૈયાર કરવામાં લાભો સમયગાળો લગે છે અને તે જે તે એસેટની કિંમતના ભાગરૂપે કેપીટલાઈઝ કરવામાં આવેલ હોય. અન્ય બોરોઈંગ કિંમતને તે જે તે સમયગાળામાં થયેલ હોય તે સમયના ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે.

આઈ. બોરોઈંગ :

બોરોઈંગને કરન્ટ લાયબલીટી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને ફક્ત ત્યારે કે જ્યારે કંપનીને રીપોર્ટિંગ સમયગાળાથી ૧૨ મહિના પછી એવો બીન શરતી હકક રહેલ હોય કે તેઓ લાયબલીટી માટે સેટલમેન્ટને ફેરવી શકે. જ્યારે લાભા ગાળાની લોન વ્યવસ્થાના પ્રાવધાનોમાં કોઈ બ્રીચ થયેલ હોય અને તે પણ રીપોર્ટિંગ સમયગાળા પહેલા કે તેના અંતે કે જેની એવી અસર થાય કે આવા લાયબલીટી રીપોર્ટિંગની તારીખે માંગણી પર ચૂકવવા પાત્ર થાય ત્યાર કંપની આવા લાયબલીટીને કરન્ટ તરીકે નોંધતી નથી, અને જો નાણાં આપનાર સ્વીકારે તો રીપોર્ટિંગના સમયગાળા બાદ અને નાણાંકીય પત્રકોની મંજૂરી પહેલા આવા ચૂકવણાની માંગણી બ્રીચના કારણે થયેલ હોય તો.

જે. રેવન્યુની મંજૂરી

(એ) ગ્રાહકો સાથે કરારમાંથી આવક:-

કંપની દ્વારા ઈન્ડ એએસ - ૧૧૫ માં દર્શાવેલ પાંચ પગલા પદ્ધતિથી ગ્રાહકો સાથેથી થયેલ કરારમાંથી થયેલ આવકને ઓળખવામાં આવે છે.

(૧) ગ્રાહકો સાથે કરારમાંથી આવક:- એક કરારને બે કે તેથી વધુ પક્ષકારો સાથેના કરારની મદદથી ઓળખવામાં આવે છે કે જે અમલકારી હકકો અને જવાબદારી પેદા કરે છે અને કોઈ પણ કરારના શરતોનું પાલન કરવું જરૂરી છે.

(૨) કરારમાં રહેલ કામગીરીની જવાબદારીઓની ઓળખ:- આ એક એવી શરત છે કે જેથી ગ્રાહકને જે સે ઉત્પાદન કે સેવા ગ્રાહકને આપવા માટે વાયદો કરેલ છે તે પૂરો કરવામાં આવે છે.

(૩) લેવડ દેવડની કિંમત નક્કી કરવી:- લેવડ દેવડની રકમ તે રકમ છે કે જેની અપેક્ષા કંપની રાખે છે કે જેના માટે કંપનીએ વાયદો કરેલ વસ્તુઓ કે સેવાઓ ગ્રાહકને પૂરી પાડેલ હોય અને તેમાંથી તેવી રકમ બાદ કરવામાં આવે છે કે જે ત્રીજા પક્ષકાર માટે એકત્રિત કરવામાં આવેલ છે.

(૪) પ્રાપ્ત થયેલ લેવડ દેવડની રકમાને કરારના પરફોરમેન્સ જવાબદારી માટે આપવામાં આવે:- એક કરાર માટે કે જેમાં એક કરતા વધારે પરફોરમેન્સ જવાબદારી હોય તેના માટે કંપની દરેક લેવડ દેવડની રકમને પરફોરમેન્સ જવાબદારી માટે આપવામાં આવે છે અને તે રકમ કંપનીનો કન્સીડરેશન રકમ છે કે જેની અપેક્ષા કંપની તેઓ દ્વારા પૂરી કરવામાં આવેલ જવાબદારી માટે રાખે છે.

(૫) જ્યારે કંપની પોતાની પરફોરમેન્સ જવાબદારી પુરી કરે ત્યારે તેને આવક તરીકે ગણતરી કરવાની રહે.

રેલ્વે કામગીરીમાંથી આવક

કંપની દ્વારા પ્રાપ્ત થયેલ ફેઈટ કે જે કન્સેશન કરારની શકતો મુજબ હોય કે જે ફેઈટ કામગીરીમાંથી પ્રાપ્ત થયેલ હોય અને જે કંપની દ્વારા ઓળખવામાં આવેલ હોય તેને ઈન્ડ એએસ ૧૧૫ મુજબ ઓપરેટીંગ રેવેન્યુ તરીકે ઓળખવામાં આવે છે. (એટલે કે રેલ્વે દ્વારા ખરેખર પ્રાપ્ત કરેલ આવક).

રેલ્વે દ્વારા આવકને અપોરશન કરવામાં આવે છે અને તેને કંપની દ્વારા આઈઆરએફએ નિયમો મુજબ ઓળખવામાં આવે છે અને તે રેલ્વે બોર્ડના જુદા જુદા સર્યુલરો મુજબ છે.

(બી) અન્ય રેવેન્યુ આવક:-

વ્યાજની આવકને અસરકારક વ્યાજ પદ્ધતિથી ઓળખવામાં આવે છે અને તેને એક્યુરલ આધારે ગણવામાં આવે છે.

અન્ય તમામ આવકોને એક્યુરલ બેઝીસ પર ગણવામાં આવે છે.

કે. પ્રાવધાનો (કર્મચારી ફાયદા સિવાયના) :

જો એક પ્રાવધાનને કોઈ જુના ઈવેન્ટના કારણે મંજૂરી આપવામાં આવે તો કંપનીને હાલમાં પણ એવી જવાબદારી રહેલ છે કે જેનો અદાજ લઈ શકાય અને તે સંભવિત છે કે નાણાંકીય બેનીફીટની જરૂર આવા કાયદાકીય કે કરારી જવાબદારીઓને પુરી કરવા માટે પડી શકે છે. પ્રાવધાનો તેના પર નક્કિ કરવામાં આવે છે કે ભવિષ્યમાં કેટલો કેશ ફ્લો થઈ શકે (બેલેન્સ શીટની તારીખે થનાર સંભવિત ખર્ચના અંદાજોના આધારે) અને તે પણ વેર પહેલાના દર મુજબ કે ચાલતા બજાર અંદાજો અને તે સમયે રહેલ પૈસાની કિંમત મુજબ અને જવાબદારીઓમાં રહેલ રીસ્ક મુજબ રહે છે. થનાર રીસ્કાઉન્ડો નાણાંકીય કિંમત મુજબ રહેશે. ભવિષ્યમાં થનાર ઓપરેટીંગ કિંમતોનો અંદાજ લેવામાં આવેલ નથી.

કંટીજન્સીઓ

તેવા કંટીજન્સી નુકશાનો કે જે દાવાઓ, લીટીગેશન, એસેસમેન્ટ, ફાઈન, પેનલ્ટી વગેરેને લગત હોય તેના પ્રાવધાનોને ઓળખવામાં આવેલ છે કે જેયાર તેવી સંભાવના હોય કે લાયબલીટી થઈ શકે અને તેની રકમનો અંદાજ લઈ શકાય.

એલ. કંટીજન્સીને લગતી જવાબદારીઓ :

કંટીજન્સીને ત્યારે દર્શાવવામાં આવે કે જ્યારે એવી સંભવિત જવાબદારી હોય કે જુના કોઈ ઈવેન્ટને કારણે ઉદભવે અને તેનો અસ્તિત્વ ત્યારે જ નિશ્ચિત થાય કે જ્યારે ભવિષ્યમાં એક કે તેનાથી વધારે ઈવેન્ટો થાય કે જે કંપનીના પુરા નિયંત્રણમાં ન હોય કે ભૂતકાળના ઈવેન્ટના કારણે હાલમાં કોઈ જવાબદારીઓ ઉભી થઈ હોય કે જ્યાં આવા ઈવેન્ટને સેટલ કરવા માટે નાણાં ચૂકવવાની જરૂરીયાત ઉભી થાય કે આવા થનાર ખર્ચનો પુરેપુરો અંદાજ પ્રાપ્ત કરી ન શકાય.

એમ. આવક વેરો :

આવક વેરામાં કરન્ટ અને ડીફર્ડ ટેક્સનો સમાવેશ થાય છે. તેને નફા કે નુકશાન તરીકે ઓળખવામાં આવે છે અને ફક્ત ત્યારે કે જ્યારે કે જ્યારે તેનો સંબંધ તેવા આઈટ સાથે હોય કે જેન સીધી રીતે ઈકવીટી તરીકે ઓળખવામાં આવે કે કોમ્પ્રીહેન્સીવ આવક તરીકે ઓળખવામાં આવે ત્યારે તેમ કરવામાં આવતી નથી.

કરન્ટ ટેક્સ

કરન્ટ ટેક્સમાં ચૂકવવા પાત્ર વેરો કે ટેક્સેબલ આવકમાંથી મળવાપાત્ર આવક કે નુકશાન જેતે વર્ષનો હોય અને જુના વર્ષોના આધારે ચૂકવવા પાત્ર કે મળવા પાત્ર વેરામાં એડજેસ્ટ કરવામાં આવે છે. કરન્ટ ટેક્સની રકમ તે દર્શાવે છે કે વેરાની રકમનો સૌથ સારો અંદાજ શુ છે કે જે ચૂકવવા કે મળવાપાત્ર છે અને તેના પર આવક વેરાની અનિશ્ચિતતાને ધ્યાને લીધેલ હોય. તની ગણતરી વેરા દરો (અને વેરાના નિયમો) કે જે રીપોર્ટીંગની તારીખે લાગુ પડતા હોય તેના આધારે કરવામાં આવે છે.

કરન્ટ ટેક્સ અને કરન્ટ ટેક્સની જવાબદારીઓ ઓફસેટ ત્યારેજ હોય જ્યારે લાગુ પડતા રકમ પર કોઈ કાયદાકીય હકકો કે અધિકારો રહેલ હોય, અને તેનો ઉદ્દેશ્ય એસેટને પ્રાપ્ત કરવા અને તેને નેટ બેઝીસ કે એક સાથે સેટલ કરવા માટે થાય છે.

તેવા વેરાના લાભો કે જે કર્મચારી સ્ટોક ઓપશનમાં થયેલ બાદબાકીથી પ્રાપ્ત થયેલ હોય કે જે કોમ્પ્રીહેન્સીવ આવકમાં જમા કરવામાં આવેલ આવકમાં ચાર્જ કરવામાં આવેલ વળતર કરતા વધારે હોય ત્યારે.

ડીફર્ડ ટેક્સ

ડીફર્ડ ટેક્સને તે રીતે ઓળખવામાં આવે છે કે તે એસેટની રકમ અને જવાબદારીઓમાં રહેલ ફેરફારો કે જેનો ઉપયોગ નાણાંકીય રીપોર્ટીંગ માટે કરવામાં આવેલ હોય અને તેવા રકમને વેરાના કામે ઉપયોગ કરવામાં આવેલ હોય. ડીફર્ડ ટેક્સને એમ પણ ઓળખવામાં આવે છે કે જેમા કેરી ફોર્વર્ડ કરવામાં આવેલ ટેક્સ અને ટેક્સ કેડીટ હોય. ડીફર્ડ ટેક્સને ત્યારે રેકગનાઈઝ કરવામાં આવતી નથી જ્યારે:-

- કોઈ પણ લેવડ દેવડ વખતે ટેક્ષના નફા / નુકશાની ગણત્રી પર અસર ન કરે તો તેવા એસેટ કે લાયબલીટીમાં અસ્થાઈ ફેરફાર હોય તો.
- ગુડવીલના પહેલા ઓળખ વખતે રહેલ અસ્થાઈ ટેક્ષમાં ફેરફારો.

ડીફર્ડ ટેક્ષ એસેટને તે હદ સુધી ઓળખવામાં આવે છે કે જ્યાર તેવી સંભાવના રહેલ હોય કે ભવિષ્યમાં ટેક્ષવાળો નફો ઉભલબ્ધ હોય અને તેનો ઉપયોગ કરી શકાય. બીન વપરાયેલ વેરાના નુકશાનોનો અસ્થિત્વ તે ચોક્કસપણે દર્શાવે છે કે ભવિષ્યમાં વેરામાં નફો રહેશે નહિ. આથી, નુકશાનનો ઈતીહાસ હોય તો, કંપનીએ ડીફર્ડ ટેક્ષ એસેટને ત્યારે જ ઓળખવી જોઈએ કે જ્યારે તેની પાસે જરૂરીયાત મુજબ ટેક્ષમાં તફાવત રહેલ હોય કે ત્યારે જ્યારે એવી ચોક્કસ સાબીતી હોય કે જરૂરીયાત મુજબનો ટેક્ષમાં નફો ઉપલબ્ધ રહેશે કે જેની સામે ડીફર થયેલ ટેક્ષ એસેટ પ્રાપ્ત કરી શકાય. ડીફર થયેલ ટેક્ષ એસેટ - રેકગનાઈઝ થયેલ કે રેકગનાઈઝ થયા વગરની, તેનો રીવ્યુ દરેક રીપોર્ટીંગની તારીખે કરવામાં આવે છે અને તેને તે હદે રેકગનાઈઝ કરવામાં આવે છે કે જ્યારે તેવી સંભાવના રહેલ હોય કે સંબંધિત વેરાના ફાયદાઓ પ્રાપ્ત કરી શકાય.

ડીફર્ડ ટેક્ષની ગણત્રી તેવા વેરાના દર પર કરવામાં આવે છે કે જે તેવા સમયે લાગુ પડે કે જ્યારે તે એસેટ ઉભો થયો હોય કે જવાબદારી પૂરી થઈ હોય અને રીપોર્ટીંગના સમયે જે નિયમો અસરમાં હોય ત્યારે.

ડીફર્ડ ટેક્ષની ગણત્રી તે દર્શાવે છે કે વેરાની જવાબદારીઓ પાછળથી આવશે અને તે રીતે આવશે કે જે રીતે કંપનીની અપેક્ષા છે, અને તે પણ રીપોર્ટીંગની તારીખે, કે જેથી એસેટ કે લાયબલીટીના કેરીઈંગ એમાઉન્ટને વસુલ કે ચૂકવી શકાય.

ડીફર્ડ ટેક્ષ એસેટ અને લાયબલીટી ત્યારે ઓફસેટ હોય જ્યારે કરન્ટ ટેક્ષ લાયબલીટી કે એસેટને ઓફસેટ કરવાનો કોઈ કાયદાકીય લાગુ કરવાનો હકક રહેલ હોય, અને તે સમાન સંતા દ્વારા વસુલ કરવામાં આવેલ આવક વેરાને લગત હોય કે સમાન ટેક્ષ એન્ટીટી કે જુદો ટેક્ષ એન્ટીટી હોય, પરંતુ તે કરન્ટ ટેક્ષ લાયબલીટી અને એસેટને નેટ બેઝીસના આધાર સુટલ કરવા માગતી હોય કે તેઓના ટેક્ષ એસેટ કે લાયબલીટીને એકસાથે પ્રાપ્ત કરી શકાય.

ટાઈમીંગના ફેરફારને લગ ડીફર્ડ ટેક્ષ કે જે તે વર્ષના ટેક્ષ હોલીડે પીરીયડ રેકગનાઈઝ થયા બાદ રીવર્સ કરવામાં આવેલ હોય.

એન. પ્રતિ શેરની આવક:-

સામાન્ય આવક / (નુકશાન) પ્રતિ શેરની ગણત્રી વર્ષના નેટ નફા કે નુકશાનનો ભાગાકાર કરીને કરવામાં આવે છે કે જે

ઈકવીટી શેરધારકોને લગત હોય કે જે તે વર્ષના આઉટસ્ટેન્ડીંગ ઈકવીટીશેરની સંખ્યાના સરેરાશ મુજબ હોય છે. દરેક બોનસ અને શેર સ્પલીટને જે તે વર્ષના આઉટસ્ટેન્ડીંગ ઈકવીટી શેરના સરેરાશ સંખ્યા સામે સરભર કરવામાં આવે છે. દરેક શેરના ડાયલ્યુટેડ આવક / (નુકશાન) ની ગણતરી કરવા માટે દરેક ઈકવીટી શેર ધારકના વર્ષમાં થયેલ નફા કે નુકશાન અને વર્ષમાં આઉટસ્ટેન્ડીંગ રહેલ શેરોના વેઈડ એવરેજ સંખ્યાને એડજેસ્ટ કરવામાં આવે છે.

ઓ. કેશ અને કેશના સમાન્તરો :

એક બેલેન્સ શીટમાં કેશ અને કેશ ફલોના સમાન્તરોમાં બેન્કમાં રહેલ કેશ અને હાથ પર રહેલ અને ટુકા ગાળાના ડીપોઝીટ કે જેની મેચ્યુરીટી સમય ત્રણ માસ કે તેનાથી ઓછો હોય તેનો સમાવેશ થાય છે અને તેના પર વેલ્યુમાં ફેરફારમાં રહેલ રીસ્કની અસર રહેલ છે.

કંપનીના કેશ મેનેજમેન્ટના આંતરીક ભાગ તરીકે કેશ ફલો, કેશ અને કેશના સમાન્તર કે જેમાં કેશ અને શોર્ટ ટર્મ ડીપોઝીટ, કે જે ઉપર દર્શાવવામાં આવેલ છે અને બેન્ક ઓવરડ્રાફ્ટના નેટનો સમાવેશ થાય છે.

પી. રીપોર્ટીંગના સમયગાળા પછી થયેલ ઈવેન્ટ :

તેવા ઈવેન્ટને એડજેસ્ટ કરવા કે જે રીપોર્ટીંગ પીરીયડના અંતે રહેલ પરીસ્થિતિ દર્શાવે છે. નાણાંકીય પત્રકોને ઈશ્યુના એથોરાઈઝેશન પહેલા દરેક ઈવેન્ટ માટે એડજેસ્ટ કરવામાં આવે છે. એડજેસ્ટ કર્યા સિવાયના ઈવેન્ટ તે દર્શાવે છે કે રીપોર્ટીંગ સમયગાળાના અંતે કેવી પરિસ્થિતિઓ રહેલ છે. રીપોર્ટીંગની તારીખે પછી થયેલ નોન - એડજસ્ટીંગ ઈવેન્ટને એકાઉન્ટ કરવામાં આવતી નથી પરંતુ તેને ડીસ્કોલસ કરવામાં આવે છે.

ક્યુ. રોકડ પ્રવાહનું પત્રક :

કેશ ફલોનું રીપોર્ટીંગ ઈન્ડાયરેક્ટ પદ્ધતિથી કરવામાં આવે છે કે જેમાં નફા / (નુકશાન) પહેલાનું ટેક્સ એડજસ્ટ કરવામાં આવે છે કે જેથી નોન કેશ પ્રકારનો અસર પ્રાપ્ત કરી શકાય અને કોઈ પણ ડીયરલ કે ભૂતકાળના એકરુઅલ કે ભવિષ્યના કેશ રીસીપ્ટ કે ચૂકવણાની અસર પ્રાપ્ત કરી શકાય. વર્ષ દર્મયાનના કશ ફલોને ઓપરેટીંગ, રોકાણ અને નાણાંકીય કામગીરીઓને વર્ગીકૃત કરીને કરવામાં આવે છે.

આર. સામાન્ય :

ખાસ સબંધ ધરાવતા ન હોય તેવા હિસાબી પોલીસીઓ કે જેને અત્રે દર્શાવવામાં આવતી ન હોય તે સામાન્ય રીતે સ્વીકૃત થયેલ હિસાબી પ્રિન્સીપલ મુજબ છે.

૪. પ્રોપર્ટી, પ્લાન્ટ અને ઉપકરણ

(રકમ રૂ. માં)

વિગત	કોમ્પ્યુટર	કોમ્પ્યુટર અને ડેટા પ્રોસેસીંગ યુનિટ - સર્વર અને નેટવર્ક	કોમ્પ્યુટર હાર્ડવેર	કોમ્પ્યુટર સર્વર	ઇલેક્ટ્રીક ઇન્સ્ટોલેશન ઇકવીપમેન્ટ	ફર્નિચર અને ફીટીંગ	લીઝલેસ પ્રોપર્ટીને સુધારો	આઈટી ઇન્સ્ટોલેશન કામગીરી	કચેરી સામગ્રી	ખિન્તર	જમીન	કુલ
એપ્રિલ, ૦૧, ૨૦૨૨ ના રોજનું કેરીઈંગ ગ્રોસ વેલ્યુ	-	-	-	-	-	-	-	-	-	-	-	-
ઉમેરો	૭૫૭ ૪૮૩	૧૮૨૮ ૬૭૬	૫ ૧૪ ૧૪૫	૧૬૮૮૩૪૮	૩૧ ૭૭ ૧૧૪	૧૭૮ ૮૬ ૮૨૬	૫૭૩૫ ૩૮૬	૬ ૦૧ ૪૮૫	૫૬ ૫૧ ૩૮૭	૬૮ ૬૭૧	૫૪૬૮૮ ૪૫૨	૧૦ ૩૪ ૧૧ ૦૬૪
ડીબીઝલ	-	-	-	-	-	-	-	-	-	-	-	-
ઈન્ડ એએસ	-	-	-	-	-	-	-	-	-	-	-	-
એડજસ્ટમેન્ટ	-	-	-	-	-	-	-	-	-	-	-	-
૩૧ મી માર્ચ, ૨૦૨૩	૭ ૫૭ ૪૬૩	૧૯ ૨૯ ૬૭૬	૫ ૧૪ ૧૪૫	૧૬ ૮૯ ૩૪૯	૩૧ ૭૭ ૧૧૪	૧ ૭૯ ૮૬ ૯૨૬	૧ ૫૭ ૩૫ ૩૬૬	૬ ૦૧ ૪૮૫	૫૬ ૫૧ ૩૮૭	૬૮ ૬૭૧	૫ ૪૬ ૯૯ ૪૫૨	૧૦૩૪ ૧૧ ૦૬૪
એપ્રિલ ૦૧, ૨૦૨૨ ના રોજનો ઘસારો	-	-	-	-	-	-	-	-	-	-	-	-
વર્ષ દરમ્યાન થયેલ એડજસ્ટમેન્ટ	૨૮ ૫૭૪	૩૭ ૬૬૮	૨૭ ૦૪૭	૩૨ ૮૭૬	૩૭ ૨૧૧	૨૧ ૩૩ ૮૫૩	૬૧ ૪૩૩	૧૧ ૭૪૧	૩ ૮૩ ૬૧૨	૨૬ ૧૦૬	-	૨૭ ૯૧ ૨૨૧
ઈન્ડ એએસ	-	-	-	-	-	-	-	-	-	-	-	-
એડજસ્ટમેન્ટ	-	-	-	-	-	-	-	-	-	-	-	-
૩૧ મી માર્ચ, ૨૦૨૩	૨૯ ૫૭૪	૩૭ ૬૬૮	૨૭ ૦૪૭	૩૨ ૮૭૬	૩૭ ૨૧૧	૨૧ ૩૩ ૮૫૩	૬૧ ૪૩૩	૧૧ ૭૪૧	૩ ૮૩ ૬૧૨	૨૬ ૧૦૬	-	૨૭ ૯૧ ૨૨૧
નેટ કેરીઈંગ વેલ્યુ	૭ ૨૭ ૯૧૯	૧૮ ૯૨ ૦૦૮	૪ ૮૭ ૦૯૮	૧૬ ૫૬ ૩૭૩	૩૧ ૩૯ ૯૦૩	૧૫૮ ૫૩ ૦૭૩	૧ ૫૬ ૭૩ ૬૬૩	૫ ૮૯ ૭૪૪	૫૨ ૫૭ ૭૦૫	૬ ૪૨ ૫૮૫	૫૪૬ ૯૯ ૪૫૨	૧૦ ૦૬ ૧૯ ૮૭૩
૩૧ માર્ચ, ૨૦૨૩												

પ. ઇન્ટેન્જીબલ એસેટ

(રકમ રૂ. માં)

વિગત	ફેઈટ શેરીંગ રાઈટ	કુલ ઇન્ટેન્જીબલ એસેટ
ગોસ કેરીઈંગ વેલ્યુ		
૧ લી એપ્રીલ, ૨૦૨૨ મુજબ	-	-
ઉમેરો	૩૪૮ ૪૫ ૯૫ ૪૫૮	૩૪૮ ૪૫ ૯૫ ૪૫૮
ડીઝપોઝલ	-	-
ઈન્ડ એએસ એડજેસ્ટમેન્ટ	-	-
૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતિત	૩૪૮ ૪૫ ૯૫ ૪૫૮	૩૪૮ ૪૫ ૯૫ ૪૫૮
એમોરટાઈઝેશન		
૧ લી એપ્રીલ, ૨૦૨૨ મુજબ	-	-
વર્ષ દર્મયાન ફેરફાર	૨૬ ૦૩ ૯૭૯	૨૬ ૦૩ ૯૭૯
એડજેસ્ટમેન્ટ	-	-
ઈન્ડ એએસ એડજેસ્ટમેન્ટ	-	-
૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતિત	૨૬ ૦૩ ૯૭૯	૨૬ ૦૩ ૯૭૯
નેટ કેરીઈંગ વેલ્યુ		
૩૧ મી માર્ચ, ૨૦૨૩ મુજબ	૩૪૮ ૧૯ ૯૧ ૪૭૯	૩૪૮ ૧૯ ૯૧ ૪૭૯

બહુચરાણ રેલ કોર્પોરેશન લિ.			
૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતિત નાણાકીય પત્રકોની નોંધ			
(રકમ રૂ.માં)			
વિગત	૩૧-૩-૨૦૨૩ અંતિત	૩૧-૩-૨૦૨૨ અંતિત	
૬. રાઈટ ઓફ યુઝ એસેટ - લીઝ હોલ્ડ ઓફિસ *			
ગ્રોસ કેરીઈટ વેલ્યુ			
ઉઘડતી સિલક	૭૬ ૩૧ ૮૪૩	-	
ઉમેરો	-	૭૬ ૩૧ ૮૪૩	
ડીઝપોઝલ	-	-	
આઈએનડીએએસ મુજબ એડજેસ્ટમેન્ટ	-	-	
બંધ સિલક	<u>૭૬ ૩૧ ૮૪૩</u>	<u>૭૬ ૩૧ ૮૪૩</u>	
ઘસારો			
ઉઘડતી સિલક	૭ ૬૩ ૧૮૪	-	
વર્ષ દર્મયાન ફેરફાર	૧૫ ૨૬ ૩૮૮	૭ ૬૩ ૧૮૪	
એડજેસ્ટમેન્ટ	-	-	
આઈએનડીએએસ મુજબ એડજેસ્ટમેન્ટ	-	-	
બંધ સિલક	<u>૨૨ ૮૯ ૫૮૩</u>	<u>૭ ૬૩ ૧૮૪</u>	
નેટ કેરીઈગ વેલ્યુ	<u>૫૩ ૪૨ ૩૬૦</u>	<u>૬૮ ૬૮ ૭૪૯</u>	
* જુઓ નોંધ નં. ૪૬			
૭. કેપીટલ વર્ક ઈન પ્રોગ્રેસ જેમાં:-			
કેપીટલ વર્ક ઈન પ્રોગ્રેસ - કચેરી*	-	૧ ૮૩ ૧૭ ૩૭૭	
કેપીટલ વર્ક ઈન પ્રોગ્રેસ - જમીન સંપાદન	૮ ૮૬ ૩૨ ૪૭૮	૪ ૧૮ ૮૭ ૪૮૮	
કુલ	<u>૮ ૮૬ ૩૨ ૪૭૮</u>	<u>૬ ૧૨ ૦૪ ૮૭૫</u>	
* જુઓ નોંધ નં. ૪૧			
૮. વિકાસ હેઠળ રહેલ અવાસ્તવિક મિલકતો			
વિકાસ હેઠળ રહેલ ફ્રેઈટ શેરીંગ રાઈટ	૨ ૨૦ ૫૭ ૮૮ ૧૭૭	૨ ૨૭ ૫૧ ૬૫ ૮૬૦	
કુલ	<u>૨ ૨૦ ૫૭ ૮૮ ૧૭૭</u>	<u>૨ ૨૭ ૫૧ ૬૫ ૮૬૦</u>	
* જુઓ નોંધ નં. ૪૨			

વિગત	૩૧-૩-૨૦૨૩ અંતિત	૩૧-૩-૨૦૨૨ અંતિત
૯. અન્ય નોન - કરન્ટ એસેટ		
વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસેટ માટેનો એડવાન્સ ચૂકવણી*		
- ઈપીસી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવેલ એડવાન્સ	૧૮ ૯૩ ૮૭ ૦૮૬	૪૦ ૫૪ ૮૪ ૫૯૭
- ઈપીસી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવેલ મોબલાઈઝેશન એડવાન્સ પર મળવાપાત્ર વ્યાજ**	૨ ૨૫ ૬૮ ૯૫૦	૨ ૪૫ ૩૪ ૬૮૦
સ્ટેચ્યુટરી / સરકારી સત્તાઓ પાસે રહેલ સિલક મળવાપાત્ર જીએસટી	૫ ૩૨ ૨૫ ૬૪૦	૧ ૯૭ ૬૦ ૮૧૯
ડીપોઝીટ		
સિક્યુરીટી ડીપોઝીટ - ટોરેન્ટ પાવર	૧ ૦૦ ૦૦૦	-
સિક્યુરીટી ડીપોઝીટ - એનએસડીએલ	૧ ૫૦ ૦૦૦	-
કુલ	૨૬ ૫૪ ૩૧ ૬૭૬	૪૪ ૯૭ ૮૦ ૦૯૬
*અંત થતા વર્ષ મુજબ આવનાર ૧૨ માસમાં વસુલ કરવાની થતી મોબલાઈઝેશન એડવાન્સ અને મળવાપાત્ર વ્યાજની રકમ નક્કી કરવામાં આવેલ નથી. આથી મોબલાઈઝેશન એડવાન્સ અને મળવાપાત્ર વ્યાજ લાભા ગાળાના એસેટ હોવાથી તેને નોન - કરન્ટ એસેટમાં દર્શાવવામાં આવેલ છે.		
** જુઓ નોંધ નં. ૪૨		
૧૦. મળવાપાત્ર લેણા*		
૬ માસથી ઓછા માટે		
તકરાર વગર મળવાપાત્ર ટ્રેડ - સારા પ્રકારની	૮ ૯૧ ૨૪ ૮૪૪	૧૩ ૬૭ ૯૯ ૧૯૬
તકરાર વગર મળવાપાત્ર ટ્રેડ - કેડીટ ખતરામાં ખાસ વધારો હોય તેવું	-	-
તકરાર વગર મળવાપાત્ર ટ્રેડ - કેડીટ ઈમ્પેર થયેલ	-	-
તકરારી મળવાપાત્ર ટ્રેડ - સારા પ્રકારની	-	-
તકરારી મળવાપાત્ર ટ્રેડ - કેડીટ ખતરામાં ખાસ વધારો હોય તેવું	-	-
તકરારી મળવાપાત્ર ટ્રેડ - કેડીટ ઈમ્પેર થયેલ	-	-
૬ માસ - ૧૬ વર્ષ	-	-
૧ - ૨ વર્ષ	-	-
૨ - ૩ વર્ષ	-	-
૩ વર્ષથી વધારે	-	-
કુલ	૮ ૯૧ ૨૪ ૮૪૪	૧૩ ૬૭ ૯૯ ૧૯૬
*જુઓ નોંધ નં. ૩૫ અને ૩૭		

વિગત	૩૧-૩-૨૦૨૩ અંતિત	૩૧-૩-૨૦૨૨ અંતિત
૧૧. કેશ અને કેશનો સમાન્તર		
બેન્ક પાસે રહેલ સિલક		
યુનીયન બેંક ઓફ ઈન્ડિયા કરન્ટ ખાતુ	૧૨૨૮૦૫૬૦૧	૭૦૮૨૩૯૧૪
યસ બેંક કરન્ટ ખાતુ	૬૬૨૯૮૯૧	૧૦૭૫૧૩૧૩
જીએસએફએસ પાસે રહેલ સિલક - લીકવીડ રોકાણ	૯૦૦૦૦૦૦	૩૧૪૩૪૯૯૪૭
કુલ	૨૧૯૪૩૫૪૯૨	૩૯૫૯૨૫૧૭૪
૧૨. અન્ય બેંક પાસે રહેલ સિલક		
જીએલએફસી પાસે રહેલ સિલક - ઈન્ટર કોર્પોરેટ રોકાણ	-	૨૦૦૦૦૦૦૦૦
કુલ	-	૨૦૦૦૦૦૦૦૦
૧૩. કરન્ટ વેરા એસેટ (નેટ)		
સી. વાય. પી. વાય.		
નાણાકીય વર્ષ ૨૦૨૧ - ૨૨	૯૨૨૮૭૬૮	૯૨૨૮૭૬૮
માટે આવક વેરાનો પ્રાવધાન	-	-
ઘટાડો:-		
યુકવેલ એડવાન્સ વેરો	૩૩૬૦૯૯૩	૩૩૬૦૯૯૩
નાણાકીય વર્ષ ૨૦૨૧ - ૨૨	-	-
મળવાપાત્ર ટીડીએસ	૧૪૮૫૬૨૬૩	૧૪૮૫૬૨૬૩
વર્ષ ૨૦૨૧ - ૨૨	-	-
મળવાપાત્ર ટીડીએસ	૧૫૯૧૦૨૪૨	-
વર્ષ ૨૦૨૨ - ૨૩	-	-
કુલ	૨૪૮૯૮૭૨૯	૯૯૯૯૪૯૯
૧૪. કરવેરા		
નફા અને નુકશાનનના પત્રકમાં દર્શાવેલ વેરા ખર્ચ		
કરન્ટ વેરો	-	૯૨૨૮૭૬૮
ડીફર થયેલ વેરો	૮૪૯૩૨૬૮૦	-
ચાલુ વર્ષે ઓળખવામાં આવેલ કુલ વેરા ખર્ચ	૮૪૯૩૨૬૮૦	૯૨૨૮૭૬૮
વર્ષ માટેના વેરા ખર્ચને હિસાબી નફામાં નીચે મુજબ રીકન્સાઈલ કરી શકાય:-		

વિગત	૩૧-૩-૨૦૨૩ અંતિત	૩૧-૩-૨૦૨૨ અંતિત
વેરા પહેલાનો નફો / (નુકશાન) અને અસામાન્ય બાબતો	-	૧૪૫ ૮૮ ૮૦૦
લાગુ પડતો વેરાનો દર	-	૨૭.૮૨
ગણતરી કરેલો વેરા ખર્ચ	-	૪૦ ૫૮ ૮૮૨
વેરાની અસરો:-		
એકઝેમ્પ્ટ થયેલ આવક	-	-
નામંજુર થયેલ ખર્ચ (૧,૮૫,૮૩,૩૪૩ *૨૭.૮૨%)	-	૫૧ ૬૮ ૮૮૬
જો એમએટી કેડીટ થયેલ હોય તો	-	-
વધારાના એલોવેન્સનું નેટ	-	-
કરન્ટ વેરાનો પ્રાવધાન	-	૯૨ ૨૮ ૭૬૮
મિલકત, પ્લાન્ટ અને ઉપકરણ, ઈન્ટેન્જેબલ		
એસેટ, મકાન અને પ્લાન્ટ અને મશીનરી	૮ ૪૮ ૩૪ ૬૮૦	-
નાણાકીય એસેટ અને અન્ય આઈટમો પર ઈન્કીમેન્ટલ ડીફર		
થયેલ વેરાની જવાબદારી / (એસેટ)	-	-
ડીફર પયેલ વેરા પ્રાવધાન	-	-
નફા અને નુકશાનના પત્રમાં દર્શાવેલ વેરા ખર્ચ	-	૯૨ ૨૮ ૭૬૮
અસરકારક વેરાનો દર	-	૬૩%
એકસેપશનલ આઈટમ પર વેરો	-	-
૧૫. અન્ય કરન્ટ એસેટ		
કેપીટલ એડવાન્સ સિવાયનો એડવાન્સ		
અન્ય એડવાન્સ		
અગાઉ થી ચુકવેલ ખર્ચ	૨ ૯૬ ૬૨૧	૩ ૩૭૬
જીએસએફએસ પર મળવાપાત્ર વ્યાજ	૩૩ ૨૮૮	૮૨ ૨૩ ૮૧૮
ટોરન્ટ પાવર પર મળવાપાત્ર વ્યાજ	૧ ૪૨૧	-
બીલ થયા વગરની રેવન્યુ*	૧ ૭૫ ૨૮૫	-
કેપીટીએલ પાસેથી મળવાપાત્ર ખર્ચ	૧૮ ૭૪ ૬૩૮	-
એમએસઆઈએલ પાસેથી મળવાપાત્ર રકમ	૭૧ ૨૮ ૩૧૨	-
કુલ	૯૫ ૧૦ ૫૬૫	૮૨ ૨૭ ૧૯૫

*વેસ્ટર્ન રેલવે પાસેથી નાણાંકીય વર્ષ ૨૦૨૨ - ૨૩ માટે બીલ થયા વગરની આવક કે જે નાણાંકીય વર્ષ ૨૦૨૩ - ૨૪ માં બીલ કરવામાં આવેલ છે. તેથી ચાલુ વર્ષે તેને અન બીલ્ડ રેવન્યુ તરીકે બુક કરવામાં આવેલ છે.

વિગત	૩૧-૩-૨૦૨૩ અંતિત	૩૧-૩-૨૦૨૨ અંતિત		
૧૬. ઈકવીટી શેર કેપીટલ				
ઓથોરાઈઝ થયેલ:-				
૭૮,૬૨,૨૦,૦૦૦ ઈકવીટી શેર પ્રતિ રૂ. ૧૦ ના ફૂલ્લી પેઈડ અપ (૭૮,૬૨,૨૦,૦૦૦ ઈકવીટી શેર પ્રતિ રૂ. ૧૦ ના ફૂલ્લી પેઈડ અપ)	૭૮૬ ૨૨ ૦૦ ૦૦૦	૭૮૬ ૨૨ ૦૦ ૦૦૦		
કુલ	૭૮૬ ૨૨ ૦૦ ૦૦૦	૭૮૬ ૨૨ ૦૦ ૦૦૦		
ઈશ્યુ કરેલ, સબસ્ક્રાઈબ કરેલ:-				
૬૧,૨૧,૨૨,૪૦૨ ઈકવીટી શેર પ્રતિ રૂ. ૧૦ ના ફૂલ્લી પેઈડ અપ (૪૯,૬૯,૧૭,૨૦૦ ઈકવીટી શેર પ્રતિ રૂ. ૧૦ ના ફૂલ્લી પેઈડ અપ)	૬૧૨ ૧૨ ૨૪ ૦૨૦	૪૯૬ ૯૧ ૭૨ ૦૦૦		
કુલ	૬૧૨ ૧૨ ૨૪ ૦૨૦	૪૯૬ ૯૧ ૭૨ ૦૦૦		
ચુકવેલ કેપીટલ:-				
૬૧,૨૧,૨૨,૪૦૨ ઈકવીટી શેર પ્રતિ રૂ. ૧૦ ના ફૂલ્લી પેઈડ અપ (૪૯,૬૯,૧૭,૨૦૦ ઈકવીટી શેર પ્રતિ રૂ. ૧૦ ના ફૂલ્લી પેઈડ અપ)	૬૧૨ ૧૨ ૨૪ ૦૨૦	૪૯૬ ૯૧ ૭૨ ૦૦૦		
કુલ	૬૧૨ ૧૨ ૨૪ ૦૨૦	૪૯૬ ૯૧ ૭૨ ૦૦૦		
બ્રેકેટમાં રહેલ આંકડાઓ ગત વર્ષના આંકડાઓ દર્શાવે છે.				
નોંધો:-				
(૧) સમયગાળા શરૂઆતે અને અંતે આડિટસ્ટેન્ડીંગ શેરોના રીકન્સીલેશન				
	૨૦૨૨-૨૩		૨૦૨૧-૨૨	
વિગત	શેરોની સંખ્યા	રકમ	શેરોની સંખ્યા	રકમ
વર્ષની શરૂઆતમાં	૪૯ ૬૯ ૧૭ ૨૦૦	૪ ૯૬ ૯૧ ૭૨ ૦૦૦	૧૯ ૨૩ ૭૫ ૦૦૦	૧ ૯૨ ૩૭ ૫૦ ૦૦૦
ઉમેરો : વર્ષ દરમ્યાન ઈશ્યુ થયેલ	૧૧ ૫૨ ૦૫ ૨૦૨	૧ ૧૫ ૨૦ ૫૨ ૦૨૦	૩૦ ૪૫ ૪૨ ૨૦૦	૩ ૦૪ ૫૪ ૨૨ ૦૦૦
વર્ષના અંતે આડિટસ્ટેન્ડીંગ	૬૧ ૨૧ ૨૨ ૪૦૨	૬ ૧૨ ૧૨ ૨૪ ૦૨૦	૪૯ ૬૯ ૧૭ ૨૦૦	૪ ૯૬ ૯૧ ૭૨ ૦૦૦

(૨) ઈકવીટી શેરને લગત નિયમો / હક્કો

- કંપની પાસે એક જ કલાસના ઈકવીટી શેરો છે અને તેની કિંમત રૂ. ૧૦/- પ્રતિ શેર છે.
- દરેક શેર ધારકને પ્રતિ શેર એક વોટ પ્રાપ્ત છે.
- જો કંપનીનું લીકવીડેશન થાય તો ઈકવીટી શેર ધારકોને બધી લાયબલીટીઓ ચૂકવ્યા બાદ કંપની પાસે રહેલ એસેટો પર હકક રહેશે. તેની વહેંચણી શેર ધારકો પાસે રહેલ ઈકવીટી શેરોની સંખ્યા મુજબ રહેશે.

(૩) રાઈટ ઈશ્યુ પ્રમાણે શેરોની ફાળવણી

- ચાલુ વર્ષે કંપનીએ નીચે દર્શાવેલ દરેક પ્રમોટરોને રૂ. ૧૦/- ના ઈકવીટી શેરોની ફાળવણી કરેલ છે.
- ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ (જી - રાઈડ) ૧૧,૫૨,૦૫,૨૦૨ (પી. વાય. ૧૨,૬૦,૦૦,૦૦૦) પાસે રૂ. ૧૦/- પ્રતિ શેરના ઈકવીટી શેર રહેલ છે.
- મારૂતી સુઝુકી ઈન્ડિયા લિમીટેડ (એમએસઆઈએલ) ને ચાલુ સાલે - શૂન્ય (પી. વાય. ૧૪,૫૯,૧૭,૨૦૦) રૂ. ૧૦/- પ્રતિ શેરના ઈકવીટી શેર રહેલ છે. છે.
- ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી) ને ચાલુ સાલે - શૂન્ય (પી. વાય. ૩,૨૬,૨૫,૦૦૦) રૂ. ૧૦/- પ્રતિ શેરના ઈકવીટી શેર રહેલ છે.

(૪) ૫% કરતા વધારે શેર કેપીટલ ધરાવતા શેર ધારકોની વિગત નીચે મુજબ છે.

શેર ધારકનું નામ	૩૧ માર્ચ ૨૦૨૩ અંતિત		૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત	
	શેરોની સંખ્યા	% હોલ્ડિંગ	શેરોની સંખ્યા	% હોલ્ડિંગ
ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ (જી - રાઈડ)	૩૪ ૨૪ ૫૫ ૨૦૨	૫૫.૯૫%	૨૨ ૭૨ ૫૦ ૦૦૦	૪૫.૭૩%
મારૂતી સુઝુકી ઈન્ડિયા લિમીટેડ (એમએસઆઈએલ)	૨૦ ૪૪ ૧૭ ૨૦૦	૩૩.૩૯%	૨૦ ૪૪ ૧૭ ૨૦૦	૪૧.૧૪%
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી)	૬ ૫૨ ૫૦ ૦૦૦	૧૦.૬૬%	૬ ૫૨ ૫૦ ૦૦૦	૧૩.૧૩%

કંપનીના રેકોર્ડ અનુસાર, કે જેમાં શેર ધારકો / સભ્યોના રજીસ્ટરોનો સમાવેશ થાય છે તે મુજબ ઉપર જણાવેલ શેરધારકો શેરોના કાયદા મુજબ માલીકી દર્શાવે છે.

યાલુ વર્ષે કંપનીએ કોઈપણ બોનસ શેર બહાર પાડેલ નથી.

(૫) શેર ધારણ કરનાર પ્રમોટરોનું ડીઝકલોશર

પ્રમોટરનું નામ	૩૧ માર્ચ ૨૦૨૩ અંતિત		વર્ષ દરમ્યાન ફેરફારની ટકાવારી
	શેરોની સંખ્યા	% હોલ્ડીંગ	
ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ	૩૪ ૨૪ ૫૫ ૨૦૨	૫૫.૮૫%	૧૦.૨૧%
મારૂતી સુઝુકી ઈન્ડીયા લિમીટેડ	૨૦ ૪૪ ૧૭ ૨૦૦	૩૩.૩૮%	(૭.૭૪)%
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન	૬ ૫૨ ૫૦ ૦૦૦	૧૦.૬૬%	(૨.૪૭)%

પ્રમોટરનું નામ	૩૧ માર્ચ ૨૦૨૨ અંતિત		વર્ષ દરમ્યાન ફેરફારની ટકાવારી
	શેરોની સંખ્યા	% હોલ્ડીંગ	
ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ	૨૨ ૭૨ ૫૦ ૦૦૦	૪૫.૭૩%	(૬.૮૦)%
મારૂતી સુઝુકી ઈન્ડીયા લિમીટેડ	૨૦ ૪૪ ૧૭ ૨૦૦	૪૧.૧૪%	૧૦.૭૩%
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન	૬ ૫૨ ૫૦ ૦૦૦	૧૩.૧૩%	(૩.૮૩)%

વિગત	૩૧-૩-૨૦૨૩ અંતિત	૩૧-૩-૨૦૨૨ અંતિત
૧૭. અન્ય ઈકવીટી		
રીટેઈન થયેલ આવક		
રીટેઈન થયેલ આવકની ઉઘડતી સિલક	(૩૦૪ ૧૫ ૦૩૦)	(૩૫૬ ૯૮ ૬૧૪)
વર્ષ દરમ્યાનનું એડજેસ્ટમેન્ટ વધારો / ઘટાડો	-	-
વર્ષ દરમ્યાનનો નેટ (નુકશાન) / નફો	(૨૫૮ ૬૧ ૮૮૨)	૫૨ ૮૩ ૫૮૪
બંધ સિલક	(૫ ૬૨ ૭૬ ૯૧૩)	(૩૦૪ ૧૫ ૦૩૦)
કુલ રીઝર્વ અને સરપ્લસ	(૫ ૬૨ ૭૬ ૯૧૩)	(૩ ૦૪ ૧૫ ૦૩૦)
૧૮. અન્ય નાણાંકીય જવાબદારીઓ - નોન કરન્ટ		
હેલ્ડ રકમ સાથે રીટેન્શનની રકમ	૭૦૧ ૯૭ ૪૯૦	૭૪૧ ૯૬ ૬૮૯
લીઝની જવાબદારી (જુઓ નોંધ નં. ૪૬)	૪૨ ૬૫ ૨૪૦	૫૭૦૮ ૧૪૦
કુલ	૭ ૪૪ ૬૨ ૭૩૦	૭ ૯૯ ૦૪ ૮૨૯
<p>કરન્સી અને લીકવીડીટી ખતરાઓ કે જે નાણાકીય જવાબદારીઓને લગત છે તેની નોંધ નંબર - ૩૫ માં દર્શાવવામાં આવેલ છે. આ રકમ સામાન્ય રીતે નોન કરન્ટ પ્રકારની છે પરંતુ તેનો એક ભાગ બેન્ક ગેરેન્ટી તરીકે કોન્ટ્રાક્ટરોને ફાળવવામાં આવેલ છે. આથી તે રકમને નોન-કરન્ટ તરીકે રજુ કરવામાં આવેલ છે.</p>		
૧૯. અન્ય નોન - કરન્ટ જવાબદારીઓ *		
કેપીટલ એસેટ સામે ચૂકવવાપાત્ર	૧૫ ૯૫ ૨૫૦	-
બીડ સેક્યુરીટી / અર્નસ્ટ મની / પ્રફોર્મેન્ટ સેક્ટયુરીટી	-	૧ ૦૭ ૨૫૦
*જુઓ નોંધ નં. ૩૮		
કુલ	૧૫ ૯૫ ૨૫૦	૧ ૦૭ ૨૫૦
૨૦. ડીફર થયેલ વેરાની જવાબદારીઓ (નેટ)		
નીચે મુજબ ડીફર થયેલ વેરાની જવાબદારીઓ		
મીલકત, પ્લાન્ટ અને ઉપકરણ, ઈન્ટેન્જેબલ એસેટ	૯ ૯૩ ૧૪ ૭૦૧	-
કુલ ડીફર થયેલ વેરાની જવાબદારીઓ	૯ ૯૩ ૧૪ ૭૦૧	-
નીચે મુજબ ડીફર થયેલ એસેટ પર વેરા		
પ્રાથમિક ખર્ચાઓ	૧ ૪૨ ૯૩ ૩૫૫	-
લીઝ ધારક મિલકતમાં સુધારો	૮૮ ૬૬૬	-
કુલ ડીફર થયેલ વેરા એસેટ	૧ ૪૩ ૮૨ ૦૨૦	-
નેટ ડીફર થયેલ વેરાની જવાબદારીઓ / (એસેટો)	૮ ૪૯ ૩૨ ૬૮૦	-

વિગત	૩૧-૩-૨૦૨૩ અંતિત	૩૧-૩-૨૦૨૨ અંતિત
૨૧. ચૂકવવાપાત્ર ટ્રેડ - કરન્ટ		
એક વર્ષથી ઓછા સમયગાળા માટે		
૧ થી ૨ વર્ષ	-	-
૨ થી ૩ વર્ષ	-	-
૩ વર્ષથી વધારે	-	-
અન્ય		
ઝીલ થયા વર્ગનું ચૂકવવાપાત્ર		
એક વર્ષથી ઓછું		
ચૂકવવા પાત્ર કન્સલ્ટનેસી / પ્રોફેશનલ	૧ ૪૪ ૦૭૮	૮૦ ૫૫૦
ચૂકવવા પાત્ર વિજળી ખર્ચ	૪૬ ૦૩૯	-
ભાડા ખર્ચ ચૂકવવાપાત્ર	૪ ૩૨ ૭૬૯	૪ ૩૨ ૭૬૯
સુધારો અને જાળવણી - મકાનનુ ચૂકવવાપાત્ર	૯૬ ૧૨૦	૬૩ ૧૩૨
ચૂકવવાપાત્ર આંતરીક ઓડીટર ફિ	૧૪ ૪૭૫	૧ ૦૧ ૦૩૩
ચૂકવવાપાત્ર મેનપાવર સેવાઓ ખર્ચ	૬ ૦૬ ૨૪૨	૫ ૮૭ ૨૫૫
ચૂકવવાપાત્ર સ્ટેચ્યુટરી ઓડીટર ફી	૯૦ ૦૦૦	૬૭ ૫૦૦
ચૂકવવાપાત્ર વાહનો ભાડે લેવાનો ખર્ચ	૨ ૨૦ ૪૪૨	૧ ૫૨ ૩૯૮
ચૂકવવાપાત્ર સેક્રેટરીયલ ઓડીટ ફી	૪૫ ૦૦૦	૪૫ ૦૦૦
ચૂકવવાપાત્ર બોર્ડ મીટીંગ ખર્ચ	૧૦ ૦૦૦	૧૫ ૦૦૦
ચૂકવવાપાત્ર ખર્ચા માટેના પ્રાવધાનો - ઈપીસી કોન્ટ્રાક્ટ	૧૯ ૪૩ ૧૭ ૧૫૨	૨૮ ૧૩ ૪૩ ૭૭૩
ચૂકવવાપાત્ર ખર્ચા માટેના પ્રાવધાનો - પીએમસી ચીર્જસ	૧ ૦૯ ૧૭ ૦૩૩	૧ ૫૫ ૯૫ ૯૯૬
ચૂકવવાપાત્ર ખર્ચા માટેના પ્રાવધાનો - ફીઝેબીલીટી અભ્યાસ ખર્ચ	-	૩૭ ૭૨ ૦૦૦
ચૂકવવાપાત્ર ખર્ચા માટેના પ્રાવધાનો - કચેરી	૧ ૦૦૦	૧ ૯૩ ૦૫૦
૧ થી ૨ વર્ષ	-	-
૨ થી ૩ વર્ષ	-	-
૩ વર્ષ થી વધારે	-	-
કુલ	૨૦ ૬૯ ૪૦ ૩૪૯	૩૦ ૨૪ ૪૯ ૪૫૫
*જુઓ નોંધ નંબર ૩૮		

વિગત	૩૧-૩-૨૦૨૩ અંતિત	૩૧-૩-૨૦૨૨ અંતિત
૨૨. અન્ય નાણાકીય જવાબદારીઓ - કરન્ટ લીજની હાલની જવાબદારી		
ચક્રવવામાં બાકી રહેલ લીજની જવાબદારી ની હાલની મેચ્યુરીટી	૧૪ ૪૨ ૯૦૦	૧૩ ૧૨ ૬૨૫
કુલ	૧૪ ૪૨ ૯૦૦	૧૩ ૧૨ ૬૨૫
જુઓ નોંધ નંબર ૪૬		
૨૩. અન્ય કરન્ટ જવાબદારીઓ		
બીડ સુરક્ષા / ઈર્નસ્ટ રકમનું રોકાણ	૧ ૦૭ ૨૫૦	૧ ૦૭ ૨૫૦
ચૂકવવાપાત્ર સ્ટેચ્યુટરી ડ્યુ		
ચૂકવવાપાત્ર જીએસટી	૭૧ ૨૯ ૩૧૨	-
ચૂકવવાપાત્ર ટીડીએસ	૧ ૭૧ ૧૧ ૫૧૩	૧ ૨૨ ૭૬ ૪૫૨
લેબર સેસ	૫૭ ૮૬ ૯૯૨	૨૩ ૯૦ ૯૯૫
ચૂકવવાપાત્ર ટીડીએસ જીએસટી	૧ ૧૧ ૩૨ ૧૪૮	૪૧ ૩૦ ૫૮૨
ચૂકવવાપાત્ર જીએસટી આરસીએમ	-	૩૫ ૩૨૬
કેપીટલ એસેટ સામે ચૂકવવાપાત્ર*	૧ ૫૧ ૯૮ ૪૪૨	૧૫ ૯૫ ૨૫૦
કુલ	૫ ૬૪ ૬૫ ૬૫૭	૨ ૦૪ ૨૮ ૬૦૪
*જુઓ નોંધ નંબર ૩૮		
૨૪. અન્ય કરન્ટ વેરાની જવાબદારી (નેટ)		
આવક વેરાનો પ્રાવધાન - નાણાકીય વર્ષ ૨૦૨૦ - ૨૧	-	-
લેસ:-		
અગાથી ભરપાઈ કરેલ વેરો - નાણાકીય વર્ષ ૨૦૨૦ - ૨૧	-	-
કુલ મળવાપાત્ર ટીડીએસ	-	-
કુલ	-	-
૨૫. કામગીરીમાંથી આવક		
ગ્રાહકો સાથે કરારમાંથી આવક		
બાંધકામ સેવાઓ*	૧૯ ૮૩ ૭૧ ૯૪૦	૩૬ ૪૬ ૨૦ ૫૩૬
રેલનું વેચાણ	-	૬ ૬૦ ૦૦ ૦૦૦
પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ચાર્જ	૨૮ ૭૫ ૦૦૦	૮૬ ૨૫ ૦૦૦
રેલ્વેની કામગીરીમાંથી બીલ થયા વર્ગની આવક	૧ ૭૫ ૨૮૫	-
કુલ	૨૦ ૧૪ ૨૨ ૨૨૫	૪૩ ૯૨ ૪૫ ૫૩૬

વિગત	૩૧-૩-૨૦૨૩ અંતિત	૩૧-૩-૨૦૨૨ અંતિત
<p>*ગયા વર્ષમાં કંપની એમએસઆઈએલ અને જી - રાઈડ સાથે એમઓયુ કરેલ છે. આ એમઓયુ પ્રમાણે બીઆરસીએલ મુખ્ય પ્રોજેક્ટને અન્ડરટેક/પ્રોક્યોર કરી ડેજીટલ થયેલ પોઈન્ટ સુધી લઈ જશે કે જે એમએસઆઈએલ ગુજરાત પ્લાન્ટ પરીસરમાં થશે કે જે બહુચરાજી ખાતે આવેલ છે અને તેમાં એમએસઆઈએલ ની જરૂરીયાત મુજબનું પ્રપોઝ થયેલ રેલ્વે સાઈડીગને બનાવવા અને લંબાવવાની કામગીરી રહેલ છે. આ પ્રોજેક્ટ એક જાણકાર કવોલીફાલડ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે કે જે બીઆરસીએલ દ્વારા ઓળખવામાં અને નિયુક્ત કરવામાં આવશે અને તે એમએસઆઈએલ ની મંજૂરી થી કરવામાં આવશે. બીઆરસીએલએ એમએસઆઈએલ ને મદદ કરીને કોન્ટ્રાક્ટને પૂર્ણ કરવા માટે જરૂરી ટેન્ડરોની બીડ મંગાવવા માટે જરૂરી કામગીરી કરેલ છે. આ કોન્ટ્રાક્ટનું મંજૂર થયેલ કિંમત રૂ. ૬૩.૬૦ કરોડ છે અને તેમાં તમામ વેરાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટને એમઓયુ મુજબ મુખ્ય પ્રોજેક્ટનું એકસ્ટેન્શન માની શકાશે.</p> <p>** નાણાંકીય વર્ષ ૨૦૨૨ - ૨૩ માટે બીલ થયા વર્ગની આવક વેસ્ટન રેલ્વેમાંથી પ્રાપ્ત થયેલ છે અને તેને નાણાંકીય વર્ષ ૨૦૨૩ - ૨૪ માં બીલ કરવામાં આવે. જેથી ચાલુ વર્ષે તેને બીલ થયા વર્ગની આવક દર્શાવવામાં આવેલ છે.</p> <p>** તારીખ ૨૩ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ બહુચરાજી રેલ્વે કનેક્ટીવિટી લાઈનનું ૨૯.૬૫ કીલોમીટર અંતર ચાલુ થઈ ગયેલ છે. બહુચરાજી રેલ જોડાણ લાઈન માટે કંપનીએ ૨૩ મી માર્ચ, ૨૦૨૩ થી ૩૧ મી માર્ચ, ૨૦૨૩ સુધીના સમયગાળાને ઓપરેટીંગ આવક તરીકે ઓળખેલ છે અને કટોસન રોડ થી બેચરાજી સ્ટેશન સુધીના લાઈનની આવક પ્રોવીઝનલ આધાર પર ગણવામાં આવેલ છે. લોડીંગના સમયે રેલ્વે ને પ્રાપ્ત થયેલ સંપૂર્ણ આવકમાંથી બીઆરસીએલનો હિસ્સો રીઝર્વ થયેલ સેવાઓ અને ટર્મિનલ કિંમત (એટલે કે ભારતીય રૂપિયા ૨૬ પ્રતિ ટન) ના અપોરશન થયેલ આવકમાંથી ૫૦% છે. વધુમાં બીઆરસીએલ લાઈન (૨૯.૬૫ કીલોમીટર) માં મુસાફરી કરેલ અંતરના ટકાવારીમાંથી આવક કમ્પ્યુટ કરવામાં આવેલ છે. પરંતુ વેસ્ટન રેલ્વે એ બીઆરસીએલને ચૂકવેલ આવકને જે રુટ નોંધવામાં આવેલ હોય તેના સીઆરઆઈએસના એફઓઆઈએસ સિસ્ટમ પ્રમાણે ગણવામાં આવેલ છે.</p> <p>નોંધ:-</p> <p>સર્વિસ કન્સેશન કરારો</p> <p>પબ્લિક થી ખાનગી સેવાઓમાં રહેલ કન્સેશન એગ્રીમેન્ટને એપેન્ડિક્ષ ડી સર્વિસ કન્સેશન એગ્રીમેન્ટ આઈએનડી - એએસ - ૧૧૫ મુજબ નોંધવામાં આવેલ છે.</p> <p>સર્વિસ કન્સેશન એગ્રીમેન્ટ ત્યારે લાગુ પડે છે કે જ્યારે:-</p> <p>એ) ગેરેન્ટર જ્યારે ઓપરેટર દ્વારા અપાતી સેવાઓનું નિયંત્રણ કે રેગ્યુલેશન કરે અને તેની સાથે ઈન્ફાસ્ટ્રક્ચર પણ હોય, અને જેઓને સેવાઓ આપવામાં આવેલ હોય અને કઈ કિંમતે અને</p> <p>બી) ગેરેન્ટર માલિકી દ્વારા અથવા બેનીફિશયલ એન્ટાઈટલમેન્ટ અથવા અન્ય રીતે નિયંત્રિત કરતો હોય અને ઈન્ફાસ્ટ્રક્ચરમાં કોઈ ખાઈ રેસડ્યુયલ ઈન્ટરેસ્ટ રહેલ હોય જે તે કરારના અંતે રહેલ હોય.</p> <p>જો ઉપરની બંને શરતોનું પાલન એક સાથે થયેલ હોય તો ઓપરેટર વાપરનારને પબ્લીક સેવાઓ માટે ચાર્જ કરી શકે અને તેને ઈન્ટેન્જેબલ એસેટ તરીકે ઓળખવામાં આવે, પરંતુ આવા ચાર્જ શરતોને આધિન હોવા જોઈએ અને તે વપરાયેલ સેવાઓ મુજબ જ હોવા જોઈએ.</p> <p>આવા ઈન્ટેન્જેબલ એસેટને કોસ્ટ પર જ ઓળખવામાં આવે છે, અને તેને આપવામાં આવેલ સેવાઓના ફેર વેલ્યુ અને કામગીરીમાં રહેલ અન્ય સીધા ખર્ચાઓનો આમા સમાવેશ થાય છે. ત્યાર બાદ તેને કન્સેશનના સમયગાળા માટે એમોરાઈઝ કરવામાં આવે છે.</p> <p>કરારની વિગત</p> <p>તારીખ ૧૬ મી ઓગષ્ટ, ૨૦૨૨ ના રોજ બહુચરાજી રેલ કોર્પોરેશન લીમીટેડ (બીઆરસીએલ) અને રેલ્વે મંત્રાલય (એમઓઆર), ભારત સરકારે કરાર કરેલ છે અને રેલ્વે મંત્રાલય (સત્તા) ની શરતો મુજબ કંપનીને (કન્સેશનર) ને પ્રોજેક્ટ રેલ્વેને ડેવલોપ, ફાઈનાન્સ, ડીઝાઈન, એન્જીનીયર, પ્રોક્યોર, કન્સ્ટ્રક્ટ અને મેઈન્ટેઈન કરવાની સત્તા છે અને તેઓને હકો, સત્તા, લાભો અને અન્ય ફાયદાઓ તેના અંતે આપવામાં આવેલ છે. આ કરારમાં બીઆરસીએલએ પ્રોજેક્ટના ફેઝ - ૧ ને પૂર્ણ કરેલ છે અને ફેઝ - ૨ ની કામગીરી ચાલુમાં છે. કન્સેશન કામગીરીના ૩૦</p>		

વિગત	૩૧-૩-૨૦૨૩ અંતિત	૩૧-૩-૨૦૨૨ અંતિત
વર્ષના સમયગાળા માટે રહેશે. કન્સેશન સમયગાળાના અંતે બીઆરસીએલ પ્રોજેક્ટ એસેટને એમઓઆર ને પરત સોંપસે અને બીઆરસીએલ ને એમઓઆર સાઈટના કિંમતના સમાન્તરમાં (જમીન અને જમીન સંપાદનનેલગત ખર્ચાઓ) કિંમત ચૂકવવામાં આવશે. જો ખરેખરનો કિલોમીટર ટન ટ્રાફિક લક્ષ્યાંક કરતા ઓછો / અથવા વધારે થયેલ હોય તો દરેક ૨% (બે ટકા) શોર્ટફોલ / વધારા માટે કે તેના એક ભાગ માટે કે જે લક્ષ્યાંક ટ્રાફિકની સરખામણીમાં હોય, કન્સેશન સમયગાળાને ૬ (છ) મહિના માટે કે તેના એક ભાગ માટે વધારવા / ઘટાડવામાં આવશે પરંતુ આવા વધારા / ઘટાડાને કે જે કન્સેશન સમયગાળા માટે કરવામાં આવશે તે ૫ (પાંચ) વર્ષ કરતા વધારે નહિ હોય શકે. જો એમઓઆર અને બીઆરસીએલ સાથે થયેલ આ કરારમાં કોઈ મટીરીયલ બ્રીચ થાય તો બન્ને પક્ષકારોને આ કરારને રદ કરવાનો હક રહેશે જો તેઓ આવા કરારના ડીફોલ્ટને સુધારી ન શકે તો.		
૨૬. અન્ય આવક		
ટેન્ડર પ્રોસેસ કરવાની ફી	૧૨ ૭૧૨	૧ ૧૮ ૬૪૪
પરચૂરણ આવક	-	-
પ્રાપ્ત થયેલ વ્યાજ		
૧) જીએસએફએસમાં આઈસીડી પરનો વ્યાજ	૭ ૩૩ ૭૨ ૮૫૨	૨ ૮૮ ૨૬ ૬૦૬
૨) લીકવીડ રોકાણ પરનો વ્યાજ	૬૧ ૨૪ ૪૬૭	૭૦ ૨૯ ૭૦૬
૩) આવક વેરના રીફંડ પર વ્યાજ	૧ ૪૨૧	-
કુલ	૭ ૯૫ ૧૧ ૪૫૨	૩ ૫૯ ૭૪ ૯૫૬
૨૭. વપરાયેલ મટીરીયલની કિંમત		
ઈપીસી કરારનો ખર્ચ - એમએસઆઈએલ લાઈન	૧૯ ૭૧ ૧૧ ૫૭૬	૩૬ ૭૩ ૩૮ ૮૩૯
રેવલે રેલનો ખર્ચ	-	૬ ૬૦ ૦૦ ૦૦૦
પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સી ખર્ચ	૨૭ ૯૧ ૪૯૦	૮૭ ૦૮ ૫૧૦
કુલ	૧૯ ૯૯ ૦૩ ૦૬૬	૪૪ ૨૦ ૪૭ ૩૪૯
૨૮. કર્મચારીઓના લાભનો ખર્ચ, કોન્ટ્રાક્ટરો અને કન્સલ્ટન્ટોનું ચૂકવણું		
મેનપાવર સેવાઓ	૭૭ ૯૩ ૭૭૧	૩૦ ૯૫ ૮૦૬
કુલ	૭૭ ૯૩ ૭૭૧	૩૦ ૯૫ ૮૦૬
૨૯. નાણાંકીય કિંમત		
લીઝની જવાબદારીનું વ્યાજ	૬ ૧૦ ૭૯૫	૩ ૫૦ ૫૩૨
કુલ	૬ ૧૦ ૭૯૫	૩ ૫૦ ૫૩૨
જુઓ નોંધ નં. ૪૬		
૩૦. ઘસારો અને એમોરાઈઝેશન ખર્ચ		
રાઈટ ઓફ યુઝ એસેટનો એમોરાઈઝેશન (જુઓ નોંધ નં. ૪૬)	૧૫ ૨૬ ૩૮૯	૭ ૬૩ ૧૯૪

વિગત	૩૧-૩-૨૦૨૩ અંતિત	૩૧-૩-૨૦૨૨ અંતિત
ફાઈટ શેરીંગ રાઈટનો એમોરાઈઝેશન (જુઓ નોંધ નં. ૫)	૨૬ ૦૩ ૯૭૯	-
મિલકત, પ્લાન્ટ અને ઉપકરણનો ઘસારો (જુઓ નોંધ નં. ૪)	૨૭ ૯૧ ૨૨૧	-
કુલ	૬૯ ૨૧ ૫૮૯	૭ ૬૩ ૧૬૪
જુઓ નોંધ નં. ૪૪		
૩૧. અન્ય ખર્ચાઓ		
બોર્ડ બેઠક ખર્ચ	૪૫ ૦૦૦	૧૫ ૦૦૦
કન્સલ્ટન્ટ્સી / પ્રોફેશનલ ચાર્જ	૭ ૪૦ ૬૭૪	૬ ૩૯ ૦૦૦
ડીમેટ રજીસ્ટ્રેશન અને કસ્ટડી ફી	૫૭ ૧૮૮	-
ઈન્સ્યોરેન્સ ખર્ચ	૩ ૩૭૬	૨ ૬૯૪
ભાડા ખર્ચ **	-	૩૩ ૫૫ ૬૩૩
વીજળી ખર્ચ	૧ ૮૯ ૮૧૩	-
ફિજેબીલીટી અભ્યાસ ખર્ચ ***	-	૩૭ ૭૨ ૦૦૦
કચેરી ખર્ચ	૨ ૮૮ ૫૪૦	૭૬ ૫૫૦
દિવાળી ભેટ ખર્ચ	૩ ૪૦ ૫૯૨	-
રાઈન્ડ ઓફ	(૨૦)	-
સેક્રેટેરીયલ ઓડીટ ફી	૫૦ ૦૦૦	-
સ્ટેશનરી અને પ્રિન્ટીંગ ખર્ચ	૧ ૬૨ ૮૩૯	૧ ૩૪ ૨૪૩
સેટ્યુટરી ઓડીટ ફી	૧ ૦૦ ૦૦૦	૭૫ ૦૦૦
ટ્રાવેલીંગ અને કન્વેયન્સ ખર્ચ - અન્ય	૧ ૧૨૦	-
વાહન ભાડનો ખર્ચ	૩૦ ૩૧ ૨૧૮	૨૫ ૫૮ ૩૩૯
સુધારો અને જાળવણી **	૨ ૧૩ ૨૦૦	૬ ૧૯ ૭૩૯
વિજ્ઞાપનો આપવાનો ખર્ચ *	૨ ૩૮ ૮૦૩	૫૦ ૩૧૨
ટેન્ડર ફી	૭૫૦૦	-
આરઓસી અને કાયદાકીય ખર્ચ **	૧૧ ૬૩ ૮૧૫	૩૦ ૬૫ ૯૫૪
કુલ	૬૬ ૩૩ ૬૫૮	૧ ૪૩ ૭૩ ૯૧૧
* જુઓ નોંધ નં. ૪૦		
** જુઓ નોંધ નં. ૪૫		
*** આ વર્ષે જી - રાઈડે તેના બીલ થયેલ પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ ખર્ચને ૧૫% માર્ક એ થી બીલ કરેલ છે અને તે બીઆરસીએલના ચોથા બોર્ડ મીટીંગમા (નોંધ નંબર - ૪.૦૭) માં નકકી કરવામાં આવેલ છે.		
અન્ય ખર્ચાઓમાં:-		
⊗ ઓડીટરને રેમ્યુનરેશન		
સેટ્યુટરી ઓડીટર ફી	૧ ૦૦ ૦૦૦	૭૫ ૦૦૦
કન્સલ્ટન્ટ્સી અને પ્રોફેશનલ ફી	૫૦ ૦૦૦	-
કુલ	૧ ૫૦ ૦૦૦	૭૫ ૦૦૦

વિગત	૩૧-૩-૨૦૨૩ અંતિત	૩૧-૩-૨૦૨૨ અંતિત
<p>અન્ય કોમ્પ્રીહેન્સીવ આવક (ઓસીઆઈ) તેવા કોઈપણ અન્ય કોમ્પ્રીહેન્સીવ આવકના ભાગો રહેલ નથી કે જેને દર્શાવવાની જરૂર રહેલ છે.</p>		
<p>૩૨. પ્રતિ શેર આવક (ઈપીએસ) પ્રતિ શેરના આવકની ગણતરી દરેક શેર ધારકને એટ્રીબ્યુટ કરવામાં આવેલ નેટ નફા / (નુકશાન) ને રૂ. ૧૦/- પ્રતિ ઈકવીટી શેરના વેઈટેડ સરેરાશ સંખ્યા સાથે ભાગાકાર કરીને કરવામાં આવે છે અને તેના ચાલુ વર્ષની વિગત નીચે મુજબ છે.</p>		
વિગત	૨૦૨૨-૨૦૨૩	૨૦૨૧-૨૦૨૨
<p>બેઝીક અને ડાયલુટ થયેલ ઈપીએસના કોમ્પ્યુટેશન માટે વપરાયેલ</p>		
<p>શેર ડેટા અને નફા / (નુકશાન) ની વિગત</p>		
ઈકવીટી શેર ધારકોને લગત નેટ નફા / (નુકશાન)	(૨ ૫૮ ૬૧ ૮૮૨)	૫૨ ૮૩ ૫૮૪
ચાલુ સાલે રહેલ ઈકવીટી શેરનો વેઈટેડ સરેરાશ સંખ્યા કે જે બેઝીક અને ડાયલ્યુટેડ ઈપીએસના કમ્પ્યુટેશનને લગત છે	૫૭ ૦૩ ૮૯ ૬૫૧	૨૪ ૯૭ ૨૫ ૭૬૮
પ્રતિ ઈકવીટી શેરનો ફેસ વેલ્યુ રૂપિયામાં (રૂ. ૧૦)	૧૦	૧૦
પ્રતિ શેર બેઝીક અને ડાયલ્યુટેડ આવક	(૦.૦૫)	૦.૦૨
<p>કોઈ પોટેન્શીયલ ઈકવીટી શેર ન હોવાથી બેઝીક અને ડાયલ્યુટેડ ઈપીએસ સમાન છે.</p>		
<p>૩૩. સેગમેન્ટની માહિતી:-</p> <p>ઈન્ડ - એએસ ૧૦૮ અનુસાર, સેગમેન્ટ માહિતી આપવા માટે વપરાતા ઓપરેટીંગ સેગમેન્ટને કંપનીના મેનેજમેન્ટ દ્વારા ઉપયોગમાં લેવાતા આંતરીક અહેવાલોના આધારે ઓળખવામાં આવે છે કે જે સેગમેન્ટોને રીસોર્સ ફાળવામાં અને તેની કામગીરીનો અંદાજ પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.</p> <p>કંપનીના નિયામક મંડળ કંપનીનો 'ચિફ ઓપરેટીંગ ડીઝીશન મેકર' અથવા તો 'સીઓડીએમ' છે કે જે ઈન્ડ એએસ ૧૦૮ ની વ્યાખ્યા અંતર્ગત આવે છે. આતરીક રીપોર્ટીંગની કામગીરી માટેના લક્ષણો એવી રીતે ઉદભવે છે કે જે કાર્યરત પ્રફોર્મેન્સ એસેસમેન્ટ પદ્ધતિઓ સાથે સંબંધ રાખે છે.</p> <p>ભૌગોલીક વિસ્તારોની માહિતી</p> <p>કંપનીને વાણીજ્ય વાતાવરણમાં કોઈપણ કામગીરી રહેલ નથી કે જે અલગ અલગ રીસ્ક અને લાભો આપી શકે. તેથી તેને એકજ ભૌગોલીક સેગમેન્ટમાં કામ કરતી હોય તેમ માની શકાય.</p>		
<p>૩૪. માર્ફકો, સ્માલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝના કારણો:-</p> <p>માર્ફકો, સ્માલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝને કોઈ રકમ ચૂકવવાનું રહેતુ નથી કે જેમને કંપનીને ઓવર ડયુ થયેલ છે અને</p>		

જે ૩૧ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ ૪૫ થી વધારે દિવસો માટે ઓવરડયુ રહેલ છે.

૩૫. નાણાંકીય રીસ્ક મેનેજમેન્ટના ઉદ્દેશો અને પોલીસીઓ:-

કંપનીએ બજારમાં રહેલ ખતરાઓ, કેડીટને લગત ખતરાઓ અને લીકવીડીટીને લગત ખતરાઓનો સામનો કરવો પડે છે. આવા ખતરાઓનો સામનો કંપનીના ઉચ્ચતર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે. કંપનીના ઉચ્ચતર મેનેજમેન્ટને આવા બાબતોમાં નાણાંકીય વિભાગનો સહાય પ્રાપ્ત રહે છે અને તેઓ આવા નાણાંકીય ખતરાઓનો સામનો કરવા માટે જરૂરી ઉપદેશ આપે છે અને નાણાંકીય ખતરાઓનો સારી રીતે સામનો કરવાની કંપનીની પ્રણાલી તૈયાર કરે છે. નાણાંકીય વિભાગ કંપનીના ઉચ્ચતર મેનેજમેન્ટને તે બાબતે આશ્વાસન આપે છે કે કંપનીના આવા નાણાંકીય ખતરાઓનો સારી રીતે સામનો કંપની કરી શકશે.

(અ) બજારને લગત ખતરાઓ:-

બજારમાં રહેલ ખતરાઓ એવા ખતરાઓ છે કે જે નાણાંકીય ઉપકરણોમાં રહેલ ભવિષ્યના કેશ ફ્લોમાં ફેરફાર થઈ શકે છે કારણે તે બજાર કિંમતોમાં ફેરફાર થાય છે. બજાર કિંમતોમાં વ્યાજ દરને લગત ખતરાઓનો સમાવેશ થાય છે. નીચેના વિભાગોમાં આવા સેન્સીટીવીટી વિશ્લેષણોને લગત વિગતો આપેલ છે જે ૩૧ મી માર્ચ, ૨૦૨૩ ની સ્થિતિ મુજબ છે. આવા વિશ્લેષણમાં માર્કેટ વેરીએબલોમાંના આવન જવનની અસર ગ્રેડયુટીની કેરીઈંગ કિંમત પર થાય છે અને તેમાં અને પોસ્ટ રીટાયરમેન્ટ જવાબદારીઓ પણ રહેલ છે, અને પ્રાવધાનો અને બીન નાણાંકીય એસેટો અને જવાબદારીઓ પણ રહેલ છે.

(૧) વ્યાજ દરમાં રહેલ ખતરાઓ:-

વ્યાજ દરમાં રહેલ ખતરાઓ તે ખતરાઓ છે કે જે ફેર વેલ્યુ કે નાણાંકીય ઉપકરણોમાં રહેલ ભવિષ્યના કેશ ફ્લો પર આધારીત છે કે જે બજારના વ્યાજના દરમાં થતા ફેરફારોને લીધે ફરી શકે છે. કંપની દ્વારા કરવામાં આવેલ બોરોઈંગ વ્યાજથી મુક્ત છે અને તેથી તેના પર વ્યાજ દરના ખતરાની અસર થતી નથી કે જે ઈન્ડ એસેસ ૧૦૭ માં દર્શાવેલ છે. જી - રાઈડ પાસેથી ઉધાર લેવામાં આવેલ નાણાનો વ્યાજ દર ૮.૫૦% છે. પરંતુ આ લેણા ટુકા ગાળાના છે અને તેથી તે કંપનીના ભવિષ્યના કેશ ફ્લોને લાભા ગાળમાં અસર કરી શકે નહીં.

(બી) લીકવીડીટીને લગત ખતરાઓ:-

લીકવીડીટી એવો ખતરો છે કે જેમાં કંપની તેના હાલના કે ભવિષ્યના કેશ કે કોલેટ્રલ જવાબદારીઓને સ્વીકારી શકાય તેવા નુકશાનો કર્યા સીવાય પુરા કરી ન શકે. કંપનીનો ઉદ્દેશ્ય છે કે તમામ સમયે તેને તેના તમામ કેશ અને કોલેટ્રોલ જરૂરીયાતોને પુરા કરવા માટે લીકવીડીટીનો ઓછામાં ઓછો સ્તર વાપરી શકે. કંપની તેના તેના લીકવીડીટીના સ્થિતિને ધ્યાને રાખે છે અને તેની પાસે એક સચોટ કેશ મેનેજમેન્ટ વ્યવસ્થા રહેલ છે. તેની પાસે તેવા સ્રોત છે કે જેથી તે નાણાંકીય વ્યવસ્થા ઓપટીમલ કિંમતે રાખી શકે.

(૧) નીચેનું પત્રક કોન્ટ્રાક્ટ પર આધારીત દર્શાવ્યા વગરના ચુકવણા માટે રહેલ કંપનીના નાણાંકીય જવાબદારીઓની એક મેચયોર રૂપરેખાનું વિષલેશણ પ્રદાન કરે છે

૩૧ માર્ચ, ૨૦૨૩ અંતિત	ઓન ડીમાન્ડ	૩ મહિનાથી ઓછુ	૩ થી ૧૨ મહિના સુધી	૧ - ૫ વર્ષ સુધી	૫ વર્ષથી વધુ	કુલ
ચુકવવા પાત્ર ટ્રેડ	૨૦ ૬૯ ૪૦ ૩૪૯	-	-	-	-	૨૦ ૬૯ ૪૦ ૪૩૯
અન્ય નાણાંકીય જવાબદારીઓ - નોન કરન્ટ	-	-	-	૭ ૪૪ ૬૨ ૭૩૦	-	૭ ૪૪ ૬૨ ૭૩૦
અન્ય નાણાંકીય જવાબદારીઓ - કરન્ટ	-	-	૧૪ ૪૨ ૯૦૦	-	-	૧૪ ૪૨ ૯૦૦

૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત	ઓન ડીમાન્ડ	૩ મહિનાથી ઓછુ	૩ થી ૧૨ મહિના સુધી	૧ - ૫ વર્ષ સુધી	૫ વર્ષથી વધુ	કુલ
ચુકવવા પાત્ર ટ્રેડ	-	-	-	-	-	-
અન્ય નાણાંકીય જવાબદારીઓ - નોન કરન્ટ	-	-	-	૭ ૯૯ ૦૪ ૮૨૯	-	૭ ૯૯ ૦૪ ૮૨૯
અન્ય નાણાંકીય જવાબદારીઓ - કરન્ટ	-	-	૧૩ ૧૨ ૬૨૫	-	-	૧૩ ૧૨ ૬૨૫

(સી) કેડીટને લગત ખત્રાઓ:-

કેડીટ ખત્રો એવો ખત્રો છે કે જેમાં સામે વાળો પક્ષ તેઓની જવાબદારીઓતે પુરી ન કરે કે જે ગ્રાહકના કરાર પરના નાણાંકીય ઉપકરણો પર રહેલ છે, કે જેના કારણે નાણાકીય નુકશાન થાય છે. કંપનીને તેના ઓપરેટીંગ કામગીરીઓને કારણે આવા કેડીટ ખત્રાઓનો સામનો કરવો પડે છે (પ્રાથમીક મળવાપાત્ર ટ્રેડ) અને તે તેના નાણાકીય કામગીરીને કારણે પણ થઈ શકે છે, જેમાં બેન્ક સાથેના અને અન્ય નાણાંકીય સંસ્થાઓ અને અન્ય નાણાંકીય ઉપકરણોમાં થયેલ રોકાણોનો પણ સામવેશ થાય છે.

(૧) મળવાપાત્ર ટ્રેડ:-

કંપનીના તમામ બાકી રહેલ ગ્રાહક મળવાપાત્રનો કંપની દ્વારા નિયમિતપણે ચકાસણી કરવામાં આવી રહેલ છે. કંપનીને કોઈપણ બેડ ડેપ્ટ કે લાબાગાળાના બાકી નાણાંનો સામનો વર્ષ દરમ્યાન કરવો પડેલ નથી. વધુમાં રીપોર્ટીંગની તારીખે તમામ બાકી રહેલ ગ્રાહક મળવાપાત્ર છ માસથી ઓછાના છે. તે મુજબ ટ્રેડ મળવાપાત્ર ખુબજ ઓછા કેડીટ ખત્રાને લગત છે અને મેજેનમેન્ટે એવી ચકાસણી કરેલ છે કે કોઈ ટ્રેડ મળવાપાત્ર માટે કોઈ પણ ઈમ્પેરીમેન્ટની જરૂરીયાત રહેલ નથી.

(૨) નાણાંકીય ઉપકરોણ અને કેશ રોકાણ:-

કંપનીના નાણાંકીય વિભાગ દ્વારા બેન્ક અને નાણાંકીય સંસ્થાઓ સાથે રહેલ તમામ કેડીટને લગત ખત્રાઓ સંભાળવામાં આવેલ છે અને તે કંપનીના ઉચ્ચતર મેનેજમેન્ટની નજરો હેઠળ છે. બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ સાથે રહેલ તમામ સિલ્લકો ઓછા કેડીટ ખત્રાઓને લગત છે કારણ કે કંપનીને ખુબજ સારા કેડીટ રેટીંગ આપવામાં આવેલ છે. આ રેગ્યુલેટરી સત્તાની દેખરેખ હેઠળ રહેલ છે.

(૨) સંબંધિત પાર્ટી સાથે લેવડ દેવડ

લેવડ દેવડની વિગત / સંબંધિત પાર્ટીઓને લગત બેલેન્સ	સંયુક્ત સાહસ		સંયુક્ત સાહસના પ્રમોટર		ખાસ વહીવટી પ્રસનલ અને તેઓના સબધીઓ	
	૩૧ માર્ચ, ૨૦૨૩ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૩ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૩ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત
આપવામાં આવેલ લોન	-	-	-	-	-	-
પરત મળેલ લોન	-	-	-	-	-	-
ખર્ચનો રેમ્યુનરેશન (કેપીટલાઈઝ થયેલ સીડબલ્યુઆઈપી)	-	-	-	-	-	-
અન્ય ખર્ચાઓ - બોર્ડ મીટીંગ વગેરે	-	-	-	-	૪૫ ૦૦૦	૧૫ ૦૦૦
ચૂકવેલ વ્યાજ (કેપીટલાઈઝ થયેલ સીડબલ્યુઆઈપી)	-	-	-	-	-	-
ફીઝબીલીટી અભ્યાસ ખર્ચ	-	૩૭ ૭૨ ૦૦૦	-	-	-	-
ચૂકવેલ પીએમસી ચાર્જ (કેપીટલાઈઝ થયેલ સીડબલ્યુઆઈપી)	૪ ૩૦ ૭૫ ૮૭૮	૯ ૮૬ ૩૮ ૧૬૦	-	-	-	-
ચૂકવેલ પીએમસી ચાર્જ (કેપીટલાઈઝ થયેલ ફાઈટ શેરીંગ રાઈટ)	૨ ૪૭ ૨૯ ૫૮૬	-	-	-	-	-
પીએમસી ચાર્જસમાંથી આવક (એમએસઆઈ એલ પ્રોજેટક)	૨૮ ૭૫ ૦૦૦	૮૬ ૨૫ ૦૦૦	-	-	-	-
પીએમસી ચાર્જસમાંથી ખર્ચ (એમએસઆઈ એલ પ્રોજેટક)	૨૭ ૯૧ ૪૯૦	૮૭ ૦૮ ૫૧૦	-	-	-	-

રેલ ખરીદી - એમ ઓઆર પાસેથી એમએસઆઈએલ પ્રોજેટક માટે	-	-	-	₹ ૬૦ ૦૦ ૦૦૦	-	-
રેલ ખરીદી (કેપીટલાઈઝ થયેલ સીડબલ્યુઆઈપી)	-	-	-	૧૦ ૦૨ ૦૫ ૭૮૫	-	-
સીડબલ્યુઆઈપી માટે એડીશનલ ફીડર બે	-	-	-	-	-	-
એમએસઆઈએલ માટે રેલનુ વેચાણ	-	₹ ૬૦ ૦૦ ૦૦૦	-	-	-	-
એમએસઆઈએલ માટે બાંધકામ સેવાઓનુ વેચાણ	૧૯ ૮૩ ૭૧ ૮૪૦	૩૬ ૪૬ ૨૦ ૫૩૬	-	-	-	-
પ્રાપ્ત થયેલ ઈકવીટી શેર કોન્ટ્રીબ્યુશન	૧૧૫ ૨૦ ૫૨ ૦૨૦	૩૦૪ ૫૪ ૨૨ ૦૦૦	-	-	-	-
બીડ પ્રોસેસીસગ ફી - પ્રાપ્ત થયેલ અને ટ્રાન્સફર કરેલ	૭ ૫૦૦	૭ ૫૦૦	-	-	-	-
કુલ	૧૪૨ ૩૬ ૦૩ ૫૧૫	૩૫૬ ૫૭ ૯૩ ૭૦૬	-	૧૬ ૬૨ ૦૫ ૭૮૫	૪૫ ૦૦૦	૧૫ ૦૦૦

લેવડ દેવડની વિગત / સંબંધિત પાર્ટીઓને લગત બેલેન્સ	સંયુક્ત સાહસ		સંયુક્ત સાહસના પ્રમોટર		ખાસ વહીવટી પ્રસનલ અને તેઓના સહધીઓ	
	૩૧ માર્ચ, ૨૦૨૩ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૩ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૩ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત
મળવાપાત્ર રકમ	૮ ૯૧ ૨૪ ૮૪૪	૧૩ ૬૭ ૯૯ ૧૯૬	-	-	-	-
ચૂકવવાપાત્ર રકમ	૧ ૪૨ ૬૬ ૮૪૭	-	-	-	-	-

૩૭ ફેર વેલ્યુની ગણતરી

કંપનીના નાણાંકીય ઈન્સ્ટ્રુમેન્ટના ફેર વેલ્યુ અને કેરીઈંગ રેકમની કલાસની સરખામણી નીચે મુજબ છે.

કેટેગરી	૩૧ માર્ચ, ૨૦૨૩ અંતિત		૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત	
	કેરીઈંગ વેલ્યુ	ફેર વેલ્યુ	કેરીઈંગ વેલ્યુ	ફેર વેલ્યુ
૧) એમોરાઈઝડ કોસ્ટ પર નાણાકીય એસેટ				
મળવાપાત્ર ટ્રેડ (કરન્ટ / નોન કરન્ટ)	૮ ૮૧ ૨૪ ૮૪૪	૮ ૮૧ ૨૪ ૮૪૪	૧૩ ૬૭ ૯૯ ૧૯૬	૧૩ ૬૭ ૯૯ ૧૯૬
રોકડ અને રોકડનો સમાન્તર	૨૧ ૯૪ ૩૫ ૪૯૨	૨૧ ૯૪ ૩૫ ૪૯૨	૩૯ ૫૯ ૨૫ ૧૭૪	૩૯ ૫૯ ૨૫ ૧૭૪
બેન્ક સાથે રહેલ અન્ય સિલ્લક	-	-	૨૦૦ ૦૦ ૦૦ ૦૦૦	૨૦૦ ૦૦ ૦૦ ૦૦૦
અન્ય નાણાકીય એસેટ(કરન્ટ/નોન કરન્ટ)	-	-	-	-
કુલ	૩૦ ૮૫ ૬૦ ૩૩૬	૩૦ ૮૫ ૬૦ ૩૩૬	૨૫૩ ૨૭ ૨૪ ૩૭૦	૨૫૩ ૨૭ ૨૪ ૩૭૦
૨) એમોરાઈઝડ કોસ્ટ પર નાણાકીય લાયબલીટી				
બોરોઈંગ	-	-	-	-
ચૂકવવાપાત્ર ટ્રેડ	૨૦ ૬૯ ૪૦ ૩૪૯	૨૦ ૬૯ ૪૦ ૩૪૯	૩૦ ૨૪ ૨૯ ૪૫૫	૩૦ ૨૪ ૪૯ ૪૫૫
અન્ય નાણાકીય જવાબદારીઓ (કરન્ટ / નોન કરન્ટ)	૭ ૫૯ ૦૫ ૬૩૦	૭ ૫૯ ૦૫ ૬૩૦	૮ ૧૨ ૧૭ ૪૫૪	૮ ૧૨ ૧૭ ૪૫૪
કુલ	૨૮ ૨૮ ૪૫ ૯૭૯	૨૮ ૨૮ ૪૫ ૯૭૯	૩૮ ૩૬ ૬૬ ૯૦૯	૩૮ ૩૬ ૬૬ ૯૦૯

નાણાકીય એસેટ અને જવાબદારીના ફેર વેલ્યુમાં તે રકમનો સમાવેશ થાય છે કે જેમાં ઈન્સ્ટ્રુમેન્ટને સહમત પક્ષકારો વચ્ચે હાલના લેવડ દેવડ તરીકે એક્ષચેન્જ કરી શકાય, સિવાય કે તે જબરજસ્તીનો કે લીકવીડેશન સેલ હોય. મેનેજમેન્ટે પ્રાપ્ત થયેલ ટ્રેડ, રોકડ અને રોકડના સમાન્તર, અન્ય બેન્કની સિલ્લક, અન્ય નાણાકીય એસેટ, બોરોઈંગ, ચૂકવવાપાત્ર ટ્રેડ, અને અન્ય નાણાકીય લાયબલીટીસને ચકાસેલ છે અને તે કેરીઈંગ એમાઉન્ટના એપ્રોક્સીમેટ છે કે જે ઈન્સ્ટ્રુમેન્ટના ટુકાવાળાના મેચ્યુરીટી મુજબ છે.

ફેર વેલ્યુ હેરાંકી:-

તમામ ફાઈનાન્શીયલ ઈન્સ્ટ્રુમેન્ટ કે જે માટે ફેર વેલ્યુ ઓળખાયેલ છે કે ખુલાસો કરવામાં આવેલ છે તે ફેર વેલ્યુના કેટેગરીમાં આવે છે, અને તેનું વિવરણ નીચે આપવામાં આવેલ છે, અને તેનો આધાર સૌથી નીચેના સ્તરનું ઈનપુટ પર છે કે જે ફેર વેલ્યુની ગણતરી માટે પુરી રીતે અગત્યનું છે.

લેવલ ૧ : કોટ કરેલ (એડજેસ્ટ કર્યા સિવાય) રકમ કે જે ચાલુ માર્કેટમાં એક સમાન એસેટ કે લાયબલીટી માટે રહેલ છે.

લેવલ ૨ : વેલ્યુએશન ટેકનીકો કે જેના માટે સૌથી નીચેના સ્તરનું ઈનપુટ વપરાય કે જે ફેર વેલ્યુની ગણતરીમાં ખાસ

અસર કરી શકે અને જે ઓબઝર્વેબલ હોય સીધી કે આડકતરી રીતે.

લેવલ ૩ : તેવા વેલ્યુએશન ટેકનીકો કે જેમાં સૌથી નીચેના સ્તરનું ઈનપુટ વેલની ગણતરીમાં ખાસ અસર કરી શકે અને તેનો આધાર ઓબઝર્વેબલ માર્કેટ ડેટા પર ન રહેલ હોય.

નીચે દર્શાવેલ કોષ્ટક કંપનીના એસેટ અને લાયબલીટીઓના ફેર વેલ્યુ ગણતરીને દર્શાવે છે.

૩૧ માર્ચ, ૨૦૨૩ અંતિત એસેટનો ફેર વેલ્યુ ગણતરી માટેનો કવોન્ટીટેટીવ ડીસ્ક્લોઝર:-

વિગત	કુલ /(કેરીઈગી વેલ્યુ)	ચાલુ બજારમા ના કોટેડ કિમત (લેવલ - ૧)	ખાસ નોંધપાત્ર ઈનપુટ (લેવલ - ૨)	નોંધપાત્ર નોન-ઓબઝર્વેબલ ઈન્ફ્રાપુટ (લેવલ - ૩)
એમોરાઈઝડ કોસ્ટ પર ગણતરી કરેલ નાણાંકીય એસેટ				
મળવાપાત્ર ટ્રેડ	૮ ૯૧ ૨૪ ૮૪૪	-	-	-
રોકડ અને તેનો સમાન્તર	૨૧ ૯૪ ૩૫ ૪૯૨	-	-	-
અન્ય બેન્કો સાથે રહેલ સિલક	-	-	-	-
અન્ય નાણાંકીય એસેટ (કરન્ટ / નોન કરન્ટ)	-	-	-	-
કુલ	૩૦ ૮૫ ૬૦ ૩૩૬	-	-	-

૩૧ માર્ચ, ૨૦૨૩ અંતિત લાયબલીટીઓનો ફેર વેલ્યુ ગણતરી માટેનો કવોન્ટીટેટીવ ડીસ્ક્લોઝર:-

વિગત	કુલ /(કેરીઈગી વેલ્યુ)	ચાલુ બજારમા ના કોટેડ કિમત (લેવલ - ૧)	ખાસ નોંધપાત્ર ઈનપુટ (લેવલ - ૨)	નોંધપાત્ર નોન-ઓબઝર્વેબલ ઈન્ફ્રાપુટ (લેવલ - ૩)
એમોરાઈઝડ કોસ્ટ પર ગણતરી કરેલ નાણાંકીય લાયબલીટીઓ				
બોરોઈંગ	-	-	-	-
ચૂકવવાપાત્ર ટ્રેડ	૨૦ ૬૯ ૪૦ ૩૪૯	-	-	-
અન્ય નાણાંકીય લાયબલીટી (કરન્ટ / નોન કરન્ટ)	૭ ૫૯ ૦૫ ૬૩૦	-	-	-
કુલ	૨૮ ૨૮ ૪૫ ૯૭૯	-	-	-

૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત એસેટનો ફેર વેલ્યુ ગણત્રી માટેનો કવોન્ટીટેટીવ ડીસ્ક્લોઝર:-

વિગત	કુલ /(કેરીઈગી વેલ્યુ)	ચાલુ બજારમા ના કોટેડ કિમત (લેવલ - ૧)	ખાસ નોંધપાત્ર ઈનપુટ (લેવલ - ૨)	નોંધપાત્ર નોન-ઓબઝર્વેબલ ઈનપુટ (લેવલ - ૩)
એમોરાઈઝડ કોસ્ટ પર ગણત્રી કરેલ નાણાંકીય એસેટ				
મળવાપાત્ર ટ્રેડ	૧૩ ૬૭ ૯૯ ૧૯૬	-	-	-
રોકડ અને તેનો સમાન્તર	૩૯ ૫૯ ૨૫ ૧૭૪	-	-	-
અન્ય બેન્કોમાં રહેલ સિલક	૨૦૦ ૦૦ ૦૦ ૦૦૦	-	-	-
અન્ય નાણાંકીય એસેટ (કરન્ટ / નોન કરન્ટ)	-	-	-	-
કુલ	૨૫૩ ૨૭ ૨૪ ૩૭૦	-	-	-

૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત લાયબલીટીઓનો ફેર વેલ્યુ ગણત્રી માટેનો કવોન્ટીટેટીવ ડીસ્ક્લોઝર:-

વિગત	કુલ /(કેરીઈગી વેલ્યુ)	ચાલુ બજારમા ના કોટેડ કિમત (લેવલ - ૧)	ખાસ નોંધપાત્ર ઈનપુટ (લેવલ - ૨)	નોંધપાત્ર નોન-ઓબઝર્વેબલ ઈનપુટ (લેવલ - ૩)
એમોરાઈઝડ કોસ્ટ પર ગણત્રી કરેલ નાણાંકીય લાયબલીટીઓ				
બોરોઈંગ	-	-	-	-
ચૂકવવાપાત્ર ટ્રેડ	૨ ૩૦ ૯૨૬	-	-	-
અન્ય નાણાંકીય લાયબલીટી (કરન્ટ / નોન કરન્ટ)	૨ ૪૮ ૨૯ ૦૬૮	-	-	-
કુલ	૨ ૫૦ ૫૯ ૯૯૪	-	-	-

૩૮. રી - ગુપીગના કારણે ગત વર્ષના નાણાંકીય પત્રકો ઉપર થયેલ અસર

રી - ગુપ થયેલ આઈટમ	રકમ	ગયા વર્ષના ગુપ હેડળ	ચાલુ વર્ષના ગુપ હેડળ
રી - ગુપ થયેલ આઈટમ	રકમ હેડ	ગત વર્ષમાં ગુપ થયેલ હેડ	ચાલુ વર્ષે ગુપ થયેલ
કેપીટલ એસેટ સામે ચૂકવવાપાત્ર	૧૫ ૮૫ ૨૫૦	ચૂકવવાપાત્ર ટ્રેડ - કરન્ટ	અન્ય કરન્ટ જવાબદારીઓ
જીએસએફસી પાસે રહેલ સિલ્લક - લીકવીડ રોકાણ	૩૧ ૪૩ ૪૯ ૮૪૭	અન્ય બેન્કો સાથે રહેલ સિલ્લક	રોકડ અને રોકડનો સમાન્તર
બીડ સેક્યુરીટી/અર્નેસ્ટ મની ડીપોઝીટ/પર્ફોર્મન્ટ સેક્યુરીટી	૧ ૦૭ ૨૫૦	ચૂકવવાપાત્ર ટ્રેડ - કરન્ટ	અન્ય કરન્ટ જવાબદારીઓ
ચૂકવવાપાત્ર ટ્રેડ - અન્ય - એક્યુરલ - કરન્ટ	૩૧ ૬૦ ૫૨ ૪૪૭	પ્રોવીઝન - કરન્ટ	ચૂકવવાપાત્ર ટ્રેડ - અન્ય - કરન્ટ

૩૯. જી - રાઈડને આપેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની પરની નોંધો:-

જીરાઈડને બીઆરસીએલ દ્વારા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કોટાસણ રોડ - બેચરાજી - ચાણસમા - રણુજ પ્રોજેક્ટના અમલીકરણ માટે નિયુક્ત કરવામાં આવેલ છે અને તેમાં એમએસઆઈએલ સાઈડીગનો સમાવેશ પ્રોજેક્ટ કિંમતના ૧૦% વેલ્યુ લેખે કરવામાં આવેલ છે અને તે બીઆરસીએલના પહેલા બોર્ડ મીટીંગમાં મંજૂર કરવામાં આવેલ છે કે જે તારીખ ૦૮/૦૧/૨૦૧૯ ના રોજ થયેલ છે. આ માટેનો કરાર એગ્રીમેન્ટ તારીખ ૨૮/૦૮/૨૦૨૦ ના રોજ કરવામાં આવેલ છે.

પીએમસી ચાર્જસ ઓરીજનલ અંદાજ કિંમત પર રાખવામાં આવેલ છે અને તે રૂ. ૪૫૨.૬૦ કરોડ છે કે જે બે ફેઝમાં છે અને કુલ પીએમસી ચાર્જ રૂ. ૪૫.૨૬ કરોડ છે. ફેઝ પ્રમાણેના પીએમસી ચાર્જસ નીચે મુજબ છે:-

(૧)	કોટાસણ રોડ થી બહેચરાજી એમએસઆઈએલ સલાઈડીંગ સાથે (ફેઝ - ૧)	૧૯.૮૨ કરોડ
(૨)	બહેચરાજી થી રનુજ (ફેઝ - ૨)	૨૫.૪૪ કરોડ
	કુલ મંજુર થયેલ પીએમસી ચાર્જ	૪૫.૨૬ કરોડ

જીરાઈડ સાથે ૨૮ મી ઓગષ્ટ, ૨૦૨૦ માં થયેલ કરાર મુજબ જીરાઈડને ચૂકવવાના થતા પીએમસી ચાર્જસની સ્ટેજવાઈજ વિગત નીચે મુજબ છે:-

(રૂ. કરોડમાં)

ક્રમ	પીએમસીનો ફેઝ	ફેઝ - ૧ માટે મંજુર થયેલ પીએમસી ચાર્જ	ફેઝ - ૧ માટેનો સ્ટેજવાઈઝ પી એમસી ચાર્જસ, વેરા સાથે
૧.	ટ્રાન્ઝેક્શન એડવાઈઝરી (ફેઝ - ૧ માટે મંજુર થયેલ ૩૦% ચાર્જસ)	૧૯.૮૨	૫.૯૪૬
૨.	પ્રોજેક્ટ મેનેજમેન્ટ (ફેઝ - ૧ માટે મંજુર થયેલ ૪૫% ચાર્જસ)		૮.૯૧૯
૩.	કમીશનીંગ અને ટેસ્ટીંગ (ફેઝ - ૧ માટે મંજુર થયેલ ૨૫% ચાર્જસ)		૪.૯૫૫

(રૂ. કરોડમાં)

ક્રમ	પીએમસીનો ફેઝ	ફેઝ - ૨ માટે મંજુર થયેલ પીએમસી ચાર્જ	ફેઝ - ૨ માટેનો સ્ટેજવાઈઝ પી એમસી ચાર્જસ, વેરા સાથે
૧.	ટ્રાન્ઝેક્શન એડવાઈઝરી (ફેઝ - ૨ માટે મંજુર થયેલ ૩૦% ચાર્જસ)	૨૫.૪૪	૭.૬૩૨
૨.	પ્રોજેક્ટ મેનેજમેન્ટ (ફેઝ - ૨ માટે મંજુર થયેલ ૪૫% ચાર્જસ)		૧૧.૪૪૮
૩.	કમીશનીંગ અને ટેસ્ટીંગ (ફેઝ - ૨ માટે મંજુર થયેલ ૨૫% ચાર્જસ)		૬.૩૬૦

તા. ૩૧/૦૩/૨૦૨૩ મુજબ બીલીગ સ્થિતી

(રકમ રૂ.માં)

ક્રમ	પીએમસીનો સ્ટેજ	જીએસટી સાથે સર્ટીફાઇ થયેલ રકમ	વધારવામાં આવેલ બીલીગ
૧.	ટ્રાન્ઝેક્શન એડવાઈઝરી ફેઝ - ૧ માટે મંજૂર થયેલ ૩૦% ચાર્જસ)	-	૫ ૯૪ ૬૦ ૦૦૦
૨.	ટ્રાન્ઝેક્શન એડવાઈઝરી ફેઝ - ૨ માટે મંજૂર થયેલ ૩૦% ચાર્જસ)	-	૭ ૬૩ ૨૦ ૦૦૦
૩.	પ્રોજેક્ટ મેનેજમેન્ટ (ફેઝ - ૧ માટે મંજૂર થયેલ ૪૫% ચાર્જસ) (રૂ.૮.૯૧૯ કરોડ પ્રમાણે પીએમસી ચાર્જસના રૂ.૨૬૩.૫૨ કરોડ)		
એ.	આઈપીસી - ૦૧ થી ૩૧	૨૨૯ ૪૪ ૯૬ ૯૩૦	૭૬૮ ૫૯ ૬૪૦
બી.	તારીખ ૩૧/૦૫/૨૦૨૩ ના રોજ આઈપીસી - ૩૨ અને ૩૩ કોલમ બીલમાં રહેલ રકમ વધારવામાં આવેલ છે અને જીએસટી બાદ કરવામાં આવેલ છે કારણ કે તેના પ્રાવધાનો કરવામાં આવેલ છે અને પુરી ઈન્વોઈસ વેલ્યુ નહિ (માર્ચ, ૨૦૨૩ માટે)	૧૫ ૧૪ ૨૦ ૯૩૬	૪૮ ૬૪ ૩૪૭
૪.	પ્રોજેક્ટ મેનેજમેન્ટ (ફેઝ - ૨ માટે મંજૂર થયેલ ૪૫% ચાર્જસ) (રૂ.૧૧.૪૪૮ કરોડ પ્રમાણે પીએમસી ચાર્જસના રૂ.૩૩૩.૬૨૫ કરોડ)		
એ.	આઈપીસી - ૦૧ થી ૧૨	૧૪૪ ૩૧ ૩૪ ૦૪૬	૪ ૭૩ ૭૦ ૩૩૯
બી.	તારીખ ૦૭/૦૭/૨૦૨૩ ના રોજ આઈપીસી - ૧૩ કોલમ બીલમાં રહેલ રકમ વધારવામાં આવેલ છે અને જીએસટી બાદ કરવામાં આવેલ છે કારણ કે તેના પ્રાવધાનો કરવામાં આવેલ છે અને પુરી ઈન્વોઈસ વેલ્યુ નહિ (માર્ચ, ૨૦૨૩ માટે)	૧૯ ૭૩ ૫૪ ૮૦૮	૬૪ ૨૭ ૬૮૮
	૩૧ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ સુધી બીલ રેઈજ કરવામાં આવેલ છે	૪૦૮ ૬૪ ૦૬ ૭૨૦	૨૭ ૧૩ ૦૨ ૦૧૪

આ વર્ષે જી - રાઈડને કંપની દ્વારા એમએસઆઈએલ ઈન્સાઈડ સલાઈટીંગ કામગીરી માટે પીએમએસ ચૂકવવામાં આવેલ અને તેની વિગત નીચે મુજબ છે.

કામગીરી માટે કુલ પીએમસી ચાર્જસ	૧ ૩૫ ૭૦ ૦૦૦ (૧૮% જીએસટી સાથે)
માર્ચ, ૨૦૨૨ સુધી થયેલ પીએમસી ચાર્જસ	૧,૩૫,૭૦,૦૦૦ (૧૮% જીએસટી સાથે)*

* તેમાં રૂ.૮,૩૮,૦૦૨/- નો પ્રાવધાન કરેલ છે અને તેમાં જીએસટીનો સમાવેશ થતો નથી.

૪૦. ચાલી રહેલ ડેવલોપમેન્ટ / કેપીટલ કામગીરી હેઠળ ઈન્ટેન્જેબલ એસેટના ભાગ રૂપે નીચેના ખર્ચાઓ કેપીટલાઈઝ કરવામાં આવેલ છે:-

વિગત	૩૧ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ પૂર્ણ થતા વર્ષ માટે		૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ પૂર્ણ થતા વર્ષ માટે	
	રકમ	જુઓ નોંધ નં	રકમ	જુઓ નોંધ નં
વિજ્ઞાપનનો ખર્ચ		૫		૫
ચાલી રહેલ કેપીટલ કામગીરી માટે ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - લેન્ડ એકવેઝીશન	-		૨૦ ૮૭૨	
ચાલી રહેલ કેપીટલ કામગીરી માટે ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - કચેરી	-		૫ ૦૦ ૧૮૪	
ટેમ્પીંગ મશીન માટેનો ખર્ચ		૪૦		૪૦
વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસેટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - ફેઝ ૧	-		૨ ૩૧ ૫૮૧	
ઈપીસી પ્રોજેક્ટ વિકાસ ખર્ચ		૪૦		૪૦
વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસેટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - ફેઝ ૧	૧ ૨૮ ૨૪ ૧૪ ૦૦૨		૧૦૬ ૮૦ ૦૧ ૬૩૪	
વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસેટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - ફેઝ ૨	૧ ૫૮ ૦૧ ૫૮ ૩૪૧		૧૮ ૮૨ ૧૦ ૬૪૭	
પીએમસી કોન્ટ્રાક્ટ ખર્ચ		૪૦		૪૦
વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસેટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - ફેઝ ૧	૨૪૭૨૮૫૮૫		૨૭૭૯૭૭૫૬	
વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસેટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - ફેઝ ૨	૪૩૦૭૫૮૭૮		૭૦૮૪૦૪૦૫	

આરઓસી અને લીગલ ચાર્જ્સ		૪૦		૪૦
વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસેટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - ફેઝ ૧	-		-	
વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસેટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - ફેઝ ૨	-		૫૯૦૦૦	
વીજળી ખર્ચ		૪૦		
વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસેટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - ફેઝ ૧	૩૫૭૫૭૬		-	
કુલ	૨૯ ૪૦ ૭૩ ૬૪૮૩		૧૩૫ ૬૬ ૬૨ ૦૭૯	

૪૧. ૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજનું ચાલુ મૂડી કાર્ય પ્રગતિની કામગીરી માટેનું એજુંગ:-

ચાલુ મૂડી કાર્ય પ્રગતિમાં	૧ વર્ષ થી ઓછુ	૧ થી ૨ વર્ષ	૨ થી ૩ વર્ષ	૩ થી વધારે વર્ષ	કુલ
ચાલુ મૂડી કાર્ય પ્રગતિમાં - કચેરી	૧ ૯૦ ૬૪ ૨૬૭	૨ ૫૩ ૧૧૦	-	-	૧ ૯૩ ૧૭ ૩૭૭
ચાલુ મૂડી કાર્ય પ્રગતિમાં - જમીન સંપાદન	૪ ૧૩ ૨૩ ૩૭૩	૫ ૬૪ ૧૨૫	-	-	૪ ૧૮ ૮૭ ૪૯૮
કુલ	૬ ૦૩ ૮૭ ૬૪૦	૮ ૧૭ ૨૩૫	-	-	૬ ૧૨ ૦૪ ૮૭૫

ચાલુ મૂડી કાર્ય પ્રગતિમાં	૧ વર્ષ થી ઓછુ	૧ થી ૨ વર્ષ	૨ થી ૩ વર્ષ	૩ થી વધારે વર્ષ	કુલ
ચાલુ મૂડી કાર્ય પ્રગતિમાં - જમીન સંપાદન	૭ ૨૦ ૧૩ ૭૭૦	૧ ૬૬ ૧૮ ૭૦૮	-	-	૮ ૮૬ ૩૨ ૪૭૮
કુલ	૭ ૨૦ ૧૩ ૭૭૦	૧ ૬૬ ૧૮ ૭૦૮	-	-	૮ ૮૬ ૩૨ ૪૭૮

- તા. ૧૫/૦૨/૨૦૨૩ ના રોજ બીઆરસીએલના ઓફીસની કામગીરી પૂર્ણ થયેલ છે. તેથી ૧૫ મી ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ કેપીટલ વર્ક ઈન પ્રોગ્રેસ - ઓફીસ પ્રોજેક્ટ ને કેપીટલાઈઝ કરવામાં આવેલ છે. (જુઓ નોંધ નં. ૪)
- ૨૩ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ વેસ્ટર્ન રેલ્વે દ્વારા ફેઝ - ૧ માટે માલ પરીવહનના ઓપરેશન માટે સત્તા આપેલ છે. તેથી ૨૩ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ પ્રોજેક્ટના ફેઝ - ૧ માટે જમીન સંપાદન માટે કેપીટલ વર્ક ઈન પ્રોગ્રેસ ને કેપીટલાઈઝ કરવામાં આવેલ છે. (જુઓ નોંધ - ૪)

૪૨. વિકાસ હેઠળ રહેલ ઇન્ટેન્જેબલ એસેટ (વિકાસ હેઠળનો ફેઈટ શેરીંગ રાઈટ)

ક્રમ	કામગીરી ની બાબત / આઈટમની વિગત	ફેઝ ૧		ફેઝ ૨	
		૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતીત (એ)	૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતીત (બી)	૩૧ મી માર્ચ, ૨૦૨૩ અંતીત (સી)	૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતીત (ડી)
૧.	સીવીલ અને ટ્રેકની કામગીરી	૨૪ ૭૮૧૫૬ ૫૫૬	૧૩૪ ૫૨ ૩૬ ૩૭૭	૧૩૪ ૨૦ ૦૪ ૬૬૯	૧૪ ૪૯ ૭૦ ૭૨૬
	પ્રોજેક્ટ સુવિધા	૨ ૦૦ ૧૭ ૫૪૬	૧ ૯૦ ૭૬ ૩૭૬	૩૧ ૪૦ ૨૭૯	૪ ૨૩ ૩૩૦
	અર્થવર્ક	૫૯ ૮૨ ૬૧ ૩૧૫	૨૪ ૯૯ ૯૪ ૭૩૨	૪૫ ૩૪ ૩૮ ૩૬૧	-
	સુરક્ષા કામગીરી	૯ ૨૯ ૭૯ ૧૭૪	૪ ૮૨ ૬૬ ૪૫૭	૮૫ ૯૯૨	-
	મોટા પુલો પીએસસી સલેબ બ્રીજ સાથે	૮ ૧૭ ૫૯ ૦૨૩	૪ ૭૬ ૦૬ ૪૯૪	૧૦ ૦૪ ૯૫ ૪૭૨	-
	નાના પુલો પીએસસી સલેબ બ્રીજ સાથે	૪૪ ૦૮ ૦૫ ૫૯૨	૧૭ ૯૬ ૪૧ ૦૦૩	૧૪ ૪૦ ૫૪ ૦૪૦	-
	આરયુબીઓ	૪૮ ૫૭ ૮૦ ૯૦૦	૩૦ ૧૦ ૭૬ ૭૦૨	૧૮ ૬૦ ૧૦ ૩૦૨	-
	ટ્રેક કામગીરી	૪૯ ૦૨ ૬૫ ૯૦૬	૩૮ ૧૦ ૭૪ ૫૩૪	૩૯ ૯૮ ૯૧ ૦૪૫	૧૪ ૪૫ ૪૭ ૩૯૬
	અન્ય સીવીલ એન્જીનીયરીંગ કામગીરી એફઓબી અને સબવે સાથે	૨૨ ૬૧ ૧૦ ૫૯૭	૧૧ ૮૫ ૦૦ ૦૭૯	૫ ૪૮ ૮૯ ૧૭૯	-
	સીવીલ અને ટ્રેક કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ તેનું ઇન્ટેગ્રેટેડ ટેસ્ટીંગ અને કમીશનીંગ.	૧ ૬૬ ૨૭ ૫૭૭	-	-	-
૨	સીગનલીંગ કામગીરી	૧૨ ૮૩ ૯૯ ૦૩૭	૯ ૬૦ ૮૧ ૬૭૧	૧૧ ૬૬ ૮૬ ૦૫૭	૫૪ ૩૬ ૮૯૬
૩	ટેલીકોમ્યુનિકેશન કામગીરી	૨ ૦૪ ૬૨ ૯૦૨	૧ ૦૨ ૮૬ ૨૯૧	૨ ૦૩ ૩૪ ૬૩૦	૧ ૦૫ ૯૨ ૬૦૭
૪	વીજળીની કામગીરી (ઓએચ ઈ કામગીરીઓ)	૧૯ ૬૫ ૮૦ ૦૪૩	૧ ૧૨ ૯૨ ૮૪૧૨	૨૬ ૭૯ ૦૬ ૫૦૯	-
	ઓવરહેડ ઈકવીપમેન્ટ કામગીરી, ઓએચઈ મોડીફિકેશન, ટીએસએસ, એસએસ	-	૧૧ ૨૯ ૨૮ ૪૧૨	-	-
૫	જનરલ વીજળી કામગીરી (જીઈડબલ્યુ)	૪ ૧૩ ૦૭ ૪૬૫	૧ ૭૯ ૫૯ ૨૫૨	૨ ૩૨ ૩૮ ૧૨૩	૨ ૮૨ ૧૦ ૪૧૭
	જુદા જુદા સામાન્ય વીજળી સેવાઓની કામગીરી	-	૧ ૦૯ ૫૨ ૪૦૩	-	૨ ૬૩ ૦૨ ૧૩૬
	૩૩ કેવી સુધી એચટી પાવર લાઈ કોસીગમાં મોડીફિકેશન (યુજી કેબલીગથી રીપ્લેસમેન્ટ)	-	૭૦ ૦૬ ૮૪૯	-	૧૯ ૦૮ ૨૮૧

૬	પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટેનો કન્સલ્ટન્સી ચાર્જસ	૧૧ ૭૭ ૨૩ ૦૮૭	૯ ૨૯ ૯૩ ૫૦૧	૧૧ ૩૯ ૧૬ ૩૮૪	૭ ૦૮ ૪૦ ૪૦૫
૭	વીજળી કામગીરી માટે જીઈટી સીઓ ને ચૂકવણું	૨ ૯૦ ૫૭ ૨૫૯	૨ ૯૦ ૫૭ ૨૫૯	૨૨ ૫૩ ૯૦ ૫૧૫	૧૯ ૯૫ ૪૯ ૭૧૧
૮	સાઈટની સફાઈ કામગીરી	૧ ૨૧ ૧૨૫	૧ ૨૧ ૧૨૫	-	-
૯	લોન માટે જી - રાઈડ પાસેથી પ્રાપ્ત થયેલ વ્યાજ	૪૯ ૬૨ ૧૯૫	૪૯ ૬૨ ૧૯૫	-	-
૧૦	રેલ્વે પાસેથી રેલની ખરીદી માટે ચૂકવણું	૪૭ ૫૭ ૧૯ ૦૪૦	૧૨૮૪૫૮૮૯૧	૧૩ ૦૧ ૦૧ ૫૫૫	-
૧૧	વધારાના ફીડર બે માટેનું ચૂકવણું	૩ ૦૯ ૨૦ ૯૪૯	૩ ૦૯ ૨૦ ૯૪૯	-	-
૧૨	અન્ય	૨૧ ૧૭ ૭૬૮	૧ ૯૫ ૫૪૬	૨ ૮૦ ૪૫૪	૨ ૮૦ ૫૪૫
	પેટા કુલ	૩૫૨ ૫૫ ૨૭ ૪૨૭	૧૮૬ ૯૨ ૦૧ ૪૬૮	૨૨૪ ૮૯ ૫૮ ૮૯૬	૪૫ ૯૮ ૮૧ ૨૧૬
	ઓછુ : મોબલાઈઝેશન એડાવન્સ પરનો વ્યાજ	૪ ૦૯ ૩૧ ૯૬૯	૩ ૯૩ ૭૨ ૦૪૫	૪ ૩૧ ૫૯ ૭૧૯	૧ ૪૫ ૪૪ ૬૭૯
	વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસેટ પરનો કુલ	૩૪૮ ૪૫ ૯૫ ૪૫૮	૧૮૨ ૯૮ ૨૯ ૪૨૩	૨૨૦ ૫૭ ૯૯ ૧૭૭	૪૪ ૫૩ ૩૬ ૫૩૭
	ઓછુ : ઈન્ટેન્જેબલ એસેટમાં ટ્રાન્સફર - ફાઈટ શેરીંગ રાઈટ	૩૪૮ ૪૫ ૯૫ ૪૫૮	-	-	-
		-	૧૮૨ ૯૮ ૨૯ ૪૨૩	૨૨૦ ૫૭ ૯૯ ૧૭૭	૪૪ ૫૩ ૩૬ ૫૩૭

૩૧મી માર્ચ, ૨૦૨૩ અંતીતના વર્ષ માટે વિકાસ હેઠળ રહેલ કુલ ઈન્ટેન્જેબલ એસેટ (એ + બી + સી નુ કુલ) ૨૨૦ ૫૭ ૯૯ ૧૭૭

૩૧મી માર્ચ, ૨૦૨૨ અંતીતના વર્ષ માટે વિકાસ હેઠળ રહેલ કુલ ઈન્ટેન્જેબલ એસેટ (બી + ડી નુ કુલ) ૨૨૭ ૫૧ ૬૫ ૯૬૦

નોંધ:- ઉપર દર્શાવેલ આંકડાઓમાં પ્રાઈઝ વેરીયેશન અને સ્કોપ એમાઉન્ટમાં ફેરફારનો સમાવેશ ફેઝ - ૧ માટે થાય છે અને તે રૂા.૨૭,૧૨,૯૩,૯૫૬/- છે.

- ઉપરના આંકડાઓમાં ફેઝ - ૨ માટે રૂા. ૧૩,૮૮,૮૧,૧૩૬/- ના પ્રાઈઝ વેરીયેશનનો સમાવેશ થાય છે.

- ૨૩ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ વેસ્ટન રેલવે દ્વારા ફેઝ - ૧ માટે ગુડસ ટ્રાફિક ઓપરેશન માટે ઓથોરાઈઝ કરવામાં આવેલ છે.

૩૧ મી માર્ચ, ૨૦૨૩ ના રોજનુ વિકાસ હેઠળ રહેલ અવાસ્તવિક મિલકત માટેનું એજુગ:-

વિકાસ હેઠળની અવાસ્તવિક મિલકત	૧ વર્ષ થી	૧ થી ૨ ઓછુ	૨ થી ૩ વર્ષ	૩ થી વધારે વર્ષ	કુલ વર્ષ
ચાલુ રહેલ પ્રોજેક્ટ - ફેઝ ૧	-	૧૧૭ ૬૦ ૯૫ ૪૪૪	૬૫૩૭૩૩૯૭૯	-	૧૮૨ ૯૮ ૨૯ ૪૨૩
ચાલુ રહેલ પ્રોજેક્ટ - ફેઝ ૨	૧૭૬ ૦૪ ૬૨ ૬૪૦	૪૪ ૫૩ ૩૬ ૫૩૭	-	-	૨૨૦ ૫૭ ૯૯ ૧૭૭
કુલ	૧૭૬ ૦૪ ૬૨ ૬૪૦	૧૬૨ ૧૪ ૩૧ ૯૮૧	૬૫ ૩૭ ૩૩ ૯૭૯	-	૪૦૩ ૫૬ ૨૮ ૬૦૦

૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજનુ વિકાસ હેઠળ રહેલ અવાસ્તવિક મિલકત માટેનું એજુગા:-

વિકાસ હેઠળની અવાસ્તવિક મિલકત	૧ વર્ષ થી	૧ થી ૨ ઓછુ	૨ થી ૩ વર્ષ	૩ થી વધારે વર્ષ	કુલ વર્ષ
ચાલુ રહેલ પ્રોજેક્ટ - ફેઝ ૧	૧૧૭ ૬૦ ૮૫ ૪૪૪	૬૫ ૩૭ ૩૩ ૮૭૮	-	-	૧૮૨ ૯૮ ૨૯ ૪૨૩
ચાલુ રહેલ પ્રોજેક્ટ - ફેઝ ૨	૪૪ ૫૩ ૩૬ ૫૩૭	-	-	-	૪૪ ૫૩ ૩૬ ૫૩૭
કુલ	૧૬૨ ૧૪ ૩૧ ૯૮૧	૬૫ ૩૭ ૩૩ ૯૭૮	-	-	૨૨૭ ૫૧ ૬૫ ૯૬૦

૪૩. કેપીટલ કમીટમેન્ટ

૩૧ મી માર્ચ, ૨૦૨૩ ના વર્ષ અંતિત

કરાર કરવામાં આવેલ પાર્ટી નું નામ	કરારની કુલ કિંમત	૩૧ મી માર્ચ, ૨૦૨૩ સુધી પૂર્ણ કરેલ કરારની કિંમત	બાકી રહેલ કરારની કિંમત
કલ્પતરુ પાવર ટ્રાન્સમીશન લી - ઈપીસી કોન્ટ્રાક્ટ	૨૬૭ ૬૩ ૨૫ ૩૮૮	૨૪૭ ૩૧ ૭૩ ૬૩૪	૨૦ ૩૧ ૫૧ ૭૫૪
ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ - પીએમસી કરાર	૪૫ ૨૬ ૦૦ ૦૦૦	૨૭ ૩૩ ૩૪ ૫૮૦	૧૭ ૯૨ ૬૫ ૪૨૦
અશોકા બિલ્ડકોન લીમીટેડ	૩૪૮ ૫૨ ૮૧ ૪૬૦	૧૮૬ ૫૩ ૮૮ ૮૦૬	૧૬૨ ૯૮ ૮૧ ૬૫૪
હરેશ પટેલ એન્જીનીયર્સ અને કોન્ટ્રાક્ટરો	૪ ૭૦ ૧૫ ૩૮૮	૪ ૫૫ ૮૨ ૧૨૩	૧૪ ૩૩ ૨૬૫
કુલ કેપીટલ કમીટમેન્ટ	૬૬૭ ૧૨ ૩૨ ૨૩૬	૪૬૫ ૭૪ ૯૦ ૧૪૩	૨૦૧ ૩૭ ૪૨ ૦૯૩

નોંધ:- જીએસટીના દરમાં ૧૨% થી ૧૮% નો વધારો કરવામાં આવેલ હોવાથી કોન્ટ્રાક્ટ કિંમતને ફરવવામાં આવેલ છે.

૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના વર્ષ અંતિત

કરાર કરવામાં આવેલ પાર્ટી નું નામ	કરારની કુલ કિંમત	૩૧ મી માર્ચ, ૨૦૨૨ સુધી પૂર્ણ કરેલ કરારની કિંમત	બાકી રહેલ કરારની કિંમત
કલ્પતરુ પાવર ટ્રાન્સમીશન લી - ઈપીસી કોન્ટ્રાક્ટ	૨૬૩ ૫૨ ૦૦ ૦૦૦	૧૭૪ ૮૮ ૬૨ ૦૨૧	૮૮ ૬૩ ૩૭ ૯૭૯
ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ - પીએમસી કરાર	૪૫ ૨૬ ૦૦ ૦૦૦	૧૮ ૧૭ ૭૨ ૩૪૫	૨૬ ૦૮ ૨૭ ૬૫૫
અશોકા બિલ્ડકોન લીમીટેડ	૩૩૩ ૬૨ ૫૦ ૦૦૦	૫૨ ૨૮ ૩૫ ૬૪૭	૨૮૧ ૩૪ ૧૪ ૩૫૩
હરેશ પટેલ એન્જીનીયર્સ અને કોન્ટ્રાક્ટરો	૪૪૬ ૦૮ ૮૮૮	૧૬૬ ૧૩ ૩૮૦	૨૭૯ ૯૫ ૫૦૮
કુલ કેપીટલ કમીટમેન્ટ	૬૪૬ ૮૬ ૫૮ ૮૯૬	૨૪૮ ૦૦ ૮૩ ૪૦૩	૩૯૮ ૮૫ ૭૫ ૪૯૬

૪૪. જુદા જુદા નાણાંકીય રેશિયો નીચે દર્શાવવામાં આવેલ છે:-

ક્રમ	રેશિયો	ન્યુમરેટર	ડીનોમીનેટર	૩૧/૦૩/૨૦૨૩	૩૧/૦૩/૨૦૨૨
૧	કરન્ટ રેશિયો (X)	કરન્ટ એસેટ	કરન્ટ જવાબદારી	૧.૨૦	૭.૮૪
ફેરફાર માટે કારણ : ચાલુ વર્ષની જવાબદારીઓ કરતા ચાલુ વર્ષની મિલકતોના વધારાના કારણે.					
૨	ડેબ્ટ ઇકવીટી (X) રેશિયો	કુલ ડેબ્ટ	શેર ધારકોનો ઇકવીટી (કેપીટલ વત્તા રીઝર્વ)	-	-
૩	ડેબ્ટ સેવા કવરેજ રેશિયો (X)	વેરા પહેલાનો નેટ નફો + નોન કેશ ઓપરેટીંગ ખર્ચ જેવા કે ઘસારો અને અન્ય એમોરાઈઝેશન + વ્યાજ + અન્ય એડજેસ્ટમેન્ટ જેવા કે ફીક્સ એસેટ ના વેચાણ પર થયેલ લોસ વગેરે	વ્યાજ અને લીઝ ચુકવણી + પ્રીન્સીપલ ચુકવણી	-	-
૪	ઇકવીટી પર રીટર્ન (%)	વેરા પછી નેટ નફો - પ્રેફરેન્સ ડીવીડેન્ડ (જો કોઈ હોય તો)	સરેરાશ શેર ધારકનું ઇકવીટી	(૪૫.૩૪)%	૨૧%
૫	ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો	વેચેલ ગુડસની કિંમત કે સેલ્સ	સરેરાશ ઇન્વેન્ટરી (ઓપનીંગ + કલોઝીંગ સિલક / ૨)	-	-

૬	મળવાપાત્ર ટ્રેડ ટર્નઓવર રેશિયો	નેટ કેડીટ સેલ (ગ્રોસ કેડીટ સેલ્સ બાદ સેલ્સ રીટર્ન)	સરેરાશ મળવાપાત્ર હિસાબો (ઓપનીંગ + બંધ સિલક / ૨)	૨.૨૬	૩.૨૧
ફેરફાર માટે કારણ : ગત વર્ષે કોઈપણ મળવાપાત્ર ટ્રેડ રહેલ નથી તેથી.					
૭	ચૂકવવાપાત્ર ટ્રેડ ટર્નઓવર રેશિયો	નેટ કેડીટ ખરીદી (ગ્રોસ કેડીટ ખરીદી માઈનસ ખરીદીના રીટર્ન)	સરેરાશ વર્કીંગ કેપીટલ	૦.૦૪	૦.૦૭
ફેરફાર માટે કારણ : ગત વર્ષે કોઈપણ ચૂકવવાપાત્ર ટ્રેડ રહેલ નથી તેથી.					
૮	નેટ કેપીટલ ટર્નઓવર રેશિયો	નેટ સેલ્સ (કુલ સેલ્સ માઈનસ સેલ્સ રીટર્ન)	સરેરાશ વર્કીંગ કેપીટલ	૦.૦૪	૦.૦૭
ફેરફાર માટે કારણ : ગત વર્ષે કોઈપણ વેચાણ થયેલ નથી તેથી.					
૯	નેટ નફા રેશિયો	નેટ નફો	નેટ સેલ્સ	(૦.૧૩)%	૦.૦૧
ફેરફાર માટે કારણ : ગત વર્ષે કોઈપણ વેચાણ થયેલ નથી તેથી.					
૧૦	એમ્પ્લોઈડ કેપીટલ પરનુ રીટર્ન	વ્યાજ અને વેરા પહેલાનું રીટર્ન	એમ્પ્લોઈ થયેલ કેપીટલ (ટેન્જેબલ નેટ વર્થ + કુલ ડેબીટ + ડીફર થયેલ વેરાની જવાબદારી)	૦.૦૧૦	૦.૦૦૩
ફેરફાર માટે કારણ : એમ્પ્લોઈડ થયેલ કેપીટલમાં રહેલ પ્રપોરશીનેટ વધારો આવક કરતા વધારે છે.					
૧૧	રોકાણ પર રીટર્ન	રીટર્ન	રોકાણ	-	-

૪૫. નીચેના ખર્ચાઓમાં જુના સમયગાળાના ખર્ચાઓનો સમાવેશ થાય છે:-

વિગત	૩૧-૦૩-૨૩	૩૧-૦૩-૨૦૨૨	જુઓ નોંધ નં.
ભાડા ખર્ચ	-	૨૩ ૯૩ ૯૨૭	૨૮
રીપેયર અને મેન્ટેનેન્સ	-	૩ ૪૪ ૩૩૦	૨૮
આરઓસી અને લીગલ ખર્ચ - પ્રોફેશનલ વેરા	-	૯ ૭૧૭	૨૮
કુલ	-	૨૭ ૪૭ ૯૭૪	

૪૬. લીઝની વ્યવસ્થાઓ

કંપનીએ ગુજરાત ઉદ્યોગ ભવન સોસાયટી સાથે ઓફીસ પ્રીમાઈસીસ ને પાંચ વર્ષના લીઝ માટે રૂા. ૧, ૬૦, ૨૮૫/- ના માસિક ભાડાથી પ્રાપ્ત કરવા માટે કરાર કરેલ છે.

ઉપર જણાવેલ લીઝને રાઈટ ટુ યુઝ - લીઝ હોલ્ડ ઓફિસમાં ડેબીટ કરીને તેને એકાઉન્ટ કરેલ છે અને તેની સંબંધીત લીઝ જવાબદારીમાં કેડીટ કરેલ છે. ઉપર જણાવેલ લીઝ જવાબદારીને ભવિષ્યના લીઝ ચૂકવણા ને ૫ વર્ષ માટે ૯.૫% પ્રતિ વર્ષના લખે ડીસ્કાઉન્ટ કરી પ્રાપ્ત કરેલ છે.

લીઝના જવાબદારીનું મેચ્યુરીટી વિશ્લેશણ

વિગત	૧૨ માસથી ઓછા માટે	૧૨ માસથી વધારે માટે	કુલ જવાબદારી
૩૧ મી માર્ચ, ૨૦૨૩ મુજબ	૧૪ ૪૨ ૯૦૦	૪૨ ૬૫ ૨૪૦	૫૭ ૦૮ ૧૪૦
૩૧ મી માર્ચ, ૨૦૨૨ મુજબ	૧૩ ૧૨ ૬૨૫	૫૭ ૦૮ ૧૪૦	૭૦ ૨૦ ૭૬૫

નફા અને નુકશાનના પત્રકમાં દર્શાવવામાં આવેલ રકમ

વિગત	૩૧-૦૩-૨૦૨૩	૩૧-૦૨-૨૦૨૨
લીઝની જવાબદારી પરનો વ્યાજ	૬ ૧૦ ૭૯૫	૩ ૫૦ ૫૩૨
આરઓયુ એસેટ પરનું એમોરાઈઝેશન	૧૫ ૨૬ ૩૮૯	૭ ૬૩ ૧૯૪
કુલ	૨૧ ૩૭ ૧૮૪	૧૧ ૧૩ ૭૨૬

રાઈટ ટુ યુઝ (આરઓયુ) એસેટની વિગતો - લીઝ હોલ્ડ ઓફિસ

વિગત	૩૧-૦૩-૨૦૨૩	૩૧-૦૨-૨૦૨૨
બેલેન્સ શીટની તારીખે ઉઘડતી કેરીઈંગ વેલ્યુ	૬૮ ૬૮ ૭૪૯	-
વર્ષ દરમ્યાન આરઓયુમાં ઉમેરો	-	૭૬ ૩૧ ૯૪૩
દર્ષ દરમ્યાન આરઓયુ એસેટનું એમોરાઈઝેશન	૧૫ ૨૬ ૩૮૯	૭ ૬૩ ૧૯૪
બેલેન્સ શીટની તારીખે બંધ થતો કેરીઈંગ વેલ્યુ	૫૩ ૪૨ ૩૬૦	૬૮ ૬૮ ૭૪૯

૪૭. ગત વર્ષના આકડાં ને રી ગ્રુપ/રી કલાસીફ જયા જરૂર હોય ત્યા કરેલ છે જેથી તે ચાલુ વર્ષના આંકડા સાથે સરખામણીમાં રહે.

નોંધ નંબર ૧ થી ૪૭ ના સીગનેટરી

હિસાબી ફોર્મ પરની નોંધો નાણાંકીય પત્રકોનો આતરીક ભાગ છે.
સમાન તારીખના અમારા અહેવાલ પ્રમાણે

શાહ અને દલાલ વતી

નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

એફઆરએન: ૧૦૮૪૩૨૩બલ્યુ

સહી/-

સહી/-

સહી/-

સહી/-

મલય દલાલ

એસ.એન.જોષી

જવલેશ ઝવેરી

આર. એસ. કપુર

ભાગીદાર,
સભ્ય નં.૦૩૬૭૭૬

સીએફઓ

નિયામક

નિયામક

યુડીઆઈએન:૨૩૦૩૬૭૭૬બીજીડબલ્યુજેજેડેડ૪૫૫૧

ડીઆઈએન: ૦૮૫૦૭૨૨૪

ડીઆઈએન : ૦૮૩૦૩૬૮૮

સ્થળ:- અમદાવાદ

સ્થળ:- ગાંધીનગર

તારીખ:- ૨૮/૦૮/૨૦૨૩

તારીખ:- ૨૮/૦૮/૨૦૨૩

99/05

Industries & Mines Department
5th Administrative Report of
Bahucharaji Rail Corporation Limited
Pursuant to Section 394(2) of the Companies Act, 2013
(For the F.Y. 2022-23)

Bahucharaji Rail Corporation Limited (BRCL) is a Joint Venture of Gujarat Rail Infrastructure Development Corporation Limited, Gujarat Industrial Development Corporation and Maruti Suzuki India Limited, incorporated under provision of the Companies Act, 2013 on 13.12.2018.

BRCL has been incorporated to carry on the business of development, financing, planning and implementation of Gauge Conversion of Katosan Road–Bechraji–Chanasma-Ranuj (65 Kms) line project in the state of Gujarat.

The Company is started commercial operations during the previous year.

- a) During the year for Phase I of the project, engine rolling successfully completed & SAG inspection completed successfully and automobile rake loading started during the year.
- b) For field supervision and contract management, Project Management Consultancy agency has been working.
- c) Other in-house day-to-day work for smoother progress of project are being undertaken by the Company.
- d) Land Acquisition for the project is being coordinated with the State Government and District Administration.
- e) The company is monitoring the progress of project for various activities.
- f) The company is liasoning with Railways and State Government on all issues related to Project.

During the reporting period, company has incurred loss of Rs. 2,58,61,882/- . (After Tax)



Chief Executive Officer

Bahucharaji Rail Corporation Limited



Additional Chief Secretary

Industries & Mines Department
Government of Gujarat



BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

(CIN: U45101GJ2018SGC105602)

5th Annual Report F.Y. 2022-2023

Date : 28/12/2023

Time : 01:45 PM

Place : Block No.6, 7th Floor

Udyog Bhawan, Sector - 11,

Gandhinagar-382011, Gujarat

: Registered Office:

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

Block No. 6, 7th Floor, Udyog Bhavan, Sector-11,

Gandinagar-382011

Phone: -079-232-32728/29, Email: - info@brcl.org.in

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
(CIN: U45101GJ2018SGC105602)

INDEX

Sr. No.	Particulars	Page No.
1	Board of Directors	4
2	Notice of 5 th Annual General Meeting	5
3	Board's Report	6
4	Report of C & AG	21
5	Independent Auditor's Report	23
6	Balance Sheet	42
7	Profit & Loss Account	44
8	Statement of Changes in Equity	46
9	Cash Flow Statement	48
10	Notes forming part of Financial Statements	50

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
(CIN: U45101GJ2018SGC105602)

Board of Directors

Sr. No.	Name & DIN of Director	Designation
1.	SHRI SANTOSH KUMAR - 07854179	Director
2.	SHRI BAJRANG CHHAGANBHAI WARLI - 07133942	Director
3.	SHRI PAWAN AGARWAL - 09650740	Director
4.	SHRI RAJ SWARUP KAPOOR - 08303688	Director
5.	JWALESH PIYUSHBHAI ZAVERI - 09507224	Nominee Director
6.	SANTOSH KUMAR - AFPPK5776D	CEO
7.	SHAMBHUPRASAD JOSHI - ABEPJ6568K	CFO

Statutory Auditors

M/s Shah & Dalal
Chartered Accountants,
Ahmedabad

Bankers

Yes Bank, Gandhinagar
Union Bank of India, Gandhinagar

Registered Office

Block No. 6, 7th Floor,
Udyog Bhavan, Sector-11,
Gandinagar-382011.

Notice for the 5th Annual General Meeting

NOTICE is hereby given that the Fifth Annual General Meeting of the Company Bahucharaji Rail Corporation Limited will be held on **Thursday, the 28th December, 2023 at 1:45 p.m. (at a shorter notice) through Video conferencing/OAVM mode with a deemed place of meeting at Block No. 6, 7th Floor, Udyog Bhavan, Sector 11, Gandhinagar – 382011** to transact the following business:

ORDINARY BUSINESS:

1. To receive, consider and adopt the Audited Financial Statement of the Company for the Financial Year ended March 31, 2023 together with the reports of the Board of Directors and Auditors and comments of Comptroller and Auditor General of India thereon.
2. To appoint Shri B. C. Warli (DIN: 07133942), who retires by rotation as a Director and being eligible offers herself for re-appointment.
3. To appoint Shri Raj Swarup Kapoor (DIN: 08303688), who retires by rotation as a Director and being eligible offers himself for re-appointment.
4. To authorize Board of Directors of the Company to fix the remuneration of the Statutory Auditors of the Company appointed by the office of CAG of India for audit of accounts of the Company for the year 2023-24.

Regd. Office:

Block No. 6, 7th Floor,
Udyog Bhavan,
Sector -11,
Gandhinagar - 382 011

By order of the Board of Directors**Date: 28th December, 2023****Sd/-****CHAIRMAN/DIRECTOR****NOTES:**

1. Shareholders seeking any information regarding any aspect of this report are requested to write to the company well in advance so as to enable the management to keep the information ready.

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

(CIN: U45101GJ2018SGC105602)

Reg. Office: Block No. 6, 7TH Floor, Udhog Bhavan, Sector-11, Gandhinagar, Gujarat-382011**DIRECTORS' REPORT**

To,

The Members,

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

Gandhinagar, Gujarat

Your Directors have pleasure in presenting their 5th Annual Report on the business and operations of Bahucharaji Rail Corporation Limited (“the Company”) and the accounts for the financial year ended on 31st March, 2023.

1. FINANCIAL SUMMARY OR HIGHLIGHTS/PERFORMANCE OF THE COMPANY:

The financial position of the Company for financial year ended on 31st March, 2023 is as follows:

(Amount in ₹)

Particulars	2022-23	2021-22
Revenue from Operations	20,14,22,225	43,92,45,536
Other Income	7,95,11,452	3,59,74,956
Total Revenue	28,09,33,677	47,52,20,492
Less: Total Expenses	(22,18,62,789)	(46,06,30,692)
Profit / (Loss) Before Tax	5,90,70,798	1,45,89,800
Less: Tax Expenses	(8,49,32,680)	(93,06,216)
Profit / (Loss) after tax	(2,58,61,882)	52,83,584

2. BRIEF DESCRIPTION OF THE COMPANY'S WORKING DURING THE YEAR:

The Company is started commercial operations during the year.

- During the year for Phase I of the project, engine rolling successfully completed & SAG inspection completed successfully and automobile rake loading started during the year.
- For field supervision and contract management, Project Management Consultancy agency

has been working.

- c) Other in-house day to day works for smoother progress of project are being undertaken by the Company.
- d) Land Acquisition for the project is being coordinated with State Government and District Administration.
- e) Monitoring the progress of project for various activities.
- f) Liasoning with Railways and State Government on all issues related to Project.

The management is accelerating its activities and speed up implementation of Phase II of the project during the year.

3. CHANGE IN THE NATURE OF BUSINESS, IF ANY:

During the financial year under review, there is no Change in the nature of business.

4. DIVIDEND:

During the financial year under review, the Board of Directors did not recommend any Dividend on the Equity Shares of the Company.

5. TRANSFER TO RESERVES:

During the financial year under review, Company has not transferred any amount to General Reserve.

6. DEPOSITS:

During the financial year under review, the Company has not accepted any Deposits from the public and it is therefore not required to comply with the requirement under the Companies (Accounts) Rules, 2014.

7. PARTICULARS OF LOANS, GUARANTEES AND INVESTMENTS:

During the year under review, the Company has not given any loans, made any investments or given guarantees on any loans, which fall within the purview of the provisions of Section 134(3)(g) of the Companies Act, 2013 and hence, no disclosures are required to be made thereof.

8. SUBSIDIARIES, JOINT VENTURES AND ASSOCIATE COMPANIES:

The Company is Joint Venture Company promoted by, Gujarat Rail Infrastructure

Development Corporation Limited, Gujarat Industrial Development Corporation and Maruti Suzuki India Limited. Therefore by virtue of shareholding agreement of the company becomes Joint Venture Company of J.V. Partners.

9. ANNUAL RETURN:

The Company do not have any website therefore pursuant to the provisions of Section 134 (3) (a) of the Companies Act, 2013 read with the rules made thereunder, with respect to requirements for website disclosures relating to Annual Return (Form MGT - 7) are not applicable to the Company.

10. SHARE CAPITAL OF THE COMPANY AND CHANGE IN SHARE CAPITAL, IF ANY:

The Authorized, Issued, Subscribed and Paid-up Share Capital of the Company as at 31st March, 2023 as follows:

SHARE CAPITAL STRUCTURE	
Authorised Share Capital *	Rs. 7,86,22,00,000 (Rupees Seven Hundred Eighty Six Crores and Twenty Two Lakhs Only) divided into 78,62,20,000 (Seventy Eight Crores Sixty Two Lakhs Twenty Thousand) Equity Shares of Rs. 10/- each.
Issued, Subscribed and Paid-up Share Capital **	Rs. 612,12,24,020/- (Rupees Six Hundred Twelve Crores Twelve Lakhs Twenty Four Thousand Twenty only) divided into 61,21,22,402 (Sixty One Crores Twenty One Lakhs Twenty Two Thousand Four Hundred and Two) Equity Shares of Rs. 10/- each.

**Allotment of 11,52,05,202 (Eleven Crore Fifty Two Lakh Five Thousand Two Hundred and Two) Equity shares of Rs. 10/- each to equity shareholders of the Company on right basis in tranches, which shall rank pari passu in all respect with existing shareholders w.e.f 22nd April, 2022, 20th July, 2022, 22nd September, 2022 and 3rd November, 2022 respectively during the year.

11. DISCLOSURE REGARDING ISSUE OF EQUITY SHARES WITH DIFFERENTIAL RIGHTS:

The Company has not issued any Equity Shares with Differential Voting Rights during the financial year and it is therefore not required to make disclosures specified in Rule 4 (4) of Companies (Share Capital and Debenture) Rules, 2014.

12. DISCLOSURE REGARDING ISSUE OF SWEAT EQUITY SHARES:

The Company has not issued any Sweat Equity Shares during the financial year and it is therefore not required to make disclosures specified in Rule 8 (13) of Companies (Share Capital and Debenture) Rules, 2014.

13. DISCLOSURE REGARDING ISSUE OF EMPLOYEE STOCK OPTION:

The company has not issued any shares under Employee Stock Option Scheme during the financial year and it is therefore not required to make disclosures specified in Rule 12 (9) of Companies (Share Capital and Debenture) Rules, 2014.

14. PARTICULARS OF EMPLOYEES:

As the Bahucharaji Rail Corporation Limited is not a Listed Company therefore section 197 (12) and Companies (Appointment and Remuneration of Managerial Personnel) Rules, 2014, statement of particulars of employees are not applicable to the Company.

15. DIRECTORS AND KEY MANAGERIAL PERSONNEL:

During the financial year under review, details of Board of Directors and Key Managerial Personnel as well as changes made in the Composition of the Board of Directors and Key Managerial Personnel (KMPs) as on the date of this Report are as follows:

Sr. No.	Name of Directors/ KMP Appointed	DIN	Designation	Date of Appointment	Date of Cessation
1	Santosh Kumar, IRSE	07854179	Director	13/12/2018	Continue
2	Bajrang Warli	07133942	Director	13/12/2018	Continue
3	Jwalesh Zaveri	09507224	Nominee Director	16/02/2022	Continue
4	Raj Swarup Kapoor	08303688	Director	13/12/2018	Continue
5	Pawan Agarwal	09650740	Director	20/07/2022	Continue
6	Batchu Venugopal	08303687	Director	13/12/2018	20/07/2022
7	Santosh Kumar, IRSE	AFPPK5776D	CEO	22/09/2020	Continue
8	Shambhuprasad Joshi	ABEPJ6568K	CFO	22/09/2020	Continue

16. DIRECTORS LIABLE TO RETIRE BY ROTATION:

Pursuant to the Section 152(6) of the Companies Act, 2013, Shri Santosh Kumar (DIN : 07854179) and Shri Pawan Agarwal (DIN: 09650740) retires by rotation at the AGM of the

Company and being eligible offer themselves for re-appointment. The Company has received the disclosure in Form DIR-8 stating that they are eligible to be re-appointed at the forthcoming AGM of the Company.

17. MANAGERIAL REMUNERATION:

The Company is not required to make disclosures pursuant to Rule 5 of Companies (Appointment and Remuneration of Managerial Personnel) Rules, 2014 relating to Managerial Remuneration being an Unlisted Company.

18. DIRECTORS' RESPONSIBILITY STATEMENT:

The Directors' Responsibility Statement referred to in clause (c) of sub-section (3) of Section 134 of the Companies Act, 2013, shall state that—

- (a) In the preparation of the Annual Accounts, the applicable Accounting Standards had been followed along with proper explanation relating to material departures;
- (b) The Directors had devised proper systems to ensure compliance with the provisions of all applicable laws and that such systems were adequate and operating effectively.
- (c) The Directors had selected such Accounting Policies and applied them consistently and made judgments and estimates that are reasonable and prudent so as to give a true and fair view of the state of affairs of the Company at the end of the financial year and of the profit and loss of the Company for that financial year;
- (d) The Directors had taken proper and sufficient care for the maintenance of adequate accounting records in accordance with the provisions of this Act for safeguarding the assets of the Company and for preventing and detecting fraud and other irregularities;
- (e) The Directors had prepared the Annual Accounts on a going concern basis;

19. BOARD MEETING:

Notice of Meeting is prepared and circulated in advance to the Directors as required under Secretarial Standards. During the year, Four Board Meetings were convened and held on 20th July, 2022, 22nd September, 2022, 19th December, 2022 and 14th March, 2023.

20. BOARD EVALUATION:

As per the Ministry of Corporate Affairs, Government of India vide notification dated 05th June, 2015, Government Companies are exempted from the provision of sub-section 3 clause (p) of section 134 of the Companies Act, 2013. Your company being a Government Company, provision of Board Evaluation is not applicable.

21. AUDIT COMMITTEE:

During the year under review, the provisions pursuant to Section 178 of the Companies Act, 2013 read with Rule (6) of the Companies (Meetings of Board and its Powers) Rules, 2014 were not applicable to the company in context of Audit Committee.

22. NOMINATION AND REMUNERATION COMMITTEE:

During the year under review, the provisions pursuant to Section 178 of the Companies Act, 2013 read with rule (6) of the Companies (Meetings of Board and its Powers) Rules, 2014 were not applicable to the company in context of Nomination and Remuneration Committee.

23. INTERNAL AUDIT & CONTROLS:

The Company has in place adequate internal financial controls commensurate with the size and nature of its business. Internal Audit Reports given by M/s Trupal J. Patel & Associates, Chartered Accountants, Internal Auditors of the company are self-explanatory and hence do not call for any further comments. The Services of M/s Trupal J. Patel, Chartered Accountants were found satisfactory for F. Y. 2022-23 and Board reappointed them for a further period of one year for F. Y. 2023-24.

24. AUDITORS:

The Auditors, M/s. NAUTAM R VAKIL & CO (FRN: 106980W), Chartered Accountant, Ahmedabad, were appointed as Statutory Auditors of the Company for the Financial Year 2023-24 by the Comptroller and Auditor General of India, vide Letter No. CA.V/COY/GUJARAT, BRCL (1)/716 dated 18/09/2023.

25. AUDITORS' REPORT:

The Auditors' Report does not contain any qualification. Notes to Accounts and Auditors

remarks in their report are self-explanatory and do not call for any further comments.

26. COMMENTS OF THE COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA UNDER SECTION 143(6) (b) OF THE COMPANIES ACT, 2013:

The Company has received letter no. A.M.G.-1/Accounts/BRCL/2022-23/O.W. 1350 dated 6th December, 2023 from Comptroller and Auditor General of India on the audited accounts of the company for the year ended on 31/03/2023 stating that nothing significant has come to the knowledge which would give raise to any comment upon statutory Auditors' Report by C&AG.

27. SECRETARIAL AUDIT REPORT:

The Company has obtained Secretarial Audit Report in Form No. MR-3 pursuant to Section 204(1) of the Companies Act, 2013 and Rule (9) of the Companies (Appointment and Remuneration of Managerial Personnel) Rules, 2014 from M/s Kiran Patel and Associates, a Practicing Company Secretary. A copy of the Report is annexed to this Directors Report.

28. CORPORATE SOCIAL RESPONSIBILITY (CSR):

During the year under review, the provision of Corporate Social Responsibility under Section 135 of the Companies Act, 2013 is applicable to the company.

The Companies net worth is greater than of Rs. 500 Crores as on 31st March, 2023, on the basis of net worth criteria CSR applicability triggered to the company from the financial year 2023-24.

As per Section 135 of the Companies Act, 2013, a company, meeting the applicability threshold, needs to spend at least 2% of its average net profit for the immediately preceding three financial years on corporate social responsibility (CSR) activities up to 31st March, 2024.

The areas for CSR activities are eradication of hunger and malnutrition, promoting education, art and culture, healthcare, sanitation, destitute care and rehabilitation, environment sustainability, disaster relief and rural development projects.

29. RISK MANAGEMENT POLICY:

BRCL shall identify the possible risks associated with its business and commits itself to put

in place a Risk Management Framework to address the risk involved on an ongoing basis to ensure achievement of the business objective without any interruptions. BRCL shall optimize the risks involved by managing their exposure and bringing them in line with the acceptable risk appetite of the Company.

30. CONSERVATION OF ENERGY, TECHNOLOGY ABSORPTION AND FOREIGN EXCHANGE EARNINGS AND OUTGO:

The Company has no activities which required disclosure relating to conservation of energy or technology absorption as it is not a Manufacturing Company. There has been no foreign exchange earnings or outgo during the year under review.

31. MATERIAL CHANGES AND COMMITMENTS, IF ANY, AFFECTING THE FINANCIAL POSITION BETWEEN THE END OF THE FINANCIAL YEAR AND THE DATE OF THE REPORT:

No material changes and commitments have occurred after the close of the financial year till the date of this report, which affect the financial position of the Company other than those specifically highlighted in this report. However the Company has allotted 49,01,961 and 16,27,50,000 equity shares of Rs. 10/- each on 01st August, 2023 and 21st August, 2023 to GUJARAT RAIL INFRASTRUCTURE DEVELOPMENT CORPORATION LIMITED [G-RIDE] and GUJARAT INDUSTRIAL DEVELOPMENT CORPORATION [GIDC] respectively.

32. DETAILS OF SIGNIFICANT AND MATERIAL ORDERS PASSED BY THE REGULATORS OR COURTS OR TRIBUNALS IMPACTING THE GOING CONCERN STATUS AND COMPANY'S OPERATIONS IN FUTURE:

No significant or material orders were passed by the regulator or court or tribunals which impact the going concern status and Company's operations in future.

33. OBLIGATION OF COMPANY UNDER THE SEXUAL HARASSMENT OF WOMEN AT WORKPLACE (PREVENTION, PROHIBITION AND REDRESSAL) ACT, 2013:

In order to prevent sexual harassment of women at work place a new act The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013 has been notified on 9th December, 2013. Under the said Act every company is required to

set up an Internal Complaints Committee to look into complaints relating to sexual harassment at work place of any women employee.

Company will adopt a policy in future for prevention of Sexual Harassment of Women at workplace and will set up Committee for implementation of said policy in future. During the financial year under review, Company has not received any complaint of harassment.

34. PARTICULARS OF CONTRACTS OR ARRANGEMENTS WITH RELATED PARTIES:

During the year under review, contracts and arrangements with related parties under Section 188(1) of the Companies Act, 2013, are reported in the Audited Balance sheet of the Company.

35. DETAILS OF APPLICATION MADE OR PROCEEDING PENDING UNDER INSOLVENCY AND BANKRUPTCY CODE, 2016:

During the period under review, there were no applications made or proceedings pending in the name of the company under the Insolvency Bankruptcy Code, 2016.

36. DETAILS OF DIFFERENCE BETWEEN VALUATION AMOUNT ON ONE TIME SETTLEMENT AND VALUATION WHILE AVAILING LOAN FROM BANKS AND FINANCIAL INSTITUTIONS:

During the period under review, there has been no one time settlement of Loans taken from Banks and Financial Institutions.

37. TRANSFER OF AMOUNTS TO INVESTOR EDUCATION AND PROTECTION FUND:

In terms of Section 124 of the Companies Act, 2013, read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, shares of the Company in respect of which dividend entitlements have remained unclaimed or unpaid for seven consecutive years or more, are required to be transferred by the Company to the Investor Education and Protection Fund (IEPF) of the Government of India. There were no such instances requiring compliance with the same.

38. STATEMENT ON COMPLIANCE WITH APPLICABLE SECRETARIAL STANDARDS:

During the year under review, the Company has complied with all the applicable provisions of Secretarial Standard – 1 and Secretarial Standard – 2 issued by the Institute of Company Secretaries of India and notified by the Ministry of Corporate Affairs.

39. ACKNOWLEDGEMENTS:

Your Directors express their warm wish to place on record their sincere appreciation to the Co-Operation extended by the Registrar of Companies, Comptroller & Auditor General of India and Statutory Auditors. The Directors are also grateful to the Government of Gujarat, G-RIDE, MSIL, GIDC Officers and staff of the Company for their co-operation and look forward for their continued support.

**For & on behalf of the Board of Directors of
BAHUCHARAJI RAIL CORPORATION LIMITED**

Place : Gandhinagar

Date : 28/12/2023

**Sd/-
SANTOSH KUMAR
DIRECTOR & CEO
[DIN: 07854179]**

**Sd/-
JWALESH ZAVERI
DIRECTOR
[DIN: 09507224]**

SECRETARIAL AUDIT REPORTFOR THE FINANCIAL YEAR ENDED ON 31st MARCH, 2023*[Pursuant to section 204(1) of the Companies Act, 2013 and rule No.9 of the Companies (Appointment and Remuneration Personnel) Rules, 2014]*

To,

The Members,

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

Block No. 6, 7th Floor, Udyog Bhavan

Sector-11, Gandhinagar-382 011

We have conducted the secretarial audit of the compliance of applicable statutory provisions and the adherence to good corporate practices by Bahucharaji Rail Corporation Limited. The Secretarial Audit was conducted in a manner that provided us a reasonable basis for evaluating the corporate conducts/statutory compliances and expressing my opinion thereon.

Based on our verification of the Company's books, papers, minute books, forms and returns filed and other records maintained by the Company and also the information provided by the Company, its officers, agents and authorized representatives during the conduct of secretarial audit, we hereby report that in our opinion, the Company has during the audit period covering the financial year ended on 31st March, 2023 complied with the statutory provisions listed hereunder and also that the Company has proper Board-processes and compliance-mechanism in place to the extent, in the manner and subject to the reporting made hereinafter:

We have examined the books, papers, minute books, forms and returns filed and other records maintained by the Company for the financial year ended on 31st March, 2023 according to the provisions of:

- (i) The Companies Act, 2013 (the Act) and the rules made thereunder;
- (ii) The Securities Contracts (Regulation) Act, 1956 ('SCRA') and the rules made thereunder;
- (iii) The Depositories Act, 1996 and the Regulations and Bye-laws framed there-under are complied with to the extent applicable. Further, MCA vide notification dated 22nd January, 2019 exempted government companies from dematerialization of shares and hence the same is not applicable to the Company.
- (iv) Foreign Exchange Management Act, 1999 and the rules and regulations made there-under

to the extent of Foreign Direct Investment, Overseas Direct Investment and External Commercial Borrowings.

- (v) The following Regulations and Guidelines prescribed under the Securities and Exchange Board of India Act, 1992 ('SEBI Act') are not applicable to the Company during the period under review.
- (a) The Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011;
 - (b) The Securities and Exchange Board of India (Prohibition of Insider Trading) Regulations, 1992;
 - (c) The Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2009;
 - (d) The Securities and Exchange Board of India (Employee Stock Option Scheme and Employee Stock Purchase Scheme) Guidelines, 1999;
 - (e) The Securities and Exchange Board of India (Issue and Listing of Debt Securities) Regulations, 2008;
 - (f) The Securities and Exchange Board of India (Registrars to an Issue and Share Transfer Agents) Regulations, 1993 regarding the Companies Act and dealing with client;
 - (g) The Securities and Exchange Board of India (Delisting of Equity Shares) Regulations, 2009; and
 - (h) The Securities and Exchange Board of India (Buyback of Securities) Regulations, 1998;
- (vi) I further report that, having regard to the compliance system prevailing in the Company and on examination of the relevant documents and records in pursuance thereof on test-check basis, the Company has complied with the following laws applicable specifically to the Company:
- (i) The Contract Labour (Regulation & Abolition) Act, 1970
- I have also examined compliance with the applicable clauses of the following:
- (i) Secretarial Standards issued by The Institute of Company Secretaries of India.

- (ii) The Company being unlisted is not required to comply with the Listing Agreements of Stock Exchange(s) / SEBI (LODR) Regulations, 2015.

During the period under review, the Company has generally complied with the provisions of the Act, Rules, Regulations, Guidelines, Standards, etc. mentioned above subject to our following observations:

1. We further report that the the Company is in process of appointing a suitable candidate as Company Secretary as Key Managerial Personnel (KMP) u/s 203 of the Companies Act, 2013 as per the information provided by the management during the period under review
2. The vacancy occurred due to resignation of Smt. Kavita Shah on 29.03.2022 as Women Director is yet to be filled by the company. The Company is in the process of appointing a Women Director as per the requirement of Section 149 of Companies Act, 2013 as informed by the management during the period under review.

We further report that

The Board of Directors of the Company is duly constituted as on 31st March, 2023 subject to our above observation. The changes in the composition of the Board of Directors that took place during the period under review were carried out in compliance with the provisions of the Act.

Adequate notice is given to all directors to schedule the Board Meetings, agenda and detailed notes on agenda were sent at least seven days in advance and in case of shorter notice required compliance as per Companies Act, 2013 has been ensured.

Majority decision is carried through and recorded as part of the minutes.

We further report that

There are adequate systems and processes in the company commensurate with the size and operations of the company to monitor and ensure compliance with applicable laws, rules, regulations and guidelines.

We further report that

1. During the audit period the Company has:-

- (i) allotted 3,67,73,831 Equity Shares of Rs. 10 each aggregating to Rs. 36,77,38,310 by passing the Board Resolution by circulation on 22.04.2022 to existing shareholder on right basis.

- (ii) allotted 1,96,07,843 Equity Shares of Rs. 10 each aggregating to Rs.19,60,78,430 by passing the Board Resolution in the Board meeting held on 20.07.2022 to existing shareholder on right basis.
- (iii) allotted 95,84,313 Equity Shares of Rs. 10 each aggregating to Rs. 9,58,43,130 by passing the Board Resolution in the Board meeting held on 22.09.2022 to existing shareholder on right basis.
- (iv) allotted 4,92,39,215 Equity Shares of Rs. 10 each aggregating to Rs. 49,23,92,150 by passing the Board Resolution by circulation on 03.11.2022 to existing shareholder on right basis.

For K. K. Patel & Associates

Date : 30/09/2023
Place : Gandhinagar

CS Kiran Kumar Patel
Proprietor
FCS No.6384, CP No.6352
UDIN:F006384E001145049

(This report is to be read with our letter of even date which is annexed as **Annexure A (Page 5)** and forms an integral part of this report.)

'Annexure A'

To,

The Members,

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

Block No. 6, 7th Floor, Udyog Bhavan

Sector-11, Gandhinagar-382 011

Our report of even date is to be read along with this letter.

1. Maintenance of secretarial record is the responsibility of the management of the Company. Our responsibility is to express an opinion on these secretarial records based on our audit.
2. We have followed the audit practices and processes as were appropriate to obtain reasonable assurance about the correctness of the contents of the Secretarial records. The verification was done on test basis to ensure that correct facts are reflected in secretarial records. We believe that the processes and practices, we followed provide a reasonable basis for our opinion.
3. We have not verified the correctness and appropriateness of financial Statements, financial records and Books of Accounts of the company.
4. The compliance of the provisions of Corporate and other applicable laws, rules, regulations, standards is the responsibility of management. Our examination was limited to the verification of procedures on test basis.
5. The Secretarial Audit report is neither an assurance as to the future viability of the company nor of the efficacy or effectiveness with which the management has conducted the affairs of the company.

For K. K. Patel & Associates

Date : 30/09/2023
Place : Gandhinagar

CS Kiran Kumar Patel

Proprietor

FCS No.6384, CP No.6352

UDIN:F006384E001145049

ANNEXURE – I

Office of the Principal Accountant General (Audit)-II, Gujarat

No.AMG-1/Accounts/BRCL/2022-23/0W1350/06.12.2023

To,

Managing Director,

Bahucharaji Rail Corporation Limited,

7th Floor, Block No-6, Udyog Bhavan

Sector-11, Gandhinagar-382011

Subject: Comment of the Comptroller and Auditor General of India under Section 143(6)(b) of the Companies Act, 2013 on the financial statements of Bahucharaji Rail Corporation Limited for the year ended 31 March 2023.

Sir,

Please find enclosed nil comment certificate of the Comptroller and Auditor General of India under Section 143(6)(b) of the Companies Act, 2013 on the financial statements of Bahucharaji Rail Corporation Limited for the year ended 31 March 2023 for being placed before Annual General Meeting of the Company.

Under Section 143(6) of the Companies Act, 2013 the comments of the Comptroller and Auditor General of India are required to be sent by Company to every person entitled to copies of audited financial statements under Section 136(1) of the Companies Act, 2013 and also to be placed before the Annual General Meeting of the Company at the same time and in the same manner as the Statutory Auditor's Report of the Company. The date of placing the Report of the Comptroller and Auditor General of India before the Annual General Meeting may please be intimated to this office.

Six copies of the printed accounts may please be sent to this office for our use and record.

Receipt of this letter with its enclosures may please be acknowledged.

Yours faithfully,

Sr. Dy. Accountant General(AMG-I)

Encl: As above

COMMENTS OF THE COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA UNDER SECTION 143(6)(b) OF THE COMPANIES ACT, 2013 ON THE FINANCIAL STATEMENTS OF BAHUCHARAJI RAIL CORPORATION LIMITED FOR THE YEAR ENDED 31 MARCH 2023

The preparation of financial statements of the Bahucharaji Rail Corporation Limited for the year ended 31 March 2023 in accordance with the financial reporting framework prescribed under the Companies Act, 2013 (Act) is the responsibility of the Management of the Company. The Statutory Auditors appointed by the Comptroller and Auditor General of India under Section 139 (5) of the Act are responsible for expressing opinion on the financial statements under Section 143 of the Act based on independent audit in accordance with the Standards on Auditing prescribed under Section 143 (10) of the Act. This is stated to have been done by them vide their Audit Report dated 29 September 2023.

I, on behalf of the Comptroller and Auditor General of India, have conducted a supplementary audit of the financial statements of Bahucharaji Rail Corporation Limited for the year ended 31 March 2023 under Section 143(6)(a) of the Act, This supplementary audit has been carried out independently without access to the working papers of the Statutory Auditors and is limited primarily to inquiries of the Statutory Auditors and Company personnel and a selective examination of some of the accounting records.

On the basis of my audit nothing significant has come to my knowledge which would give rise to any comment upon or supplement to Statutory Auditor's Report.

For and on behalf of the
Comptroller and Auditor General of India

Sd/-

(Saurav Kumar Jaipuriyar)

Principal Accountant General (Audit-II), Gujarat

Place: Ahmedabad

Date: 06/12/2023

INDEPENDENT AUDITORS' REPORT

**TO THE MEMBERS OF
BAHUCHARAJI RAIL CORPORATION LIMITED**

Report on the Financial Statements

Opinion

We have audited the accompanying financial statements of **BAHUCHARAJI RAIL CORPORATION LIMITED** ('the Company'), which comprise the Balance Sheet as at March 31, 2023, and the Statement of Profit and Loss (including Other Comprehensive Income), Statement of Changes in Equity and the Statement of cash flows for the year then ended, notes to the financial statements, including a summary of significant accounting policies and other explanatory information (herein after referred to as "financial statements").

In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid financial statements give the information required by the Companies Act, 2013, as amended (the Act) in the manner so required and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India including Indian Accounting Standards (Ind AS), of the state of affairs of the Company as at March 31, 2023, and its financial performance including other comprehensive income, changes in equity and cash flows for the year ended on that date.

Basis For Opinion

We conducted our audit in accordance with the Standards on Auditing (SAs) specified under section 143(10) of the Companies Act, 2013. Our responsibilities under those Standards are further described in the Auditor's Responsibilities for the Audit of the Financial Statements section of our report. We are independent of the Company in accordance with the Code of Ethics issued by the Institute of Chartered Accountants of India together with the ethical requirements that are relevant to our audit of the financial statements under the provisions of the Companies Act, 2013 and the Rules thereunder, and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the Code of Ethics. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our opinion on the Financial Statements.

Responsibilities of Management and Those Charged with Governance for the Financial Statements

The Company's Board of Directors is responsible for the matters stated in Section 134(5) of the Companies Act 2013 ("the Act") with respect to the preparation of these financial statements that give a true and fair view of the financial position, financial performance, total comprehensive income, changes in equity and cash flows of the Company in accordance with the accounting principles generally accepted in India, including the Indian Accounting Standards (Ind AS) specified under Section 133 of the Act, read with Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended.

This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding of the assets of the Company and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

In preparing the financial statements, management is responsible for assessing the Company's ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless management either intends to liquidate the Company or to cease operations, or has no realistic alternative but to do so.

Those Board of Directors are also responsible for overseeing the Company's financial reporting process.

Auditor's Responsibilities for the Audit of the Financial Statements

Our objectives are to obtain reasonable assurance about whether the financial statements as a whole are free from material misstatement, whether due to fraud or error, and to issue an auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance but is not a guarantee that an audit conducted in accordance with SAs will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the basis of these financial statements.

As part of an audit in accordance with SAs, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also:

- Identified and assessed the risks of material misstatement of the financial statements, whether due to fraud or error, design and also performed audit procedures responsive to those risks and obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.
- Obtained an understanding of internal controls relevant to the audit in order to design audit procedures that are appropriate in the circumstances. Under section 143(3)(I) of the Companies Act, 2013, we are also responsible for expressing our opinion on whether the company has adequate internal financial controls system in place and the operating effectiveness of such controls.
- Evaluated the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by management.
- Concluded on the appropriateness of management's use of the going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the Company's ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the financial statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the audit evidence obtained up to the date of our auditor's report. However, future events or conditions may cause the Company to cease to continue as a going concern.
- Evaluated the overall presentation, structure and content of the financial statements including the disclosures, and whether the financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related safeguards.

From the matters communicated with those charged with governance, we determine those matters that were of most significance in the audit of the financial statements of the current period and are therefore the key audit matters. We describe these matters in our auditor's report unless law or regulation precludes public disclosure about the matter or when, in extremely rare circumstances, we determine that a matter should not be communicated in our report because the adverse consequences of doing so would reasonably be expected to outweigh the public interest benefits of such communication.

Report on Other Legal and Regulatory Requirements

1. As required by the Companies (Auditor's Report) Order, 2020 ("the Order") issued by the Central Government of India in terms of Section 143(11) of the Act, we give in "**Annexure A**" a statement on the matters specified in paragraphs 3 and 4 of the Order, to the extent applicable.
2. In terms of Section 143(5) of the Companies Act, 2013, we give in **Annexure 'C'** a statement on the directions issued under the aforesaid section by the Comptroller and Auditor General of India.
3. As required by Section 143(3) of the Act, we report that:
 - a) We have sought and obtained all the information and explanations which to the best of our knowledge and belief were necessary for the purposes of our audit of the aforesaid financial statements.
 - b) In our opinion, proper books of account as required by law relating to preparation of the aforesaid financial statements have been kept by the Company so far as it appears from our examination of those books.
 - c) The Balance Sheet, the Statement of Profit and Loss including Statement of other

comprehensive in come and the Statement of Changes in equity and the Cash Flow Statement dealt with by this Report are in agreement with the relevant books of account maintained for the purpose of financial statement.

- d) In our opinion, the aforesaid financial statements comply with the Indian Accounting Standards (Ind AS) specified under Section 133 of the Act, read with Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended.
- e) The company being Government Company, provisions of sub section 2 of section 164 of the Companies Act, 2013 are not applicable as per Notification No.G.S.R.463 [E] dated 5th June, 2015 of Ministry of Corporate Affairs.
- f) With respect to the adequacy of the internal financial controls over financial reporting of the Company and the operating effectiveness of such controls, refer to our separate report in “**Annexure B**”; and
- g) The company being Government Company, provisions of sub section 16 of section 197 of the Companies Act, 2013 are not applicable as per Notification No.G.S.R.463 [E] dated 5th June, 2015 of Ministry of Corporate Affairs.
- h) With respect to the other matters to be included in the Auditor's Report in accordance with Rule 11 of the Companies (Audit and Auditors) Rules, 2014, as amended, in our opinion and to the best of our knowledge and belief and according to the information and explanations given to us:
 - 1. The Company does not have any pending litigations as on Balance Sheet dated March 31, 2023.
 - 2. The Company has made provision, as required under the applicable law or Indian Accounting Standards, for material foreseeable losses, if any, on long-term contracts including derivative contracts.
 - 3. There has been no delay in transferring amounts, required to be transferred, to the Investor Education and Protection Fund by the Company.
 - 4. (a) The management has represented that, to the best of its knowledge and belief, no funds have been advanced or loaned or invested (either from borrowed funds or share premium or any other sources or kind of funds) by the Company to or in any other persons or entities, including foreign entities (“Intermediaries”), with understanding, whether recorded in writing or otherwise, that the intermediary shall whether,

- directly or indirectly lend or invest in other persons or entities identified in any manner whatsoever by or on behalf of the company (“Ultimate Beneficiaries”) or
- provide any guarantee, security or the like to or on behalf of the Ultimate Beneficiaries.

(b) The management has represented, that, to the best of its knowledge and belief, no funds have been received by the Company from any persons or entities, including foreign entities (“Funding Parties”), with the understanding, whether recorded in writing or otherwise, that the Company shall, whether,

- directly or indirectly lend or invest in other persons or entities identified in any manner whatsoever by or on behalf of the Funding Party (“Ultimate Beneficiaries”) or
- provide any guarantee, security or the like from or on behalf of the Ultimate Beneficiaries: and

(C) Based on such audit procedures as considered reasonable and appropriate in circumstances, nothing has come to our notice that has caused us to believe that the representations under sub clause (a) and (b) above, contain any material misstatement.

5. The company has not declared or paid any dividend during the year and has not proposed final dividend for the year.
 - i. As per the Section 203(1) of Companies Act, 2013 read with Rule 8 of the Companies (appointment and Remuneration of Managerial Personnel) Rules 2014 which required appointment of Key Managerial Personnel (KMP). The company has not appointed full time Qualified Company Secretary till the date of report. However, as per the information and explanation provided by management, Company has availed services of Practicing Company Secretary.

For Shah & Dalal
Chartered Accountants
[FRN: 109432W]

Sd/-
Malay Dalal
Partner
M. No. : 036776

Place : Ahmedabad
Date : 29/09/2023

UDIN:23036776BGWJJZ4551

“ANNEXURE A” TO THE AUDITORS' REPORT

(Referred to in paragraph 1 under 'Report on other legal and regulatory requirement section of our Report of even date)

The Annexure referred to in Independent Auditors; Report to the members of **BAHUCHARAJI RAIL CORPORATION LIMITED** (“the Company”) on the financial statements for the year ended 31 March 2023.

We report that:

(I) In respect of Fixed Assets:

(a) The Company has maintained proper records showing full particulars, including quantitative details and situation of Property, Plant and Equipment if any.

(b) The Company has maintained proper records showing full particulars of Right of Use Asset in Financial Statement.

(C) According to the information and explanations are given to us and on the basis of our examination of the records of the Company, the title deeds of immovable properties are held in the name of the Company.

(d) According to the information and explanations are given to us and on the basis of our examination of the records of the Company, the company has not revalued its Property, Plant & Equipment (including Right of Use assets) or intangible assets or both during the year.

(e) According to the information and explanation given to us, there are no proceedings have been initiated and/or are pending against the company for holding any Benami property under the Benami Transactions (Prohibition) Act, 1988 (45 of 1988) and rules made there under. Hence, this clause is not applicable to the company.

(ii) The company does not have any inventory therefore this clause is not applicable.

(iii) According to information and explanations given to us and on the basis of our examination of the record of the company during the year the company has not made investment in, provided any guarantee or security or granted any loans or advances in the nature of loans, secured or unsecured to companies, firms, Limited Liability Partnership or other parties covered in the register maintained under section 189 of the Companies Act,

2013. Therefore, clause (iii) of the paragraph 3 of the order is not applicable to the company.

- (iv) According to the information and explanation given to us, the Company has not granted any loans, nor given any guarantees and securities u/s 185 and 186 of the Companies Act, 2013. Thus, the clause (iv) of the paragraph 3 of the order is not applicable to the company.
- (v) According to the information and explanation given to us, the Company has not accepted any deposits or amounts which are deemed to be deposits during the year as per the directives issued by Reserve Bank of India and within the meaning of provision of section 73 to 76 and other relevant provisions of the Companies Act, 2013 and the rules framed there under where applicable. Thus, the clause (v) of the paragraph 3 of the order is not applicable to the company.
- (vi) The maintenance of cost records specified by the Central Government under section 148(1) of the Companies Act, 2013 is not applicable to this Company. Thus, the clause (vi) of the paragraph 3 of the order is not applicable to the company.
- (vii) According to the information and explanation given to us, in respect of statutory dues:
 - (a) The Company had been regular in depositing undisputed statutory dues, including, Income Tax, Goods and Service Tax, and other material statutory dues applicable to the appropriate authorities.
 - (b) There is no dispute with revenue authorities regarding any duty or tax payable.
- (viii) According to the information and explanations given to us and on the basis of our examination of the records of the Company, the Company has not surrendered or disclosed any transactions, previously unrecorded as income in the books of account, in the tax assessments under the Income Tax Act, 1961 as income during the year.
- (ix) (a) The company does not have any loans or borrowings from any financial institutions, banks, government, or debenture holders during the year. Thus, the clause (ix) of paragraph 3 of the order is not applicable to the company.
 - (b) According to the information and explanations given to us and on the basis of our examination of the records of the Company, the Company has not been declared a willful defaulter by any bank or financial institution or government or government authority.
 - (C) According to the information and explanations given to us by the management, the

Company has not obtained any term loans during the year. Accordingly, clause 3(ix)(c) of the Order is not applicable to the Company.

(d) According to the information and explanations given to us and on an overall examination of the balance sheet of the company, we report that no funds raised on short-term basis have been used for long-term purposes by the company.

e) According to the information and explanations given to us and on an overall examination of the financial statements of the company, we report that the company has not taken any funds from any entity or person on account of or to meet the obligations of its subsidiary as defined under Companies Act, 2013. The Company does not hold any investment in any associate companies or joint ventures as defined under Companies Act, 2013.

(f) According to the information and explanations given to us and procedures performed by us, we report that the company has not raised loans during the year on the pledge of securities held in its subsidiary as defined under Companies Act, 2013.

(x) (a) To the best of our knowledge and according to the information and explanation given to us, during the year Company has not raised money by way of Initial Public Offer and/or Further Public Offer (including Debt Instrument) and also company has not obtained any Term loan and therefore this clause is not applicable to the company. However, company has utilized the monies raised by way of issue of equity shares for the purpose for which they were raised.

(b) According to the information and explanations given to us and based on our examination of the records of the Company, the company has not made any preferential allotment or private placement of shares or convertible debentures (fully, partially or optionally convertible) during the year under review in terms of provisions of section 42 and section 62 of the Companies Act, 2013. Accordingly, clause 3(x)(b) of the Order is not applicable.

(xi) (a) Based on examination of the books and records of the Company and according to the information and explanations given to us, no fraud by the Company and no fraud on the Company by its officers or employees has been noticed or reported during the period.

(b) According to the information and explanations given to us, no report under sub-section

(12) of Section 143 of the Companies Act, 2013 has been filed by the auditors in Form ADT-4 as prescribed under rule 13 of Companies (Audit and Auditors) Rules, 2014, as amended with the Central Government.

(c) According to information and explanations given to us, there is no whistle blower complaint has been received by the company during the year.

(xii) According to the information and explanations given to us, the Company is not a Nidhi Company. Accordingly, clause 3(xii) of the Order is not applicable.

(xiii) In our opinion and according to the information and explanation given to us, the Company is in compliance with section 188 and 177 of the Companies Act, 2013, wherever applicable. For all transaction with the related parties and the details of related parties' transactions have been disclosed in the financial statements etc., as required by the applicable Indian Accounting Standards.

(xiv) (a) Based on information and explanations provided to us and our audit procedures, in our opinion, the Company has an internal audit system commensurate with the size and nature of its business.

(b) We have considered the internal audit reports of the Company issued till date for the period under audit.

(xv) In our opinion and according to the information and explanation given to us, during the period Company has not entered into any non-cash transaction with its directors or persons connected with them during the period.

(xvi) (a) & (b) The company is not required to be registered under section 45-IA of the Reserve Bank of India Act, 1934. Accordingly, provision of clause 3 (xvi) (a) & (b) of the Order is not applicable to the Company.

(c) & (d), The Company is not a Core Investment Company (CIC) as defined in the regulations made by the Reserve Bank of India. Accordingly, clause 3(xvi)(c) and clause 3(xvi)(d) of the Order is not applicable.

xvii. The Company has not incurred cash losses in the current and in the immediately preceding financial year.

xviii. There has not been any resignation of the statutory auditors during the period.

- xix. On the basis of the financial ratios, ageing and expected dates of realization of financial assets and payment of financial liabilities, other information accompanying the financial statements, Plans of the Board of Directors and management we are of the opinion that no material uncertainty exists as on the date of the audit report, that the company is capable of meeting its liabilities existing at the date of balance sheet as and when they fall due within a period of one year from the balance sheet date.
- xx. According to information and explanation given to us, unspent amount which is required to be transferred to a Fund specified in Schedule VII to the Companies Act in compliance with second proviso to sub section (5) of Section 135 of the Said Act is not applicable to the company. Accordingly, clauses 3(xx)(a) and 3(xx)(b) of the Order are not applicable.
- xxi. According to information and explanation given to us, Company does not have any Associate, Joint Venture Company. Thus, the clause (xxi) of the paragraph 3 of the order is not applicable to the company.

For Shah & Dalal
Chartered Accountants
[FRN: 109432W]

Sd/-
Malay Dalal
Partner

M. No. : 036776

Place : Ahmedabad
Date : 29/09/2023

UDIN:23036776BGWJJZ4551

Annexure “B” TO THE INDEPENDENT AUDITOR'S REPORT

(Referred to in paragraph 3(f) under 'Report on other legal and regulatory requirement section of our report of even date)

Report on the Internal Financial Controls Over Financial Reporting

Report on the Internal Financial Control under clause (i) of Sub section 3 of Section 143 of the companies Act, 2013 ('the Act').

We have audited the Internal financial controls over financial reporting **BAHUCHARAJI RAIL CORPORATION LIMITED** (“the Company”) as on 31st March 2023 in conjunction with our audit of the financial statements of the company for the year ended on that date.

MANAGEMENT'S RESPONSIBILITY FOR INTERNAL FINANCIAL CONTROLS

The Company's Board of Director is responsible for establishing and maintaining internal financial controls based on the internal control over financial reporting criteria established by the Company considering the essential component of internal control stated in the guidance note on audit of Internal Financial Controls over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India (ICAI). These responsibilities include the design implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the orderly and efficient conduct of its business, including adherence to company's policies, the safeguarding of its assets, the prevention and detection of frauds and errors, the accuracy and completeness of the accounting records, and the timely preparation of reliable financial information, as required under the Companies Act, 2013.

AUDITOR'S RESPONSIBILITY

Our responsibility is to express an opinion on the Company's Internal financial controls over financial reporting based on our audit. We conducted our audit in accordance with the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting (the “Guidance Note”) issued by the ICAI and the standards on auditing prescribed under Section 143(10) of the Companies Act, 2013, to the extent applicable to an audit of internal financial controls, both applicable to an audit of Internal Financial Controls and, both issued by ICAI. Those Standards and the Guidance Note require that we comply with ethical requirement and plan and perform the audit to obtain reasonable assurance about whether adequate financial controls over financial reporting were established and maintained and if such controls operated effectively in

all material respects.

Our audit involves performing procedures to obtain audit evidence about the adequacy of the internal financial controls system over financial reporting and their operating effectiveness.

Our audit of internal financial controls over financial reporting included obtaining an understanding of internal financial controls over financial reporting, assessing the risk that a material weakness exists, and testing and evaluating the design and operating effectiveness of internal control based on the assessed risk. The procedure selected depend on auditor's judgment, including the assessment of the risks of material misstatement of the financial statements, whether due of fraud or error.

We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion on the Company's internal financial controls system over financial reporting.

MEANING OF INTERNAL FINANCIAL CONTROLS OVER FINANCIAL REPORTING

A company's internal financial controls over financial reporting is a process designed to provide reasonable assurance regarding the reliability of financial reporting and the preparation of financial statements for external purposes in accordance with generally accepted accounting principles. A company's internal financial control over financial reporting includes those policies and procedures that:

1. pertain to the maintenance of records that, in reasonable detail, accurately and fairly reflect the transactions and dispositions of the assets of the company;
2. provide reasonable assurance that transaction are recorded as necessary to permit preparation of financial statement in accordance with generally accepted accounting principles, and that receipt and expenditures of the company are being made only in accordance with authorizations of management and directors of the company; and
3. provide reasonable assurance regarding prevention or timely detection of unauthorized acquisition, use, or disposition of the company's assets that could have a material effect on the financial statements.

INHERENT LIMITATION OF INTERNAL FINANCIAL CONTROLS OVER FINANCIAL REPORTING

Because of the inherent limitation of internal financial controls over financial reporting,

including the possibility of collusion or improper management override of controls, material misstatements due to error or fraud may occur and not be detected. Also, projection of any evaluation of the internal financial controls over financial reporting to future periods are subject to the risk that the internal financial control over financial reporting may become inadequate because of changes in conditions, or that the degree of compliance with the policies or procedures may deteriorate.

OPINION

In our opinion, to the best of our information and according to the explanation given to us, the company has, in all material respects, an adequate internal financial controls system over financial reporting and such internal financial controls over financial reporting were operating effectively as at 31st March, 2023, based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls over Financial Reporting issued by The Institute of Chartered Accountant of India.

For Shah & Dalal
Chartered Accountants
[FRN: 109432W]

Sd/-
Malay Dalal
Partner
M. No. : 036776

Place : Ahmedabad
Date : 29/09/2023

UDIN:23036776BGWJJZ4551

**“Annexure C” to the Independent Auditors' Report of
Bahucharaji Rail Corporation Limited**

**To
The Members
Bahucharaji Rail Corporation Limited**

In continuation of our Independent Auditor's Report on Financial Statements of **BAHUCHARAJI RAIL CORPORATION LIMITED** (“The Company”), we have reported on Directions and Sub-directions under 143 (5) of the Companies Act, 2013 applicable for the year 2022-2023, as under:

Report under Section 143(5) of Companies Act, 2013 for the Financial Year 2022-23

(1) MAIN DIRECTION:

Sr. No.	Directions	Comments
1.	Whether the Company has system in place to process all the accounting transactions through Information Technology system? If yes, the implications of processing of accounting transactions outside IT system on the integrity of the accounts along with the financial implications, if any, may be stated.	Yes. All Accounting transactions are processed through Information Technology Systems. Therefore, there is no financial implication on the integrity of the accounts.
2.	Whether there is any restructuring of an existing loan or cases of waiver/write off of debts/loans/interest etc. made by a lender to the Company due to the Company's inability to repay the loan? If yes, the financial impact may be stated.	No waiver/write off is done during the period under Audit.
3.	Whether funds (grants/subsidy etc.) received /receivable for specific schemes from Central/State Government or its agencies were properly accounted for/utilized as per its term and conditions? List the cases of deviation.	As per the information and explanation provided to us, the Company has not received any amount for specific scheme from Central/State agencies except share capital amount received from Gujarat Industrial Development Corporation and Gujarat Rail Infrastructure Development Corporation Limited and the same is accounted properly and deposited in bank account.

(2) SECTOR SPECIFIC DIRECTIONS : INFRASTRUCTURE SECTOR

Sr. No.	Sub-Directions	Comments
1.	Whether the Company has taken adequate measures to prevent encroachment of idle land owned by it. Whether any land of the Company is encroached, under litigation, not put to use or declared surplus? Details may be provided.	As per the information and explanation provided to us, during the course of audit we have observed that the company does not have any idle land and therefore, there is no question of encroachment to the idle land as well as there is no litigation in connection to idle land.
2.	Whether the system in vogue for identification of projects to be taken up under Public Private Partnership is in line with the guidelines/ policies of the Government? Comment on deviation if any.	Not Applicable.
3.	Whether system for monitoring the execution of works vis-à-vis the milestones stipulated in the agreement is in existence and the impact of cost escalation, if any, revenues/ losses from contracts, etc., have been properly accounted for in the books.	<p>As per the information and explanation provided to us, we report as under:</p> <p>1. System for Monitoring the Execution of Works:</p> <p>a. Company has appointed Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE) in its 1st Board Meeting held on 09.01.2019 as Project Management Consultant (PMC) and the Contract for said PMC has been executed on 28.08.2020.</p> <p>b. Company therefore has an adequate system of monitoring for the project where G-RIDE is providing service as mentioned in PMC Agreement at Para 1.1, which constitute a better monitoring system for company project.</p> <p>2. Agreement Milestone Status:</p> <p>a. Company has awarded EPC Contract to Kalpataru Power Transmission Limited (KPTL) for 1st Phase of Katosan Road – Becharaji</p>

(26.6 Kms) and specified Milestone (MS) for the project as under, which are extended by issuing letter bearing reference no. G-RIDE/Transaction Advisor/2019-20/038/4662 dated 13.04.2023 to KPTL as per the Office Memorandum issued by Ministry of Finance, Department of Expenditure, Procurement Policy Division:

Sr. No.	Milestone	Completion Date as per Contract Agreement	Revised Completion Date	Remarks
1	MS-I	19-08-2020	14-02-2021	Milestone Achieved in Dec-2020
2	MS-II	19-06-2021	19-04-2022	Milestone Achieved in Feb - 2022
3	MS-III	19-10-2021	19-04-2022	Milestone Achieved in May - 2022
4	MS-IV	19-02-2022	30-08-2023	Milestone Achieved in Aug - 2023

b. Company has awarded EPC Contract to Ashoka Buildcon Limited (ABL) for 2nd Phase of Becharaji – Ranuj (38.153 Kms) and specified Milestone (MS) for the project as under:

Sr. No.	Milestone	Completion Date as per Contract Agreement	Revised Completion Date	Remarks
1	MS-I	31-08-2022	-	Milestone Achieved in May - 2022
2	MS-II	28-02-2023	-	Milestone Achieved in Feb - 2023
3	MS-III	30-07-2023	-	Milestone Achieved in July - 2023
4	MS-IV	30-11-2023	-	-

3. The Impact of Cost Escalation:
Company has adequately accounted the Escalation Amount in Books of Account claimed by the EPC Contractor during the year under report, which are as per the Contract

		Agreement and approved by the competent authority.
4.	Whether funds received/ receivable for specific schemes from central/ State agencies were properly accounted for/ utilized? List the cases of deviations.	As per the information and explanation provided to us, the Company has not received any amount for specific scheme from Central/State agencies except share capital amount received from Gujarat Industrial Development Corporation and Gujarat Rail Infrastructure Development Corporation Limited and the same is accounted properly and deposited in bank account.
5.	Whether the bank guarantees have been revalidated in time?	As per the information and explanation provided to us, the company has not availed any Bank Guarantee during the year. However, the company has received Bank Guarantees and the same has been revalidated by the Company in time.
6.	Comment on the confirmation of balances of trade receivables, trade payables, term deposits, bank accounts and cash obtained.	<p>We have obtained following Confirmations and all are in agreement with figures of Financial Statements:</p> <ol style="list-style-type: none"> 1. Bank Balance Certificate from Yes Bank and Union Bank of India. 2. Balance & Interest certificate of Deposit with GSFS. 3. Balance Confirmation of Gujarat Rail Infrastructure Development Corporation Limited. 4. Balance and Interest receivable on Mobilization advances and Trade Payables from EPC Contractor (M/s. Kalpataru Power Transmission Limited and M/s. Ashoka Buildcon Limited).

		<p>5. Cash Balance as on 31.03.2023 from Management.</p> <p>6. Balance Confirmation from Trade receivables (M/s. Maruti Suzuki India Limited) as on Balance Sheet date.</p>
7.	The cost incurred on abandoned projects may be quantified and the amount actually written-off shall be mentioned.	As per the information and explanation provided to us, there are no abandoned projects therefore this point is not applicable.

For Shah & Dalal
Chartered Accountants
[FRN: 109432W]

Sd/-
Malay Dalal
Partner

M. No. : 036776

Place : Ahmedabad

Date : 29/09/2023

UDIN:23036776BGWJJZ4551

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
(A JV of G-RIDE, GIDC & MSIL)
CIN:U45101GJ2018SGC105602
Balance Sheet as at March 31, 2023

(Amount in ₹)

Particulars	Notes	As at March 31, 2023	As at March 31, 2022
ASSETS			
NON-CURRENT ASSETS			
Property, Plant and Equipment	4	10 06 19 873	--
Intangible Assets	5	348 19 91 479	--
Right of Use Asset - Leasehold Office	6	53 42 360	68 68 749
Capital Work-in-Progress	7	8 86 32 478	6 12 04 875
Intangible Assets Under Development	8	220 57 99 177	227 51 65 960
Other Non-Current Assets	9	26 54 31 676	44 97 80 096
Income Tax Assets (Net)	13	2 48 98 729	89 88 488
TOTAL NON -CURRENT ASSETS		617 27 15 772	280 20 08 168
CURRENT ASSETS			
Financial Assets			
(i) Trade Receivable	10	8 91 24 844	13 67 99 196
(ii) Cash and Cash Equivalents	11	21 94 35 492	39 59 25 174
(iii) Other balances with banks	12	--	200 00 00 000
Other Current Assets	15	95 10 565	82 27 195
TOTAL CURRENT ASSETS		31 80 70 901	254 09 51 565
TOTAL ASSETS		649 07 86 673	534 29 59 733
EQUITY AND LIABILITIES			
EQUITY			
Equity share capital	16	612 12 24 020	496 91 72 000
Other equity	17	(5 62 76 913)	(3 04 15 030)
TOTAL EQUITY		606 49 47 107	493 87 56 970

Particulars	Notes	As at March 31, 2023	As at March 31, 2022
LIABILITIES			
NON-CURRENT LIABILITIES			
Financial liabilities			
(i) Other financial liabilities	18	7 44 62 730	7 99 04 829
Other Non-Current liabilities	19	15 95 250	1 07 250
Deferred tax liabilities (net)	20	8 49 32 680	--
TOTAL NON -CURRENT LIABILITIES		16 09 90 660	8 00 12 079
CURRENT LIABILITIES			
Financial liabilities			
(i) Trade Payable	21		
MSME		--	--
Others		20 69 40 349	30 24 49 455
Disputed Dues - MSME		--	--
Disputed Dues - Other		--	--
(ii) Other financial liabilities	22	14 42 900	13 12 625
Other current liabilities	23	5 64 65 657	2 04 28 604
TOTAL CURRENT LIABILITIES		26 48 48 906	32 41 90 684
TOTAL EQUITY AND LIABILITIES		649 07 86 673	534 29 59 733
Significant accounting policies			
See accompanying Notes to Financial Statements 1 to 47			
Notes on accounts form integral part of the financial statements			
As per our report of even date			
For Shah & Dalal		For and on behalf of the Board	
Chartered Accountants			
FRN. 109432W			
Sd/-	Sd/-	Sd/-	Sd/-
Malay Dalal	S. N. Joshi	Jwalesh Zaveri	R S Kapoor
Partner	CFO	Director	Director
Membership No. 036776		DIN: 09507224	DIN: 08303688
UDIN:23036776BGWJJZ4551			
Place: Ahmedabad	Place: Gandhinagar		
Date: September 29, 2023	Date: September 29, 2023		

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
(A JV of G-RIDE, GIDC & MSIL)
CIN:U45101GJ2018SGC105602
Statement of Profit and Loss for the year ended on March 31, 2023
 (Amount in ₹)

Particulars	Notes	For the period from April 01, 2022 to March 31, 2023	For the period from April 01, 2021 to March 31, 2022
Income			
Revenue from operations	25	20 14 22 225	43 92 45 536
Other Income	26	7 95 11 452	3 59 74 956
Total Income		28 09 33 677	47 52 20 492
Expenses			
Cost of Materials Consumed	27	19 99 03 066	44 20 47 349
Employee benefit expense, payment to contractors and consultants	28	77 93 771	30 95 806
Finance costs	29	6 10 795	3 50 532
Depreciation and amortisation expense	30	69 21 589	7 63 194
Other expenses	31	66 33 658	1 43 73 811
Total Expenses		22 18 62 879	46 06 30 692
Profit /(Loss) before exceptional item and taxes		5 90 70 798	1 45 89 800
Exceptional Item(Net off Tax)		--	--
Profit/(loss) before tax		5 90 70 798	1 45 89 800
Tax expense			
Current tax	14	--	92 28 768
Earlier Year Tax		--	77 448
Deferred Tax		8 49 32 680	--
Total Tax Expenses		8 49 32 680	93 06 216
Profit/(loss) after tax for the period		(2 58 61 882)	52 83 584

Particulars	Notes	For the period from April 01, 2022 to March 31, 2023	For the period from April 01, 2021 to March 31, 2022
Other comprehensive income			
(i) Items that will not be reclassified to profit or loss		--	--
(ii) Income tax on items that will not be reclassified to profit or loss		--	--
(iii) Items that will be reclassified to profit or loss		--	--
(iv) Income tax relating to items that will be reclassified to profit or loss		--	--
Total Other Comprehensive Income/(Loss) for the Year(Net off Tax)		--	--
Total Comprehensive Income for the period		(2 58 61 882)	52 83 584
Earnings Per Equity Share of Face Value of Rs. 10 each	32		
Basic		(0.05)	0.02
Diluted		(0.05)	0.02
Significant accounting policies			
See accompanying Notes to Financial Statements	1 to 47		
Notes on accounts form integral part of the financial statements			
As per our report of even date			
For Shah & Dalal	For and on behalf of the Board		
Chartered Accountants			
FRN. 109432W			
Sd/-	Sd/-	Sd/-	Sd/-
Malay Dalal	S. N. Joshi	Jwalesh Zaveri	R S Kapoor
Partner	CFO	Director	Director
Membership No. 036776		DIN: 09507224	DIN: 08303688
UDIN:23036776BGWJJZ4551			
Place: Ahmedabad	Place: Gandhinagar		
Date: September 29, 2023	Date: September 29, 2023		

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
CIN:U45101GJ2018SGC105602
STATEMENT OF CHANGES IN EQUITY AS ON 31/03/2023

A. EQUITY SHARE CAPITAL **(Amount in ₹)**

Particulars	Amount
As at April 1, 2021	192 37 50 000
Changes in Equity Share Capital due to prior period errors	--
Restated Balance as at April 1, 2021	--
Changes during the year 2021-22	304 54 22 000
As at March 31, 2022	496 91 72 000
Changes in Equity Share Capital due to prior period errors	--
Restated Balance as at April 1, 2022	--
Changes during the year 2022-23	115 20 52 020
As at March 31, 2023	612 12 24 020

B. OTHER EQUITY **(Amount in ₹)**

Particulars	Reserves and Surplus				Equity instruments through other comprehensive income	Total
	General Reserve	Capital Reserve	Capital redemption reserve	Retained earnings		
Balance as at April 1, 2021	-	-	-	(3 56 98 614)	-	(3 56 98 614)
(Loss)/Profit for the year	-	-	-	52 83 584	-	52 83 584
Re-measurement of defined benefit plans (net of tax)	-	-	-	-	-	-
Other comprehensive income for the year	-	-	-	-	-	-
Total comprehensive income for the year	-	-	-	(3 04 15 030)	-	(3 04 15 030)
Payment of dividend	-	-	-	-	-	-
Transfer to General reserve	-	-	-	-	-	-
Balance as at March 31, 2022	-	-	-	(3 04 15 030)	-	(3 04 15 030)
(Loss)/Profit for the year	-	-	-	(2 58 61 882)	-	(2 58 61 882)
Re-measurement of defined benefit plans (net of tax)	-	-	-	-	-	-
Other comprehensive income for the year	-	-	-	-	-	-
Total comprehensive income for the year	-	-	-	(5 62 76 913)	-	(5 62 76 913)
Payment of dividend	-	-	-	-	-	-
Transfer to General reserve	-	-	-	-	-	-
Balance as at March 31, 2023	-	-	-	(5 62 76 913)	-	(5 62 76 913)

see accompanying notes to the Financial Statements

Notes on accounts form integral part of the financial statements

As per our report of even date

**For Shah & Dalal
Chartered Accountants
FRN. 109432W**

For and on behalf of the Board

**Sd/-
Malay Dalal
Partner
Membership No. 036776
UDIN:23036776BGWJJZ4551**

**Sd/-
S. N. Joshi
CFO**

**Sd/-
Jwalesh Zaveri
Director
DIN: 09507224**

**Sd/-
R S Kapoor
Director
DIN: 08303688**

**Place: Ahmedabad
Date: September 29, 2023**

**Place: Gandhinagar
Date: September 29, 2023**

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
(A JV of G-RIDE, GIDC & MSIL)
CIN:U45101GJ2018SGC105602
Cash Flow Statement for the year ended March 31, 2023

(Amount in ₹)

Particulars	For the period from April 01, 2022 to March 31, 2023	For the period from April 01, 2021 to March 31, 2022
1 Cash Flows from Operating Activities		
Profit/(Loss) before tax as per Statement of Profit & Loss	5 90 70 798	1 45 89 800
Adjusted for:-		
Depreciation & Amortisation	69 21 589	7 63 194
Interest Income	(7 94 98 740)	(3 58 56 312)
Finance Cost	6 10 795	3 50 532
Operating Profit/(Loss) before Working Capital Changes	(1 28 95 558)	(2 01 52 786)
Adjusted for Movement in Working Capital:		
(Increase)/ Decrease in Trade Receivable	4 76 74 352	(13 67 99 196)
(Increase)/ Decrease in Financial Assets	-	2 06 30 777
(Increase)/ Decrease in Other Current Assets	(12 44 962)	1 01 66 048
(Increase)/ Decrease in Current Tax Asset	-	(89 88 488)
Increase/ (Decrease) in trade Payable	(9 55 09 107)	45 64 259
Increase/ (Decrease) in Other Current liabilities	3 60 37 053	47 55 698
Increase/ (Decrease) in Other financial liabilities	(53 11 824)	-
Increase/ (Decrease) in Other non current liabilities	14 88 000	-
Increase/ (Decrease) in Current Tax liabilities	-	(19 97 352)
Operating Profit after Working Capital Changes	(1 68 66 488)	(10 76 68 254)
Taxes Paid (Net of Refund)	(1 59 10 241)	(93 06 216)
Net cash flow from / (used in) operating activities (A)	(4 56 72 287)	(13 71 27 256)
2 Cash Flows from Investing Activities:		
(Increase)/Decrease in PPE	(5 88 24 928)	-
(Increase)/Decrease in Intangible Assets (Freight Sharing Rights)	(165 47 66 035)	-
(Increase)/Decrease in Capital Work in Progress	(7 20 13 770)	(6 04 31 613)
(Increase)/Decrease in Intangible Assets Under Development	(176 04 62 639)	(132 04 63 743)
(Increase)/Decrease in Non Current Assets	18 43 48 420	(15 14 87 017)
(Increase)/Decrease in Financial Assets	200 00 00 000	(104 00 00 000)
Interest Income	7 94 60 332	70 01 716
Net cash flow from / (used in) investing activities (B)	(128 22 58 620)	(256 53 80 657)

Particulars	For the period from April 01, 2022 to March 31, 2023	For the period from April 01, 2021 to March 31, 2022
3 Cash flow from financing activities :		
Proceeds From Share Capital	115 20 52 020	304 54 22 000
Interest Expense on account of Lease Liability	(6 10 795)	(3 50 532)
Net cash flow from / (used in) financing activities (C)	115 14 41 225	304 50 71 468
Net increase in cash and cash equivalents (A)+(B)+(C)	(17 64 89 682)	34 25 63 556
Cash and cash equivalents as at the beginning of the year	39 59 25 174	5 33 61 618
Cash and cash equivalents as at end of the year	21 94 35 492	39 59 25 174
Break up of cash and cash equivalents at the end of the year		
Balances with Banks - Current Accounts	12 94 35 492	8 15 75 227
Balance with GSFS - Liquid Deposit	9 00 00 000	31 43 49 947
	21 94 35 492	39 59 25 174
Notes:		
1. Cash and cash equivalent include cash and bank balances and deposits with the Bank (Original Maturity less than 3 months).		
2. The above Cash Flow Statement has been prepared under the 'Indirect method' as set out in the Ind AS - 7 Statement of Cash Flow.		
3. Previous year figures have been regrouped and reclassified wherever considered necessary to conform to the current year's figures.		
Notes on accounts form integral part of the financial statements		
As per our report of even date		
For Shah & Dalal	For and on behalf of the Board	
Chartered Accountants		
FRN. 109432W		
Sd/-	Sd/-	Sd/-
Malay Dalal	S. N. Joshi	Jwalesh Zaveri
Partner	CFO	Director
Membership No. 036776		DIN: 09507224
UDIN:23036776BGWJJZ4551		DIN: 08303688
Place: Ahmedabad	Place: Gandhinagar	
Date: September 29, 2023	Date: September 29, 2023	

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED**Notes to Financial Statements for the year ending on March 31, 2023****1. Corporate Information:**

Bahucharaji Rail Corporation Limited, is a special purpose vehicle (SPV) for the Railway project as per GR No.MIS-10-2017-1665-1-1 dated 05/02/2018 issued by Government of Gujarat to carry on the business of development, financing, planning and implementation of Gauge Conversion of Katosan Road-Becharaji-Chanasma-Ranuj for 65 Kms line project in the state of Gujarat.

2. The financial statements were authorized for issue in accordance with resolution of the Directors on September 29, 2023.

3 (i) Basis of Preparation

These financial statements have been prepared on a historical cost basis, except for certain financial instruments which are measured at fair value at the end of each reporting period. Historical cost is generally based on the fair value of the consideration given in exchange for goods and services. Fair value is the price that would be received to sell an asset or paid to transfer a liability in an orderly transaction between market participants at the measurement date.

A. Statement of Compliance:

These financial statements of the company have been prepared to comply with Indian Accounting Standards (Ind AS) including the rules notified under the relevant provision of the Companies Act, 2013, amended from time to time.

Details of the Company's accounting policies are included in Note 3(ii).

B. Functional and Presentation Currency:

These financial statements are presented in Indian Rupees (INR), which is also the Company's functional currency.

C. Use of Estimates and Judgements:

In preparing these financial statements, management has made judgements, estimates and assumptions that affect the application of accounting policies and the reported amounts of

assets, liabilities, income and expenses. Actual results may differ from these estimates.

Critical Estimates and Judgments

This note provides an overview of the areas that involved a higher degree of judgement or complexity, and of items which are more likely to be materially adjusted due to estimates and assumptions turning out to be different than those originally assessed. Detailed information about each of these estimates and judgements is included in relevant notes together with information about the basis of calculation for each affected line item in the financial statements.

Areas involving critical estimates or judgements are:

• Depreciation and Amortization:

– Depreciation and amortization are based on management estimates of the future useful lives of the property, plant and equipment and intangible assets. Estimates may change due to technological developments, competition, changes in market conditions and other factors and may result in changes in the estimated useful life and in the depreciation and amortization charge.

• Other areas are as below:

- Estimation of current and deferred tax expense and payable:

Deferred tax assets are recognized to the extent that it is regarded as probable that deductible temporary differences can be realized. The Company estimates deferred tax assets and liabilities based on current tax laws and rates and in certain cases, business plans, including management's expectations regarding the manner and timing of recovery of the related assets. Changes in these estimates may affect the amount of deferred tax liabilities or the valuation of deferred tax assets and there by the tax charge in the Statement of Profit and Loss.

Provision for tax liabilities requires judgements on the interpretation of tax legislation, developments incase laws and the potential outcomes of tax audits and appeals which may be subject to significant uncertainty. Therefore, the actual results may vary from expectations resulting in adjustments to provisions, the valuation of deferred tax assets, cash tax settlements and therefore the tax charge to the Statement of Profit and Loss.

- **Recognition and measurement of provisions and contingencies:**

From time to time, the Company is subject to legal proceedings and other contingencies the ultimate outcome of each being always subject to many uncertainties inherent in litigation. A provision for expense is made when it is considered probable that a payment will be made, and the amount of the loss can be reasonably estimated.

Significant judgement is made when evaluating, among other factors, the probability of unfavourable outcome and the ability to make a reasonable estimate of the amount of potential loss. Expense provisions are reviewed at each accounting period and revisions made for the changes in facts and circumstances.

- **Impairment of Assets:**

Property, plant and equipment and intangible assets that are subject to depreciation/ amortization are tested for impairment periodically including when events occur or changes in circumstances indicate that the recoverable amount of the cash generating unit is less than its carrying value. The recoverable amount of cash generating units is higher of value-in-use and fair value less cost to sell. The calculation involves use of significant estimates and assumptions which includes turnover and earnings multiples, growth rates and net margins used to calculate projected future cash flows, risk-adjusted discount rate, future economic and market conditions.

Estimates and underlying assumptions are reviewed on an ongoing basis. Revisions to accounting estimates are recognized prospectively.

D. Measurement of Fair Values:

A number of the Company's accounting policies and disclosures require measurement of fair values, for both financial and non-financial assets and liabilities.

Fair values are categorized into different levels in a fair value hierarchy based on the inputs used in the valuation techniques as follows.

- Level 1: quoted prices (unadjusted) in active markets for identical assets or liabilities.
- Level 2: inputs other than quoted prices included in Level 1 that are observable for the asset or liability, either directly (i.e. as prices) or indirectly (i.e. derived from prices).
- Level 3: inputs for the asset or liability that are not based on observable market data

(unobservable inputs).

When measuring the fair value of an asset or a liability, the Company uses observable market data as far as possible. If the inputs used to measure the fair value of an asset or a liability fall into different levels of the fair value hierarchy, then the fair value measurement is categorized in its entirety in the same level of the fair value hierarchy as the lowest level input that is significant to the entire measurement.

The Company recognizes transfers between levels of the fair value hierarchy at the end of the reporting period during which the change has occurred.

Further information about the assumptions made in measuring fair values is included in the note of financial instruments.

3 (ii) Significant Accounting Policies

The accounting policies set out below have been applied consistently to the period presented in these financial statements.

a. Foreign Currency Transactions:

Transactions in foreign currencies are translated into the functional currency of the Company at the exchange rates at the dates of the transactions or an average rate if the average rate approximates the actual rate at the date of the transaction.

Monetary assets and liabilities denominated in foreign currencies are translated into the functional currency at the exchange rate at the reporting date. Non-monetary assets and liabilities that are measured at fair value in a foreign currency are translated into the functional currency at the exchange rate when the fair value was determined. Non-monetary assets and liabilities that are measured based on historical cost in a foreign currency are translated at the exchange rate at the date of the transaction.

Exchange differences are recognized in profit or loss, except exchange differences arising from the translation of the following items which are recognized in OCI:

- Equity investments at fair value through OCI (FVOCI);
- qualifying cash flow hedges to the extent that the hedges are effective.

b. Financial Instruments:**Recognition and Initial Measurement**

Trade receivables are initially recognized when they are originated. All other financial assets and financial liabilities are initially recognized when the Company becomes a party to the contractual provisions of the instrument.

A financial asset or financial liability is initially measured at fair value plus, for an item not at fair value through profit and loss (FVTPL), transaction costs that are directly attributable to its acquisition or issue.

Classification and Subsequent Measurement and Gain and Losses: Financial Assets

Financial Assets at amortized cost- These assets are subsequently measured at amortized cost using the effective interest method. The amortized cost is reduced by impairment losses. Interest income, foreign exchange gains and losses and impairment are recognized in profit or loss. Any gains or loss or derecognition is effected in profit or loss statement.

Financial Assets at Fair Value through Other Comprehensive Income (FVTOCI) - All equity investments are measured at fair values. Investments which are not held for trading purposes and where the Company has exercised the option to classify the investment as at FVTOCI, all fair value changes on the investment are recognized in Other Comprehensive Income (OCI). The accumulated gains or losses are recognized in OCI are reclassified to retained earnings on sale of such investment.

Financial assets at Fair Value through Profit and loss (FVTPL) - These assets are subsequently measured at fair value. Net gains and losses, including any interest or dividend income, are recognized in profit or loss.

Classification, Subsequent Measurement and Gains and Losses: Financial Liabilities

Financial liabilities are subsequently measured at amortized cost using an effective interest method. For trade and other payable maturing within one year from the balance sheet date, the carrying value approximates fair value due to the short maturity of these investments.

Equity Instruments

An equity instrument is a contract that evidences residual interest in the assets of the

company after deducting all of its liabilities. Incremental costs directly attributable to the issuance of equity instruments are recognized as a deduction from equity instrument net of any tax effects.

Derecognition: Financial Assets

The Company derecognizes a financial asset when the contractual rights to the cash flows from the financial asset expire, or it transfers the rights to receive the contractual cash flows in a transaction in which substantially all of the risks and rewards of ownership of the financial asset are transferred or in which the company neither transfers nor retains substantially all of the risks and rewards of ownership and does not retain control of the financial asset.

If the Company enters into transactions whereby it transfers assets recognized on its balance sheet but retains either all or substantially all of the risks and rewards of the transferred assets, the transferred assets are not derecognized.

Derecognition: Financial Liabilities

The Company derecognizes a financial liability when its contractual obligations are discharged or cancelled or expired.

The Company also derecognizes financial liability when its terms are modified and the cash flows under the modified terms are substantially different. In this case, a new financial liability based on the modified terms is recognized at fair value. The difference between the carrying amount of the financial liability extinguished and the new financial liability with modified terms is recognized in profit or loss.

Offsetting

Financial assets and financial liabilities are offset, and the net amount presented in the balance sheet when, and only when, the Company currently has a legally enforceable right to set off the amounts and it intends either to settle them on a net basis or to realize the asset and settle the liability simultaneously.

c. Current and Non-Current Classification

The Company presents assets and liabilities in the balance sheet based on current/non-current classification. An asset is treated as current when it is:

- (a) expected to be realised in, or is intended to be sold or consumed in Company's normal operating cycle;
- (b) held primarily for the purpose of being traded.
- (c) expected to be realised within 12 months after the reporting date; or
- (d) cash or cash equivalent unless restricted from being exchanged or used to settle a liability for at least 12 months after the reporting date.

All other assets are classified as non-current.

A Liability is current when:

- (a) it is expected to be settled in Company's normal operating cycle;
- (b) it is held primarily for the purpose of being traded;
- (c) it is due to be settled within 12 months after the reporting date; or
- (d) The Company does not have an unconditional right to defer settlement of the liability for at least 12 months after the reporting date.

All other liabilities are classified as non-current.

Operating Cycle

Operating cycle is the time between the acquisition of assets for processing and their realisation in cash or cash equivalents. The Company has identified twelve months as its operating cycle.

d. Property, Plant and Equipment

Recognition and Measurement

Items of property, plant and equipment are measured at cost, which includes capitalised borrowing costs, less accumulated depreciation, and accumulated impairment losses, if any.

Cost of an item of property, plant and equipment comprises its purchase price, including import duties and non-refundable purchase taxes, after deducting trade discounts and rebates, any directly attributable cost of bringing the item to its working condition for its intended use and estimated costs of dismantling and removing the item and restoring the site on which it is located.

The cost of a self-constructed item of property, plant and equipment comprises the cost of materials and direct labour, any other costs directly attributable to bringing the item to working condition for its intended use, and estimated costs of dismantling and removing the item and restoring the site on which it is located.

If significant parts of an item of property, plant and equipment have different useful lives, then they are accounted for as separate items (major components) of property, plant and equipment.

Any gain or loss on disposal of an item of property, plant and equipment is recognised in profit or loss.

Subsequent Expenditure

Subsequent expenditure is capitalized only if it is probable that the future economic benefits associated with the expenditure will flow to the Company.

Depreciation

Depreciation on property, plant and equipment is provided on straight line basis based on the rates as per useful life prescribed in Schedule II to the Companies Act, 2013. Assets costing up to INR 25,000 each are fully depreciated in the year of capitalisation from the financial year 2022-23. (As approved in 16th Board Meeting held on 14th March 2023 agenda item No. 16/12)

Depreciation on additions / disposals is provided on a pro-rata basis i.e. from / up to the date on which asset is ready for use / disposed of.

Depreciation method, useful lives and residual values are reviewed at each financial year-end and adjusted if appropriate. In case of a revision, the unamortized depreciable amount is charged over the revised remaining useful life.

Losses arising from retirement or gains or losses arising from disposal of fixed assets which are carried at cost are recognized in the Statement of Profit and Loss.

Capital work in progress represents projects under which property, plant & equipment are not yet ready for their intended use and are carried at cost determined as aforesaid. Indirect expense related to Capital Work in Progress has been capitalised to respective Capital Work in Progress Account.

e. Leases

As a lessee, the company recognizes a right-of-use asset and a lease liability at the lease commencement date. The right-of-use asset is initially measured at cost, which comprises the initial amount of the lease liability adjusted for any lease payments made at or before the commencement date, plus any initial direct costs incurred and an estimate of costs to dismantle and remove the underlying asset or the site on which it is located, less any lease incentives received.

The right-of-use asset is subsequently depreciated using the Straight-line method from the commencement date to the earlier of the end of the useful life of the right-of-use asset or the end of the lease term. The estimated useful lives of right-of-use assets are determined on the same basis as those of Property, Plant & Equipment. In addition, the right-of-use asset is periodically reduced by impairment losses, if any, and adjusted for certain re-measurements of the lease liability.

The lease Liability is initially measured at the present value of the lease payments that are not paid at the commencement date, discounted using the interest rate as per standard.

Lease Payments included in the measurement of the lease liability comprise the Fix payments, including in-subsequent fixed payments. The lease liability is measured at amortized cost using the effective interest method. When the lease liability is remeasured, a corresponding adjustment is made to the carrying amount of the right-of-use asset or is recorded in profit and loss if the carrying amount of the right-of-use asset has been reduced to zero. The company presents right-of-use assets (Lease hold Office) as separate line items in Non-Current Assets and lease liabilities in 'Other financial liability' in the balance sheet.

f. Intangible Assets & Intangible Assets Under Development

(A) Freight Sharing Right (Railway Line under Service Concession Arrangement)

The company recognizes an intangible asset arising from a service concession arrangement when it has a right to charge for usage of the concession infrastructure. An intangible asset received as consideration for providing construction or upgrade services in a service concession arrangement is measured at fair value on initial recognition by reference to the fair value of the services provided. Subsequent to initial recognition, the intangible asset is stated at cost, which includes capitalized borrowing costs, less accumulated amortization and accumulated impairment losses.

The estimated useful life of an intangible asset in a service concession arrangement is the period from when the company is able to charge the public for the use of the infrastructure to the end of the concession period (i.e. 30 year of operation).

Freight sharing right is amortised using the straight-line method on pro-rata basis from the date of addition or from the date when the right brought into service to the expiry of 30 year of operation. Amortisation methods and useful lives are reviewed at each reporting date, with the effect of change in estimate accounted for on a prospective basis. The carrying value of intangible asset is reviewed for impairment annually or more often if events or changes in circumstances indicate that the carrying value may not be recoverable.

As authorization for operation of good traffic for Phase 1 has been Approved by Western Railway on 23 March 2023. Hence, capitalisation of Phase 1 of Intangible Asset Under Development capitalised on 23 March 2023.

(B) Freight sharing right under development

Expenditure incurred on development of existing and new assets (including revenue sharing rights in respect of project railway are recognised as Intangibles under development at cost incurred by company which is reckoned as fair value of services provided including cost directly attributable including fair value adjustment of land related to the service concession arrangement.

g. Impairment

Impairment of Financial Instruments

The Company recognizes loss allowances for expected credit losses on financial assets measured at amortized cost.

At each reporting date, the Company assesses whether financial assets carried at amortized cost are credit-impaired. A financial asset is 'credit-impaired' when one or more events that have a detrimental impact on the estimated future cash flows of the financial asset have occurred.

The Company measures loss allowances at an amount equal to lifetime expected credit losses. Lifetime expected credit losses are the expected credit losses that result from all possible default events over the expected life of a financial instrument.

When determining whether the credit risk of a financial asset has increased significantly since initial recognition and when estimating expected credit losses, the Company considers reasonable and supportable information that is relevant and available without undue cost or effort. This includes both quantitative and qualitative information and analysis, based on the Company's historical experience and informed credit assessment and including forward-looking information.

Measurement of Expected Credit Losses

Expected credit losses are a probability-weighted estimate of credit losses. Credit losses are measured as the present value of all cash shortfalls (i.e. the difference between the cash flows due to the Company in accordance with the contract and the cash flows that the Company expects to receive).

Presentation of Allowance for Expected Credit Losses in the Balance Sheet

Loss allowances for financial assets measured at amortized cost are deducted from the gross carrying amount of the assets.

Write-off

The gross carrying amount of a financial asset is written off (either partially or in full) to the extent that there is no realistic prospect of recovery. This is generally the case when the Company determines that the debtor does not have assets or sources of income that could generate sufficient cash flows to repay the amounts subject to the write-off. However, financial assets that are written off could still be subject to enforcement activities in order to comply with the Company's procedures for recovery of amounts due.

Impairment of Non-Financial Assets

The Company's non-financial assets, other than inventories and deferred tax assets, are reviewed at each reporting date to determine whether there is any indication of impairment. If any such indication exists, then the asset's recoverable amount is estimated. The recoverable amount being higher of the net selling price or value in use. Value in use is determined from the present value of the estimated future cash flows from the continuing use of the assets.

If the recoverable amount of an asset (or cash-generating unit) is estimated to be less than its carrying amount, the carrying amount of the asset (or cash-generating unit) is reduced to

its recoverable amount. An impairment loss is recognized immediately in the Statement of Profit and Loss. When an impairment loss subsequently reverses, the carrying amount of the asset (or a cash-generating unit) is increased to the revised estimate of its recoverable amount, but so that the increased carrying amount does not exceed the carrying amount that would have been determined had no impairment loss been recognized for the asset (or cash-generating unit) in prior years. A reversal of an impairment loss is recognized immediately in the Statement of Profit and Loss.

h. Borrowing Cost

Borrowing costs are interest and other costs (including exchange differences relating to foreign currency borrowings to the extent that they are regarded as an adjustment to interest costs) incurred in connection with the borrowing of funds. Borrowing costs directly attributable to acquisition or construction of an asset which necessarily take a substantial period of time to get ready for their intended use are capitalized as part of the cost of that asset. Other borrowing costs are recognized as an expense in the period in which they are incurred.

I. Borrowing

Borrowings are classified as current liabilities unless the Company has an unconditional right to defer settlement of the liability for at least 12 months after the reporting period. Where there is a breach of a material provision of a long-term loan arrangement on or before the end of reporting period with the effect that the liability becomes payable on demand on the reporting date, the Company does not classify the liability as current, if the lender agreed, after the reporting period and before the approval of the financial statement for issue, not to demand payment as a consequence of the breach.

j. Revenue Recognition

(a) Revenue from Contracts with Customers

Company Recognises revenue from contracts with customers based on a five-step as set out in Ind AS- 115: -

- (i) **Identify contracts with a customer:** - A contract is defined as an agreement between two or more parties that creates enforceable rights and obligations and sets out the criteria for every contract that must be met.

- (ii) **Identify performance obligations in the contract:** A performance obligation is a promise in a contract with a customer to transfer a good or service to the customer.
- (iii) **Determine the transaction price:** The transaction price is the amount of consideration to which the company expects to be entitled in exchange for transferring promised goods or services to a customer excluding amounts collected on behalf of third parties.
- (iv) **Allocate the transaction price to the performance obligations in the contract:** For a contract that has more than one performance obligation the Company allocates the transaction price to each performance obligation in an amount that depicts the amount of consideration to which the Company expects to be entitled in exchange for satisfying each performance obligation.
- (v) Recognise revenue when or as the Company satisfies a performance obligation.

Revenue from Railway Operation

Apportionment of freight as accrued to the company under terms of the concession agreement for freight operation on the project assets is recognized by the company in point in time as operating revenue as per Ind AS 115 (i.e., actual freight collected by Railways).

Income is apportioned by the Railway and Recognized by Company on the basis of IRFA Rules and various circulars issued by Railway Board from time to time.

(b) Other Revenue Recognition

Interest income is recognized using the effective interest method and is accounted on an accrual basis.

All other items of income are accounted for on an accrual basis.

k. Provisions (other than Employee Benefits)

A provision is recognized if, as a result of a past event, the Company has a present obligation that can be estimated reliably, and it is probable that an outflow of economic benefits will be required to settle the legal or contractual obligation. Provisions are determined by discounting the expected future cash flows (representing the best estimate of the expenditure required to settle the present obligation at the balance sheet date) at a pre-tax rate that reflects current market assessments of the time value of money and the risks

specific to the liability. The unwinding of the discount is recognized as a financial cost. Expected future operating losses are not provided for.

Contingencies

Provision in respect of loss contingencies relating to claims, litigation, assessment, fines, penalties, etc. are recognized when it is probable that a liability has been incurred and the amount can be estimated reliably.

I. Contingent Liabilities

Contingent liabilities are disclosed when there is a possible obligation arising from past events, the existence of which will be confirmed only by the occurrence or non-occurrence of one or more uncertain future events not wholly within the control of the Company or a present obligation that arises from past events where it is either not probable that an outflow of resources will be required to settle, or a reliable estimate of the amount cannot be made.

m. Income Taxes

Income tax comprises current and deferred tax. It is recognized in profit or loss except to the extent that it relates to an item recognized directly in equity or in other comprehensive income.

Current Tax

Current tax comprises the expected tax payable or receivable on the taxable income or loss for the year and any adjustment to the tax payable or receivable in respect of previous years. The amount of current tax reflects the best estimate of the tax amount expected to be paid or received after considering the uncertainty, if any, related to income taxes. It is measured using tax rates (and tax laws) enacted or substantively enacted by the reporting date.

Current tax assets and current tax liabilities are offset only if there is a legally enforceable right to set off the recognized amounts, and it is intended to realize the asset and settle the liability on a net basis or simultaneously.

Tax benefits of deductions earned on exercise of employee stock options in excess of compensation charged to income are credited to other comprehensive income.

Deferred Tax

Deferred tax is recognized in respect of temporary differences between the carrying amounts of assets and liabilities for financial reporting purposes and the corresponding amounts used for taxation purposes. Deferred tax is also recognized in respect of carried forward tax losses and tax credits. Deferred tax is not recognized for:

- Temporary differences arising on the initial recognition of assets or liabilities in a transaction that affects neither accounting nor taxable profit/loss at the time of the transaction.
- Taxable temporary differences arising on the initial recognition of goodwill.

Deferred tax assets are recognized to the extent that it is probable that future taxable profits will be available against which they can be used. The existence of unused tax losses is strong evidence that future taxable profit may not be available. Therefore, in case of a history of recent losses, the Company recognizes a deferred tax asset only to the extent that it has sufficient taxable temporary differences or there is convincing other evidence that sufficient taxable profit will be available against which such deferred tax asset can be realized. Deferred tax assets – unrecognized or recognized, are reviewed at each reporting date and are recognized/ reduced to the extent that it is probable/ no longer probable respectively that the related tax benefit will be realized.

Deferred tax is measured at the tax rates that are expected to apply to the period when the asset is realized or the liability is settled, based on the laws that have been enacted or substantively enacted by the reporting date.

The measurement of deferred tax reflects the tax consequences that would follow from the manner in which the Company expects, at the reporting date, to recover or settle the carrying amount of its assets and liabilities.

Deferred tax assets and liabilities are offset if there is a legally enforceable right to offset current tax liabilities and assets, and they relate to income taxes levied by the same tax authority on the same taxable entity, or on different tax entities, but they intend to settle current tax liabilities and assets on a net basis, or their tax assets and liabilities will be realized simultaneously.

Deferred tax in respect of timing differences which reverse after the tax holiday period is recognized in the year in which the timing differences originate.

n. Earnings per Share

Basic earnings/ (loss) per share are calculated by dividing the net profit or loss for the year attributable to equity shareholders by the weighted average number of equity shares outstanding during the year. The weighted average numbers of equity shares outstanding during the year are adjusted for events of bonus issue and share split. For the purpose of calculating diluted earnings/ (loss) per share, the net profit or loss for the year attributable to equity shareholders and the weighted average number of shares outstanding during the year are adjusted for the effects of all dilutive potential equity shares.

o. Cash and Cash Equivalents

Cash and cash equivalents in the balance sheet comprise cash at banks and on hand and short-term deposits with an original maturity of three months or less, which are subject to an insignificant risk of changes in value.

For the purpose of the statement of cash flows, cash and cash equivalents consist of cash and short-term deposits, as defined above, net of outstanding bank overdrafts as they are considered an integral part of the Company's cash management.

p. Events after the Reporting Period

Adjusting events are events that provide further evidence of conditions that existed at the end of the reporting period. The financial statements are adjusted for such events before authorization for issue. Non-adjusting events are events that are indicative of conditions that arose after the end of the reporting period. Non-adjusting events after the reporting date are not accounted but disclosed.

q. Statement of cash flows

Cash flows are reported using the indirect method, whereby profit/ (loss) before tax is adjusted for the effects of transactions of non-cash nature and any deferrals or accruals of past or future cash receipts or payments. Cash flow for the year are classified by operating, investing and financing activities.

r. General

Any other accounting policy not specifically referred to are in consistent with the generally accepted accounting principles.

4. Property, Plant and Equipment

Particulars	Computer	Computer & Data Processing Unit- Server & Network	Computer Hardware	Computer server	Electric Installations equipment	Furniture & fittings	Improvement to Leasehold Property	IT Installation Work	Office Equipment	Printer	Land	Total
Gross Carrying value												
As on April 01,2022	-	-	-	-	-	-	-	-	-	-	-	-
Addition	7 57 493	19 29 676	5 14 145	16 89 349	31 77 114	1 79 86 926	1 57 35 396	6 01 485	56 51 387	6 68 671	5 46 99 452	10 34 11 094
Disposal	-	-	-	-	-	-	-	-	-	-	-	-
Ind AS Adjustment	-	-	-	-	-	-	-	-	-	-	-	-
As at March 31,2023	7 57 493	19 29 676	5 14 145	16 89 349	31 77 114	1 79 86 926	1 57 35 396	6 01 485	56 51 387	6 68 671	5 46 99 452	10 34 11 094
Depreciation												
As on April 01,2022	-	-	-	-	-	-	-	-	-	-	-	-
Change for the year	29 574	37 668	27 047	32 976	37 211	21 33 853	61 433	11 741	3 93 612	26 106	-	27 91 221
Adjustments	-	-	-	-	-	-	-	-	-	-	-	-
Ind AS Adjustment	-	-	-	-	-	-	-	-	-	-	-	-
As at March 31,2023	29 574	37 668	27 047	32 976	37 211	21 33 853	61 433	11 741	3 93 612	26 106	-	27 91 221
Net carrying value												
As at March 31,2023	7 27 919	18 92 008	4 87 098	16 56 373	31 39 903	1 58 53 073	1 56 73 963	5 89 744	52 57 775	6 42 565	5 46 99 452	10 06 19 873

5. Intangible Assets

Particulars	Freight Sharing Right	Total Intangible Assets
Gross Carrying Value		
As on April 01,2022	-	-
Addition	348 45 95 458	348 45 95 458
Disposal	-	-
Ind AS Adjustment	-	-
As at March 31,2023	348 45 95 458	348 45 95 458
Amortization		
As on April 01,2022	-	-
Change for the year	26 03 979	26 03 979
Adjustments	-	-
Ind AS Adjustment	-	-
As at March 31,2023	26 03 979	26 03 979
Net Carrying Value		
As at March 31,2023	348 19 91 479	348 19 91 479

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
Notes to Financial Statements for the year ending on March 31, 2023

(Amount in ₹)

Particulars	As at March 31, 2023	As at March 31, 2022
6 Right of Use Asset - Leasehold Office *		
Gross carrying value		
Opening	76 31 943	--
Addition	--	76 31 943
Disposal	--	--
Ind As Adjustment	--	--
Closing	<u>76 31 943</u>	<u>76 31 943</u>
Depreciation		
Opening	7 63 194	--
Changes for the year	15 26 389	7 63 194
Adjustment	--	--
Ind As Adjustment	--	--
Closing	<u>22 89 583</u>	<u>7 63 194</u>
Net Carrying Value	Total	Total
	<u>53 42 360</u>	<u>68 68 749</u>
*Refer Note No.46		
7 Capital Work-in-Progress includes		
Capital Work in Progress-Office	-	1 93 17 377
Capital Work in Progress-Land Acquisition	8 86 32 478	4 18 87 498
*Refer Note No 41		
	Total	Total
	<u>8 86 32 478</u>	<u>6 12 04 875</u>
8 Intangible Assets Under Development*		
Freight Sharing Right Under Development	220 57 99 177	227 51 65 960
*Refer Note No 42		
	Total	Total
	<u>220 57 99 177</u>	<u>227 51 65 960</u>
9 Other Non-Current Assets		
Advance Paid for Intangible Assets Under Development*		
-Advance paid to EPC Contractors	18 93 87 086	40 54 84 597
-Interest Receivable on Mobilisation Advance to EPC Contractor**	2 25 68 950	2 45 34 680
Balance With Statutory/Government Authorities		
GST Receivable	5 32 25 640	1 97 60 819

Particulars	As at March 31, 2023	As at March 31, 2022
Deposits		
Security Deposit-Torrent Power	1 00 000	--
Security Deposit-NSDL	1 50 000	--
Total	26 54 31 676	44 97 80 096
<p>*As on year ended amount of Mobilization Advance and Interest Receivable thereon recoverable in next 12 months is not ascertainable. Hence Mobilization Advance and Interest Receivable thereon being in the nature of Long Term Asset presented under other Non-Current Assets.</p> <p>**Refer Note 42</p>		
10 Trade Receivable		
Less than 6 months		
Undisputed Trade Receivable - Considered good	8 91 24 844	13 67 99 196
Undisputed Trade Receivable - Which have significant increase in credit risk	--	--
Undisputed Trade Receivable - Credit impaired	--	--
Disputed Trade Receivable - Considered good	--	--
Disputed Trade Receivable - Which have significant increase in credit risk	--	--
Disputed Trade Receivable - Credit impaired	--	--
6 months - 1year	--	--
1-2 years	--	--
2-3 years	--	--
More than 3 years	--	--
Total	8 91 24 844	13 67 99 196
*Refer Note No 35 & 37		
11 Cash and Cash Equivalents		
Balances with banks		
Union Bank of India Current Account	12 28 05 601	7 08 23 914
Yes Bank Current Account	66 29 891	1 07 51 313
Balance with GSFS - Liquid Deposit	9 00 00 000	31 43 49 947
Total	21 94 35 492	39 59 25 174
12 Other Balances with Banks		
Balance with GSFS - Inter Corporate Deposit	--	200 00 00 000
Total	--	200 00 00 000

Particulars			As at March 31, 2023	As at March 31, 2022
13 Income Tax Assets (Net)				
	C.Y.	P.Y.		
Income Tax Provision- F.Y. 2021-22	92 28 768	92 28 768		
Less:				
Advance Tax Paid F.Y 2021-22	33 60 993	33 60 993		
TDS Receivable F.Y. 2021-22	1 48 56 263	1 48 56 263		
TDS Receivable F.Y. 2022-23	<u>1 59 10 242</u>	--	2 48 98 729	89 88 488
			Total	89 88 488
			2 48 98 729	89 88 488
14 TAXATION				
TAX EXPENSE RECOGNISED IN STATEMENT OF PROFIT & LOSS				
Current Tax			--	92 28 768
deferred Tax			8,49,32,680	--
Total Tax Expense Recognised in Current Year			8,49,32,680	92 28 768
The Tax Expense for the year can be reconciled to the accounting profit as follows:				
Profit/(Loss) Before Tax and Exceptional Item			--	1 45 89 800
Applicable Tax Rate			--	27.82
Computed Tax Expense			--	40 58 882
TAX EFFECT OF:				
Exempted income			--	--
Expense disallowed (1,85,83,343*27.82%)			--	51 69 886
Additional Allowance net if MAT Credit			--	--
Current Tax Provision			--	92 28 768
Property, Plant & Equipment, Intangible Assets, Building & Plant & Machinery			8,49,32,680	--
Incremental deferred Tax Liability /(Asset) on account of Financial Asset & other Item			--	--
deferred tax Provision			8,49,32,680	--
Tax Expense Recognised in statement of Profit & Loss Account			--	92 28 768
Effective Tax Rate			--	63%
Tax on Exceptional Item			--	--
15 Other Current Assets				
Advance other than capital advance				
Other Advance				
Prepaid Expense			2 96 621	3 376
Interest Receivable from GSFS			33 288	82 23 819
Interest Receivable from Torrent Power			1 421	--

Particulars	As at March 31, 2023	As at March 31, 2022		
Unbilled Revenue*	1 75 285	--		
Expense Receivable from KPTL	18 74 638	--		
Amount Receivable from MSIL	71 29 312	--		
Total	95 10 565	82 27 195		
<p>*Unbilled revenue receivable from Western Railway for the F.Y. 2022-23, But billed in F.Y. 2023-24. Hence booked as Unbilled Revenue in current year.</p>				
16 Equity Share Capital				
Authorised				
78,62,20,000 Equity Shares of ₹ 10 each, fully paid up	786 22 00 000	786 22 00 000		
(78 62 20 000 Equity Shares of ₹ 10 each, fully paid up)*	Total 786 22 00 000	786 22 00 000		
Issued, subscribed				
61,21,22,402 Equity shares of ₹ 10 each, fully paid up	612 12 24 020	496 91 72 000		
(49,69,17,200 Equity shares of ₹ 10 each, fully paid up)*	Total 612 12 24 020	496 91 72 000		
Paid-up Capital:				
61,21,22,402 Equity shares of ₹ 10 each, fully paid up	612 12 24 020	496 91 72 000		
(49,69,17,200 Equity shares of ₹ 10 each, fully paid up)*	Total 612 12 24 020	496 91 72 000		
<p>*Figures in bracket represents Previous year's figure</p>				
Notes:				
(i) Reconciliation of the shares outstanding at the beginning and at the end of the period				
Particulars	2022-23		2021-22	
	No of shares	Amount	No of shares	Amount
At the beginning of the year	49 69 17 200	496 91 72 000	19 23 75 000	192 37 50 000
Add: Issued during the year	11 52 05 202	115 20 52 020	30 45 42 200	304 54 22 000
Outstanding at the end of the year	61 21 22 402	612 12 24 020	49 69 17 200	496 91 72 000
(ii) Terms/rights attached to equity shares				
<ul style="list-style-type: none"> - The Company has only one class of equity shares having a par value of ₹ 10 per share. - Each holder of the equity shares is entitled to one vote per share. - In the event of liquidation of the Company, the holders of the equity shares will be entitled to receive assets of the Company remaining after settlement of all liabilities. The distribution will be in proportion of the number of equity shares held by the shareholders. 				

Particulars	As at March 31, 2023		As at March 31, 2022	
(iii) Allotment of Shares Under Right Issue				
'During the year company has allotted Right Equity Shares of Rs.10/- each to below promoters:				
- Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE) 11,52,05,202 (P.Y. 12,60,00,000) Right Equity Shares of Rs.10/-each				
- Maruti Suzuki India Limited (MSIL) Current Year - Nil (P.Y. 14,59,17,200) Right Equity Shares of Rs.10/-each				
- Gujarat Industrial Development Corporation (GIDC) Current Year - Nil (P.Y. 3,26,25,000) Right Equity Shares of Rs.10/-each				
(iv) The details of shareholders holding more than 5 % of issued share capital is set out below:				
Name of Shareholder	As at March 31, 2023		As at March 31, 2022	
	No. of shares	% holding	No. of shares	% holding
Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE)	34 24 55 202	55.95%	22 72 50 000	45.73%
Maruti Suzuki India Limited (MSIL)	20 44 17 200	33.39%	20 44 17 200	41.14%
Gujarat Industrial Development Corporation (GIDC)	6 52 50 000	10.66%	6 52 50 000	13.13%
As per records of the Company, including its register of shareholders / members, the above shareholding represents legal and beneficial ownership of shares.				
The Company has not issued any Bonus Shares during the year.				
(v) Disclosure of Shareholding of Promoters				
Promoter Name	As at March 31, 2023		% Changes during the year	
	No. of shares	% of total shares		
Gujarat Rail Infrastructure Development Corporation Limited	34 24 55 202	55.95%	10.21%	
Maruti Suzuki India Limited	20 44 17 200	33.39%	(7.74)%	
Gujarat Industrial Development Corporation	6 52 50 000	10.66%	(2.47)%	
Promoter Name	As at March 31, 2022		% Changes during the year	
	No. of shares	% of total shares		
Gujarat Rail Infrastructure Development Corporation Limited	22 72 50 000	45.73%	(6.90)%	
Maruti Suzuki India Limited	20 44 17 200	41.14%	10.73%	
Gujarat Industrial Development Corporation	6 52 50 000	13.13%	(3.83)%	

Particulars	As at March 31, 2023	As at March 31, 2022
17 Other Equity		
Retained Earnings		
Opening Balance of retained earnings	(3 04 15 030)	(3 56 98 614)
Add/ Less Adjustments during the year	--	--
Net (Loss) / profit for the current year	(2 58 61 882)	52 83 584
Closing Balance	(5 62 76 913)	(3 04 15 030)
Total Reserves and Surplus	(5 62 76 913)	(3 04 15 030)
18 Other financial liabilities-Non Current		
Retention & With Held Money*	7 01 97 490	7 41 96 689
Lease Liability (Refer Note No 46)	42 65 240	57 08 140
Total	7 44 62 730	7 99 04 829
<p>The Company's exposure to currency and liquidity risks related to other financial liabilities covered in Note 35 *This amount is primarily is in the nature of Non Current although part amount was released against bank guarantee received from contractors. Considering the same full amount is presented under non-Current.</p>		
19 Other Non-Current liability		
Payable against Capital Asset*	15 95 250	--
Bid Security/Ernest Money Deposit/Performance Security*	--	1 07 250
	15 95 250	1 07 250
*Refer Note 38		
20 Deferred Tax Liabilities (Net)		
Deferred tax liability on		
Property, Plant & Equipment, Intangible Assets	9 93 14 701	--
Total deferred tax liability	9 93 14 701	--
Deferred tax Assets on		
Preliminary Expenses	1 42 93 355	--
Improvement to Leasehold Property	88 666	--
Total deferred tax asset	1 43 82 020	--
Net Deferred Tax Liability/ (Assets)	8 49 32 680	--
21 Trade Payable-Current		
Less than 1 Year	--	--
1-2 Years	--	--
2-3 years	--	--
More than 3 Years	--	--

Particulars	As at March 31, 2023	As at March 31, 2022
Others		
Unbilled Payable*		
Less than 1 Year		
Consultancy / Professional Charges Payable	1 44 078	80 550
Electricity Expense Payable	46 039	--
Rent Expense Payable	4 32 769	4 32 769
Repair & Maintenance - Building Payable	96 120	63 132
Internal Audit Fees Payable	14 475	1 01 033
Man Power Service Exp Payable	6 06 242	5 87 255
Statutory Audit Fees Payable	90 000	67 500
Vehicle Hire Charges Payable	2 20 442	1 52 398
Secretarial Audit Fees Payable	45 000	45 000
Board Meeting Expense Payable	10 000	15 000
Provision for Expenses Payable-EPC Contract	19 43 17 152	28 13 43 773
Provision for Expenses Payable-PMC Charges	1 09 17 033	1 55 95 996
Provision for Expenses Payable- Feasibility Study Expense	-	37 72 000
Provision for Expenses Payable-Office	1 000	1 93 050
1-2 Years	--	--
2-3 years	--	--
More than 3 Years	--	--
Total	20 69 40 349	30 24 49 455
*Refer Note 38		
22 Others Financial liability-Current		
Current maturity of lease liability*		
Current maturity of lease liability unpaid	14 42 900	13 12 625
Total	14 42 900	13 12 625
*Refer Note No 46		
23 Other Current liabilities		
Bid Security/Ernest Money Deposit	1 07 250	--
Statutory Dues Payable		
GST Payable	71 29 312	--
TDS Payable	1 71 11 513	1 22 76 452
Labour Cess	57 86 992	23 90 995
TDS GST Payable	1 11 32 148	41 30 582
GST RCM Payable	--	35 326

Particulars	As at March 31, 2023	As at March 31, 2022
Payable against Capital Asset*	1 51 98 442	15 95 250
Total	5 64 65 657	2 04 28 604
*Refer Note 38		
24 Current tax liabilities (net)		
Income Tax Provision- F.Y. 2020-21	--	--
Less:		
Advance Tax Paid in F.Y 2020-21	--	--
Total TDS Receivable	--	--
Total	--	--
25 Revenue from operations		
Revenue From Contracts with Customers		
Construction Service*	19 83 71 940	36 46 20 536
Sale of Rails	--	6 60 00 000
Project Management Consultancy Charges	28 75 000	86 25 000
Unbilled Revenue from Railway Operations**	1 75 285	--
Total	20 14 22 225	43 92 45 536
<p>* During the previous year company has entered in to MOU with MSIL & G-Ride. According to this MOU BRCL would undertake/procure the extension of main project to the designated point in the MSIL Gujarat plant premises at (Becharaji) (including extension & Construction of proposed railway siding as required by MSIL. The project has been carried out by a duly qualified contractor, as identified & appointed by BRCL with approval of MSIL. BRCL has assisted MSIL to undertake appropriate bid process for calling of tenders for and finalization of contract. The agreed contract price of this project is Rs 63.60 Crores inclusive of all taxes. This project would be considered as extension of the main project as per MOU.</p>		
<p>**Unbilled revenue receivable from Western Railway for the F.Y. 2022-23, But billed in F.Y. 2023-24. Hence booked as Unbilled Revenue in current year.</p>		
<p>**Bahucharaji Rail connectivity line of travelled length 29.65 kilometers became operational from 23th March 2023. The operating income of the company has been recognized for the period from 23rd March 2023 to 31st March 2023 for Bahucharaji Rail connectivity line, with the revenue pertaining to Katosan Road to Becharaji Station being computed on provisional basis. The share of BRCL in the total revenue collected by the Railway at the time of loading is summation of 50% of Apportioned Revenue on account of Reserved Services & Terminal Cost (at INR 26 per tonne). Further, apportioned revenue computed based on percentage of chargeable distance travelled on BRCL line (29.65 Km) to the total chargeable distance travelled. However, earnings have been made available by Western Railway to BRCL in accordance with the carried route recorded in FOIS system of CRIS.</p>		

Particulars	As at March 31, 2023	As at March 31, 2022
<p>Note:</p> <p>Service Concession Arrangements</p> <p>Public-to-private service concession arrangements are recorded according to Appendix “D” Service Concession Arrangements” IND-AS-115 .</p> <p>Service Concession Arrangements applies if:</p> <p>a) The Grantor controls or regulates which services the operator should provide with the infrastructure, to whom it must provide them, and at what price; and</p> <p>b) The Grantor controls- through ownership, beneficial entitlement, or otherwise- any significant residual interest in the infrastructure at the end of the term of the arrangement.</p> <p>If both of the above conditions are met simultaneously, an intangible asset is recognized to the extent that the operator receives the right to charge users of the public service, provided that these charges are conditional on the degree to which the service is used.</p> <p>These intangible assets are initially recognized at cost, which is understood as the fair value of the service provided plus other direct costs directly attributable to the operation. They are then amortized over the term of the concession.</p> <p>Description of Arrangement</p> <p>The Bahucharaji Rail Corporation Limited (BRCL) has entered into a Concession Agreement with Ministry of Railways (MoR), Government of India dated August 16, 2022 in terms of which the Ministry of Railways (Authority) has authorized the Company (Concessionaire) to develop, finance, design, engineer, procure, construct, and maintain the Project Railway and to exercise and/or enjoy the rights, powers, benefits, privileges authorizations and entitlements upon its completion. In terms of the said agreement BRCL has completed construction of Phase 1 of the project and further Phase 2 in work in progress. The concession period shall be 30 years of operation.</p> <p>At the end of concession period, the project assets shall be hand over by BRCL to MOR and BRCL shall be entitled to receive and MOR shall pay to BRCL an amount equal to cost of the site (Land & Land Acquisition related Expense only).</p> <p>In the event actual Net Tonne Km shall have fallen short / excess of the Target Traffic, then for every 2% (two per cent) shortfall / excess or part thereof as compared to the Target Traffic, the Concession Period shall be increased/ decreased by 6(six) months respectively or part thereof; provided that such increase/ decrease in Concession Period shall not in any case exceed 5 (five) years.</p> <p>In case of material breach in terms of the agreement the MOR and BRCL both have the right to terminate the agreement if they are not able to cure the event of default in accordance with such agreement.</p>		

Particulars	As at March 31, 2023	As at March 31, 2022
26 Other income		
Tender Processing Fee	12 712	1 18 644
Miscellaneous Income	--	--
Interest Received		
i) Interest on ICDS in GSFS	7 33 72 852	2 88 26 606
ii) Interest on Liquid Deposit	61 24 467	70 29 706
iii) Interest on Torrent Deposit	1 421	--
Total	7 95 11 452	3 59 74 956
27 Cost of Materials Consumed		
EPC Contract Expense - MSIL Line	19 71 11 576	36 73 38 839
Railway Rail Expense	--	6 60 00 000
Project Management Consultancy Expense	27 91 490	87 08 510
Total	19 99 03 066	44 20 47 349
28 Employee benefit expense, payment to contractors and consultants		
Man Power Services	77 93 771	30 95 806
Total	77 93 771	30 95 806
29 Finance Cost		
Interest on lease liability*	6 10 795	3 50 532
Total	6 10 795	3 50 532
*Refer Note No 46		
30 Depreciation and amortisation expense		
Amortization of Right of use Asset (Refer Note No. 46)	15 26 389	7 63 194
Amortization of Freight Sharing Right (Refer Note No. 5)	26 03 979	--
Depreciation of Property, Plant & Equipment (Refer Note No. 4)	27 91 221	--
Total	69 21 589	7 63 194
31 Other expenses		
Board Meeting Exp	45 000	15 000
Consultancy / Professional Charges	7 40 674	6 39 000
Demat Registration & Custody Fees	57 188	--
Insurance Expense	3 376	2 694
Rent Expense**	--	33 55 633
Electricity Expense	1 89 813	--
Feasibility Study Expense***	--	37 72 000
Office Exp	2 88 540	76 550
Diwali Gift Expense	3 40 592	--
Round Off	(20)	--
Secretarial Audit Fees	50 000	--
Stationery & Printing Exp	1 62 839	1 34 243
Statutory Audit Fees^	1 00 000	75 000
Traveling & Conveyance Exp-Others	1 120	--
Vehicle Hire Charges	30 31 218	25 58 339
Repairs & Maintenance**	2 13 200	6 19 739
Advertisement Expenses*	2 38 803	50 312

Particulars	As at March 31, 2023	As at March 31, 2022
Tender Fees	7 500	9 347
ROC & legal charges**	11 63 815	30 65 954
Total	66 33 658	1 43 73 811
*Refer Note No 40		
**Refer Note No 45		
*** During the previous year G-Ride has billed Project Development Expenditure with 15% Mark up as decided by BRCL in its 4th Board Meeting (Item No.4.07).		
Other Expenses includes:		
^Auditors Remuneration:		
Statutory Audit Fees	1 00 000	75 000
Consultancy & Professional Fees	50 000	--
Total	1 50 000	75 000
Other Comprehensive Income (OCI)		
There are no component of other comprehensive income that are required or to be disclosed.		
32 Earnings per share ('EPS')		
Earnings per share is calculated by dividing the net profit/ (loss) attributable to the equity shareholders by the weighted average number of equity shares of Rs.10 each outstanding during the year which is as under:		
Particulars	2022-23	2021-22
The following reflects the profit / (Loss) and share data used in the basic and diluted EPS computations:		
Net Profit/(Loss) attributable to equity shareholders	(2 58 61 882)	52 83 584
Weighted average number of equity shares in computing basic and diluted EPS	57 03 89 651	24 97 25 768
Face value of each equity share (Rs. 10)	10	10
Basic and diluted* Earning Per share	(0.05)	0.02
* There is no potential equity Shares so Basic and Diluted EPS are Same		
33 Segment Information		
In accordance with Ind-As 108, the operating segments used to present segment information are identified on the basis of internal reports used by the Company's Management to allocate resources to the segments and assess their performance.		
The Board of Directors is collectively the Company's 'Chief Operating Decision Maker' or 'CODM' within the meaning of Ind AS 108. The indicators used for internal reporting purposes may evolve in connection with performance assessment measures put in place.		
Information about geographical areas		
The Company do not have any operations in economic environments with different set of risks and returns. Hence, it is considered to be operating in a single geographical segment		
34 Dues to Micro, Small and Medium Enterprises		
There were no amounts payable to any Micro, Small & Medium Enterprises to whom the company over dues, which are outstanding for more than 45 days as at March 31, 2023.		

35 Financial Risk Management Objectives and Policies

The Company is exposed to market risk, credit risk and liquidity risk. The Company's senior management oversees the management of these risks. The Company's senior management is supported by Finance Department that advises on financial risks and the appropriate financial risk governance framework for the Company. The Finance department provides assurance to the Company's senior management that the Company's financial risk activities are appropriately governed.

(a) Market Risk

Market Risk is the risk that the fair value of future cash flows of a financial instrument will fluctuate because of changes in market prices. Market prices comprises interest rate risk. The sensitivity analyses in the following sections relate to the position as at March 31, 2023. The analyses exclude the impact of movements in market variables on; the carrying values of gratuity and other post retirement obligations: provisions; and the non-financial assets and liabilities.

(i) Interest Rate Risk

Interest Rate Risk is the risk that the fair value or future cash flows of a financial instrument will fluctuate because of changes in market interest rates. The borrowings of the Company are interest free and therefore not subject to interest rate risk as defined in Ind AS 107. Borrowing from G-RIDE is bearing interest rate of 9.50%. However, said loan is short term in nature and hence it will not affect future cash flows of the company in long run.

(b) Liquidity Risk

Liquidity Risk is the risk that the Company may not be able to meet its present and future cash and collateral obligations without incurring unacceptable losses. The Company's objective is to, at all times maintain optimum levels of liquidity to meet its cash and collateral requirements. The Company closely monitors its liquidity position and deploys a robust cash management system. It maintains adequate sources of financing including loans from banks at an optimised cost.

(i) The table below summarises the maturity profile of the Company's financial liabilities based on contractual undiscounted payments.

As at March 31, 2023	On demand	Less than 3 months	3 to 12 months	1-5 years	More than 5 years	Total
Trade Payable	20 69 40 349	-	-	-	-	20 69 40 349
Other Financial Liabilities-Non Current	-	-	-	7 44 62 730	-	7 44 62 730
Other Financial Liabilities-Current	-	-	14 42 900	-	-	14 42 900

As at March 31, 2022	On demand	Less than 3 months	3 to 12 months	1-5 years	More than 5 years	Total
Trade Payable	-	-	-	-	-	-
Other Financial Liabilities-Non Current	-	-	-	7 99 04 829	-	7 99 04 829
Other Financial Liabilities-Current	-	-	13 12 625	-	-	13 12 625

(ii) Transactions with Related Parties

Summary of transactions / Balances with Related Parties	Joint Venture		Promoters of Joint Venture		Key management personnel and relatives	
	For the year ended March 31, 2023	For the year ended March 31, 2022	For the year ended March 31, 2023	For the year ended March 31, 2022	For the year ended March 31, 2023	For the year ended March 31, 2022
Loan received	-	-	-	-	-	-
Loan Repaid	-	-	-	-	-	-
Reim. of exp. (Capitalised-CWIP)	-	-	-	-	-	-
Other Expenses - Board Meeting Exp.	-	-	-	-	45 000	15 000
Interest Paid (Capitalised-CWIP)	-	-	-	-	-	-
Feasibility Study Expense	-	37 72 000	-	-	-	-
PMC Charges paid (Capitalised-CWIP)	4 30 75 979	9 86 38 160	-	-	-	-
PMC Charges paid (Capitalised-Freight Sharing Right)	2 47 29 586	-	-	-	-	-
PMC Charges Income (MSIL Project)	28 75 000	86 25 000	-	-	-	-
PMC Charges Exp. (MSIL Project)	27 91 490	87 08 510	-	-	-	-
Rail Purchases- From MOR for MSIL Project	-	-	-	6 60 00 000	-	-
Rail Purchases- (Capitalised-CWIP)	-	-	-	10 02 05 785	-	-
Additional Feeder Bay for CWIP	-	-	-	-	-	-
Sale of Rails to MSIL	-	6 60 00 000	-	-	-	-
Sale of Construction Services-MSIL	19 83 71 940	36 46 20 536	-	-	-	-
Equity Share Contribution Received	115 20 52 020	304 54 22 000	-	-	-	-
Bid Processing Fees-Collected & Transfer	7 500	7 500	-	-	-	-
Total	142 39 03 515	359 57 93 706	-	16 62 05 785	45 000	15 000

Summary of transactions / Balances with Related Parties	Joint Venture		Promoters of Joint Venture		Key management personnel and relatives	
	For the year ended March 31, 2023	For the year ended March 31, 2022	For the year ended March 31, 2023	For the year ended March 31, 2022	For the year ended March 31, 2023	For the year ended March 31, 2022
Amount Receivable	8 91 24 844	13 67 99 196	-	-	-	-
Amount Payable	1 42 66 847	-	-	-	-	-

37. Fair Value Measurements

Set out below, is a comparison by class of the carrying amounts and fair value of the Company's financial instruments:

Category	As at March 31, 2023		As at March 31, 2022	
	Carrying Value	Fair Value	Carrying Value	Fair Value
1) Financial assets at Amortized Cost				
Trade receivables (Current & Non Current)	8 91 24 844	8 91 24 844	13 67 99 196	13 67 99 196
Cash and Cash equivalents	21 94 35 492	21 94 35 492	39 59 25 174	39 59 25 174
Other balances with banks	--	--	200 00 00 000	200 00 00 000
Other financial asset (Current & Non Current)	--	--	--	--
Total	30 85 60 336	30 85 60 336	253 27 24 370	253 27 24 370
2) Financial Liabilities at Amortized Cost				
Borrowings	--	--	--	--
Trade payables	20 69 40 349	20 69 40 349	30 24 49 455	30 24 49 455
Other financial liabilities (Current & Non Current)	7 59 05 630	7 59 05 630	8 12 17 454	8 12 17 454
Total	28 28 45 979	28 28 45 979	38 36 66 909	38 36 66 909

The fair value of the financial assets and liabilities is included at the amount at which the instrument could be exchanged in a current transaction between willing parties, other than in a forced or liquidation sale. Management has assessed that trade receivables, cash and cash equivalents, other bank balances, other financial assets, borrowings, trade payables and other financial liabilities approximate their carrying amounts largely due to the short-term maturities of these instruments.

Fair Value Hierarchy

All financial instruments for which fair value is recognised or disclosed are categorised within the fair value hierarchy, described as follows, based on the lowest level input that is significant to the fair value measurement as a whole.

Level 1: Quoted (unadjusted) prices in active markets for identical assets or liabilities.

Level 2: Valuation techniques for which the lowest level input that has a significant effect on the fair value measurement are observable, either directly or indirectly.

Level 3: Valuation techniques for which the lowest level input that has a significant effect on the fair value measurement is not based on observable market data.

The following table provides the fair value measurement hierarchy of the Company's assets and liabilities.

Quantitative disclosures fair value measurement hierarchy for assets as at March 31, 2023:

Particulars	Total (Carrying Value)	Quoted Price in Active Markets (Level 1)	Significant observable inputs (Level 2)	Significant unobservable inputs (Level 3)
Financial assets measured at amortised cost				
Trade receivables	8 91 24 844	--	--	--
Cash and Cash equivalents	21 94 35 492	--	--	--
Other balances with banks	--	--	--	--
Other financial asset (current/non current)	--	--	--	--
Total	30 85 60 336	--	--	--

Quantitative disclosures fair value measurement hierarchy for liabilities as at March 31, 2023:

Particulars	Total (Carrying Value)	Quoted Price in Active Markets (Level 1)	Significant observable inputs (Level 2)	Significant unobservable inputs (Level 3)
Financial Liabilities measured at amortised cost				
Borrowings	--	--	--	--
Trade Payables	20 69 40 349	--	--	--
Other financial Liabilities(current & non current)	7 59 05 630	--	--	--
Total	28 28 45 979	--	--	--

Quantitative disclosures fair value measurement hierarchy for assets as at March 31, 2022:

Particulars	Total (Carrying Value)	Quoted Price in Active Markets (Level 1)	Significant observable inputs (Level 2)	Significant unobservable inputs (Level 3)
Financial assets measured at amortised cost				
Trade receivables	13 67 99 196	--	--	--
Cash and Cash equivalents	39 59 25 174	--	--	--
Other balances with banks	200 00 00 000	--	--	--
Other financial asset (current & non current)	--	--	--	--
Total	253 27 24 370	--	--	--

Quantitative disclosures fair value measurement hierarchy for liabilities as at March 31, 2022:

Particulars	Total (Carrying Value)	Quoted Price in Active Markets (Level 1)	Significant observable inputs (Level 2)	Significant unobservable inputs (Level 3)
Financial Liabilities measured at amortised cost				
Borrowings	--	--	--	--
Trade Payables	30 24 49 455	--	--	--
Other financial Liabilities(current & non current)	8 12 17 454	--	--	--
Total	38 36 66 909	--	--	--

38 Impact on previous year figures in Financial Statements due to Re-grouping:

Item Re-grouped	Amount	Grouped under the head in Previous year	Grouped under the head in Current year
Payable against Capital Asset	15 95 250	Trade Payable-Current	Other Current liabilities
Balance with GSFS - Liquid Deposit	31 43 49 947	Other balances with banks	Cash and Cash Equivalents
Bid Security/Ernest Money Deposit/Performance Security	1 07 250	Trade Payable-Current	Other Current liabilities
Trade Payable-Others-Accruals-Current	31 60 52 447	Provision-Current	Trade Payable-Others-Current

39 Note on Project Management Consultancy to G-RIDE

GRIDE is appointed by BRCL as Project Management Consultant for execution of project of Katosan Road – Becharaji –Chanasma – Ranuj including MSIL siding at the value of 10% of the project cost as approved in the 1st meeting of Board of Director of BRCL held on 09.01.2019. Contract agreement has been executed as on 28.08.2020 for the same.

The PMC charges shall be kept at Original Estimated Cost, which is Rs 452.60 Crore, in two phases for claiming total PMC charges Rs 45.26 crore. Phase-wise PMC charges are as under:

(I) Katosan Road to Becharaji incl MSIL Siding (Phase-I)	19.82 Crore
(ii) Becharaji to Ranuj (Phase-II)	25.44 Crore
Total Sanctioned PMC charge	45.26 Crore

As per contract executed with Gride on August 28, 2020 the details of stage wise PMC charges payable to GRIDE as under:

(₹ in Crore)

Sr. No	Stages of PMC	Sanctioned PMC Charges for Phase-I	Stage-wise PMC Charges for Phase-I, Including Taxes
1	Transaction Advisory (30% of sanctioned charges for Phase-I)	19.82	5.946
2	Project Management (45% of sanctioned charges for Phase-I)		8.919
3	Commissioning & Testing (25% of sanctioned charges for Phase-I)		4.955

(₹ in Crore)

Sr. No	Stages of PMC	Sanctioned PMC Charges for Phase-II	Stage-wise PMC Charges for Phase-II, Including Taxes
1	Transaction Advisory (30% of sanctioned charges for Phase-II)	25.44	7.632
2	Project Management (45% of sanctioned charges for Phase-II)		11.448
3	Commissioning & Testing (25% of sanctioned charges for Phase-II)		6.360

Billing Status as on 31.03.2023

Sr. No	Stages of PMC	Amount certified including GST	Bill Raised
1	Transaction Advisory (30% of sanctioned charges for Phase-I)		5 94 60 000
2	Transaction Advisory (30% of sanctioned charges for Phase-II)		7 63 20 000
3	Project Management (45% of sanctioned charges for Phase-I) (PMC Charges @ 8.919 Crore for Rs 263.52 Crore*)		
a	IPC-01 to IPC 31	229 44 96 930	7 68 59 640
b	IPC-32 & 33 at 31-05-2023 Amount in Column Bill raised ₹ is excluding GST as only provision for the same has been accounted for and not the total invoice value (For the month of March 2023)	15 14 20 936	48 64 347
4	Project Management (45% of sanctioned charges for Phase-II) (PMC Charges @ 11.448 Crore for Rs 333.625 Crore*)		
a	IPC-01 to IPC 12	144 31 34 046	4 73 70 339
b	IPC-13 at 07-07-2023 Amount in Column Bill raised ₹ is excluding GST as only provision for the same has been accounted for and not the total invoice value (For the month of March 2023)	19 73 54 808	64 27 688
	Total Bill Raised up to March 31, 2023	408 64 06 720	27 13 02 014

During the year company has paid PMC to G-RIDE for MSIL inside siding work details of which are as under:

Total PMC charges for the work	1,35,70,000(including GST @ 18%)	
PMC Charges incurred till March'22	1,35,70,000(including GST @ 18%)*	

* Which includes Provision of Rs. 8,38,002/- excluding GST

40 The following expenditures have been capitalised as part of Intangible Asset under Development / Capital Work in Progress

Particulars	For the year ended on 31 st March 2023		For the year ended on 31 st March 2022	
	Amount	Refer Note No	Amount	Refer Note No
Advertisement Expense		5		5
Amount Transfer to Capital Work in progress - Land Acquisition	-		20 872	
Amount Transfer to Capital Work in progress - Office	-		5 00 184	
Tamping Machine Expense		40		40
Amount transfer to Intangible asset under development - Phase I	-		2 31 581	
EPC Project Development Expense		40		40
Amount transfer to Intangible asset under development - Phase I	128 24 14 002		106 80 01 634	
Amount transfer to Intangible asset under development - Phase II	159 01 59 341		18 92 10 647	
PMC Contract Expense		40		40
Amount transfer to Intangible asset under development - Phase I	2 47 29 585		2 77 97 756	
Amount transfer to Intangible asset under development - Phase II	4 30 75 979		7 08 40 405	
ROC & Legal Charges		40		40
Amount transfer to Intangible asset under development - Phase I	-		-	
Amount transfer to Intangible asset under development - Phase II	-		59 000	
Electricity Expense		40		-
Amount transfer to Intangible asset under development - Phase I	3 57 576		-	
Total	294 07 36 483		135 66 62 079	

Note: As authorization for operation of goods traffic for Phase I has been Approved by Western Railway on 23 March 2023. Hence, Phase I of the project has been capitalised in Freight Sharing Right accordingly on 23 March 2023

41 Ageing for Capital work in progress as at March 31, 2022 is as follows:
(Amount in ₹)

Capital work in progress	Less than 1 year	1-2 years	2-3 years	More than 3 years	TOTAL
Capital Work in Progress-Office*	1 90 64 267	2 53 110	-	-	1 93 17 377
Capital Work in Progress-Land Acquisition	4 13 23 373	5 64 125	-	-	4 18 87 498
Total	6 03 87 640	8 17 235	-	-	6 12 04 875

Ageing for Capital work in progress as at March 31, 2023 is as follows:
(Amount in ₹)

Capital work in progress	Less than 1 year	1-2 years	2-3 years	More than 3 years	TOTAL
Capital Work in Progress-Land Acquisition**	7 20 13 770	1 66 18 708	-	-	8 86 32 478
Total	7 20 13 770	1 66 18 708	-	-	8 86 32 478

*As work of office of BRCL has been completed on 15.02.2023. Hence, Capital Work in Progress-Office project has been capitalised accordingly on February 15, 2023.(Refer Note 4)

**As authorization for operation of good traffic for Phase 1 has been Approved by Western Railway on 23 March 2023. Hence, Capital Work in Progress-Land Acquisition for Phase 1 of the project has been capitalised accordingly on March 23, 2023.(Refer Note 4)

42 Intangible Assets Under Development (Freight Sharing Right Under Development)

Sr No	Category of works / Item Description	PAHSE I		PAHSE II	
		For the Year ended on 31 March 2023* (A)	For the Year ended on 31 March 2022 (B)	For the Year ended on 31 March 2023** (C)	For the Year ended on 31 March 2022 (D)
i	Civil & Track Works	247 81 56 556	134 52 36 377	134 20 04 669	14 49 70 726
	Project Facilities	2 00 17 546	1 90 76 376	31 40 279	4 23 330
	Earthwork	59 82 61 315	24 99 94 732	45 34 38 361	-
	Protection work	9 29 79 174	4 82 66 457	85 992	-
	Major Bridges including PSC Slab bridge	8 17 59 023	4 76 06 494	10 04 95 472	-
	Minor Bridges including PSC Slab bridge	44 08 05 592	17 96 41 003	14 40 54 040	-
	RUBs	48 57 80 900	30 10 76 702	18 60 10 302	-
	Track Works	49 02 65 906	38 10 74 534	39 98 91 045	14 45 47 396
	Other Civil Engineering works including FOB & Subways	22 61 10 597	11 85 00 079	5 48 89 179	-
	Integrated testing and commissioning after satisfactory execution of Civil & Track work	1 66 27 577	-	-	-
ii	Signalling Works	12 83 99 037	9 60 81 671	11 66 86 057	54 36 896
iii	Telecommunication works	2 04 62 902	1 02 86 291	2 03 34 630	1 05 92 607

iv	Electrification (OHE Works)	19 65 80 043	11 29 28 412	26 79 06 509	-
	Overhead Equipment Work, Modification of OHE, TSS, SS		11 29 28 412		-
v	General Electrical Works (GEW)	4 13 07 465	1 79 59 252	3 23 38 123	2 82 10 417
	Various electrical general services Works		1 09 52 403		2 63 02 136
	Modification of HT power lines crossings up to 33 KV (replacement by UG)		70 06 849		19 08 281
vi	Project management Consultancy Charges	11 77 23 087	9 29 93 501	11 39 16 384	7 08 40 405
vii	Payment to GETCO for electrical work	2 90 57 259	2 90 57 259	22 53 90 515	19 95 49 711
viii	Site cleaning work	1 21 125	1 21 125	-	-
ix	Interest on Loan from G-RIDE	49 62 195	49 62 195	-	-
x	Payment for Rails Purchased from Railway	47 57 19 040	12 84 58 891	13,01,01,555	-
xi	Payment for Additional Feeder Bay	3 09 20 949	3 09 20 949	-	-
xii	Others	21 17 768	1 95 546	2 80 454	2 80 454
	Sub Total	352 55 27 427	186 92 01 468	224 89 58 896	45 98 81 216
	Less : Interest on Mobilization Advance*	4 09 31 969	3 93 72 045	4 31 59 719	1 45 44 679
	Total Intangible Assets Under Development	348 45 95 458	182 98 29 423	220 57 99 177	44 53 36 537
	Less : Transfer to Intangible Asset-Freight Sharing Right***	348 45 95 458	-	-	-
		-	182 98 29 423	220 57 99 177	44 53 36 537

Total Intangible Assets Under Development year ended 31st March 2023 (Total of C) **220 57 99 177**

Total Intangible Assets Under Development year ended 31st March 2022 (Total of B+D) **227 51 65 960**

Note:

*Above figure includes Price Variation & Change of Scope amount of Rs. 27,12,93,956/- for Phase I

**Above figure includes Price Variation of Rs. 13,88,81,136/- for Phase II

***As authorization for operation of goods traffic for Phase I has been Approved by Western Railway on 23 March 2023. Hence, Phase I of the project has been capitalised accordingly on 23 March 2023.

Ageing for Intangible Assets Under Development as at March 31, 2023 is as follows:

Intangible Assets Under Development	Less than 1 year	1-2 years	2-3 years	More than 3 years	TOTAL
Project in progress - Phase I	-	117 60 95 444	65 37 33 979	-	182 98 29 423
Project in progress - Phase II	176 04 62 640	44 53 36 537	-	-	220 57 99 177
Total	176 04 62 640	162 14 31 981	65 37 33 979	-	403 56 28 600

Ageing for Intangible Assets Under Development as at March 31, 2022 is as follows:

Intangible Assets Under Development	Less than 1 year	1-2 years	2-3 years	More than 3 years	TOTAL
Project in progress - Phase I	117 60 95 444	65 37 33 979	-	-	182 98 29 423
Project in progress - Phase II	44 53 36 537	-	-	-	44 53 36 537
Total	162 14 31 981	65 37 33 979	-	-	227 51 65 960

43 Capital Commitment

For the year ended 31st March 2023

Name of party with whom Contract Executed	Total value of contract*	Contract value Executed till March 31, 2023	Remaining Contract value
Kalpataru Power Transmission Limited-EPC Contract	267 63 25 388	247 31 73 634	20 31 51 754
Gujarat Rail Infrastructure Development Corporation Limited-PMC Contract	45 26 00 000	27 33 34 580	17 92 65 420
Ashoka Buildcon limited	349 52 91 460	186 53 99 806	162 98 91 654
Haresh Patel Engineers & Contractors	4 70 15 388	4 55 82 123	14 33 265
Total Capital Commitment	667 12 32 236	465 74 90 143	201 37 42 093

*Note: contract value has been revised due to change in GST Rate from 12% to 18%.

For the year ended 31st March 2022

Name of party with whom Contract Executed	Total value of contract	Contract value Executed till March 31, 2022	Remaining Contract value
Kalpataru Power Transmission Limited-EPC Contract	263 52 00 000	174 88 62 021	88 63 37 979
Gujarat Rail Infrastructure Development Corporation Limited-PMC Contract	45 26 00 000	19 17 72 345	26 08 27 655
Ashoka Buildcon limited	333 62 50 000	52 28 35 647	281 34 14 353
Haresh Patel Engineers & Contractors	4 46 08 899	1 66 13 390	2 79 95 509
Total Capital Commitment	646 86 58 899	248 00 83 403	398 85 75 496

44 Various Financial Ratio are disclosed as under :

Sr. No.	Ratio	Numerator	Denominator	31-03-2023	31-03-2022
1	Current ratio (X)	Current Assets	Current Liabilities	1.20	7.84
Reason for change: Proportionate change in current liability as compared to change in current assets is more.					
2	Debt equity ratio (X)	Total Debt	Shareholder's Equity(Capital plus reserve)	NIL	NIL
3	Debt service coverage ratio (X)	Net Profit before taxes + Non-cash operating expenses like depreciation and other amortizations + Interest + other adjustments like loss on sale of Fixed assets etc	Interest & Lease Payments + Principal Repayments	NIL	NIL
4	Return on Equity (%)	Net Profits after taxes – Preference Dividend (if any)	Average Shareholder's Equity	(45.34)%	21%
5	Inventory turnover ratio	Cost of goods sold OR sales	Average Inventory (Opening + Closing balance / 2)	NIL	NIL
6	Trader receivable turnover ratio	Net Credit Sales (gross credit sales minus sales return)	Average Accounts Receivable (Opening + Closing balance / 2)	2.26	3.21
Reason for change: As there were less Trade Receivables as compare with previous year.					
7	Trade payable turnover ratio	Net Credit Purchases (gross credit purchases minus purchase return)	Average Working Capital	0.04	0.07
Reason for change: As there were increase in trade payable with decrease in avarage working capital.					
8	Net capital turnover ratio	Net Sales (total sales minus sales returns)	Average Working Capital	0.04	0.07
Reason for change: As there were decrease in Sales compare with previous year.					
9	Net profit ratio	Net Profit	Net Sales	(0.13)%	0.01
Reason for change: As there were decrease in Sales compare with previous year.					
10	Return on capital employed	Earning before interest and taxes	Capital Employed (Tangible Net Worth + Total Debt + Deferred Tax Liability)	0.010	0.003
Reason for change: Proportionate increase in capital employes is more than increase in income					
11	Return on investment	Return	Investment	NIL	NIL

45 Following expense includes prior period expense as under:

Particulars	31-03-2023	31-03-2022	Refer Note No
Rent Expense	-	23 93 927	28
Repairs & Maintenance	-	3 44 330	28
ROC & legal charges - Professional Tax	-	9 717	28
Total	-	27 47 974	

46 Lease Arrangements

The Company has entered into an agreement with Gujarat Udhog Bhavan Society for obtaining office premise on lease for a period of 5 years at monthly rent of Re. 1,60,285/-

The above lease has been accounted by debiting Right of Use - leasehold office and crediting corresponding lease liability. The value of lease liability has been derived by discounting future lease payments of 5 years @ 9.5% p.a.

Maturity Analysis of Lease Liability

Particulars	Less Than 12 Months	More Than 12 Months	Total Liability
As at March 31, 2023	14 42 900	42 65 240	57 08 140
As at March 31, 2022	13 12 625	57 08 140	70 20 765

Amount Recognised in Statement of Profit & Loss

Particulars	31-03-2023	31-03-2022
Interest on Lease Liabilities	6,10,795	3,50,532
Amortisation of ROU Assets	15,26,389	7,63,194
Total	21 37 184	11 13 726

Details of Right of Use (ROU) Assets - Leasehold office:

Particulars	31-03-2023	31-03-2022
Opening Carrying Value as at Balance Sheet Date	68,68,749	-
Addition to ROU Assets during the year	-	76,31,943
Amortisation of ROU Assets during the year	15 26 389	7,63,194
Closing Carrying Value as at Balance Sheet Date	53 42 360	68 68 749

47 Figures of previous year have been re-grouped/ re-classified wherever necessary to make them comparable with current year.

Signatories to Note 1 to 47

Notes on accounts form integral part of the financial statements

As per our report of even date

For Shah & Dalal
Chartered Accountants
FRN. 109432W

For and on behalf of the Board

Sd/-
Malay Dalal
Partner
Membership No. 036776
UDIN:23036776BGWJJZ4551

Sd/-
S. N. Joshi
CFO

Sd/-
Jwalesh Zaveri
Director
DIN: 09507224

Sd/-
R S Kapoor
Director
DIN: 08303688

Place: Ahmedabad
Date: September 29, 2023

Place: Gandhinagar
Date: September 29, 2023